**સુવિચાર**

જિંદગીમાં અન્ય ભૂલ કરે તે બતાવવું સહેલું છે પણ પોતાની ભૂલનો સ્વીકાર કરવો અઘરું છે.

**-અજ્ઞાત**


# દિવ્ય ભાસ્કર

ભારતનું સૌથી ઝડપી વિકસતું અખબાર

કુલપાના ૨૦ | કિંમત ₹ ૨.૦૦

realpatidar.com

| | | |
|---|---|---|
| સેન્સેક્સ | 17,940.55 ↓ | |
| પાછલો 18,109.89 | તફાવત -169.34 | |
| નિફ્ટી | 5404.80 ↓ | |
| પાછલો 5456.55 | તફાવત -51.75 | |
| સોનું | 24,250.00 ↑ | |
| પાછલો 23750 | તફાવત 500 | |
| ચાંદી | 59,500.00 ↑ | |
| પાછલો 57900 | તફાવત 1600 | |
| ડોલર | 44.32 ↑ | |
| પાછલો 44.28 | તફાવત 0.04 | |

divyabhaskar.com ગુરુવાર ભુજ | ૪ ઓગસ્ટ, ૨૦૧૧ શ્રાવણ સુદ-૫, વિક્રમ સંવત : ૨૦૬૭

**ધર્મ દર્શન** સૃષ્ટિના સર્જક અને સંહારક શિવજી

## ઉપગ્રહ તસવીર






## કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ગૌડાની પસંદગી

એજન્સી. બેંગલોર

મુખ્યમંત્રી પદેથી ખનીજ કૌભાંડમાં હકાલપટ્ટી પામેલા બી એસ યેદિયુરપ્પાના નિકટના મનાતા સદાનંદ ગૌડા હવે કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. બુધવારે ગૌડા

...અનુસંધાન પાનાનં.૬


Admission Open
B. Pharm
Ramanbhai Patel College of Pharmacy
CHARUSAT - Changa
FEW SEATS VACANT
Ph.-02697-247500, 248133,
Mobile : 9687840633


# મોંઘવારી મુદ્દે સરકાર નિ:સહાય

### સંસદમાં ફક્ત ચર્ચા, મોંઘવારીને અંકુશમાં લેવામાં વિપક્ષે વધુ એકવાર સરકારને અસફળ ગણાવી

ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી

લોકસભામાં વિરોધ પક્ષે મોંઘવારી પર કાબૂ મેળવવામાં અસફળ રહેવા બાબતે અને ભ્રષ્ટાચારને લઇને યુપીએ સરકારની આકરી ટીકા કરી હતી. એવો આક્ષેપ કરાયો છે કે, સરકારની આર્થિક અને નાણાકીય નીતિને કારણે કરોડો લોકો ગરીબીરેખા નીચે ચાલ્યા ગયા છે. સામાન્ય માનવી સંપૂર્ણ રીતે ઉપેક્ષિત છે. ભાજપના નેતા યશવંત સિંહએ મોંઘવારી પર ચર્ચાની શરૂઆત કરી હતી. સિંહાએ કહ્યું હતું કે, આ ૧૨મી વખત છે કે, જ્યારે ગૃહમાં મોંઘવારીની ચર્ચા થઇ રહી છે. વિપક્ષના જોરદાર હોબાળા બાદ સરકાર મત વિભાજનની જોગવાઇવાળા નિયમ ૧૮૪

... અનુસંધાન પાના નં. ૬

**સંસદમાં ફિલ્મી ચક્કર : હમારે પાસ મનમોહનસિંઘ હૈ : સલમાન ખુરશીદ**

**કેન્દ્રીયમંત્રી** સલમાન ખુરશીદે ફિલ્મ દીવારના સંવાદનો ઉપયોગ કરતાં કહ્યું કે 'વિરોધ પક્ષ પાસે જો બધું જ છે તો અમારી પાસે મનમોહનસિંઘ છે, કે જેમની સૂઝબૂઝ અને દુરંદેશી નીતિને કારણે જ દેશમાં વિકાસ દર આટલો ઊંચો છે, જ્યારે વિકસિત દેશો પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિકીકરણના દોરમાં મોંઘવારી માત્ર સ્થાનિક કારણોસર નથી વધતી પણ અનેક બહારના કારણ પણ હોય છે.

# સોનામાં તેજીનું તોફાન, ₹૨૪૩૩૫ની ટોચે

### રૂ.૬૪૦ વધ્યા, ચાંદી ત્રણ મહિનાની ઊંચાઇએ, બે દિવસમાં સોનામાં રૂ.૮૦૦નો ઝડપી ઉછાળો

ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

વૈશ્વિક મંદીના ભણકારે કિંમતી ધાતુઓમાં તેજીનો તરખાટ જોવાઇ રહ્યો છે.અમેરિકા અને યુરોપની આર્થિક સ્થિતિ જોખમકારક

...અનુસંધાન પાનાનં.૬

**સોનાના ભાવ**

| વર્ષ | સોનું | ચાંદી |
|---|---|---|
| ૨૦૦૫ | ૬૧૭૦ | ૧૧૭૦૦ |
| ૨૦૦૬ | ૮૪૦૦ | ૧૬૭૦૦ |
| ૨૦૦૭ | ૯૫૦૦ | ૧૯૩૫૦ |
| ૨૦૦૮ | ૧૩૯૦૦ | ૨૬૦૦૦ |
| ૨૦૦૯ | ૧૫૨૨૦ | ૨૧૮૫૦ |
| ૨૦૧૦ | ૧૬૬૦૦ | ૨૭૨૫૫ |
| ૨૦૧૧ | ૨૧૧૧૫ | ૫૫૯૭૦ |

(તમામ ભાવ ૩૧ માર્ચના છે)


a telenor unitech company
uninor
₹ 50 = 55નુ બેલૅન્સ યુનિનોર સાથે
કૉલ 91730 91730 | www.uninor.in
વાત માં દમ છે.


## ન્યૂઝ ઇનબોક્સ

**ભજ્જી, યુવી બહાર**

એજબેસ્ટન : ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાંથી ઇજાગ્રસ્ત હરભજન અને યુવરાજ બહાર થઈ ગયા છે. તેમના સ્થાને વિરાટ કોહલી અને પ્રજ્ઞાન ઓઝાનો સમાવેશ કરાયો છે. ત્રીજી ટેસ્ટ ૧૦ ઓગસ્ટથી શરૂ થશે.

(વિસ્તૃત અહેવાલ રમત પાને)

**બચ્ચનને પરવાનગી ન મળી**

લખનઉ : સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને લખનઉમાં શાળાનાં બાળકો સાથે વાતચીતનો કાર્યક્રમ કરવાની પરવાનગી જિલ્લા વહીવટી તંત્રે આપી નથી. સ્થાનિક વિરોધને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું છે.

**એટીએમ મારફતે કર ચૂકવણી**

નવી દિલ્હી : એચડીએફસી બેંક દ્વારા એટીએમ મારફતે કર ચુકવણી સેવા શરૂ કરાઈ છે. બેંકના ૧૧૫ લાખ ડેબિટ કાર્ડ હોલ્ડર આ સેવાનો લાભ એટીએમ મારફતે લઈ શકશે.

**સચિનને ભારત રત્ન આપવા માગ**

નવી દિલ્હી : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ભારત રત્ન આપવાની માગ કરતી રજૂઆત વિવિધ ક્ષેત્ર તરફથી મળી હોવાનું સરકારે જણાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી એમ. રામચંદ્રને જણાવ્યું હતું કે આ અંગેની વિચારણા ચાલી રહી છે.

# ઉદ્યોગો સામે ૨૦ ગામોનો મોરચો

### અદાણી ગ્રૂપ તથા અન્ય કંપનીઓના ભૂમિઅતિક્રમણ સામે ઐતિહાસિક લડત

બેનર્સ લઇને સુત્રોચાર સાથે નીકળેલી હલ્લા બોલ રેલીમાં જોડાયેલા સંખ્યાબંધ લોકો. -મુકેશ મોઠ

**સેંકડો ઉપવાસીઓ અને રોજેદારો દ્વારા ભદ્રેશ્વરથી 'હલ્લા બોલ' રેલી નીકળી : આજે ભુજમાં આવેદનપત્ર પાઠવી સભા ભરાશે**

ભાસ્કર ન્યૂઝ . મુન્દ્રા

મુન્દ્રા તાલુકાના કાંઠાળ વિસ્તારમાં અદાણી ગ્રૂપની કંપનીઓ તેમજ અન્ય કંપનીઓ દ્વારા લોકોની ગૌચર જમીનો ખેડૂતોની જમીનો તેમજ માછીમારોની ક્રીક પર કરેલા અતિક્રમણને મુદ્દે ૨૦થી વધુ ગામોના હજારો લોકોએ બુધવારે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરથી એક હલ્લાબોલ રેલી કાઢી હતી. હિન્દુઓનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી ઉપવાસીઓ તેમજ મુસ્લિમોનો પવિત્ર રમજાન પણ ચાલી રહ્યો હોવાથી રોજા રાખનાર રોજેદારો પણ આ પદયાત્રામાં જોડાયા છે.

...અનુસંધાન પાનાનં.૬

**અંગ્રેજોના ગુલામી કાળની યાદ અપાવતી મોદીની સરકાર**

અદાણી વિરુદ્ધ ભેગી થયેલી વિશાળ જનમેદનીમાંથી કેટલાક લોકોએ ગુજરાત રાજ્યની નરેન્દ્ર મોદી સરકારને અંગ્રેજોના ગુલામી કાળ સાથે સરખાવ્યો હતો. જેમ અંગ્રેજોએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયદો કરાવવા માટે તમામ નીતિનિયમોને નેવે મૂકીને લોકો ઉપર અત્યાચાર કરીને શાસન કર્યું હતું. તેવી રીતે નરેન્દ્ર મોદી પણ અદાણીને પોષવા માટે કાયદાને ગણકાર્યા વિના તેમજ લોકોના સુખાકારીની ચિંતા કર્યા વિના કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે અદાણીને પધરાવી દીધી છે.

## અદાણી દ્વારા દેશી વહાણવટા ઉદ્યોગને ખતમ કરવાનો કારસો

**ઓલ્ડ મુન્દ્રા પોર્ટ યુઝર્સ એસો.એ મેરીટાઇમ બોર્ડને કરેલી રજૂઆત**

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્યનો વર્ષો જૂનો દેશી વહાણ વટા ઉદ્યોગ મુન્દ્રા બંદરના જે માર્ગેથી પસાર થઇને વિકસી રહ્યો હતો તેને અદાણી ગ્રૂપ દ્વારા બંધ કરી દેવાના કૃત્યને ઓલ્ડ મુન્દ્રા પોર્ટ યુઝર્સ એસો.એ સખત શબ્દોમાં વખોડીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ સહિત કેન્દ્ર અને રાજ્યમાં વિવિધ કક્ષાએ રજૂઆત કરીને એવો આક્ષેપ કર્યો હતો કે,

...અનુસંધાન પાનાનં.૬

# 'નિવેડો ન આવે ત્યાં સુધી જંપીશ નહીં' : કનુભાઇ

કનુભાઇ

ભુજ : મહુવામાં નિરમાના પ્લોટ સામે લાંબા સમય સુધી લડત ચલાવી સફળતા મેળવનારા શાસક ભાજપના જ ધારાસભ્ય કનુભાઇ કલસારિયા ભદ્રેશ્વર વિસ્તારના માછીમારોએ અદાણી સામે છેડેલા આંદોલનમાં જોડાઇ રહ્યા હોવાથી. લડતને નવો વેગ મળ્યો છે. શું કહે છે આ નિડર જન નેતા ? જોઇએ તેમના શબ્દોમાં જ તેમનું બયાન. 'રાજ્ય સરકારની ગરીબો પ્રત્યે

...અનુસંધાન પાનાનં.૬

(આ જાહેરાત ફક્ત માહિતીના હેતુથી છે અને સૂચિપત્રની જાહેરાત નથી)

IIFL

ઈન્ડિયા ઈન્ફોલાઈન ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસ લિ.

નોંધનીકૃત કચેરી: આઇઆઇઆઇએફએલ હાઉસ, સન ઈન્ફોટેક પાર્ક, રોડ નં. 16V, પ્લોટ નં. B-2, થાણે ઈન્ડસ્ટ્રિયલ એરિયા, વાગળે એસ્ટેટ, થાણે– 400 604, ફોન: +91 22 2580 6650 ફેક્સ: +91 22 2580 6654. કોર્પોરેટ કચેરી: આઇઆઇઆઇએફએલ સેન્ટર, કમલા સિટી, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ–400 013, ફોન: +91 4249 9000, ફેક્સ: +91 22 2495 4313, વેબસાઈટ: www.iiflinvestments.com

11.9%* વાર્ષિક નિશ્ચિત વ્યાજ 5 વર્ષ માટે સિક્યોર્ડ એનસીડી પર

*સૂચિપત્રમાં વ્યાખ્યા કર્યા પ્રમાણે શ્રેણી -3ના રોકાણકારો માટે. સર્વ અન્ય શ્રેણીઓ પર વ્યાજ દરો માટે કૃપા કરીને સૂચિપત્ર જુઓ.

- ઈશ્યુ સાઈઝ ₹750 કરોડ સુધી
- સિક્યોર્ડ રિડીમેબલ એનસીડીનો પબ્લિક ઈશ્યુ
- ટ્રેડેબલ એનસીડી એ એનએસઈ અને બીએસઈ પર લિસ્ટેડ થશે
- વ્યાજ પર સ્રોત ખાતે કરકપાત નહીં **

"(ઈક્રા) એએ-(સ્ટેબલ)" અને "કેર એએ-" રેટેડ
જે નાણાકીય ઉત્તરદાયિત્વની સમયસર સેવાઓ સંબંધે સુરક્ષાની ઉચ્ચ માત્રાનો સંકેત છે.

ઈશ્યુ આજે ખૂલે છે | ઈશ્યુ બંધ થાય છે: 12# ઓગસ્ટ, 2011

એલોટમેન્ટ રોજ પહેલો તે વહેલો ધોરણે કરાશે.

SMS 'IIISL' to 567675555 | Gaurav Singh on +91 98671 04247
ncd@indiainfoline.com | www.indiainfoline.com

#આવશ્યક મંજૂરીઓને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા નક્કી કરાઈ શકે તે સમયગાળા સુધી વહેલું બંધ કરવાના અને/ અથવા વિસ્તાર કરવાના વિકલ્પ સાથે. ઈશ્યુની સબ્સ્ક્રિપ્શન લિસ્ટ વહેલી બંધ કરવાની આવી ઘટનામાં અમારી કંપની તકેદારી રાખશે કે આવા વહેલા બંધની સૂચના અગ્રણી રાષ્ટ્રીય દૈનિક અખબારમાં જાહેરાત(તો) થકી બંધ થવાની આવી વહેલી તારીખે આપવામાં આવે.

**ડિમટીરિયલાઈઝડ સ્વરૂપમાં ધરાવાતા એનસીડી પર.

ઈન્ડિયા ઈન્ફોલાઈન ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસ લિમિટેડ ("આઈઆઈઆઈએસએલ") એ બજારની સ્થિતિઓ અને અન્ય વિચારણાઓને આધીન સિક્યોર્ડ રિડીમેબલ નોન– કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પબ્લિક ઈશ્યુ પ્રસ્તાવિત કરે છે અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ– મહારાષ્ટ્ર, મુંબઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ પાસે સૂચિપત્ર નોંધાવ્યું છે. સૂચિપત્ર અમારી વેબસાઈટ www.iiflinvestments.com પર અને શેરબજારોની વેબસાઈટો www.nseindia.com અને www.bseindia.com અને એલએમની સંબંધિત વેબસાઈટો www.axisbank.com, www.jmfinancial.in અને www.akcapindia.com પર ઉપલબ્ધ છે. ઈશ્યુમાં સહભાગી થવાનો પ્રસ્તાવ ધરાવતા રોકાણકારોએ સૂચિપત્રમાં સમાવિષ્ટ માહિતીને આધારે જ રોકાણ કરવું.


વર્ષ ૫ . અંક ૩૫. કચ્છ | ભાસ્કર જૂથ ૧૩ રાજ્ય . ૬૨ આવૃત્તિ : ગુજરાત . મધ્યપ્રદેશ . છત્તીસગઢ . રાજસ્થાન . હરિયાણા . નવી દિલ્હી . ચંદીગઢ . પંજાબ . મહારાષ્ટ્ર . હિમાચલપ્રદેશ . ઉત્તરાખંડ . ઝારખંડ . જમ્મુ-કાશ્મીર | દિવ્ય ભાસ્કર ગુજરાત, મહારાષ્ટ્ર | દિવ્ય મરાઠી મહારાષ્ટ્ર | DNA અમદાવાદ. મુંબઈ. બેંગલુરુ. પુણે. જયપુર. ઈંદોર | ૭ રાજ્ય. ૧૭ સ્ટેશન

Digitially Archived by: www.realpatidar.com/library

# Real Patidar Library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

## About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format
For Reference See Pages: 1, 6.

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2025.05.05 18:22:52 +05'30'
Real Patidar Unravel Truth

**સુવિચાર**

જિંદગીમાં અન્ય ભૂલ કરે તે બતાવવું સહેલું છે પણ પોતાની ભૂલનો સ્વીકાર કરવો અઘરું છે.

**-અજ્ઞાત**

ભારતનું સૌથી ઝડપી વિકસતું અખબાર

# દિવ્ય ભાસ્કર

કુલ પાના ૨૦ | કિંમત ₹ ૨.૦૦

realpatidar.com

| | | | |
|---|---|---|---|
| સેન્સેક્સ | 17,940.55 ↓ | પાછલો 18,109.89 | તફાવત 169.34 |
| નિફ્ટી | 5404.80 ↓ | પાછલો 5456.55 | તફાવત 51.75 |
| સોનું | 24,250.00 ↑ | પાછલો 23750 | તફાવત 500 |
| ચાંદી | 59,500.00 ↑ | પાછલો 57900 | તફાવત 1600 |
| ડૉલર | 44.32 ↑ | પાછલો 44.28 | તફાવત 0.04 |

divyabhaskar.com ગુરુવાર ભુજ | ૪ ઓગસ્ટ, ૨૦૧૧ શ્રાવણ સુદ-૫, વિક્રમ સંવત : ૨૦૬૭

**ધર્મ દર્શન** સૃષ્ટિના સર્જક અને સંહારક શિવજી

**ઉપગ્રહ તસવીર**



Rainbow Remo's Dance Institute
Grand Inauguration by
The Dance Guru REMO D'SOUZA
RAINBOW DANCE CLASS PRESENT'S
REMO'S DANCE INSTITUTE
5/8/11, Friday, 10am
Om Crossway, Airport Road, Gandhidham (Kutch), M. 97277 44559 / M. 97277 54559

## કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ગૌડાની પસંદગી

**એજન્સી. બેંગલોર**

મુખ્યમંત્રી પદેથી ખનીજ કૌભાંડમાં હકાલપટ્ટી પામેલા બી એસ યેદિયુરપ્પાના નિકટના મનાતા સદાનંદ ગૌડા હવે કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. બુધવારે ગૌડા

...અનુસંધાન પાના નં.૬

Admission Open
B. Pharm
Ramanbhai Patel College of Pharmacy
CHARUSAT - Changa
FEW SEATS VACANT
Ph.-02697-247500, 248133,
Mobile : 9687840633

# મોંઘવારી મુદ્દે સરકાર નિ:સહાય

## સંસદમાં ફક્ત ચર્ચા, મોંઘવારીને અંકુશમાં લેવામાં વિપક્ષે વધુ એકવાર સરકારને અસફળ ગણાવી

**ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી**

લોકસભામાં વિરોધ પક્ષે મોંઘવારી પર કાબૂ મેળવવામાં અસફળ રહેવા બાબતે અને ભ્રષ્ટાચારને લઈને યુપીએ સરકારની આકરી ટીકા કરી હતી. એવો આક્ષેપ કરાયો છે કે, સરકારની આર્થિક અને નાણાકીય નીતિને કારણે કરોડો લોકો ગરીબીરેખા નીચે ચાલ્યા ગયા છે. સામાન્ય માનવી સંપૂર્ણ રીતે ઉપેક્ષિત છે. ભાજપના નેતા યશવંત સિંહએ મોંઘવારી પર ચર્ચાની શરૂઆત કરી હતી. સિંહાએ કહ્યું હતું કે, આ ૧૨મી વખત છે કે, જ્યારે ગૃહમાં મોંઘવારીની ચર્ચા થઈ રહી છે. વિપક્ષના જોરદાર હોબાળા બાદ સરકાર મત વિભાજનની જોગવાઈવાળા નિયમ ૧૮૪

... અનુસંધાન પાના નં. ૬

### સંસદમાં ફિલ્મી ચક્કર : હમારે પાસ મનમોહનસિંઘ હૈ : સલમાન ખુરશીદ

**કેન્દ્રીયમંત્રી** સલમાન ખુરશીદે ફિલ્મ દીવારના સંવાદનો ઉપયોગ કરતાં કહ્યું કે 'વિરોધ પક્ષ પાસે જો બધું જ છે તો અમારી પાસે મનમોહનસિંઘ છે, કે જેમની સૂઝબૂઝ અને દુરંદેશી નીતિને કારણે જ દેશમાં વિકાસ દર આટલો ઊંચો છે, જ્યારે વિકસિત દેશો પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિકીકરણના દોરમાં મોંઘવારી માત્ર સ્થાનિક કારણોસર નથી વધતી પણ અનેક બહારના કારણ પણ હોય છે.

# સોનામાં તેજીનું તોફાન, ₹૨૪૩૩૫ની ટોચે

### રૂ.૬૪૦ વધ્યા, ચાંદી ત્રણ મહિનાની ઊંચાઇએ, બે દિવસમાં સોનામાં રૂ.૮૦૦નો ઝડપી ઉછાળો

**ભાસ્કર ન્યૂઝ. રાજકોટ**

વૈશ્વિક મંદીના ભણકારે કિંમતી ધાતુઓમાં તેજીનો તરખાટ જોવાઈ રહ્યો છે.અમેરિકા અને યુરોપની આર્થિક સ્થિતિ જોખમકારક

...અનુસંધાન પાના નં.૬

**સોનાના ભાવ**

| વર્ષ | સોનું | ચાંદી |
|---|---|---|
| ૨૦૦૫ | ૬૧૭૦ | ૧૧૭૦૦ |
| ૨૦૦૬ | ૮૪૦૦ | ૧૬૭૦૦ |
| ૨૦૦૭ | ૯૫૦૦ | ૧૯૩૫૦ |
| ૨૦૦૮ | ૧૩૯૦૦ | ૨૬૦૦૦ |
| ૨૦૦૯ | ૧૫૨૨૦ | ૨૧૮૫૦ |
| ૨૦૧૦ | ૧૬૬૦૦ | ૨૭૨૫૫ |
| ૨૦૧૧ | ૨૧૧૧૫ | ૫૫૯૭૦ |

(તમામ ભાવ ૩૧ માર્ચના છે)

a telenor unitech company
uninor
₹ 50 = 55નુ બેલૅન્સ યુનિનોર સાથે
કૉલ 91730 91730 | www.uninor.in
વાત માં દમ છે.

**ન્યૂઝ ઇનબોક્સ**

**ભજ્જી, યુવી બહાર**

એજબેસ્ટન : ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાંથી ઈજાગ્રસ્ત હરભજન અને યુવરાજ બહાર થઈ ગયા છે. તેમના સ્થાને વિરાટ કોહલી અને પ્રજ્ઞાન ઓઝાનો સમાવેશ કરાયો છે. ત્રીજી ટેસ્ટ ૧૦ ઓગસ્ટથી શરૂ થશે.

(વિસ્તૃત અહેવાલ રમત પાને)

**બચ્ચનને પરવાનગી ન મળી**

લખનઉ : સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને લખનઉમાં શાળાનાં બાળકો સાથે વાતચીતનો કાર્યક્રમ કરવાની પરવાનગી જિલ્લા વહીવટી તંત્રે આપી નથી. સ્થાનિક વિરોધને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું છે.

**એટીએમ મારફતે કર ચૂકવણી**

નવી દિલ્હી : એચડીએફસી બેંક દ્વારા એટીએમ મારફતે કર ચુકવણી સેવા શરૂ કરાઈ છે. બેંકના ૧૧૫ લાખ ડેબિટ કાર્ડ હોલ્ડર આ સેવાનો લાભ એટીએમ મારફતે લઈ શકશે.

**સચિનને ભારત રત્ન આપવા માગ**

નવી દિલ્હી : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ભારત રત્ન આપવાની માગ કરતી રજૂઆત વિવિધ ક્ષેત્ર તરફથી મળી હોવાનું સરકારે જણાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી એમ. રામચંદ્રને જણાવ્યું હતું કે આ અંગેની વિચારણા ચાલી રહી છે.

# ઉદ્યોગો સામે ૨૦ ગામોનો મોરચો

## અદાણી ગ્રૂપ તથા અન્ય કંપનીઓના ભૂમિઅતિક્રમણ સામે ઐતિહાસિક લડત

બેનર્સ લઇને સુત્રોચાર સાથે નીકળેલી હલ્લા બોલ રેલીમાં જોડાયેલા સંખ્યાબંધ લોકો. -મુકેશ મોઠ

### સેંકડો ઉપવાસીઓ અને રોજેદારો દ્વારા ભદ્રેશ્વરથી 'હલ્લા બોલ' રેલી નીકળી : આજે ભુજમાં આવેદનપત્ર પાઠવી સભા ભરાશે

**ભાસ્કર ન્યૂઝ . મુન્દ્રા**

મુન્દ્રા તાલુકાના કાંઠાળ વિસ્તારમાં અદાણી ગ્રૂપની કંપનીઓ તેમજ અન્ય કંપનીઓ દ્વારા લોકોની ગૌચર જમીનો ખેડૂતોની જમીનો તેમજ માછીમારોની ક્રીક પર કરેલા અતિક્રમણને મુદ્દે ૨૦થી વધુ ગામોના હજારો લોકોએ બુધવારે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરથી એક હલ્લાબોલ રેલી કાઢી હતી. હિન્દુઓનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી ઉપવાસીઓ તેમજ મુસ્લિમોનો પવિત્ર રમજાન પણ ચાલી રહ્યો હોવાથી રોજા રાખનાર રોજેદારો પણ આ પદયાત્રામાં જોડાયા છે.

...અનુસંધાન પાના નં.૬

### અંગ્રેજોના ગુલામી કાળની યાદ અપાવતી મોદીની સરકાર

અદાણી વિરુદ્ધ ભેગી થયેલી વિશાળ જનમેદનીમાંથી કેટલાક લોકોએ ગુજરાત રાજ્યની નરેન્દ્ર મોદી સરકારને અંગ્રેજોના ગુલામી કાળ સાથે સરખાવ્યો હતો. જેમ અંગ્રજોએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયદો કરાવવા માટે તમામ નીતિનિયમોને નેવે મૂકીને લોકો ઉપર અત્યાચાર કરીને શાસન કર્યું હતું. તેવી રીતે નરેન્દ્ર મોદી પણ અદાણીને પોષવા માટે કાયદાને ગણકાર્યા વિના તેમજ લોકોના સુખાકારીની ચિંતા કર્યા વિના કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે અદાણીને પધરાવી દીધી છે.

## અદાણી દ્વારા દેશી વહાણવટા ઉદ્યોગને ખતમ કરવાનો કારસો

### ઓલ્ડ મુન્દ્રા પોર્ટ યુઝર્સ એસો.એ મેરીટાઇમ બોર્ડને કરેલી રજૂઆત

**ભાસ્કર ન્યૂઝ. ભુજ**

કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્યનો વર્ષો જૂનો દેશી વહાણ વટા ઉદ્યોગ મુન્દ્રા બંદરના જે માર્ગેથી પસાર થઇને વિકસી રહ્યો હતો તેને અદાણી ગ્રૂપ દ્વારા બંધ કરી દેવાના કૃત્યને ઓલ્ડ મુન્દ્રા પોર્ટ યુઝર્સ એસો.એ સખત શબ્દોમાં વખોડીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ સહિત કેન્દ્ર અને રાજ્યમાં વિવિધ કક્ષાએ રજૂઆત કરીને એવો આક્ષેપ કર્યો હતો કે,

...અનુસંધાન પાના નં.૬

# 'નિવેડો ન આવે ત્યાં સુધી જંપીશ નહીં' : કનુભાઇ



કનુભાઇ

**ભુજ:** મહુવામાં નિરમાના પ્લોટ સામે લાંબા સમય સુધી લડત ચલાવી સફળતા મેળવનારા શાસક ભાજપના જ ધારાસભ્ય કનુભાઈ કલસારિયા ભદ્રેશ્વર વિસ્તારના માછીમારોએ અદાણી સામે છેડેલા આંદોલનમાં જોડાઈ રહ્યા હોવાથી. લડતને નવો વેગ મળ્યો છે. શું કહે છે આ નિડર જન નેતા ? જોઈએ તેમના શબ્દોમાં જ તેમનું બયાન. 'રાજ્ય સરકારની ગરીબો પ્રત્યે

...અનુસંધાન પાનાં.૬

શુદ્ધ અને સાત્વિક ફરાળી વાનગીઓ માટે
•રાજગરા નો લોટ •સાબુદાણા •મોરૈયો •સીંઘોડા નો લોટ
૨૦૦ ગ્રા. અને ૫૦૦ ગ્રા. ના પેકીંગમાં ઉપલબ્ધ
ગાય સાબુદાના સાબુદાણા SAGO રામદાના આટા રાજગરા લોટ RAJGARA FLOUR
Adv - 03

વિન્ટોજીનો
World renowned and trusted pain reliever WINTOGENO 100 YEARS
૧ નહીં ૨ નહીં ૩ નહીં પૂરા ૧૦ દુ:ખાવામાં રાહત આપે વિન્ટોજીનો. એ પણ ૧૦ નહીં ૨૦ નહીં ૩૦ નહીં પણ પૂરા ૧૦૦ વર્ષોથી.
શક્તિશાળી દર્દ નિવારક
WINTOGENO POWERFUL PAIN RELIEVER

નારી સ્વાસ્થ્ય! સમસ્યાઓ અનેક ઉપાય ફક્ત 'હેમપુષ્પા'
✔ માસિકના કઠિન દિવસો અને અનિયમિતતામાં લાભકારી.
✔ નવું લોહી બનાવી, રક્ત સાફ કરી નારી સૌંદર્ય નિખારે.
✔ કમર-પેડુની પીડા, હથેળી અને તાળવામાં બળતરા, ચિડીયાપણું, બેચેની, તણાવ, અનિંદ્રા દૂર કરે.
✔ ગર્ભાશય માટે ઘણું લાભકારી ટૉનિક.
૮૦ વર્ષોથી મહિલાઓની No.1 ઔષધિ અને ટૉનિક હેમપુષ્પા
Samvad-1625/Guj.
Ahemdabad Ph.: 26582901, 32906916, 26582515, Surat Ph.: 9998807515, 9979527192, Varodara Ph.: 2459307, Rajkot Ph.: 2223165, Bhuj Ph.: 254068

(આ જાહેરાત ફક્ત માહિતીના હેતુથી છે અને સૂચિપત્રની જાહેરાત નથી)
IIFL
ઈન્ડિયા ઈન્ફોલાઈન ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસ લિ.
નોંધનીકૃત કચેરી: આઇઆઇઆઇએફએલ હાઉસ, સન ઈન્ફોટેક પાર્ક, રોડ નં. 16V, પ્લોટ નં. B-2, થાણે ઈન્ડસ્ટ્રિયલ એરિયા, વાગળે એસ્ટેટ, થાણે– 400 604, ફોન: +91 22 2580 6650 ફેક્સ: +91 22 2580 6654. કોર્પોરેટ કચેરી: આઇઆઇઆઇએફએલ સેન્ટર, કમલા સિટી, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ–400 013, ફોન: +91 4249 9000, ફેક્સ: +91 22 2495 4313, વેબસાઈટ: www.iiflinvestments.com
11.9%* વાર્ષિક નિશ્ચિત વ્યાજ 5 વર્ષ માટે સિક્યોર્ડ એનસીડી પર
*સૂચિપત્રમાં વ્યાખ્યા કર્યા પ્રમાણે શ્રેણી -3ના રોકાણકારો માટે. સર્વ અન્ય શ્રેણીઓ પર વ્યાજ દરો માટે કૃપા કરીને સૂચિપત્ર જુઓ.
• ઈશ્યુ સાઈઝ ₹750 કરોડ સુધી
• સિક્યોર્ડ રિડીમેબલ એનસીડીનો પબ્લિક ઈશ્યુ
• ટ્રેડેબલ એનસીડી એ એનએસઈ અને બીએસઈ પર લિસ્ટેડ થશે
• વ્યાજ પર સ્રોત ખાતે કરકપાત નહીં **
"(ઈક્રા) એએ-(સ્ટેબલ)" અને "કેર એએ-" રેટેડ
જે નાણાકીય ઉત્તરદાયિત્વની સમયસર સેવાઓ સંબંધે સુરક્ષાની ઉચ્ચ માત્રાનો સંકેત છે.
ઈશ્યુ આજે ખૂલે છે
ઈશ્યુ બંધ થાય છે: 12# ઓગસ્ટ, 2011
એલોટમેન્ટ રોજ પહેલો તે વહેલો ધોરણે કરાશે.
SMS 'IIISL' to 567675555 | Gaurav Singh on +91 98671 04247
ncd@indiainfoline.com | www.indiainfoline.com
#આવશ્યક મંજૂરીઓને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા નક્કી કરાઈ શકે તે સમયગાળા સુધી વહેલું બંધ કરવાના અને/ અથવા વિસ્તાર કરવાના વિકલ્પ સાથે. ઈશ્યુની સબ્સ્ક્રિપ્શન લિસ્ટ વહેલી બંધ કરવાની આવી ઘટનામાં અમારી કંપની તકેદારી રાખશે કે આવા વહેલા બંધની સૂચના અગ્રણી રાષ્ટ્રીય દૈનિક અખબારમાં જાહેરાત(તો) થકી બંધ થવાની આવી વહેલી તારીખે આપવામાં આવે.
**ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં ધરાવાતા એનસીડી પર.
ઈન્ડિયા ઈન્ફોલાઈન ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસ લિમિટેડ ("આઈઆઈઆઈએસએલ") એ બજારની સ્થિતિઓ અને અન્ય વિચારણાઓને આધીન સિક્યોર્ડ રિડીમેબલ નોન- કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પબ્લિક ઈશ્યુ પ્રસ્તાવિત કરે છે અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ– મહારાષ્ટ્ર, મુંબઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ પાસે સૂચિપત્ર નોંધાવ્યું છે. સૂચિપત્ર અમારી વેબસાઈટ www.iiflinvestments.com પર અને શેરબજારોની વેબસાઈટો www.nseindia.com અને www.bseindia.com અને એલએમની સંબંધિત વેબસાઈટો www.axisbank.com, www.jmfinancial.in અને www.akcapindia.com પર ઉપલબ્ધ છે. ઈશ્યુમાં સહભાગી થવાનો પ્રસ્તાવ ધરાવતા રોકાણકારોએ સૂચિપત્રમાં સમાવિષ્ટ માહિતીને આધારે જ રોકાણ કરવું.



Digitally Archived by: www.realpatidar.com/library

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



# અદાણીનો જી.કે.ના સંકુલ પર કબજો

## અદાણી મેડિકલ કોલેજે સરકારી હોસ્ટેલ તથા રહેણાકની બિલ્ડિંગ પચાવી પાડતાં હોસ્પિટલનો સ્ટાફ તથા નર્સિંગના છાત્રો બન્યા બેઘર : અદાણીએ પોતાના છાત્રોને હોસ્ટેલ આપી હોસ્પિટલના સ્ટાફને દર્દીઓના વીઆઇપી રૂમમાં તગેડયા : વીઆઇપી રૂમ પણ બન્યા ભંગાર

જિજ્ઞા વરસાણી . ભુજ

જી.કે.જનરલ હોસ્પિટલનો વહીવટ ધણીધોરી વગર ચાલી રહ્યો છે હોસ્પિટલના સ્ટાફને હટાવી સરકારી હોસ્ટેલ તથા બિલ્ડિંગોનો ભોગવટો અદાણી મેડિકલ કોલેજ કરી રહી હોવાથી જી.કે.જનરલનો સ્ટાફ તથા નર્સિંગના છાત્રોને દર્દીઓ માટેના વીઆઇપી રૂમો રહેવા ફાળવાયા છે. સરકારી મિલકત પર સરકારી કર્મચારીઓનો હક્ક છીનવી મેડિકલ કોલેજના છાત્ર તથા સ્ટાફને સગવડો અપાઇ રહી છે. આ અણધડ વહીવટનો 'દિવ્યભાસ્કરે' પર્દાફાશ કર્યો હતો.

'દિવ્યભાસ્કર'ની ટીમને મળેલી માહિતી મુજબ તલસ્પર્શી તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, હાલે સરકારી હોસ્ટેલ તથા મેડિકલ સ્ટોર બિલ્ડિંગ કે, જ્યાં એકવર્ષ અગાઉ જી.કે.જનરલનો હોસ્પિટલનો સ્ટાફ તથા નર્સિંગના છાત્રો રહેતા હતા તેઓને ત્યાંથી બેઘર કરી મેડિકલ કોલેજ કે જે પ્રાઇવેટ છે તેના સ્ટાફને તે બિલ્ડિંગો ફાળવી દેવાઇ છે, જેના પરિણામે હોસ્પિટલના સ્ટાફને હાલે દર્દીઓ માટેના વીઆઇપી રૂમો આપવામાં આવ્યા છે એક બાજુ દર્દીઓને હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમો હોવા છતાં સુવિધા આપવામાં આવતી નથી ને બીજી બાજુ જી.કે.જનરલ હોસ્પિટલના વહીવટદારો દર્દીઓ તથા પોતાના સ્ટાફને હેરાન કરી અદાણીના પગ ધોઇ રહ્યા છે.

દિવ્ય Expose ભાસ્કર

ત્રીજા માળે આવેલા ૨૫ જેટલા દર્દીઓ માટેના સ્પેશિયલ રૂમોમાં હોસ્પિટલનો સ્ટાફ થતા નર્સિંગના છાત્રોને રહેવા રૂમો ખોલી દેવાયા છે જ્યારે દર્દીઓ રૂપિયા ચૂકવવા તૈયાર હોવા છતાં સ્પેશિયલરૂમો નથી એમ કહી જનરલવોર્ડમાં મૂકી દેવાય છે. આ રૂમો દર્દીઓને ધ્યાને રાખી તૈયાર કરાયા હતા, પરંતુ તેનો લાભ દર્દીઓને આપવામાં આવતો નથી.

### અદાણીની સરમુખત્યાશાહીના કારણે સરકારી રહેણાંક હોવા છતાં દર્દીઓના એસી રૂમમાં રહેતા સરકારી કર્મચારીઓ...

કેમેરામાં કેદ થયેલી તસવીરો ૧, ૨, ૩ અને ૪માં જોતા જણાય છે હોસ્પિટલનો સ્ટાફ અહીં રહે છે. જ્યારે તસવીર ૫ અને ૬ જોતા જણાય છે એસી રૂમોમાં લબેલ જે તે ડિપાર્ટમેન્ટના પ્રોફેસરોની કચેરીના અને દર્દીઓના રૂમના છે. પરંતુ રહે છે તેમાં સ્વસ્થ માણસો. - મયૂર ચૌહાણ

### MCIની ટીમ આવે ત્યારે સ્ટાફને વીઆઇપી રૂમ ખાલી કરાવાય છે

એમસીઆઇની ટીમ આવે છે ત્યારે, અહીં રહેતા સરકારી સ્ટાફને હટાવી અન્યત્ર ખસેડાય છે. અને અદાણી પલંગ અન્ય સામાન હટાવી ટીપટોપ ઓફિસ તથા વીઆઇપી સગવડો ઉભી કરી ટીમને ઉલ્લુ બનાવે છે. અહીં રહેતા સ્ટાફે જણાવ્યું હતું કે, આ બાજુના રૂમમાં ટેબલો તથા અન્ય સામાનો ભરેલો જ રખાય છે. જ્યારે ટીમ ના આવે ત્યારે આ સામાન ફટાફટ અમારા રૂમમાં ગોઠવીને ફિલ્મી સેટ ઉભો કરી દેવાય છે.

### સરકારી સ્ટાફની અવદશા : પાણી નથી આવતું

સરકારે કરોડો ખર્ચી હોસ્ટિપલ બનાવી છે અને સરકારી સ્ટાફ માટે રહેણાંક અને હોસ્ટેલ બનાવ્યા છે. પરંતુ અદાણી નામના સાપે જ્યારથી હોસ્પિટલ ઉપર ભરડો લીધો છે ત્યારથી દર્દીઓ સાથે સ્ટાફ પણ ઘરબાર વીનાનો થઇ ગયો છે. વીઆઇપી રૂમતો હવે નામના જ રહ્યા છે. અહીંયા જે ફાર્માસીસ્ટ, એચઆઇવી કાઉન્સીલર, વગેરે જેવો સ્ટાફ તથા નર્સિંગ છાત્રોને રખાયા છે, પરંતુ પાણીના તો ઠેકાણા નથી. સ્ટાફે જણાવ્યું હતું કે, મેડિકલ છાત્રો છૂટથી પાણી વાપરે છે. બીલ પણ સરકાર ભરે છે પરંતુ અમને જ પાણી વ્યવસ્થિત મળતું નથી.

### અદાણીએ દરેક રહેણાંક પર હોશિયારી પૂર્વક કબજો જમાવ્યો

realpatidar.com

સૂત્રોએ જણાવ્યું હતું કે, અદાણીએ દબાણ કરી હોશિયારી પૂર્વક સરકારી ઇમારત પર કબજો જમાવી હોસ્પિટલના સ્ટાફને દર્દીઓના સ્પેશિયલ રૂમોમાં રહેવા મજબૂર કર્યા છે. કારણ કે, હાલે ક્યાંય પણ રહેવા માટે રૂમો રહ્યા નથી જેથી ભવિષ્યમાં કોઇપણ પ્રશ્ન ખડા થાય તો આ બાબતમાં અદાણી ક્યાંય ન ફસાય, પરંતુ દર્દીઓની સુવિધા ભોગવતાં હોસ્પિટલના સ્ટાફ પર આંગળી ચીંધાય અને હોસ્પિટલના વહીવટદારોને જવાબ આપવા પડે.

### હોસ્પિટલ સ્ટાફે અદાણી વિરુદ્ધ આપી કેફીયત

આ રૂમોમાં રહેતા હોસ્પિટલના સ્ટાફે કહ્યું હતું કે, અમે શું કરીએ ના છૂટકે અમને રહેવું પડે છે. હોસ્પિટલના વહીવટદારો અદાણીના દબાણ હેઠળ આ બધું કરી રહ્યા છે. અમારા રહેવાની સુવિધા અદાણીનો સ્ટાફ તથા છાત્રો ભોગવી રહ્યા છે. છતાં કોઇ કંઇ બોલતું નથી બે વર્ષ પહેલાં અમે સરકારી હોસ્ટેલની બિલ્ડિંગમાં રહેતા હતા. બીજા વર્ષે અમને ત્યાંથી હટાવી મેડિકલ સ્ટોરની બિલ્ડિંગમાં મુકાયા અને સરકારી હોસ્ટેલ મેડિકલના છાત્રોને આપી દેવાઇ. બીજા વર્ષે અમને મેડિકલ સ્ટોરની બિલ્ડિંગમાંથી પણ ખદેડી ત્યાં કોલેજના સ્ટાફને રૂમો આપી દેવાયા અને અમને દર્દીઓ માટેના હોસ્પિટલમાં આવેલા વીઆઇપી રૂમોમાં મૂકી દેવાયા અમારા સાથે સરકારી નર્સિંગ કોલેજના છાત્રો પણ રહે છે. આ બધુ હોસ્પિટલના જવાબદારો પણ જાણે છે. પરંતુ અદાણી સામે તેનું કંઇજ ઉપજતું નથી. એટલે જ અમારી અને દર્દીઓની આવી હાલત છે.

### સ્પેશિયલ રૂમોનું ફર્નિચર પણ મેડિકલ છાત્રોને આપી દેવાયું !

દર્દીઓ માટેના સ્પેશિયલ રૂમો એ.સી, સેટી,પંખા સહિતની અદ્યતન સુવિધાઓ છે, પરંતુ હાલે આ રૂમોમાંથી બધુ જ ફર્નિચર ગાયબ થઇ ગયું છે અહીં રહેતા હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું કે, અમને રૂમો અપાયા ત્યારે આ રૂમોમાં રહેલી લાકડાંની સેટી(પલંગ) ગાયબ હતા જે મેડિકલના છાત્રોને આપી દેવાયા છે અમને તો દર્દીઓના સૂવાના પલંગ અપાયા છે.

**શું કહે છે અદાણીના સી.એ.ઓ**

અદાણી મેડિકલ કોલેજના સી.એ.ઓ. મયૂર રાવલે કહ્યું હતું કે, આ હોસ્પિટલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનર શિપ છે. સ્ટાફ કવાર્ટરમાં સરકારે મકાન ફાળવ્યા છે. હાલે જે રૂમો અપાયા છે ત્યાં શરૂઆતમાં વી.આઇ.પી. પેશન્ટ માટેના રૂમોનું પ્રયોજન હતું પણ પાણીની સુવિધા ન હોતાં વપરાશ થતો નથી. હવે તે સગવડ હોતાં નર્સિંગ અને ડ્યૂટી સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા કરાઇ છે. સિવિલ સર્જન સાથે આપસી સમજૂતીથી આ ગોઠવણ કરાઇ છે.

**શું કહે છે સિવિલ સર્જન ?**

આ અંગે ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. નિરંજન રાવલે જણાવ્યું હતું કે, સરકારી કવાર્ટર્સમાં હાલે હોસ્પિટલમાં સોસાયટી તેમજ અદાણીનો સ્ટાફ રહે છે. જેના કારણે જગ્યાની તંગી સર્જાતાં હોસ્પિટલના બીજા માળે રહેવાની વ્યવસ્થા કરાઇ છે, જે સરકાર સાથે કરાયેલા એમ.ઓ.યુ. પ્રમાણે છે. હોસ્પિટલમાં વી.આઇ.પી. દર્દી માટેના કોઇ ખાસ રૂમની વ્યવસ્થા ન હોવાનું ઉમેરતાં ડો. રાવલે કહ્યું હતું કે, જૂની હોસ્પિટલમાં આવી સુવિધા દર્દીને અપાતી હતી.

# કુકમાના ગ્રામજનો પણ પદયાત્રા કરી આવેદન આપશે

એલ્યુમિનિયમ રિફાઇનરીથી જમીન, ખેતી, પર્યાવરણ બચાવવા જનજાગૃતિ રેલી

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કુકમામાં સ્થાપાનારા એલ્યુમિનિયમ રિફાઇનરીના કારણે ખેતી, જમીન અને માનવજીવનને મોટા પાયે આડઅસર થનાર છે. ત્યારે તેની સામે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશથી કુકમાથી ૫૦૦ જેટલા લોકોની રેલી ૨૦ કિ.મી. પદયાત્રા કરી ભુજમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા ગ્રામજનોની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. કુકમામાં મળેલી બેઠકમાં ભવિષ્યમાં એલ્યુમિનિયમ રિફાઇરીના કારણે ખેતી, જમીનને થનારા નુકસાનથી બચવા ફેકટરી બંધ થાય તેના માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા નિર્ણય લેવાયો હતો. આ રેલી સવારે ૮.૩૦ કલાકે નીકળશે. બપોરે ૨ કલાકે ભદ્રેશ્વરની રેલી સાથે જોડાયા બાદ આવેદનપત્ર પાઠવશે. આ બેઠકમાં શાંતિલાલ પરમાર, મુકુંદભાઇ પરમાર, દેવજીભાઇ આહિર, વિનોદ પટેલ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા.

# સામત્રા પાસે ૪૦ હજારના ભંગાર સાથે જીપ પકડાઇ

ભાસ્કર ન્યૂઝ.ભુજ

તાલુકાના સામત્રા પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દયાપરથી આવતી ભંગાર ભરેલી જીપને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી હતી. સામત્રા ટોલ નાકા પાસે દયાપરથી જીપ જીજે ૧૨ વી ૩૬૪૫ લઇને હુશેન રમજુ નોતિયાર પસાર થયો હતો. એલ. સી. બી.એ તેને અટકાવીને તલાશી લેતાં એમાંથી ૧૪૦૦ કિલોગ્રામ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.

આ ભંગાર ચોરાઉ છે કે કેમ એ વિશે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

# ચાલો તાલુકે કાર્યક્રમ લોકોની પરેશાની વધારશે

જિલ્લા કોંગ્રેસ કમિટિએ રાજ્ય સરકાર પર કર્યા આક્ષેપો

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ગુજરાત ભાજપ સરકાર દ્વારા ચાલો તાલુકે કાર્યક્રમ શરૂ કરેલું છે, ત્યારે ભાજપનાં ચૂંટાયેલા ધારાસભ્યો લોકોની હાલાકી દૂર કરી શકે તેમ છે ?

કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું છે કે, ચાલો તાલુકે કાર્યક્રમનાં કારણે મોટા ભાગની વહીવટી કામગીરી ઠપ થઇ જશે અને લોકોને પારાવાર પરેશાની ભોગવવી પડશે.

ભાજપ તરફથી આ એક નાટક ઉભુ કરી અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને ભાજપની પ્રસિદ્ધિ મેળવવા માટેનું સ્ટંટ છે.ખરેખર ભાજપને કચ્છનાં લોકોની ચિંતા હોય તો વરસાદ ખેંચાઇ ગયેલ છે ત્યારે નર્મદાના નીર પૂરતા મળે, લિગ્નાઇટની ખાણો બંધ થઇ ગયેલ છે જે ચાલુ કરાવે, ખેડૂતોનાં ખેતરોમાંથી વીજલાઇનો તેમજ તેલની પાઇપ લાઇનો પસાર થાય છે. તેમાં પૂરતુ વળતર અપાવે તો તે એક કાર્ય કર્યું ગણાશે.

ભાજપના રાજમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. નાના-મોટા કોઇપણ કામમાં પ્રસાદી ધર્યા સિવાય કોઇ કામો થતાં નથી. જેથી ભાજપે આવા કાર્યક્રમોથી દૂર રહી લોકોને ઉપયોગી થવાનાં કાર્યો કરે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. એવું હુંબલે જણાવ્યું હતું.

# કચ્છીની ગ્રીન એમ્બેસેડર તરીકેની વરણી આવકારાઇ

ભાસ્કર ન્યૂઝ . ભુજ

રાજ્ય સરકારે તાજેતરમાં નલિયાના ખેતશીભાઇ મહેશ્વરીની ગ્રીન એમ્બેસેડર તરીકે કરેલી નિમણૂકને કચ્છ ઇકોલોજી ફાઉન્ડેશનને આવકાર આપ્યો છે.

નલિયામાં સમાજ સેવાના વિવિધ કાર્યો કરતાં સ્વ. મામદશેઠના ગ્રૂપના તેઓ અગ્રીમ કાર્યકર છે. આ વિસ્તારના ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલી માટે સંકલનનું કામ કરતા ખેતશીભાઇએ ગ્રીન એમ્બેસેડર તીરેક નિમણૂક મેળવતા વેતજ નલિયાના વથાણમાં તડકામાં શેકાતી ગાયોને શીતળ છાંયડો મળે તે હેતુથી ટ્રી ગાર્ડન સાથે વૃક્ષારોપણ કરી પોતાના કાર્યોનો આરંભ કર્યો હતો. આ માટે ભુજની માનવ જયોત સંસ્થાએ પૂર્વ નગરપતિ દેવરાજભાઇ ગઢવી અને ધમેન્દ્ર જેસરનો સંપર્ક સાધી ટ્રી ગાર્ડનની વ્યવસ્થા કરીઆપી હતી.

કચ્છ ઇકોલોજી ફાઉન્ડેશનના એલ. ડી. શાહે આ વરણીને આવકારતાં ઉમેર્યું હતું કે કચ્છમાં વન વિભાગ કાર્યરત છે પણ સંલનના અભાવે વૃક્ષારોપણના ધાર્યા પરિણામો મળતાં ન હતા પણ હવે ગ્રીન નવનિયુકત એમ્બેસેડર સેતુની ભૂમિકા ભજવશે.

રેલવેનું નિંભર તંત્ર આ સમસ્યા ક્યારે ઉકેલશે ?

# અંજારના રેલવે ક્રોસિંગ પાસે ફરી એકવાર ટ્રાફિક જામ

લોખંડની પ્લેટો ભરેલી ટ્રકો પસાર થતાં ઉભી થઇ સમસ્યા

ભાસ્કર ન્યૂઝ . અંજાર

હજુ મંગળવારે એક ટ્રક ફાટકમાં અથડાતા અંજારના રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકથી વાહનોની લાંબી કતાર લાગી હતી તો બીજા દિવસે લોખંડની તોતિંગ પ્લેટો ભરેલી ટ્રકો પસાર થતાં ટ્રાફિક ઓર એક કડવો અનુભવ સૌએ કર્યો હતો. જો કે અહીં રોજના માથાના દુ:ખાવા સમાન આ સમસ્યા પ્રત્યે નિંભર બની ગયેલું રેલવે તંત્ર કોઇ ધ્યાન આપતું નથી.

માલવાહક ભારે વાહન પસાર થતાં લાગેલી કતાર - ભાવેશ ગોર

અંજારના વરસામેડીના રેલવે ક્રોસિંગ પર મંગળવારે ટ્રક અથડાયાની ઘટનાના બીજા જ દિવસે ત્રણ મોટી ટ્રકો લોખંડની મહાકાય પ્લેટો લઇને પસાર થઇ ત્યારે બંને બાજુ અનેક વાહનોના પૈડા થંભી ગયા હતા.આ સમસ્યા અને અંજારના અગ્રણીઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા રેલવે તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં ક્રોસિંગને પહોળું કરવા મામલે તંત્રએ ઉદાસીન વલણ જાળવી રાખ્યુંછે.

# ભચાઉ આઇસીડીએસની કામગીરીમાં ગેરરીતિની ગંધ

આંગણવડી સંચાલકોના પગાર, મસાલા બિલ અને ટ્રાઇ સાઇકલમાં ગોટાળાની રાવ

ભાસ્કર ન્યૂઝ. ભચાઉ

ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્ર પર બાળકોને પોષણ મુક્ત આહાર મળી રહે તે માટે વિવિધ પ્રકારની યોજનાઓ સંકલીત બાળ વિકાસ યોજના અંતર્ગત અમલ કરે છે પરંતુ ભચાઉ આઇ.સી.સી. એસ.માં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે.

આંગણવાડી કેન્દ્રો ટ્રાઇસાઇકલ આપવાની યોજના અમલમાં મુકાય છે પરંતુ દરેક આંગણવાડી વર્કરોના બેંકખાતામાં સાઇકલો માટે રૂ.૧૦૦૦ જમા કરાવવામાં આવે અને ઉપરથી એમ કહેવામાં આવે છે કે, સારી સાઇકલો ખરીદવી, પરંતુ

ખરીદાયેલો સાઇકલનો જથ્થો -

બધી બહેનો પાસેથી રૂા. ૧૦૦૦ લઇને બહેનો દ્વારા જે ત્રણ સાઇકલો આપવામાં આવી તે ચાલુ કંપનીની ૨૫૦ વાળી ત્રણ એમ ૭૫૦ થાય. આ સાઇકલના દુકાનદાર પાસેથી પણ આ અધિકારી બહેને સારું એવું કમિશન મેળવ્યું છે. આ બાબતે આઇ.સી.સી.એસ.ના અધિકારી મીતાબેન દવેએ જણાવ્યું હતું કે, સૂચના મુજબ રૂા.૧૦૦૦ વર્કર બેનના ખાતામા જમા કરાવવાના હોય છે. ત્રણ સાઇકલ માટે રૂા.૧૦૦૦ ફાળવવામાં આવે છે.

# ઓવર લોડેડ વાહનોને કારણે નલિયાનો માર્ગ બિસમાર

જો તંત્ર દ્વારા દંડનાત્મક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

ભાસ્કર ન્યૂઝ.ભુજ

વર્ષો બાદની માગણી બાદ બનાવાયેલો નલિયાથી દેશલપરનો ડબલ રોડ તેના પર પસાર થતા ઓવર લોડેડ વાહનોને કારણે ચાર માસમાં જ જર્જરિત થઇ ગયો છે. તેવા આક્ષેપ સાથે જો વાહન ચાલકો સામે કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.

જે.પી. સિમેન્ટ તેમજ સાંધીમાંથી બે કે ત્રણ ઘણો ઓવર લોડ માલ ભરીને આ માર્ગેથી ટ્રકો નીકળે છે જેની સાબિતિ રૂપે નલિયાથી દેશલપર આવતી માર્ગની ડાબી બાજુજ મોટા મોટા ગાબડા પડી ગયા છે તેવો આક્ષેપ જનતા દળ (યુ) ના અબડાસા તાલૂકા પ્રમુખ શકિતસિંહ જાડેજા એ કરતાં આરટીઓ તેમજ પક્ષના જિલ્લા પ્રમુખ શૈલેષ જોશી સમક્ષ રજૂઆત કરી છે. જો ઓવર લોડેડ વાહનો સામે કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.



રસ્તાની બાજુઓ ધોવાઇ ગયેલી તસવીરમાં નજરે પડે છે તેમજ ઓવરલોડ ભરેલી ટ્રક પણ આ વિસ્તારમાંથી પસાર થતાં કેમેરામાં ઝડપાઇ ગઇ હતી - મયૂર ચૌહાણ

Digitally Archived by: www.realpatidar.com/library

દિવ્ય ભાસ્કર | ભુજ | ભુજ. ગુરુવાર ૪ ઓગસ્ટ, ૨૦૧૧ 

## બારિસ તુમ કબ આઓગે

ભુજનું હૃદય એટલે હમીરસર તળાવ સામાન્ય રીતે આ દિવસોમાં પૂરતો વરસાદ આવી જવાથી આ તળાવ છલોછલ ભરેલું હોય અને લોકો શ્રાવણના મેળામાં મહાલવાનો ઓર આનંદ લેતા હોય છે. જ્યારે પવિત્ર માસ શરૂ થવાને એક દિવસ જ બાકી છે. પણ હજુ મેઘરાજાએ ભુજ પર કૃપા નથી કરી ત્યારે દરેક ભુજવાસીના મોઢેથી સરી પડે- 'બારિસ તુમ કબ આઓગે' - પ્રકાશ ભટ્ટ

### દોસ્તથી મોંઘેરું બીજું વળી શું હોય ?

# રૂપિયા ૨થી ૧૩૦૦ સુધીના ફ્રેન્ડશિપ બેલ્ટ બન્યા આકર્ષણ

વીંટી, કપ, ચોકલેટ, કાર્ડસ જેવી વસ્તુ મળી અંદાજે બે લાખનું થાય છે વેચાણ

તેજસ પટ્ટણી . ભુજ

છેલ્લા એકાદ દાયકાથી મિત્ર માટેના વિશેષ દિવસ ઉજવવાની શરૂઆત થઇ છે. ઓગસ્ટ માસનો પ્રથમ રવિવાર આવે એટલે ફ્રેન્ડશિપ-ડે ઉજવવા બાલ વૃદ્ધ સૌ કોઇ રાજીપો અનુભવે છે. ભુજની બજારમાં બે રૂપિયાથી માંડી ૧૩૦૦ સુધીના બેલ્ટ વેચાય છે. મોંઘવારી નજર અંદાજ કરી તેની ખરીદી થઇ રહી છે. અંકે અંદાજ મુજબ ભુજમાં જ બે લાખથી વધુનું વેચાણ થાય છે.

૭મી ઓગસ્ટે પોતાના મિત્રને શ્રેષ્ઠ ગિફ્ટ આપવા માટે જાણે હોડમંડાઇ હોય તેમ ચીજ વસ્તુઓ ખરીદાઇ રહી છે. 'સ્પેશ્યલ ફ્રેન્ડ' માટે ચાંદી સોનાના પટ્ટા પણ ખરીદાય છે. ગિફ્ટ આર્ટિકલના પ્રેમલભાઇ ઠક્કરે કહ્યું કે, ૨૦૦થી ૩૦૦ની ગીફ્ટ વિશેષ ખરીદાઇ રહી છે. અન્ય એક ધંધાર્થી મિતેશ શાહે જણાવ્યું કે, માત્ર યુવાનો જ નહીં અબાલ વૃદ્ધો સૌ કોઇ એક લાગણીથી આ દિવસે બેલ્ટ ઉપરાંત અન્ય વસ્તુની આપ લે કરે છે. માત્ર બેલ્ટ જ નહી રમકડા પણ અપાતાં હોય છે. શિવમ કાર્ડઝના માલિકે કહ્યું કે, ચોકલેટ, ગ્રિટિંગ કાર્ડઝ જેવી વસ્તુઓ

બજારમાં ફ્રેન્ડશિપ બેલ્ટ અને વિક્રેતા નજરે પડે છે. કાંતિ ઠક્કર

### ફ્રેન્ડશિપ રિંગ ધૂમ મચાવશે

રિંગ એટલે કે વીંટી સામાન્ય રીતે સગપણમાં જ વપરાતી હોય છે પણ આ વખતે ફ્રેન્ડશિપ રિંગ પણ ધૂમ મચાવે તેવી શક્યતા છે. વીંટીના સેટમાં બે મિત્રો સામસામે રિંગ પહેરાવી તેની ઉજવણી કરશે.

### હું મારી બહેનને મિત્ર માનીશ

ઘરનાને દોસ્ત બનાવો તે જીવન સુંદર બંને એવું કહી ખરીદી કરતા આવેલા હારિતાએ કહ્યું કે, હું તો મારી બેનને જ બેસ્ટ બેલ્ટ આપી હેપી ફ્રેન્ડશિપ ડે કહીશ નાનકડી બેબી રોઝએ તેની મમ્મીને બેલ્ટ બાંધવા ઇચ્છા વ્યકત કરી હતી.

# કચ્છમાં રેતશિલ્પરૂપી દૂંદાળાદેવ સ્થપાશે

ગણેશોત્સવ દરમિયાન માંડવી અને ભુજમાં આયોજન: ગ્લોબલ વોર્મિંગ સામે માંડવીના કલાકાર અનીલ જોશીની અનોખી પહેલ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ગ્લોબલ વોર્મિંગના એલાર્મ વચ્ચે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી પ્રતિમાઓ જોખમી સાબિત થઇ શકે છે તેવા નિર્દેશો સામે કચ્છના માંડવીના ૩૫ વર્ષીય કલાકારે ઉત્સવની ઉજવણીમાં પણ આવો સંદેશ વહેતો કરવાની હિમાયત કરી છે. ભાદરવા સુદ ચોથથી ચૌદસ સુધી ભારતભરમાં ઉજવાનારા ગણેશ ઉત્સવ દરમિયાન માંડવી અને ભુજ માટે રેતીમાંથી દૂંદાળા દેવની મૂર્તિ બનાવવામાં આવશે.

અનિલભાઇ

માંડવીના રેતશિલ્પના કલાકાર અનીલ જોશી દ્વારા આ પ્રયાસ થવાનો છે અને તે સુરતમાં પણ રેતીમાંથી તૈયાર થનારા વિઘ્નહર્તાના દર્શન થાય તેવું આયોજન ગોઠવાઇ રહ્યું છે.

કચ્છના દરિયાકિનારે ઓરિસ્સાના જાણીતા કલાકારો સુદર્શન પટનાયક અને મનમોહન મહાપાત્ર દ્વારા નજીકના ભૂતકાળમાં તૈયાર કરાયેલા રેતશિલ્પ બાદ સ્થાનિક ચિત્ર કલાકાર દ્વારા રેતીમાં હાથ અજમાવાયો છે. આ અંગે આજે કલાકારની ઉપસ્થિતિમાં માંડવીના પૂર્વ નગરપતિ અનિરુદ્ધ દવેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ તથા મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમાં રેતશિલ્પની કારીગરીને પ્રત્સાહિત કરવાના સંદેશ તથા કંઇક નવું કરવાની ધગશ સાથે ગણપતિની મુવેબલ મૂર્તિ રેતીમાંથી તૈયાર કરાશે. તેમણે જણાવ્યું હતું કે ગણેશોત્સવ ધાર્મિક ભાવના સાથે પણ જોડાયેલો હોવાથી આ પ્રકલ્પ પ્રાથમિક તબક્કે જ હાથ ધરાશે. જેમાં માંડવીના આઝાદ ચોકમાં જ્ઞાનગિરિ મઠમાં કલાકૃતિ દર્શાવતી પ્રતિમા સાથે રેતશિલ્પવાળા ગણપતિ મહારાજની સ્થાપના કરાશે. અહીં ચારથી પાંચ ફૂટની મૂર્તિ તૈયાર થવાની છે.

પંકજભાઇ રાજગોરે તેમના માતાજીના નામે આ પ્રતિમાના નિર્માણ માટે સૌજન્ય દાખવ્યું છે અને અહીંથી જ આવા ગ્લોબલ વોર્મિંગ સામેના મહત્ત્વના મેસેજના શ્રીગણેશ કરાશે. આ પ્રતિમા બનાવતાં અંદાજે બે દિવસનો સમય લાગશે. જે ૧૦ દિવસ સુધી દર્શનિય રહેશે અને ત્યારબાદ વિસર્જન કરાશે.

### હોસ્પિટલ રોડ પર રેતીના ગણેશ બેસાડાશે

લંબોદરની પ્રતિમા માંડવી ઉપરાંત ભુજમાં પણ સ્થાપિત કરવામાં આવનાર છે. હોસ્પિટલ રોડ પર યોજાતા ગણેશ મહોત્સવમાં રેતશિલ્પની ૨૦ ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન થવાની છે. આ માટે ફ્રેન્ડસ ગ્રૂપ દ્વારા તૈયારી દર્શાવાઇ હોવાનું દવેએ જણાવ્યું હતું. કલાકાર જોશીએ કહ્યું હતું કે ૨૦ ફૂટ જેટલી ઊંચી મૂર્તિ બનાવવા માટે આશરે ૧૫ દિવસનો સમય લાગશે.

### કેવી રીતે તૈયાર થશે રેતગણપતિ ?

દરિયાકિનારે તૈયાર કરાતા રેતશિલ્પ જેવા જ વિનાયકને ગણેશ મહોત્સવમાં મૂકવામાં આવશે. સ્થળાંતરિત થઇ શકે એવી પ્રતિમાની જાળવણી કરવી અઘરી છે અને તે માટે તેમના દ્વારા પૂરતા પયત્ન થવાના છે એમ અનિલભાઇએ જણાવ્યું હતું. ગોળવાળા પાણીનો સમયાંતરે છંટકાવ તથા ઝાડ, પાન, બાંબુની મદદથી આ ગજાનનનું નિર્માણ કરવામાં આવશે.

# લોનના નામે છેતરપિંડી કરાઇ

ભુજના વ્યક્તિને છેતરી વડોદરાના શખ્સે કોરા ચેક લઇને બેંક અકાઉન્ટમાંથી ૩૫ હજાર ઉપાડી લીધા

ભાસ્કર ન્યૂઝ.ભુજ

રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લોન અપાવી દેવાના નામે અનેક ધૂતારા લોકો ફરી રહ્યા છે. વડોદરાના શખ્સએ ભુજની વ્યક્તિને વિશ્વાસમાં લઇને તેની પાસેથી બે કોરા ચેક પડાવી લીધા બાદ તેના બેંક અકાઉન્ટમાંથી ૩૫ હજાર જેવી રકમ ઉઠાવી લેતાં છેતરાયેલી વ્યક્તિ સંકટમાં મૂકાઇ ગઇ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા લોન અપાવવાની જાહેરાત વાંચીને ભુજની વ્યક્તિએ આ વડોદરા વાસી એન. વી. સાવંદકર નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. આ માણસ ત્યાર બાદ તેનો કીમિયો સફળ બનાવવા ભુજ આવ્યો હતો અને તેણે તેના શિકારને શોધીને તેને વિશ્વાસના શીશામાં ઉતાર્યો હતો. તેની પાસેથી બે કોરા ચેક મેળવી લીધા હતા. બે ત્રણ દિવસ પછી મળશું એમ કહી એ ધુતાર જતો રહ્યો હતો. એ જ દિવસે એ વ્યક્તિના બેંક અકાઉન્ટ માંથી પ્રથમ રૂા. ૨૮૦૦૦ અને પછી રૂા. ૭૦૦૦ની રકમ ઉપડી ગઇ હતી. આ પ્રમાણે અચાનક રૂા. ૩૫ હજારની રકમ ગુમાવતા એ વ્યક્તિને માથે હાથ મૂકીને અફસોસ કરવા સિવાય કોઇ રસ્તો ન હોતો કેમ કે તેણે બેંકમાં જઇને પોતાનું એકાઉન્ટ લોક કરાવ્યું ત્યાર બાદ પોલીસમાં ગયો ત્યાં પણ કોઇ એની ફરિયાદમાં રસ બતાવ્યો ન હોતો.



બેંકની પાસબુકની નકલ.

### ધૂતારાએ ધમકાવ્યો !

ભોગ બનનારે પોતાનું એકાઉન્ટ લોક કરાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરી એની જાણ થતાં જ ધૂતારાએ તેને ફોન કરીને ધમકાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ભુજની વ્યક્તિએ તેને વકીલ મારફતે નોટિસ પણ પાઠવી દીધી છે.

# માનકૂવામાં ૨૫ હજારના ભંગારની તસ્કરી : આરોપી હાથવેંતમાં

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજના માનકૂવામાં રાત્રિના સમય દરમિયાન સ્પેર પાર્ટની એક દુકાનના શટર તોડી તસ્કરો રૂા. ૨૫ હજારનો ભંગાર ઉઠાવી ગયા હતા. તસ્કરો હાથવેંતમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોએ માનકૂવાના નવાવાસમાં રહેતા માવજી શિવજી વરસાણીની ફરિયાદ ટાંકીને કહ્યું કે, તેમની દુકાનના શટર તોડીને તા. ૨ના રાત્રિના ૮થી તા. ૩ના સવારના ૮.૧૫ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ૧૦૦ કિલોનો પિત્તળનો ભંગાર ઉઠાવી ગયા હતા. ભંગાર ચોરી ગયેલા શખ્સો મુદ્દામાલ સાથે જ નજીકના સમયમાં પકડી પડાશે તેવું પોલીસ સૂત્રોએ વિશ્વાસપૂર્વક ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુકાનમાં ચોથીવાર તસ્કરી થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ચોરીના પગલે પટેલ ચોવીસીમાં ચકચાર જાગી હતી.



કચ્છ તેમજ નૈરોબી, લંડન સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં કઠોળ, ડ્રાયફ્રૂટ, બુક સ્ટોલ, ફળફૂલ કે લાઇટ ડેકોરેનના કલાત્મક હિંડોળાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. - કાંતિ ઠક્કર, રામજી હિરાણી, સુરેશ વરસાણી

# પવિત્ર શ્રાવણ અને રમજાન માસને અનુલક્ષી નિયમિત પાણી આપો

ભાસ્કર ન્યૂઝ. ભુજ

હિન્દુ- મુસ્લિમ કોમના પવિત્ર ગણાતા એવા શ્રાવણ અને રમજાન માસ શરૂ થઇ ગયા છે. તેવામાં ભાવિકોની સુવિધા માટે ભુજમાં વહેલી સવારે નિયમિત અને પૂરતા દબાણ સાથે પેયજલ આપવા ચીફ ઓફિસર સમક્ષ માંગ કરાઇ છે. વહેલી સવારે મંદિર મસ્જિદમાં શ્રદ્ધાળુઓ જતા હોવાથી પૂરતું પાણી આપવું જરૂરી છે. આ ઉપરાંત શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા અને સવારે મોડે સુધી તેમજ સાંજે વહેલી રોડ લાઇટ ચાલુ કરવા કાઉન્સિલર ગની એ. કુંભાર, રાજેન્દ્રસિંહ જાડેજા, માલસી માતંગ, મહેન્દ્ર ઠક્કર, ફાતમાબેન સમાએ માગણી કરી છે.


ENTERTAINMENT
08860923043
08860923064
08860923068
08860923002
08860923129
08860923179
08860923301
PARI FRIENDSHIP CLUB

Ganpat University
Ganpat Vidyanagar, Kherva-382711 Dist.-Mehsana
Phone No. (02762) 286080, 286924
ADMISSION TO NRI SEATS
Applications are invited from the students who have already applied and cleared the GCET-2011, for admission to NRI/NRI Sponsored Seats offered by the V. M. Patel Institute of Management (For MBA Programmes) Application form on payment of Rs.350/- (non-refundable) can be obtained from the Ganpat University from 04-08-2011 &11-08-2011 (Excluding Sunday) between 11.00am to 04.00pm. Duly filled-up forms with all relevant documents should be submitted personally at the University Office.
Important Dates
Distribution & Acceptance of form :
04-08-2011 to 11-08-2011 (Excluding Sunday)
Date : 04-08-2011 Registrar
Advt. No. 27/2011

સુરજના સથવારે હરિયાળી ખેતી
bright Solar
બ્રાઇટ સોલાર વોટર પંપ

... સોલાર પંપની વિશેષતાઓ ...

● ભારતનો સૌ પ્રથમ સુર્ય ઉર્જાથી સ્વયં સંચાલીત પંપ ● કોઇપણ પાણીના સ્તર પર કામ કરવાની ક્ષમતા ધરાવતો અને ઉપયોગી પંપ સેટ ● વિશેષ ચકાસણી અને તજજ્ઞોના ઉપયોગ બાદ આધુનિક ટેક્નોલોજી અને ખાસીયતોથી સજ્જ ● નજીવા ખર્ચથી કોઇપણ ખેતરમાં ખુબ જ સરળતાથી ફીટ કરી શકાય તેવા મોડલો ઉપલબ્ધ ● તદ્દન મફતમાં ચાલતો પંપ ● રાત્રે ખેતરોમાં પાણી પાવાથી છુટકારો ● લાઇટ કનેક્શન વગર પણ પાણી મેળવો.
: આર્થિક સહાયતા : ♣ કુલ કિંમતના ૩૦ ટકા કેપીટલ સબસિડી ♣ બાકી રકમ પર પણ લોન ઉપલબ્ધ (ફક્ત ૫ ટકા વાર્ષિક વ્યાજના દરે)
: વોરંટી / લાઇફ : ♣ દરેક સિસ્ટમ માટે પાંચ વર્ષની વોરંટી ♣ સોલાર પેનલની વોરંટી ૨૫ વર્ષ ♣ સિસ્ટમની લાઇફ ૩૫ વર્ષ
: એપ્લીકેશન : ♣ કુવા દ્વારા ખેતી ♣ નદી અને કેનાલ દ્વારા ખેતી ♣ બોર દ્વારા ખેતી ♣ ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ અને પીવાના પાણી માટે.
Our Partnership with SUN
Bright Solar Pvt. Ltd.
RESCOs & Solar Systems Integrator
Office : 44, Narayan Mill Compound, Opp. Jiviba Party Plot, Near CTM Cross Road, CTM, Ahmedabad - 380026. Gujarat (INDIA)
Mobile : 07878556205 // 09377756205//E-mail : pbthumar@gmail.com
BSCIC NABCB QM 030 ISO 9001 REGISTERED

સ્વર્ણની શક્તિનો અહેસાસ હર બાર ....

આપને ક્યારેય નિરાશ ન કરે...
'એકસ્ટ્રા સ્વર્ણ અને મૂસલી'
free consultation call

Proposal For Starting KIDZEE
Kidzee, Asia's No.1 preschool chain is expanding its network of preschools in your city. Proposals are invited from passionate individuals to become a Kidzee franchisee and explore unlimited opportunities in the area of Early Childhood Care & Education. The requirement for the proud ownership of a Kidzee franchise is an investment between 8 to 10 Lakhs and a space requirement of 3000 sqft.
• 750 Centers across India
• Best content and delivery award 2011
• Franchisor of the Year 2010 across all sectors

Call us: 093200 63100 | Mail us: franchise@zeelearn.com
www.kidzee.com
Enquiries to start Mount Litera Zee School are also solicited
India's second largest chain with 78 Schools.
ZEE LEARN

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



## આજનું પંચાંગ

વિક્રમ સંવત : ૨૦૬૭
શાલિવાહન સંવત : ૧૯૩૩
ખ્રિસ્તી સંવત : ૨૦૧૧
રાષ્ટ્રીય દિનાંક : ૧૩
યુગાબ્દ : ૫૧૧૩
જૈન સંવત : ૨૫૩૭
ઈસ્લામિક સંવત : ૧૪૩૨
પારસી વર્ષ : ૧૩૮૦




**તિથિ :** શ્રાવણ સુદ - ૫ **ખ્રિસ્તી તિથિ :** ૪ ઓગસ્ટ, ગુરુવાર
**પારસી :** ૨૧ **ઈસ્લામિક :** ૩ - રમજાન
**આજનો તહેવાર :** કલ્કી જયંતી

સૂર્યોદય-સૂર્યાસ્ત :

| શહેર | સૂર્યોદય | નવકારશી | સૂર્યાસ્ત | ચંદ્રોદય | ચંદ્રાસ્ત |
|---|---|---|---|---|---|
| સુરજબારી | ૦૬-૧૧ | ૦૬-૫૯ | ૧૯-૩૫ | ૨૨-૦૪ | ૧૦-૨૧ |
| ગાંધીધામ | ૦૬-૧૩ | ૦૭-૦૧ | ૧૯-૩૭ | ૨૨-૦૬ | ૧૦-૨૩ |
| ભુજ | ૦૬-૧૫ | ૦૭-૦૩ | ૧૯-૩૯ | ૨૨-૦૮ | ૧૦-૨૫ |
| નખત્રાણા | ૦૬-૧૬ | ૦૭-૦૪ | ૧૯-૪૦ | ૨૨-૦૯ | ૧૦-૨૭ |
| કોટેશ્વર | ૦૬-૧૯ | ૦૭-૦૭ | ૧૯-૪૩ | ૨૨-૧૨ | ૧૦-૨૯ |

**ગ્રહોની ચાલ : સૂર્ય :** કર્ક **નક્ષત્ર :** હસ્ત **યોગ :** સિદ્ધ **કરણ :** કૌલવ
રાહુકાલ : ૧૩-૩૦થી ૧૫-૦૦સુધી (રાહુકાલમાં શુભારંભ ન કરવો.)
દિશાશૂલ : અગ્નિ (તે દિશામાં પ્રવાસ ન કરવો.)

| ગોચર ગ્રહ | ૧ મેષ | ૨ વૃષભ | ૩ મિથુન | ૪ કર્ક | ૫ સિંહ | ૬ કન્યા | ૮ વૃશ્ચિક |
|---|---|---|---|---|---|---|---|
| સ્થિતિ : | ગુ. | કે. | મં. | સૂ.શુ. | બુ. | ચં.શ. | રા. |

**આજની ચંદ્રરાશિ :** કન્યા **નામાક્ષર :** પ, ઠ, ણ
**દિવસનાં ચોઘડિયાં :** શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
(પ્રત્યેક ચોઘડિયું ૧॥ કલાકનું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી)
**રાત્રિનાં ચોઘડિયાં :** અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

## આજનું રાશિફળ

કંદર્પભાઈ ત્રિવેદી

**મેષ** (શુભ રંગ : લાલ, શુભ અંક : ૧-૮) — **નામાક્ષર - અ, લ, ઈ ।** વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. હિતશત્રુઓથી સંભાળવું.

**વૃષભ** (શુભ રંગ : સફેદ, શુભ અંક : ૨-૭) — **નામાક્ષર - બ, વ, ઉ ।** વાહન-જમીન-મકાનની ખરીદી થઈ શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. નાણાભીડ દૂર થાય.

**મિથુન** (શુભ રંગ : લીંબુ, શુભ અંક : ૩-૬) — **નામાક્ષર - ક, છ, ઘ ।** સંતાનસંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વેપારાર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી.

**કર્ક** (શુભ રંગ : દૂધિયો, શુભ અંક : ૪) — **નામાક્ષર - ડ, હ ।** જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોનાં પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્યની કાળજી રાખવી. લગ્નજીવન સુખમય બની રહે.

**સિંહ** (શુભ રંગ : સોનેરી, શુભ અંક : ૫) — **નામાક્ષર - મ, ટ ।** કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. વારસાગત મિલકતનાં પ્રશ્નોમાં વડીલોનું માર્ગદર્શન મળી રહે. નોકરી-વેપાર ન્ક્ષેત્રે સમય પ્રગતિદાયક.

**કન્યા** (શુભ રંગ : લીલો, શુભ અંક : ૬-૩) — **નામાક્ષર - પ, ઠ, ણ ।** આવકના સ્રોતમાં વધારો થઈ શકે છે. વાહન ચલાવતા સંભાળવું. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. ભાગ્યોદયની તક મળી શકે છે.

**તુલા** (શુભ રંગ : સફેદ, શુભ અંક : ૭-૨) — **નામાક્ષર - ર, ત ।** માનસિક ચિંતા હળવી બનતી જણાય. આકસ્મિક ધન-લાભ થઈ શકે છે. વેપાર-વાણિજ્ય ક્ષેત્રે મોટાં સાહસ થઈ શકે છે. સ્પર્ધામાં સફળતા.

**વૃશ્ચિક** (શુભ રંગ : લાલ, શુભ અંક : ૮-૧) — **નામાક્ષર - ન, ય ।** આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જણાય. કૌટુંબિક વિખવાદોનો અંત આવતો જણાય. સ્થાવર મિલકતની ખરીદી થઇ શકે છે. સમય શુભ.

**ધન** (શુભ રંગ : પીળો, શુભ અંક : ૯-૧૨) — **નામાક્ષર - ભ, ધ, ફ ઢ ।** વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં કાળજી રાખવી. વાહન-જમીન-મકાનના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે.

**મકર** (શુભ રંગ : વાદળી, શુભ અંક : ૧૦-૧૧) — **નામાક્ષર - ખ, જ ।** આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. રોજગારીની નવી તક મળી શકે છે.

**કુંભ** (શુભ રંગ : વાદળી, શુભ અંક : ૧૧-૧૦) — **નામાક્ષર - ગ, સ, શ, ષ ।** આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જણાય. વાહન-જમીનની ખરીદી થઈ શકે છે. વેપાર ક્ષેત્રે નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી. સમય સાનુકૂળ.

**મીન** (શુભ રંગ : પીળો, શુભ અંક : ૧૨-૯) — **નામાક્ષર - દ, ચ, ઝ, થ ।** દિવસ આનંદમય પસાર થઈ શકે છે. વારસાગત મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. કૌટુંબિક વિખવાદોમાં વડીલોનું માર્ગદર્શન મળી રહે.

## ક્રોસવર્ડ-૨૪૭૧

ભૂપેન્દ્ર શાહ 'શંભુ'




**આડી ચાવી**
1. સંતાવવાની એક રમત (5)
4. જમીનમાં કરેલું ભોંયરું (3)
6. ખૂજલી, ખંજવાળ (2)
7. વિષ, ઝેર (2)
8. સાપ કે ઊંદરનું દર (3)
11. માથે બાંધવાનો ફેંટો (2)
12. ચાળીસ સેરનું તોલ (2)
13. એક મીઠાઈ (5)
14. ગરબડગોટો, અવ્યવસ્થા (4)
16. અનાજનો કણ (2)
18. જામીન તરીકેનું, સાટાનું (2)
19. મોહ પમાડે તેવી સ્ત્રી (3)
21. પગાર ઉપરાંત વચ્ચે ખર્ચી લેવી તે (3)
22. ચિહ્ન, નિશાન (3)
24. નર્મદા નદીનું એક નામ (2)
25. સૂક્ષ્મ જંતુ, અણુ જેવડો જીવ (3)
26. ભૂલી જવું તે, નજરચૂક (5)

**ઊભી ચાવી**
1. નડિયાદમાં આ મહારાજનું મંદિર આવ્યું છે. (4)
2. ધોળવા માટે બનાવેલો રેસાનો ઝૂડો (3)
3. યંત્રની ચાવી, ચાંપ (2)
4. દુઃખની વિરુદ્ધ (2)
5. બલગમ, કફ, બળખો (3)
9. અંકુર (3)
10. રાતા રંગનો છાંટવાનો ભૂકો (3)
11. સાબુ રાખવાની ડબી (4)
13. ગર્વ, અભિમાન (3)
15. જૂઠું બોલવાની ટેવવાળું (3)
17. બધાં શાક ભેગાં કરીને પાંઉ સાથે ખવાતી વાની (4)
19. છીપમાંથી નીકળતી એક દરિયાઈ પેદાશ (2)
20. યુક્તિ, કરામત (4)
22. પર્યટન, મુસાફરી (3)
23. બ્રાહ્મણની એક અટક (3)

**જવાબ ક્રોસ વર્ડ 2470**

| | | | | | | | | |
|---|---|---|---|---|---|---|---|---|
| સુ | ષ્મા | સ્વ | રા | જ | | દિ | વા | સો |
| ર | | મા | ત | બ | ર | | ર | |
| દા | મ | ન | | લ | | ઓ | સ | ડ |
| સ | દા | | સં | પુ | ટ | | દા | |
| | રી | ત | સ | ર | | ચો | ર | સ |
| સં | | ર | દ | | મા | ળા | | ર |
| ભ | ર | ત | | ચે | | ફ | ર | સ |
| વ | | | શ્વા | સ | ન | ળી | | |
| | ન | ય | ન | | શો | | મા | ળો |

## અવસાન નોંધ

**ગાંધીધામ :** ભગવતીબેન મંગતરામ આસનાની (ઉ.વ.૮૪) તે સ્વ. મંગતરામ વલીરામ આસનાની (કે.પી.ટી.)ના પત્ની, ફેરૂમલ, પ્રીતમ, અજિત, સુનીલ આસનાનીના માતા, રૂપા, અનિતા, રેખાના સાસુ, લીના ભગવાન હિંગોરાના પુત્રી, જ્યોતિ, ઉમેશ, મોનિકા, ગુંજન, પિયૂષ, હેમાંશુ, મિતાંશી, હનીના દાદી, નિશા, કરનના નાની તા. ૨/૮ના અવસાન પામ્યા છે. તેમની પઘડી/પ્રાર્થનાસભા તા. ૪-૮ના સાંજે ૬ વાગ્યે ભાઈઓ માટે ઝૂલેલાલ મંદિર, શક્તિનગર અને બહેનો માટે નિવાસસ્થાન ડી-૪૮ના શક્તિનગર ગાંધીધામ મધ્યે.

**અંજાર :** મૂળ મુન્દ્રાના હાલે અંજાર ઉમરાણિયા અતુલ લક્ષ્મીદાસ લુહાર (એસ.ટી. ડ્રાઈવર) તે લક્ષ્મીદાસ તથા ચંદ્રિકાબેનના પુત્ર, ગાંધીધામના ઉમરાણિયા રતિલાલ ડુંગરશીના ભત્રીજા, લુહાર જિતેન્દ્ર, ગિરીશ, રિતેશ, ગોપી, શોભનાના ભાઈ તથા પરમાર નરેશ ગોવિંદભાઈના સાળા તા. ૩/૮ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું તા. ૫/૮ના સાંજે ૪થી ૫ દરમિયાન કંસારા વાડી, તળાવ સામે, ગંગા નાકા પાસે અંજાર.

**આધોઇ (તા. ભચાઉ) : કોરડિઆ (પ્રજાપતિ) જેવાંબેન લખમશી** (ઉ.વ.૭૬) તે લખમશી ભોજાના પત્ની, દામજી, પ્રવીણ, વિનોદ, ડાઈબેન, ગંગાબેનના માતા, જુઠા કાના વારૈયાના પુત્રી, ગોવિંદ વીરા, આણંદ, પુરુષોત્તમ, રામજી, ગૌમતી, મુકતા, હેમલતાના સાસુ તા. ૧/૮ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર જૂના ગામમાં પ્રજાપતિ વાસ આધોઈ મધ્યે.

**નવા કંડલા : મહંત મનસુખદાસજી મહારાજ** (ઉ.વ.૮૫) (મહંત ચામુંડા માતાજી મંદિર થર્મલ કોલોનીની બાજુમાં, નવા કંડલા) તા. ૩/૮ના અવસાન પામ્યા છે.

**મોટી ચિરઇ (નંદગામ) :** ઠા. **વિઠ્ઠલદાસ ચોથાણી** (ઉ.વ.૭૬) તે પદમશીભાઈ કરમશીભાઈ ચોથાણીના પુત્ર, રતિલાલભાઈ, અમૃતબેન (અંજાર), સ્વ. કાશીબેન (મુંબઇ)ના ભાઈ, અરવિંદ, શશિકાંત, ગિરીશ, પરેશ, દિનેશ, મંજુલાબેન, રસિકલાલ રાજદે (ભુજ), ભગવતીબેન, દિનેશભાઈ ચંદે (ભચાઉ), લતાબેન રમેશચંદ્ર કોટેચા (અંજાર), કલ્પનાબેન હસમુખભાઈ ચંદે (મેઘપર)ના પિતા, અમીત, દીપ, હિરેન, નિકુંજ, યાજ્ઞિક, જય, નિર્ભયના દાદા, સ્વ. કાનજી દેવરાજ રૂપારેલ (પિત્રોડ)ના જમાઈ તા. ૨/૮ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનીભા તા. ૪/૮ના સાંજે ૫થી ૬ દરમિયાન ત્રિલોકધામ (નંદગામ), મુ. ચિરઇ, તા ભચાઉ ખાતે. (દશો રાખેલ નથી.)

### મુંબઇની મરણનોંધ

**ભારાપર :** હાલે નાંગલપુરના શિવજી ચત્રભુજ પેથાણીના પત્ની. ગં.સ્વ. દેવકાબેન (ઉં.વ.૯૨) મંગળવાર, ૨-૮-૧૧ના રોજ દેશમધ્યે રામશરણ પામેલ છે. તે ઉપેન્દ્ર, હસમુખ, ચંપક, ઈન્દુબેન લ-મીદાસ, અરુણાબેન ઈશ્વરલાલ, વિજયાબેન પરેશકુમારના માતાજી, ગામ નાંગલપુરના અજરામલ રણછોડજી મોતાની પુત્રી. સ્વ. શંભુલાલ, હીરબાઈ, લ-મીદાસ, પ્રભુલાલ, અંચલબેનના બેન. રાજેન્દ્ર, પ્રકાશ, કિશોર, મહેશના ફઈ. (પ્રાર્થનાસભા રાખેલ નથી) ઠે: મંગલાજ, સોનાર આળી, પાપડી, પોસ્ટ-પાપડી, તા. વસઈ, થાણા.

**ભાદરા : સ્વ. શંભુરામ વધારાગ માતા** (ઉં.વ.૭૦) ૨-૮-૧૧, મંગળવારના રોજ મુંબઈ મધ્યે ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના ભાઈ નેણશી લધારામ, મંગલદાસ વેલજી, સ્વ. નરશી વેલજી પુત્ર. દેવજી, રમેશ, સુરેશ, રાજેશ, સસરા. સ્વ. કાનજી નરશી જાયસર (કાટડા મઢ) જમાઈ. દયારામ શંકરલાલ દામા ઉસ્તીયા બનેવી. દયારામ આણંદજી હુશ્બડા જંગડીયા તથા સમસ્ત માવ પરિવાર તરફથી ૪-૮-૧૧, ગુરુવારના રોજ સાંજે ૫થી ૭ વાગ્યે રાખેલ છે. ઠે: ભાનુશાલીવાડી ૧લે માળે, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ.

**લાખાપર :** સ્વ. હરચંદ હેમરાજ દૈયાના પુત્ર. **ધાવરદાસ (બાબુભાઈ)** (ઉં.વ.૭૯) તે હાલે મુલુંડ તે સ્વ. વિરજી નારણજી મેઠીઆ વેરાવળના મોટા જમાઈ. તે સ્વ. ગંગાબેનના પતિ. ઠે: શ્રીકચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, પહેલે માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ)ના મધ્યે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.)

**સમાઘોઘાના લક્ષ્મીબેન લખમશી** (ઉં.વ.૮૬) ૨-૮-૧૧ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લખમશી શીવજી કોરશી સંગોઈના પત્ની. અમૃતલાલ, સ્વ. મણીલાલ દિનેશના માતા. ગં.સ્વ. ભારતીબેનના સાસુ. તુંબડીના પાનબાઈ જવેરચંદના વેવાણ. રતનબેન રામજી, મંજુલા વીરજીના જેઠાણી. સ્વ. રાયશી કોરશી, સ્વ. સોજપાર આસારીયાના ભત્રીજા વહુ. પીંકી, કુંતલના દાદી ઠે: ૨૫, જૈન બિલ્ડિંગ, ૭૦/૮૦ આંબેડકર રોડ, ચીંચપોકલી, મુંબઈ.

**ગોધરાના** સ્વ. લક્ષ્મીબહેન માણેકજી કુરવાના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૬૮) તે સોમવાર, ૧-૮-૧૧ના રોજ સાંગલી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે વનિતાબહેનના પતિ. સ્વ. શાંતુબહેન, સ્વ. વસુમતીબહેન, સ્વ. નવીનચંદ્ર, સ્વ. રતનબહેન, પ્રફુલ્લચંદ્ર, સુમતિચંદ્ર, અશોક, અશ્વિન, યોગેના ભાઈ. ઠે : પ્રવીણચંદ્ર માણેકજી કુરવા, ૨, અરિહંત એપાર્ટમેન્ટ, રતનશીનગર રોડ, સાંગલી.

**મોટા આસંબીયાના** હેમલતા મણીલાલ છેડા અવસાન પામેલ છે. (ઉં. વ. ૬૮) સુંદરબાઈ, લ-મીબહેન, આશરીયાના રવજીના પુત્ર. મણીલાલના પત્ની. સુરેન્દ્ર મહેન્દ્ર, લ-મીચંદ, રતનબહેન પુષ્પાના ભાઈના ઘરેથી. સ્મીતા, ઝવેરબહેનના દેરાણી, મીતા, લીનાના જેઠાણી. તુંબડી મણશી વીરજી, વડાલા ભરત ઉમરશીના સાલના ઘરેથી. ઠે. બી-૨, વિશ્વનાથ, ભાયંદર (વેસ્ટ), મુંબઇ.

### ગાંધીધામ મેઘવંશી મારવાડા સમાજના માજી પ્રમુખનું નિધન

**ભુજ :** ગાંધીધામ મેઘવંશી મારવાડા સમાજના માજી પ્રમુખ મુરજીભાઈ વીરમભાઈ સીજુ ના અવસાન થી કચ્છ મેઘવંશી મારવાડા સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. શ્રદ્ધાંજલિ અર્પિત કરતા સમાજના અગૃણીઓ નારાણભાઈ લોચા, જખરાભાઈ કોડેચા, માવજીભાઈ વારસુર, તેજમલ બોખાણી, કાનજીભાઈ બોચિયા, વિનોદભાઈ લોચા, પૂજારી નટુ મારાજ, નરેશ બળગા, વેરશી બુચિયા, શંકર સીજુ, નારાણ નિજાર, થાવર નિજાર વગેરે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

### પાલારા મંદિરના કાર્યકરના નિધનથી શોક ફેલાયો

**ભુજ :** રામેશ્વર મહાદેવ મંદિર પાલારામાં વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા અને મંદિર વિકાસમાં સક્રિય કાર્યકર ચંપકભાઇ નાનજી ઉગાણીનું અવસાન થતાં ભાવિકોમાં શોકની લાગણી ફેલાઇ હતી. સદગત દેવલમાં જીવદયા સંત્સગ સમિતિ આયોજિત ભગવાન કથામાં રસોયા તરીકે સેવા આપતા હતા. તેમની અંતિમ યાત્રામાં સમિતિના વસંત અજાણી, મહેશ બાવા, અરવિંદ ગોર, કિશોર બાપુ સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.

## આજે ભચાઉમાં ચલો તાલુકે કાર્યક્રમ

**ભચાઉ :** કચ્છમાં ચલો તાલુકે કાર્યક્રમનો બીજો રાઉન્ડ તા. ૪થી ભચાઉથી શરૂ થશે. કચ્છના પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલ તેમજ સહપ્રભારી કનુભાઇ ભાલાડા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ. થેન્નારસન કચ્છમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે થઇ રહેલી પ્રગતિ અને જિલ્લાના ભાવિ આયોજન અંગે નિદર્શન રજૂ કરશે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ તથા નાયબ કલેકટર ડી.જે. જાડેજા, સંબંધિત વિભાગો માહિતી આપશે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન જાટ, ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલી, રમેશભાઈ મહેશ્વરી, ડો. નીમાબેન આચાર્ય, બાબુભાઈ મેઘજી શાહ, ધનજીભાઈ સેંઘાણી અને ડો.કે.શ્રીનિવાસન ઉપસ્થિત રહેશે.

## કચ્છની નોંધપોથી

### ભૂતનાથ સત્સંગ મંડળ

ભૂતનાથ મહાદેવ(ખારીનદી) પર થતાં સત્સંગમાં તા. ૪/૮ ના બાબુભાઈ રાણપરા, કમલેશભાઈ સોલંકી ગત મંડળ સહિત રાત્રે ૧૦ વાગ્યે સત્સંગમાં જોડાશે.

### ધો. ૧૦/૧૨ ના છાત્રો જોગ

માંડવી તાલુકાના ધો. ૧૦/૧૨ ભણેલ ન હોય તેવા વિદ્યાર્થીઓ ખાનગી વિદ્યાર્થી તરીકે માર્ચ ૨૦૧૨ ની બોર્ડની પરીક્ષામાં બેસવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓના ફોર્મ ઓપન સ્કૂલના માધ્યમથી શેઠ જી. ટી. હાઈ. માંડવી દર શનિવારે ૧૧-૧૫ કલાકે (રજાના દિવસો સિવાય) ધો. ૧૦ માટે આર. આર. ત્રિપાઠી અને ધો. ૧૨ માટે ડી.એન. હિરાણીનો સંપર્ક કરવો.

### મ.ક. સઇસુતાર જ્ઞાતિ

ભુજ મ.ક.સ. સુ. જ્ઞાતિ-શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ માટે નકલ તા. ૬/૮ સુધી કૈલાસ બ્રધર્સ નાગર ચકલા તથા ઝીલ ટેઈલર, રેવન્યુ કોલોની સામે જમા કરાવવી. તથા તા. ૭/૮ ના સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ દરમિયાન દરજી જ્ઞાતિની વાડી, નાગર ચકલા મધ્યે જમા કરાવવી.

### એકતા મહિલા મંડળ

એકતા મહિલા મંડળ દ્વારા આયોજિત ૧૫મી ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિના ગીતોની સ્પર્ધા ૫થી ૧૫ વર્ષના બાળકો માટે ભાગ લેવા ઈચ્છુકે રસીલાબેન પંડયા ૮૯૦૫૯૮૨૬૪૬ અને હેમલતાબેન શાહ - ૯૪૨૬૮ ૩૫૯૫૭નો સંપર્ક કરવો.

### સ્પીચ થેરાપી કેમ્પ

જી.કે. જનરલ હોસ્પિટલ ભુજમાં તા. ૧૦/૮ના સવારે ૧૦થી ૨ વાગ્યા સુધી ઓડિયોમેટ્રી અને સ્પીચ થેરાપી કેમ્પમાં અમદાવાદના ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપીસ્ટ અમિત આનંદ સેવા આપશે.

### મા. ઉચ્ચ મા. શાળાઓ જોગ

ઈકો કલબની પ્રવૃત્તિ ચલાવતી તમામ માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાઓએ પર્યાવરણ મિત્ર યોજના હેઠળ કરેલા પ્રવૃત્તિ, જળ ઉર્જા, જૈવિક વૈવિધતા, કચરાનું વ્યવસ્થાપનનો અહેવાલ અને મૂલ્યાંકન અંગેના નિયત પત્રકો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી મેળવીને તાત્કાલિક અમદાવાદની કચેરી તથા અત્રેની કચેરીને મોકલી આપવો. ગ્રાન્ટેડ બિસરકારી માધ્યમિક ઉ.મા. શાળાઓને વર્ષ ૨૦૧૨-૧૩ અંદાજપત્ર અંગેના પરિપત્રો મોકલવામાં આવશે. તા. ૫/૮ના કચેરીમાં રજૂ કરવું.

### હિમોગ્લોબીન તપાસણી

તા. ૮/૮ના સવારે ૯થી સાંજે ૫ સુધી હિમોગ્લોબીન લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ મફતમાં પરીક્ષણ, નિદાન અને સારવાર ભાનુશાલી નર્સિંગ હોમા હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર જનરલ હોસ્પિ.ભજ

### રાજપૂત ક્ષત્રિય મહિલા સભા

આગામી વર્ષ ૨૦૧૧ દરમિયાન ક. રા. મહિલા સભા દ્વારા યોજનારા તૃતીય સરસ્વતી સન્માન માટે ધો. ૧૦/૧૨માં ઉતીર્ણ અને ૬૦ ટકાથી વધુ માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ તા. ૫/૮ સુધીમાં માર્કશીટ શક્તિધામ મોકલાવી આપવી.

### ખેતરપાળ દાદા યુવક મંડળ

કુકમા ખેતરપાળ દાદા યુવક મંડળ દ્વારા દાદાની પેડી તા. ૪/૮ના શ્રાવણ સુદ પાંચમના સાંજે ૬ વાગ્યે મહાઆરતી અને ૫ વાગ્યે મહાપ્રસાદ મંદિરે તળાવની પાળે.

### માતૃછાયા કન્યા વિદ્યાલય

જૈન મેડિકલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ઉજ્જૈન સ્થિત આયુષ્યમાનભવ ટ્રસ્ટના સ્થાપક અરૂણઋષિ 'સ્વર્ગીય'નો તા. ૫/૮ના રોજ સવારે ૮થી ૧૦ કલાકે અનોખો સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમ એક દવા નિરાલી ૧૫ સેકન્ડ તાલી. યોજાશે.

### રોટરી કલબ ઓફ ફલેમિંગો

રોટરી કલબ ઓફ ભુજ ફલેમિંગોની કલોઝ મીટિંગ તા. ૪/૮ના રોજ રાત્રે ૮ કલાકે બાલભવન, ખેંગારપાર્ક, ભુજ ખાતે.

### કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સભાની કારોબારી બેઠક

સમાજ હિતાર્થે તા. ૭/૮ના બપોરે ૩ વાગ્યે મહારાજ મદનસિંહજી કુમાર છાત્રાલય હોલમાં.

### નવનીત નગર દવાખાનું

ક.વિ.ઓ જૈન મહાજન ભુજ સંચાલિત પ્રેમીલાબેન પ્રેમચંદ સંઘવી સાર્વજનિક દવાખાના નવનીતનગર કોવઈનગર મધ્યે સોમથી શનિ ડો. કમલાબેન ગૌરી સવારે ૧૦ થી ૧૨ તથા સાંજના ૫થી ૭ મોહન ગઢવી પોતની સેવા આપશે.

### નિરાધાર વૃદ્ધોનોને ભોજન

માનવ જયોત સંસ્થા ભુજ દ્વારા એકલા - અટુલા નિરાધાર વૃદ્ધો દાતા આશા મોટર્સ, જયશ્રીબેન રામસિંગ પરમાર, જોગી રામજી પાચા સુખપર, પ્રફૂલ્લ એમ. ગુગરીયા મુન્દ્રા, હબીબ હુસેન અમીરઅલી મુન્દ્રા, ચૌહાણ મણીબેન મોહનલાલ નાગોર, શાહ રસીકલાલ પ્રેમચંદ, ડો. દેવેન્દ્ર પરમાર, જવેરલાલ દેવકરણ શાહ, સ્વ. વિક્રમભાઈ એલ. ગણાત્રા, સ્વ. હસમુખલાલ એમ. આચાર્ય, લાખાપર, લક્ષ્મણભાઇ ભીમજી વેકરિયા બળદિયા, દેવ્યાનીબેન એસ. દવેના સહયોગથી તેમના ઘેર જઇ ટિફિન દ્વારા ભોજન.

### ર.ટો. વોરા મેડિકલ સેન્ટર

ભુજ મધ્યે સોમથી શનિ સવારે ૯થી ૧૧ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ ડો. દિશાબેન ઠક્કર, સાંજે ૫.૩૦થી ૬.૩૦ ડો. અશોકભાઈ ત્રિવેદી, સેવા રાહતદરે આપશે. ફરતું દવાખાનું સોમ, ગુરુ સવારે ૯થી ૧૦ ગણેશનગર, ૧૦થી ૧૧ મહાવીરનગર, ૧૧થી ૧૨ વાલદાસનગર, કારીતાસનગર અને ગણેશનગર મધ્યે. ડો. મોહન ગઢવી સેવા રાહતદરે આપશે. તા. ૬/૮ના બપોરે ૧.૩૦ થી ૨.૩૦ અમદાવાદના બાળકોના ઓપરેશનના નિષ્ણાંત ડો. કેયૂર ભલાવત દર્દીઓની તપાસણી કરશે.

### નિઃશુલ્ક નેત્ર નિદાન

તા. ૮/૮ના રણછોડરાયજી સત્સંગ મંડળ દ્વારા યોજેલા નેત્ર નિદાન કેમ્પ ઈચ્છતા દર્દીઓએ સંસ્થાના લાલ ટેકરી કાર્યાલય પર નામ નોંધવવા ૦૨૮૩૨ - ૨૨૯૫૧૧નો સંપર્ક કરવો.

### કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ

હિન્દી પરીક્ષાના રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની પ્રાથમિકથી કોલેજ સધીની પરીક્ષામાં બેઠેલા ભુજ શહેરના શાળાના વિદ્યાર્થીઓ માટેના નિઃશુલ્ક વર્ગો માટે રાષ્ટ્રભાષા ભવન એસટી બસ સ્ટેશન સામે, સાંજે ૪થી ૫ રાષ્ટ્રભાષા ભવનમાં વાચનાલય.

### શાળા વિકાસ સંકુલની મીટિંગ

કચ્છ જિલ્લાની તમામ માધ્યમિક ઉચ્ચ. માધ્ય. શાળાઓના આચાર્યની એસ.વી.એસ. મુજબની મીટિંગ માંગેલ માહિતી સાથે આચાર્યોએ ચાણક્ય સરસ્વતી વિદ્યાલય ભચાઉ તા. ૬/૮ના ૯ કલાકે, શ્યામજી કૃષ્ણ વર્મા સહજાનંદ વિદ્યાલય પીયાવા તા. ૬/૮ના ૯ કલાકે, દ્રોણાચાર્ય ડો. સી.જી. ગીડવાની હાઈ. ગાંધીધામ તા. ૬/૮ના ૯ કલાકે, વિવેકાનંદ કુ.ટી.ડી. વેલાણી હાઈ. નખત્રાણા ૧૦/૮ના ૯ કલાકે, સાંદીપનિ પી.સી.વી. મહેતા હાઈ. ભુજ ૧૦/૮ના ૯ કલાકે.

### ગાંધીધામમાં બેંક અંગે સેમિનાર

૧૯ રાષ્ટ્રીકૃત બેંકોમાં નવી ભરતી વિશે કચ્છ કેરિયર એકેડમી વતી નિશુઃલ્ક સેમિનાર યોજાશે. સાંજે ૫ કલાકે હોટ્લ મારુતિ, ટાગોર રોડ, ગાંધીધામ ખાતે રજિસ્ટ્રેશન માટે ૯૮૭૯૧ ૨૨૮૭૦નો સંપર્ક કરવો.

### ગાંધીધામમાં ફિઝિયોથેરાપી

હિલ એન ટોન ફીઝીયોથેરાપી કિલનિક દ્વારા તા. ૭/૮ના નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું ૨૨ ચેમ્બર્સ, સેકટર ૧એ, પ્લોટ નં. ૨૦૧, હીરો હોન્ડા શોરૂમની સામે ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન માટે ફોન ૨૨૬૨૪૮ ઉપર સંપર્ક કરવો.

### ભચાઉમાં સર્વરોગ નિદાન કેમ્પ

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભચાઉ ખાતે તા. ૯/૮ના ૯થી ૧ વાગ્યા દરમિયાન સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ અને વિકલાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયયોજન કરાયું છે.

### નિષ્કલંકીધામ-નખત્રાણા

ક.ક.પા. સતપથ સનાતન સમાજ તથા ક.ક.પા.સતપંથ યુવા સંઘના સયુંકત ઉપક્રમે આગામી તા. ૫/૬/૭ ઓગસ્ટના ત્રિદિવસીય યુવા શિબિર મહંત જર્નાદનજી મહારાજ ફૈઝપૂર(મહારાષ્ટ્ર)ના સાનિધ્યમાં. વય મર્યાદા ૧૮ થી ૫૦ વર્ષ સુધીના યુવક ભાઈઓ ભાગ લઈ શકશે.

### નખત્રાણામાં સત્સંગ સભા :

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગ પારાયણ સંતોના સાનિધ્યમાં નખત્રાણા દરિયાસ્થાન મધ્યે રાત્રે ૮:૪૫ કલાકે.

### નખત્રાણા તા. રાજગોર સમાજ

જ્ઞાતિનો સરસ્વતી સન્માન સમારોહ તા. ૭/૮ ના સવારે ૯:૩૦ કલાકે લોહાર સમાજવાડી, ઉમિયા નગર, નખત્રાણા મધ્યે.

### ડો. આંબેડકર યુનિ. મુન્દ્રા

મુન્દ્રાની એસડી શેઠિયા કોલેજ ઓફ એજયુકેશન મુન્દ્રામાં ચાલતા ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, બીએડ અભ્યાસ કેન્દ્ર (ઘરબેઠા બીએડ અભ્યાસ)ના ફોર્મનું વેચાણ સવારે ૧૧થી ૫ વાગ્યાના સમયગાળામાં (રજાના દિવસો સિવાય) રૂા. ૫૦૦ ફી ભરીને અત્રેથી મેળવી તા. ૩૦/૮ સુધીમાં અમદાવાદ પહોંચતા કરવાના રહેશે.

### દાદા ભગવાનનો સત્સંગ માધાપર

તા. ૪/૮ના રાત્રે ૯થી ૧૦.૩૦ વાગ્યા સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ નવી લાઈન, સમીર ટ્રેડર્સની ઉપર માધાપર મધ્યે રહેશે વધુ વિગત માટે મો. ૯૯૭૯૪ ૦૭૪૧૫

### કલ્યાણપર (મંજલ)માં પાટોત્સવ

વાર્ષિક પાટોત્સવ નિમિત્તે તા. ૪/૮ના રાત્રે ૯ આધ્યાત્મિક ડાયરામાં શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવા લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ, કલ્યાણપર દ્વારા ઈજન.

### વિવેકાનંદ કેન્દ્ર, કન્યા કુમારી

વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી ના ગુજરાત પ્રાંત દ્વારા હર વર્ષે સ્વામી વિવેકાનંદ ના વિચારોના પ્રચાર માટે સ્વામી વિવેકાનંદ ના પુસ્તકો ઉપર શાળાઓમાં પરીક્ષા ધો. ૬ થી ૮ અને ધો. ૯ થી ૧૨ એમ બે ગ્રૂપમાં પરીક્ષા લેવામાં આવશે. ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને શાળાઓએ વિપુલ ભટ્ટ-૯૪૨૭૪ ૪૦૧૬૧ નો સંપર્ક કરવો.

## કચ્છમાં હથિયારબંધી સહિતના પ્રતિબંધો જાહેર કરાયા

**ભુજ :** કચ્છ જિલ્લામાં ચાલુ માસમાં યોજાનારા વિવિધ તહેવારો તથા મેળાઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે છે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે આગામી તા. ૧૩મીથી ૩૧ ઓગસ્ટ-૨૦૧૧ સુધી જિલ્લામાં હથિયારબંધી પ્રતિબંધો જાહેર કરાયા છે.


**દુઃખદ અવસાન, બેસણું, ઉઠમણું, શ્રદ્ધાંજલિ, પ્રાર્થનાસભાની જાહેર ખબર (અંદરના પાને)**

| ફિક્સ સાઈઝ | ફિક્સ ભાવ B/W | ફિક્સ ભાવ કલર |
|---|---|---|
| ૫x૨/૧૦x૧ | રૂ.૧૦૦૦ | રૂ. ૧૫૦૦ |
| ૧૦x૨ | રૂ.૨૦૦૦ | રૂ. ૩૦૦૦ |

-: સંપર્ક :-



**શ્રદ્ધાંજલી**

**સ્વ. સન્ની કમલેશ ચાવડા**

બાપા સીતારામ ગ્રુપ - અંજાર



**-:: પ્રથમ પુણ્યતિથી ::-**

સ્વ. ઈન્દુમતિ પ્રકાશચંદ્ર શુકલ — સ્વ. તા. ૧૯-૦૮-૨૦૧૦ ગુરુવાર, શ્રાવણ સુદ-૧૦
સ્વ. પ્રકાશચંદ્ર પ્રેમચંદ શુકલ — સ્વ. તા. ૦૪-૦૮-૨૦૧૦ બુધવાર, અષાઢ વદ-૯

લિ.

મનીષ પ્રકાશચંદ્ર શુકલ (પુત્ર)
દક્ષા મનીષ શુકલ (પુત્રવધુ)
ધ્વનિ મનીષ શુકલ (પૌત્રી)
નિશાંત મનીષ શુકલ (પૌત્ર)
મુ. પોરબંદર

ડો. મનોજકુમાર જી. દવે (જમાઈ)
ડો. રેણુબેન મનોજકુમાર દવે (પુત્રી)
હર્ષ મનોજકુમાર દવે (દોહીત્ર)
વાણી મનોજકુમાર દવે (દોહીત્રી)
મુ. મુંદ્રા


Digitally Archived by: www.realpatidar.com/library

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



# માંડવીમાં યોજાયેલી રેતશિલ્પ સ્પર્ધાના ચૂકવણા હજુ પણ બાકી

**રણોત્સવના ભાગરૂપે આઠ માસ પૂર્વે આયોજિત હરીફાઇના ૫.૫૦ લાખના ચૂકવણાં થયાં નથી**

ભાસ્કર ન્યૂઝ. માંડવી

માંડવીમાં રણોત્સવ અંતર્ગત રાબેતા મુજબ બીચ પર રેતશિલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશ અને રાજ્યના પ્રધાનોએ રેતશિલ્પનું સૌંદર્ય માણ્યું હતું, પરંતુ છેલ્લા આઠ માસથી મંડપ, ફોટગ્રાફર્સ, કેન્ટિન સહિતનું સાડા પાંચ લાખનું બિલ પેમેન્ટ ન થવાથી લોકોમાં અસંતોષ ફેલાયો છે.

ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા રણોત્સવના ભાગરૂપે બીચ પર વિદ્યાર્થીઓ માટે વર્કશોપ અને રેતશિલ્પ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરાટકાય પંડિત શ્યામજીકૃષ્ણ વર્માની રેતકૃતિનું નિર્માણ જાણીતા રેતશિલ્પકાર અનિલ જોષીએ બનાવતાં વહીવટી અધિકારી ખુશ થવાથી તેમને એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું. જેમાં તેમની કલાની મહેનત પણ આવી ગઇ છે.

દરિયા કિનારે તૈયાર કરાયેલા વર્માજીના રેતશિલ્પની ફાઇલ તસવીર.

આ ઉપરાંત રૂા. ૧૬૨૦ ફોટોગ્રાફર્સ રૂા. ૨૫૦૦, વીડિયો શૂટિંગના રૂા. ૪૦૭૭૪૭, મંડપ ખર્ચ રૂા. ૧૪૪૦૦, કેન્ટિન ખર્ચ અને વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય, બેસ્ટ થીમ તેમના બેસ્ટ મેસેજ સહિતના ૧૫૫૦૦, મામલતદાર ઓફિસર દ્વારા પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને રોકડો રકમથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે પણ બાકી રહ્યા છે. આવી રીતે આઠ માસથી રેત શિલ્પ સ્પર્ધામાં વિવિધ રીતે ઉપયોગી થનારાના બિલનુ ચૂકવણું ન થતાં નારાજગી ફેલાઇ છે.

# ભચાઉની ધરતી ૨.૭ના આંચકાથી કંપી

ભાસ્કર ન્યૂઝ. ભુજ

વાગડમાં નાના મોટા આફટર શોકની સિલસિલામાં વધુ એક ૨.૭નો આંચકો આજે રાત્રે ૧૨.૨૭ વાગ્યે ભચાઉ નજીક નોંધાયો હતો.

આઇએસઆર ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે રાત્રે ૧૨.૨૭ વાગ્યે ભચાઉથી ૫ કિમી ઉત્તરમાં કેન્દ્રબિંદુ ધરાવતું કંપન નોંધાયું હતું. જ્યારે આ ઉપરાંત બપોરે ૧૧.૧૧ વાગ્યે વધુ ૧.૯નો આંચકો આવ્યો હતો.

થોડા દિવસો પૂર્વે વાગડ પંથકમાં ચાલુ વરસાદ દરમિયાન આંચકાઓ નોંધાયા હતા જેમાં લાકડીયા વિસ્તારમાં ૩.૮ના આંચકાએ લોકોની ઉંઘ હરામ કરી દીધી હતી. જો કે, ૩ ની નીચેની તીવ્રતાથી આવતા આંચકાઓનો અનુભવ સામાન્ય ધોરણે ઓછો થતો હોય છે જો કંપનનો સમય વધારે હોય તો આવો આંચકો અનુભવાતો હોવાનો જાણવા મળ્યું હતું.

# અંજારમાં ઉત્તેજના વચ્ચે ખરીદ વેચાણ સંઘનું ૧૦૦ ટકા મતદાન

ભાસ્કર ન્યૂઝ. અંજાર

અંજાર ખરીદ વેંચાણ સંઘની ૯ બેઠક માટે તમામ ભાજપે ઉમેદવારી કર્યા બાદ આ ચૂંટણી વિવાદસ્પદ સાથે રસપદ બનવા પામી હતી. જેનું બુધવારે મતદાન થયા બાદ હવે ભાજપ એ માન્ય કરેલા ૯ પૈકીના ૨ ઉમેદવારોનું ભવિષ્ય મત પેટીમાં સીલ થયું હતું. ૪૪ મતદારો ધરાવતા ખરીદ વેચાણ સંઘની આજે થયેલી ચૂંટણીએ તાલુકા ભાજપમાં ગરમાવો લાવી દીધો હતો અને ૧૦૦ ટકા મતદાન ઉતેજનાના માહોલ વચ્ચે થયું હતું તો સાથે ભાજપ પ્રેરિત નવ ઉમેદવારો મેદાન મારશે કે ભાજપના જ અન્ય બે ઉમેદવારો મેદાન મારી જશે તે ચર્ચા વચ્ચે મતદાન નો દોર ચાલુ રહ્યો હતો. સવારે ૧૧:૩૦ વાગ્યે તો ૪૦ મત પડી ચૂક્યા હતા અને ચાર મત આપવાની રાહ જોવાઇ રહી હતી અને ૧૦૦ ટકા મતદાન થયું હતું આ અંગે ભાજપના રણધીર કોઠીવાડે ભાજપ પ્રેરિત ૯ ઉમેદવારોને ૪૪ માંથી ૩૦થી વધુ મત મળશે તેવી આશા વ્યકત કરી હતી અને બળવાખોર ઉમેદવારો ભૂંડી રીતે પરાજીત થશે. આ ચૂંટણીના પરિણામો બાદ તાલુકાની તમામ સહકારી સંસ્થાઓ ભાજપના આગેવાનો હસ્તક રહેશે તો ખરું ચિત્ર ગુરુવારે મતગણતરી પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

## ભચાઉ તાલુકા સંઘના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

ભચાઉના ખરીદવેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયાની તસવીર. પપ્પુ સોલંકી

ભાસ્કર ન્યૂઝ. ભચાઉ

ભચાઉ તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘની કચેરીમાં મામલતદાર ગોવિંદસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને ચુટણી યોજાઇ હતી.

જેમાં પ્રમુખ તરીકે ભરતભાઇ છગનભાઇ ઠક્કર, ઉપપ્રમુખ રણછોડ પાંચા ગાંધી અને ડાયરેકટર તરીકે કરશનભાઇ વરચંદ, બટુકસિંહ જાડેજા, ભચાઉ અને છગનભાઇ ઠક્કરની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હરિભાઇ પટેલ ગણેશાભાઇ ઉંદરિયા, બટુકસિંહ જાડેજા, કુંભાર દાઉદભાઇ કુરેશી અને મેનેજર લવજીભાઇ ઓઝા ઉપસ્થિત રહ્યા હતાં.

# સૂરજબારી પુલ પાસે રૂા.૧.૮૫ લાખનો ગેરકાયદે કોલસો પકડાયો

**વરનોરાથી બે ટ્રક ભરાઇને મોરબી પહોંચે એ પહેલાં જ વન વિભાગે પકડી**

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કચ્છમાં ગેરકાયદે કોલસાનું વહન અટકાવવા વન વિભાગ શાબદું જ છે એવા સંજોગોમાં ભુજના વરનોરાથી કોલસો ભરીને મોરબી જવા નીકળેલી બે ટ્રકને સુરજબારી પુલ નજીકથી ઝડપી લેવામાં આવી હતી. રૂા.૧.૮૫ લાખના કોલસા સાથે ડ્રાઇવર, કલીનરને પકડી પાડવામાં આવ્યા હતાં.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, તા. ૨/૮ના રોજ વી.એસ. દેવડા, મદદનીશ વન સરંક્ષક, મોબાઇલ સ્કવોડ, ભુજ તેમની ટીમ સાથે સૂરજબારી પુલ પાસે વહેલી સવારે પેટ્રોલિંગ કરતા હતાં તે સમય દરમિયાન શંકાસ્પદ ટ્રકો પસાર થતાં તેનો પીછો કરી ટ્રક નં. જીજે ૧૨ ટી ૯૬૭૪ તથા ટ્રક નં. જીજે ૧૨ ટી ૮૩૨૫ અટકાવી તેઓના ડ્રાઇવરને પૂછપરછ કરતાં વગર પાસ પરમિટના કોલસા હતા તેવું જાણવા મળ્યું હતું. બંને ટ્રકોનો મુદ્દામાલ ભચાઉ વન વિભાગે કબજે કર્યો હતો. ડ્રાઇવર કાસમ સાલેમામદ મેમન (વરનોરા) તથા કલીનર રહીમ આમદ નાગડા (ભુજ) તથા ડ્રાઇવર અકબર જખરા મોખા, (વરનોરા)ની અટકાયત કરી પૂછપરછ કરતાં આ બંને ટ્રકના કોલસા રાણા આમદ મોખા (વરનોરા)ની હોવાનું ખુલ્યું હતું. આ કોલસા વરનોરાથી મોરબી લઇ જતા હતાં. તેવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલું છે. કોલસાની કિંમત રૂા.૧૮૫૦૦૦ તથાં અટકમાં લીધેલી બંને ટ્રકની કિંમત રૂા. ૨૭૦૦૦ આંકવામાં આવી છે. વન વિભાગના કર્મચારીઓને અવારનવાર ફોનથી ધમકીઓ મળવા છતાં પણ કર્મચારીઓ જીવના જોખમે સાહસ કરી ગુના અટકાવવામાં પાછીપાની કરતા નથી.

**રહેણાંકમાંથી શરાબની 30 બોટલ મળી આવી**

# પખો, બાલાસરમાં ૨૯ હજારના દારૂ સાથે ત્રણ જબ્બે

## સ્થાનિક ગુના શોધક શાખાએ બે સ્થળે પાડ્યા દરોડા

ભાસ્કર ન્યૂઝ. ભુજ, નારાયણસરોવર

લખપત તાલકુાના પખો અને બાલાસરમાં પોલીસે મંગળવારે મોડી રાત્રે દરોડો પાડીને રૂા. ૨૯ હજારના અંગ્રેજી દારૂ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે બાલાપરના સપ્લાયર પાસેથી દારૂના વેચાણના રૂા. ૪૪૦૫૦ અને એક જીપકાર પણ કબજે કરી હતી.

ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને નારાયણ સરોવર પોલીસ સાથે મળીને મંગળવારે મોડી રાત્રે પ્રથમ પખૌ ગામમાં દરોડો પાડ્યો હતો. જયાં દેવા પબા રબારીને તેના મકાનમાંથી રૂા. ૨૧ હજારની કિંમતના ઇંગ્લિશ દારૂની ૩૦ બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. એની સાથે જાડવા ગામના પચાણ ખીમા ઉર્ફે જુમા રબારીને પણ ઝાલી લેવામાં આવ્યો હતો.

પખો ગામમાંથી પકડાયેલા દારૂના જથ્થાની તસવીર. નયન જોષી

બંને શખ્સોની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, એ દારૂનો સપ્લાયર બાલાપરમાં રહે છે એ જ સમયે પોલીસે બાલાપરમાં પહોંચી અને ત્યાં ગોપાલસિંહ મહેતાજી સોઢાના મકાન પર દરોડો પાડી તેને ઇંગ્લિશ દારૂની રૂા. ૮૦૫૦થી ૨૩ બોટલ સાથે ગિરફતાર કરી લેવામાં આવ્યો હતો. તેની પાસેની દારૂના વેચાણના રૂા. ૪૪૦૫૦ અને રૂા. ૨ લાખની જીપ પણ કબજે કરી લેવાઇ હતી.

એલસીબીના હે. કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા, રાણાભાઇ મેઘવાળ, હેમુભાઇ રબારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ

# માંડવીના ચીફ ઓફિસરની ગાંધીનગરથી બદલી કરાવાઇ

**છ વર્ષમાં છ ચીફ ઓફિસર બદલાયા : મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની જગ્યા પણ ખાલી હોતાં પ્રજાલક્ષી કામોનું શું થશે ?**

ભાસ્કર ન્યૂઝ. માંડવી

માંડવી સુધરાઇમાં ચીફ ઓફિસર અને હેડ કલાર્કના સસ્પેન્શનની રાવ રાજ્યની રાજધાની સુધી પહોંચી જતાં અંતે શિસ્તના આગ્રહી સી.ઓ.સંદીપસિંહ ઝાલા બદલી રાપર થતાં અમુક વર્ગ દ્વારા પેંડા વહેંચાયા હતા તો કેટલાક વર્ગના લોકોએ સમય વખતે સાવધાનનું રુખ અપનાવ્યું હતું. માંડવીમાં રાજકીય દખલગિરી ૨૦૦૫થી ૨૦૧૧ સુધીમાં ૬ ચીફ ઓફિસર બદલાયા હોવાથી પાલિકામાં રાજકીય તુમારશાહી સુધરાઇ કેટલી હદે ચાલી રહી છે તે આ પરથી સાબિત થાય છે, તેવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. ૨૦૦૫ની સાલથી ૨૦૧૧ સુધીમાં ૬ વર્ષના સમયગાળામાં છ સીઓ બદલી ગયા બાદ સ્થાનિક સુધરાઇને છેલ્લા લાંબા સમય બાદ કડક અમલદાર મળ્યા છતાં કાયદાના સકંજાનો ધારદાર ઉપયોગ કરી પાલિકાની કારોબારીએ વિકાસના કામો ન થતા હોવાથી તેમજ સીઓ પોતાના મનગડત વિચારો અમલમાં મૂકતા હોવાની શહેરી વિકાસ મંત્રાલયમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતાં માંડવીના ચીફ ઓફિસરની બદલીને રાપર પાલિકામાં મૂકવવામાં આવ્યા છે.

શહેરમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની જગ્યા પર ઇન્ચાર્જ અધિકારી છે. હવે વધારામાં ચીફ ઓફિસરની બદલી થતાં શહેરીજનો માટે મુશ્કેલી વધશે.

# કકરવામાં બીએસએનએલ લેન્ડલાઇન ટેલિફોન ૨૪ દિવસથી બંધ

ભાસ્કર ન્યૂઝ. કકરવા

કકરવામાં છેલ્લા ચોવીસ દિવસથી બીએસએનએલ લેન્ડલાઇન ટેલિફોન બંધ થતાં મુશ્કેલી ઉભી થઇ છે. આ બાબતે ગુણશીભાઇ જૈને જણાવ્યું હતું કે, મુંબઇ જેવા મહાનગરોથી ધંધાકીય રીતે જોડાયેલા આ ગામમાં લેન્ડલાઇન ટેલિફોનનો ઉપયોગ થતો રહે છે. પણ જર્જરિત લાઇનો વારંવાર ફોલ્ટમાં જ હોય છે. કટોકટીની ક્ષણોમાં સંદેશાની આપ-લે વખતે આવા ફોલ્ટ માનસિક પ્રેશર ઉભા કરી લે છે.

વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રને જાણે આ સેવા ચલાવવામાં કોઇ રસ ન હોય તેમ ધ્યાન અપાતું નથી. છેક ભુજ સુધી લાંબા થવા છતાં યોગ્ય કાર્યવાહી થતી ન હોઇ થોડા ઘણા ટેલિફોન ધારકો પણ આ સેવાથી વિમુખ થઇ જશે.



2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



# સતપંથ ધાર્મિક કાર્યક્રમમાં યુવા અગ્રણીની હાજરીથી ચર્ચાનો દોર

**ભાસ્કર ન્યૂઝ. નખત્રાણા**

પાટીદાર સમાજમાં છેલ્લા પાંચ દાયકાઓથી સતપંથ અને સનાતન સંપ્રદાયો વચ્ચે મોટી દીવાલો વર્ષોથી ઉભી છે. ત્યારે તાજેતરમાં આ મામલે બન્ને સંપ્રદાયોમાં વારંવાર વિવાદી મુદાઓ ઉભા થતા રહે છે, જેનાથી બન્ને વચ્ચે અત્યારે મોટાપાયે ધરમૂળથી ફેરફારો સમાજ લેવલે થઇ રહ્યા છે.

કાદિયા મોટા ગામે અર્થવેદી આશ્રમખાતે તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં અ.ભા.ક.ક.પાટીદાર યુવા સંઘના પૂર્વ પ્રમુખ અને જેમણે સમાજ સુધારકનો ઝંડો હાથમાં લીધો હતો એવા જયંતીભાઇ લાકડાવાળાએ અહીંની હાજરીથી બન્ને સંપ્રદાયોમાં ચર્ચાઓનો દોર ચાલુ થઇ ગયો છે. નજીકના લોકોએ જણાવ્યું હતું કે, આ ધાર્મિક કાર્યક્રમમાં કચ્છભરમાંથી સતપંથીઓ હાજર હતા ત્યારે અહીં યુવા પ્રમુખનું આવવા પાછળનું કારણ સમજાતું નથી. એક બાજુ ભારતભરમાં બન્ને સમાજો વચ્ચે બેટીથી માંડીને રોટી સુધીના વ્યવહારોમાં તિરાડો ઉભી થઇ રહી છે. જો કચ્છના નખત્રાણા તાલુકાના અનેક ગામોમાં બન્ને સંપ્રદાયોમાં ફાટા પડી રહ્યા છે. પાટીદાર સમાજની બન્ને સંપ્રદાયો સનાતન અને સતપંથ વચ્ચે ધાર્મિક, સામાજિક જેવા મુદાને લઇને ભારે કશમકસ ચાલી રહી છે ત્યારે કાદિયા આશ્રમમાં લાકડાવાળાની હાજરી પાછળ સમાધાનનો અણસાર આવે છે કે, અન્ય તે હજુ કોઇ કહેવા તૈયાર નથી. હજુ આઠ માસ અગાઉ જયંતીભાઇ લાકડાવાળા આંઠ દિવસ ગુમ હતા ત્યાર આ સમાજમાં વાયુવેગે લાકડાવાળાનું અપહરણ થયું છે તેવા સમાચારો પણ વહેતા થયા હતા. અત્યારે ફરી સતપંથમાં હાજરી પાછળ રહસ્ય તો જયંતીભાઇ જ જાણે તેમ છે. સૂત્રોમાંથી વાત એવી પણ વહેતી થઇ રહી છે કે, અહીં હાજરી આપવા પાછળ મોટા પાયે દબાણ થઇ રહ્યુ છે.

### યુવા અગ્રણી શુ કહે છે?

આ અંગે જયંતીભાઇ સ્પષ્ટપણે કહે છે કે આપણી જ્ઞાતિ સનાતન ધર્મ જ છે અને હોવા જોઇએ એવું પણ વિચારી રહ્યા છે કે, સતપંથીઓનું આસ્થા શ્રદ્ધા પણ તૂટવી જોઇએ નહીં અને 'પીરાણા'નો વહીવટ હક્ક પણ આપણી સમાજ પાસે છે તે રહેવું જોઇએ તેમણે આ મિલકત સાચવી રહેલા સતપંથીઓને અભિનંદન આપ્યા હતા. આપણા પૂર્વજોએ કઇ ગયા છે કે, આપણો મુખ્ય ધર્મ સનાતન છે, જેમાં ભલે ફાંટા હોય પણ નીતિ, નિયમ, એક હોવો જોઇએ જોતે બન્ને સંપ્રદાયો વચ્ચે સમાધાન થાય તેના માટે પોતે ઇચ્છી રહ્યા છે.

### ધાર્મિક એકતા મુખ્ય કારણ

બીજી બાજુ આ અંગે જયંતીભાઇ લાકડાવાળાએ 'દિવ્યભાસ્કર'ને ટેલિફોન ઉપર જણાવ્યું હતું કે, અમુક સતપંથીઓના આગ્રહના કારણે ત્યાં ગયો હતો. સતપંથની ધાર્મિક વિધિ કેવી રીતે થાય છે તે મને બતાવવા માગતા હતા જે આ વાત મારા સનાતન અગ્રણીઓ ભાઇઓ પણ જાણતા હતા સતપંથીઓની આસ્થા તૂટવી જોઇએ નહીં અને પીરાણાના વહીવટ પણ ચાલવો જોઇએ સાથે સનાતન ધર્મ આપણો ધર્મ છે તેમાં ભળવું જોઇએ.

realpatidar.com

## ખારોઇમાં મુસ્લિમ સમાજનું સંમેલન યોજાયું

**ભાસ્કર ન્યૂઝ.કકરવા**

ભચાઉ તાલુકાનાં ખારોઇ ગામે આલે રસુલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનાં નેજા હેઠળ વાગડ-કાઠિયાવાડ મુસ્લિમ સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ટ્રસ્ટમાં ચાલતા શિક્ષણમાં વધારો થાય તે હેતુ પર ભાર મૂક્તાં પ્રવચનો અપાયા હતા.વાગડ વિસ્તારનાં મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ સાવ ઓછું હોવાથી આ ટ્રસ્ટ તેના માટે બનતું તમામ કરી છૂટશેની નેમ વ્યક્ત કરાઇ હતી. ટ્રસ્ટનાં પ્રમુખ પીર સૈયદ મામદશા બાપુએ મુસ્લિમ સમાજને સાથ સહકાર મળતો રહેશે તો દેશને ઉત્તમ કક્ષાનાં ઈન્સાનો આ સંસ્થા આપશે એવી ખાતરી આપી હતી.

## મેડિકલ કોલેજમાં નવા ડિન નિમાયા

**ભુજ :** ભુજની અદાણી મેડિકલ કોલેજમાં ખાલી પડેલી ડિનની જગ્યા પર નવા ડિન તરીકે ડો. જી. વી. કેસરીની નિમણૂક કરાઇ છે. હોસ્પિટલમાં બે વર્ષ સેવા આપનારા ડો. મુખરજી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં નવી નિમણૂંક થઇ છે.

### માંડવીમાં કોંગ્રેસે યોજ્યો 'પોલ ખોલ'કાર્યક્રમ

# 'એવી કોઇ યોજના નથી જેમાં ભાજપે ભ્રષ્ટાચાર ન કર્યો હોય'

**ભાસ્કર ન્યૂઝ. ભુજ**

માંડવીમાં પોલ ખોલ કાર્યક્રમ અંતર્ગત તંત્રને આવેદન આપતા કોંગ્રેસીઓ.

રાજ્યમાં ભાજપના ભ્રષ્ટાચારના પોલ ખોલ કાર્યક્રમ અંર્તગત માંડવીમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે ધરણા, દેખાવો અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય છબીલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે ભાજપના આગેવાનો, કાર્યકરોનો ભ્રષ્ટાચાર ન હોય એવી કોઇ સરકારી યોજના નથી. ભાજપનો ભ્રષ્ટાચાર ગામડે-ગામડે અને શેરીએ શેરીએ લઇ જઇને ભાજપની પોલ ખોલવા તેમણે હાકલ કરી હતી.

તાલુકા પ્રમુખ જટુભા રાઠોડે ભાજપના લોકોએ કરેલા ભ્રષ્ટાચારને હથિયાર બનાવીને અગામી વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી.

નરેશભાઇ મહેશ્વરી તથા સામજીભાઇ આહિરે ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા હાકલ કરી હતી. રસિકભાઇ દોશી, કલ્પનાબેન જોષી, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અરવિંદભાઇ ગઢવી, ભોલુ શેઠે પ્રવચન કર્યુ હતું. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માંડવી તાલુકા પંચાયતના પૂવ પ્રમુખ જીવુભા રાઠોડ, ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા મૂરજીભાઇ નાકર, તાલુકા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ જાડેજા, શહેરના પ્રમુખ રફિક શેખ, કિશોર ભીડે, જિતેન્દ્ર સુરુ, સહિતના આગેવાનો તથા કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન મીડિયા ઈન્ચાર્જ રમેશભાઇ ગરવાએ કર્યુ હતું.

**દિવસ-૫**

## સ્મશાનમાં જતાં અંદરનો ભય જ ડરાવે છે

શ્રાવણ માસ ભસ્મથી રંગાવાનો માસ, સૌંદર્ય પ્રસાધનોમાં ભસ્મ કયાંક હોય પણ ખરી, એવી ભસ્મ અંગે સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂતટોળી એવા શિવજી સ્મશાન એવાં સ્થળની ભસ્મ ભગવાન શિવજીએ અંગ પર ચોળી છે. સ્મશાન નિર્ભય છે, ત્યાં કશોજ ભય નથી છતાં લોકો જતાં ડરે છે. અંદરનો ભય જ ડરાવે છે. એટલે આજ સુધી ભસ્મધારણ પણ મંત્રપૂર્વક થાય છે. ભસ્મધારણ એ ભગવાન શિવજીની તંત્રસાધના છે પણ અમુક ચોક્કસ દિવસો, જેમ કે શનિ શોહિણી યોગ, પ્રદોષ, શિવરાત્રિ,શ્રાવણ માસનો શિવયોગ અને ગ્રહણ દિવસો તે દિવસોમાં સાધુ, સંન્યાસી, સાધકો બહાર નીકળતા નથી, અઘોર મંત્ર જપે છે. અઘોર શિવજીનું રૂપ છે. તેથી જ ભોળાનાથ કહેવાય છે.

રોઝા - ૩ તા.૪/૮ ગુરુવાર
ઇફ્તાર : ૭-૩૭
રોઝા -૪ તા.૫/૮ શુક્રવાર
સેહરી : ૪-૫૨

નોંધ : ઉપરોક્ત સમય ભુજ અને માંડવી માટે છે અન્ય ગામ-શહેરના બિરાદરોએ સ્થાનિક સમય સાથે ગણતરી કરવી.

## રિસાલતની આસ્થા

અત્યંત કૃપાળુ અને માયાળુ ઈશ્વરે ઈતિહાસના જુદા- જુદા યુગોમાં ઘણા રસૂલો (ઈશદૂત) પાઠવ્યા છે. પ્રત્યેક જ્ઞાત કૌમમાં એક અથવા વધુ પથ દર્શકો મોકલ્યા છે. ઈશ્વરના એ બધાં જ રસૂલો (દૂતો) ઉમદા ચારિત્ર્ય અને ઉચ્ચ માન ધરાવતા માણસો હતા, ઈશ્વરે જ તેમને ચૂંટીને માનવ જાતિ સમક્ષ પોતાનો સંદેશ સંભળાવવા માટે તૈયાર કર્યા હતા. તેમની ઈમાનદારી અને સચ્ચાઇ તેમની બુદ્ધિમતા તથા પ્રમાતિકતામાં સહજ પણ અવકાશ ન હતો. તેઓ એવા નિષ્કલંક હતા કે, તેમણે કદી ગુનાહનું કાર્ય કર્યુ કે નજ કદી ઈશ્વરના કાનૂનનો ભંગ કર્યો. ઈશ્વર તરફથી બે રસૂલો (દૂતો)ને મોકલાવવામાં આવવું, આકાશ અને ધરતી ઈશ્વર અને માનવી વચ્ચેના મજબૂત જોડાણનું સ્પષ્ટ સંકેત છે. એનો અર્થ એ છે કે માનવી સુધારને પાત્ર છે અને એમાં ઘણી ભલાઇ છે. રિસાલતનો હેતુ માણસ જે કાંઇ જાણે છે અથવા જાણી શકે છે તેની પષ્ટિ કરવાનો અને જે કાંઇ તે જાણતો ન હોય અનેપોતાના સાધનો વડે જાણી શકતો પણ ન હોય તેની તાલીમ આપવાનો છે. રિસાલત, પોતાના સર્જન પ્રાધ ઈશ્વરના અગાધ પ્રેમની અને તેને આસ્થા તથા આચરણના સાચા માર્ગે દોરવણી કરવાના ઈરાદાની બોલતી જાહેરાત છે.

**અનુસંધાન...**

# મોંઘવારી મુદ્દે સરકાર નિ:સહાય

**પહેલા પાનાનું...**

અંતર્ગત મોંઘવારી પર ચર્ચા માટે તૈયાર થઇ હતી. સરકાર અને વિપક્ષ વચ્ચે આ સહમતી સધાઇ હતી કે, પ્રસ્તાવમાં સરકારને દોષિત નહીં ઠેરવાય. બલકે, મોંઘવારીની સ્થિતિ પર ચિંતા પ્રગટ કરાઇ જેથી, સમગ્ર ગૃહ આમા જોડાઇ શકે. પ્રસ્તાવમાં કહેવાયું છે કે, ગૃહમાં વારંવાર ચર્ચા છતાં મોંઘવારી વધતી જાય છે. આ ગૃહ મોંઘવારી પર નિયંત્રણ લાદવા સરકારને અસરકારક પગલાં લેવા અનુરોધ કરે છે. જોકે, સહમતી હોવાને કારણે વિપક્ષ મત વિભાજન પર ભાર મૂકે તેવી શક્યતા નથી.

ગરીબ વ્યક્તિ આજે પણ ત્યાં જ છે જ્યાં, તે ૬૦ વર્ષ પહેલા હતો. આર્થિક ઉદારીકરણ અને બજારવાદી નીતિઓએ ઉદ્યોગપતિઓ અને સરકાર ચલાવવાવાળાને જ લાભ કરાવ્યો છે. મોંઘવારી પર આસાનીથી કાબૂ મેળવી શકાય છે. જો સરકાર ટેલિકોમ ઓપરેટરો પાસેથી ૩.૮૦ રૂપિયા પ્રતિ લિટરની સબસીડી પરત ખેંચે. ટેલિકોમ ટાવરોને ચલાવવા વાર્ષિક રૂા. ૧૭૦૦ કરોડ રૂપિયાની સબસીડી અપાય છે.આ સબસીડી ખેડૂતોને દઇ દે તો તેનાથી હાલત બદલી જશે. વિકાસથી રોજગારના અવસરો ઉત્પન્ન થઇ રહ્યા છે.

**કર્ણાટકના મુખ્યમંત્રી...**

ભાજપના વિધાનસભા પક્ષના નેતા તરીકે ગુપ્ત મતદાનમાં ચૂંટાઇ આવ્યા હતા. પક્ષમાં નવા મુખ્યમંત્રી તરીકેના ઉમેદવારના નામ પર સર્વસહમતી સાધવાના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. લોકાયુક્તના અહેવાલમાં ખનીજ કૌભાંડમાં સંડોવણી બહાર આવતા યેદિયુરપ્પાએ મોવડી મંડળના દબાણ હેઠળ રવિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

આ ચૂંટણી સંદર્ભે કર્ણાટક ભાજપ બે જૂથમાં વહેંચાઇ ગયું હતું. યેદિયુરપ્પા છાવણી સદાનંદ ગૌડાને અને તેમની વિરોધી છાવણી ભાજપના મહામંત્રીના સમર્થકો જગદીશ શેટ્ટારને મુખ્યમંત્રી પદે ઈચ્છતા હતા. અંતે ગુપ્ત મતદાનમાં ગૌડાએ શેટ્ટારને હરાવી દીધા હતા. યેદિયુરપ્પાએ રાજીનામું આપતા પહેલા ગૌડાને પોતાના ઉત્તરાધિકારી બનાવવાનું દબાણ સર્જ્યું હતું. પરંતુ તેમની પક્ષે આ શરત માનવાનો ઈન્કાર કરી દીધો હતો. અંતે પોતાના સમર્થકોના બળ પર તેઓ ગૌડાને મુખ્યમંત્રી બનાવવામાં સફળ રહ્યા હતા.

**સોનામાં તેજીનું...**

રહેવાની ધારણાએ વૈશ્વિક સોનું ૧૬૭૪ ડોલરની સર્વોચ્ચ સપાટીએ જોવાયું હતું તેની અસરરૂપે ભારતીય બજારમાં એક જ દિવસમાં સોનામાં રૂ.૬૪૦ વધ્યા હતા અને કોલકાતા ખાતે સોનું રૂ.૨૪૩૩૫નો ટોચે પહોંચ્યું હતું. વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતા વચ્ચે ઘરઆંગણે રોકાણકારો અને સ્ટોકિસ્ટની લેવાલી નીકળી હતી.દિલ્હી ખાતે એક જ દિવસમાં રૂ.૬૪૦ વધ્યા હતા જયારે કોલકાતા ખાતે રૂ.૨૪૩૩૫ના ઊંચા ભાવ બોલાયા હતા. રાજકોટ ખાતે સોનું રૂ.૫૦૦ વધી રૂ.૨૪૨૫૦ અને ચાંદી રૂ.૧૬૦૦ વધી રૂ.૫૯૫૦૦ થઇ હતી. મુંબઇ ખાતે ચાંદી ૬૦૬૧૫ની સપાટી કૂદાવી ત્રણ મહિનાની ટોચે દેખાઇ હતી.

અમેરિકામાં દેવાની મર્યાદા વધાર્યા બાદ પણ મંદીનો ખતરો ઝળુંબી રહ્યો છે. બે વર્ષમાં પહેલી વખત જૂન મહિનામાં ખરીદ શકિત ઘટી છે. આ નકારાત્મક રિપોર્ટ યુએસ ત્રિપલ એ રેટિંગ ગુમાવે તેવી શક્યતા છે.યુરોપની સ્થિતિમાં પણ કોઇ સુધારો નથી.આજે મહત્ત્વના ચલણો સામે ડોલર નબળો પડ્યો હતો અને સતત ચોથા દિવસે ક્રૂડ વાયદો તૂટ્યો હતો.આર્થિક અનિશ્ચિતા વચ્ચે થાઇલેન્ડ, રશિયા, સાઉથ કોરિયા અને મેકિસકોએ ચાલુ વર્ષમાં સોનામાં રોકાણ વધાર્યું છે.આ તમામ કારણોને પગલે વૈશ્વિક સોનું ૧૬૭૪ ડોલર પ્રતિ ઔંશની ઊંચાઇએ પહોંચ્યું હતું. આ લખાય છે ત્યારે હાજરમાં સોનું ૧૬૬૭ ડોલર અને ચાંદી ૪૧.૫૮ ડોલર પ્રતિ ઔંશ થઇ હતી.

**ઉદ્યોગો સામે...**

૮૧ કિલોમીટર પગપાળા ચાલીને લોકોએ ગુરુવારે ભુજમાં કલેકટરને આવેદન પત્ર આપશે.

અદાણી કેપીજીએલ, પાવર પ્લાન્ટ, અદાણી એપીએસઇઝેડ, ઓપીજી જેવી કંપનીઓ દ્વારા ગૌચર જમીન દબાણ કર્યા બાદ હવે ગામના રસ્તાઓ પણ બંધ કરવામા આવી રહ્યાને કારણે લોકોની ધીરજ ખૂટી ગઇ છે. બીજી બાજુ લાંબા સમયથી ચાલી રહેલા કાનુની દાવપેચ બાદ પણ અદાણી ગ્રૂપ ઓફ કંપનીઝ ઉપર ગુજરાતની મોદી સરકારના ચાર હાથ હોવાનું હંમેશાથી મહેસુસ થતું હોવાને કારણે લોકોએ છેવટે ગુજરાત સહિત સમગ્ર દેશનું ધ્યાન આ મુદ્દે આકર્ષિત થાય તે માટે માછી માર અધિકાર સંઘર્ષ સંગઠન તથા ખેતી વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના ટેકાઓથી વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોતો ઉપસ્થિત રહ્યા જ છે. સાથે સાથે કચ્છના ભૂતપૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, જિલ્લા પંચાયતના વિરોધપક્ષના ઉપનેતા નારાણ સોંધરા તથા મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ, સભ્યો તથા મીઠાના અગરના માલિક ભીખાભાઇ આહિર, સામાજિક અગ્રણી ભગવાનભાઇ વરૂ વગેરે લોકો પણ આ વિશાળ હલ્લાબોલ રેલીમાં ખભેથી ખભા મીલાવીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.

રેલીમાં જોડાયેલા લોકો તેમજ પીઢ અગ્રણીઓએ એક સૂરે અદાણી તેમજ અન્ય કંપનીઓ દ્વારા પર્યાવરણીય નુકસાન રોજગારીના પ્રશ્નો તેવા મુદ્દે રજૂઆત કરી હતી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે સરકારી જાહેરાતથી તદ્દન વિપરીત બહુ ઓછા લોકોને આ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રોજગારી આપવામાં આવે છે અને તેમાં પણ જે લોકો નિષ્ણાંત હોય તેમને જ નોકરી મળે છે. જ્યારે પોતાના પશુધન પર નભતા કે, માછીમારી કરતા લોકોને પ્રદૂષણને કારણે પોતાની રોજીરોટી ખોવાનો વારો આવી રહ્યો છે. આ કંપનીઓથી થઇ રહેલા નુકસાનના વિરોધમાં જાગૃતિના ભાગ રૂપે તેઓ આજે રેલી સ્વરૂપે એકઠા થઇ રહ્યા છે તેવું જણાવ્યું હતું. ભદ્રેશ્વરથી નીકળેલી આ પદયાત્રા બુધવારે સાંજે ભુજ તાલુકાના કેરા ગામે આવી પહોંચી હતી અને ત્યાં રાત્રી વિરામ રાખ્યો હતો. ગુરુવારે સવારે તેઓ કેરાથી નીકળીને ભુજ કલેકટર ઓફિસ પ્રયાણ કરશે અને વિશાળ જનમેદની બહેરી સરકારના કાને તેમની રજૂઆત કરશે. આ પદયાત્રામાં માછીમાર એસો.ના પ્રમુખ આદમ ઈલિયાસ માંજલિયા, હુસેન કારા, કિરિટસિંહ જાડેજા, આદમ હાજી તથા અન્ય અગ્રણીઓ સહિત હજારો ગ્રામજનો જોડાયા હતા.

**અદાણી દ્વારા...**

અદાણી પોર્ટ તેમજ અદાણી સેઝ દ્વારા જૂના વહાણવટા ઉદ્યોગને ખતમ કરી દેવાનો આ એક ખતરનાક કારસો છે. મુન્દ્રા પોર્ટ જેમના અંડરમાં આવે છે તેવા ગુજરાત મેરીટાઇમ બોર્ડની માંડવી પોર્ટ ઓફિસના પોર્ટ અધિકારીને ઉદ્દેશીને તા. બીજી ઓગસ્ટે લખેલા પત્રમાં એસો.એ એવી રજૂઆત કરી હતી કે, દેશી વહાણોના ટ્રાફિક માટે મુન્દ્રા એક આદર્શ બંદર છે. તેમજ દેશી વહાણો પૈકીના ૮૦ ટકાથી વધારે વહાણોની માલિકી કચ્છી લોકો પાસે હોવાને કારણે મુન્દ્રા બંદરના વિકાસ માટે તેઓ સૌ કટિબધ્ધ છે. આ બંદરેથી ઉત્તર ભારતની ખેત પેદાશનો મોટા ભાગનો એક્સપોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાંઆવે છે. ત્યારે, અદાણી બંદર દ્વારા રિકલેમેશન કરવાથી રેતીનો ભરાવો થઇ જતાં મુન્દ્રા બંદરે જવુ અશકય બની ગયું છે. અને કાર્ગો હેન્ડલ થઇ શકતો નથી. મુન્દ્રા બંદરને જોડતા એપ્રોચ રોડને તાત્કાલીક રિપેર કરી મોટરેબલ કરવો જરૂરી છે. ત્યારે અદાણીએ કરેલા આ કૃત્યને કારણે મુન્દ્રાના જીરો પોઇન્ટ થઇ હોટલ રંગોલી પાસે નવા ફલાયઓવર નીચેના ભાગેથી એરપોર્ટ તરફના માર્ગે ફાટક સુધી જઇ શકાતો માર્ગો બંધ થઇ ગયો છે. જેને કારણે શહેરમાંથી પણ પસાર થઇ શકાય તેવી સ્થિતિ નથી. કારણ કે સિટીમાં હેવી ટ્રાફિકની મનાઇ કરી દેવામાં આવી છે. રંગોલી હોટલવાળો રોડ જે મુન્દ્રા અદાણી પોર્ટને જોડતો હોઇ હોટલ રંગોલી પાસે એમપીએસઇઝેડ દ્વારા બંધ કરી દેવામાંઆવ્યો છે. જેથી મુન્દ્રા બંદરને જોડતા તમામ રસ્તા બંધ થઇ ગયા છે. માત્ર એટલું જ નહીં પરંતુ મુન્દ્રા પોર્ટ અને એસીઝેડ દ્વારા મુન્દ્રા જૂના બંદરના રોડ પર બંને બાજુ ડ્રેજિંગથી રેતીનું પુરાણ કરી અને પોતાની ફેન્સિંગ બનાવી પાકી દીવાલો બનાવી દેવામાં આવી છે. જેમાં રોડની સેન્ટ્રલ લાઇનથી ૩૦થી ૪૦ મીટરની જગ્યા મૂકવામાં આવી નથી. જેને કારણે જયારે હવાનું પ્રમાણે વધારે હોય ત્યારે રસ્તા પર રેતીનું પ્રમાણ વધી જાય છે અને જૂના પોર્ટ ઉપર પહોંચી શકાતુ નથી. દર પંદર પંદર દિવસે લોડર તથા જેસીબી દ્વારા રોડ પરની આ રીતે દૂર કરવામાં આવે છે. આ પરિસ્થિતિ અંગે મુન્દ્રાની ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ સારી રીતે વાકેફ છે. તેમ છતાં જીએમબી દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.

**કાણે કોને રજૂઆત કરી**

ઓલ્ડ મુન્દ્રા પોર્ટ યુઝર એસો. વતી સુભમ શિપિંગના મહેન્દ્ર ઠક્કર, બુખારી શિપિંગના રિયાઝ બુખારી, આશાપુરા શિપિંગના અશોક ભાનુશાલી, મારુતિ શિપિંગના યોગેશ ઠક્કર, ઓમકાર શિપિંગના નિલેશ શીયાલ, ઓમ શિપિંગના અનિલ ઠક્કર, સ્ટાર મરીનના ઈસ્માઇલભાઇ, સી જીવરામ જોશી એન્ડ સન્સના સુરેશ જોશીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન ઉપરાંત મુખ્યમંત્રીની ફરીયાદ નિવારણ શાખા, કચ્છ કલેકટર, કચ્છના સાંસદ પૂનમબેન જાટ, રાજયકક્ષાના મંત્રી વાસણ આહિર, મુન્દ્રા રમેશ મહેશ્વરી, ઓલ ઈન્ડિયા સેલીંગ વેસલ એસો. - મુંબઇ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને રજૂઆત કરી છે.

**'નિવેડો ન આવે...**

શોષણનીતિ છે, ઉદ્યોગોને ગમે ત્યારે વીજળી-પાણી અને ખેડૂતોને કંઇ નહીં, એ મુદ્દાને લઇને હું આંદોલન કરું છું. કચ્છમાં અદાણી દ્વારા થતા જન અન્યાયનો નિવેડો ન આવે ત્યાં સુધી જંપીશ નહીં.

કચ્છમાં વિકાસના નામે કચ્છની ખુમારી અને સંસ્કૃતિક મૂલ્યો નષ્ટ કરવાના પ્રયાસો રોજગારી છીનવીને થઇ રહ્યા છે. જેના વિરોધમાં જનસમુદાય દ્વારા ગુરુવારે આંદોલનનો આરંભ થઇ રહ્યો છે. મારા મહુવાની નિરમા સામેની લડતનો અનુભવ છે તેના પરથી કચ્છના આ લડતકારોને માર્ગદર્શન આપીશ. ગુરુવારે કેરાથી ભુજ સુધીની પદયાત્રામાં જોડાઇને કલેકટરને આવેદન આપિશું અને સભા પણ યોજશું. આગળની રણનીતિ હવે અહીના લોકો જ નક્કી કરશે. કચ્છમાં આ લડતમાં જોડાવા સામે અત્યાર સુધી કોઇ દબાણ આવ્યું નથી. કેમ કે, હું અગાઉ ક્યારેય ઝૂક્યો નથી અને હવે દબાણ આવશે તો પણ મને પરવા નથી'.

## ઈરાની ગેંગના ૬ સભ્યો પોલીસના પંજામાં

**છેલ્લા પાનાનું...**

જાગી. ભુજ સિટી પોલીસના સબ ઈન્સ્પેકટર જે. કે. મૈયડે જણાવ્યું કે મુંબઇની કુખ્યાત ઇરાની ગેંગના રહેમતુલ્લા સૈફૂલ્લા જાફરી, મહંમદ તારીક અંસારી, અલી અકરમ જાફરી, યાસીર અલી હાજી હુજ્જત અલી, જાફર અલી આસિફ અલી અને કાસમ અલી યુસુફ અલીનો અમદાવાદની સાબરમતી જેલમાંથી ટ્રાન્ફર વોરન્ટ કબજો મેળવી અટક કરવામાં આવી છે. આ શખ્સો પોતાને પોલીસ અધિકારી હોવાનું જણાવતા અને આગળ ખૂન થયું છે અમે કહીને ભોળો મહિલઓના કિંમતી ઘરેણા તફડાવી નાસી જતા હતા. આ મોડસ ઓપરેશનડીસ તેમણે ગુજરાતમાં અનેક સ્થળે લોકોને છેતર્યા હતા. તેમની સામે પચાસેક જેટલા ગુના નોંધાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય પહેલા જ આ ગેંગની ધરપકડ કરી હતી. ભુજમાં તા. ૧૧ જૂનના રોજ વૃદ્ધાના ઘરેણા ઉતરાવ્યાની તેમણે કબૂલાત આપી હતી. એ આધારે તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવયા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવશે. ભુજ અને ગાંધીધામ આ પ્રકારના અન્ય કેસનો ભેદ પણ ઉકેલાય એવી શકયતા છે.

**બિનચૂંટાયેલા...**

આમંત્રિત સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. જેઓ કચ્છના લોકોના આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનું નિરાકરણ લાવવા મદદરૂપ બનશે. જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત હેલ્થ કમિટીમાં એકસાથે પાંચ બિનચૂંટાયેલા નાગરિકોને સ્થાન આપવામાં આવ્યું છે. કમિટીના ચેરમેન જયંતીલાલ ઠક્કર દ્વારા આ નિમણૂકને મંજૂરી અપાઇ છે.

રાજ્ય સરકાર પાસેથી કચ્છના આરોગ્ય માટે રૂપિયા ૨૦૦ કરોડ લાવવાનું આયોજન છે, ત્યારે દર્દીઓને પડતી હાલાકીઓ દૂર કરવા તથા સગવડોનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ અને અંતરિયાળ અબડાસાના ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની સૂચનાથી આરોગ્ય સમિતિમાં આમંત્રિત સભ્યોને સમાવવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હેલ્થ સેકટર સાથે જોડાયેલા આગેવાનોમાં ભુજની લેઉવા પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી અને આરોગ્યક્ષેત્રમાં અગ્રેસર એવા કે. કે. હિરાણી, બળદિયા હોસ્પિટલના ટ્રસ્ટી તથા સામાજિક કાર્યકર વિશ્રામ કરસન ગોરસિયા, કચ્છને વતન સમજી છેવાડાના ગામો સુધી શિક્ષણ, પર્યાવરણ તથા આરોગ્ય પ્રવૃતિમાં રત દિલીપભાઇ દેશમુખ, દુર્ગમ અબડાસા તાલુકામાં મફત તબીબી કેમ્પો તથા ગરીબોને મફત ઓપરેશન કરાવી આપનારા વિંઝાણના દાવતે મુસ્તફા ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ સલીમશા જાગીરશા અને ડુમરા વિકાસ સમિતિના પ્રમુખ તથા જુદી જુદી સંસ્થાનો અને દાતાઓના સહયોગથી હજારો દર્દીઓને સેવા આપનારા મહાવીરસીંહ કરણસિંહ જાડેજાની નોંધ લઇને સમાવેશ કરવામાં આવ્યો છે.

નિમણૂક પ્રક્રિયામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર મોડ, રસીકરણ અધિકારી ડો. પંકજકુમાર પાંડે જોડાયા હતા.

**ભુજના ટીડીઓ...**

પડાયા બાદ આગામી પગલાં ભરવામાં આવશે. શક્યતઃ બે દિવસમાં આવી માહિતીઓ ઉચ્ચસ્તરે પહોંચ્યા બાદ સસ્પેન્સનનો હુકમ જારી થાય એમ સમજાઇ રહ્યું છે.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલે સમર્થન આપ્યું હતું અને વહીવટી પ્રક્રિયા ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું.

**કચ્છમાં કૃત્રિમ ...**

થયેલી વિકસ પરિસ્થિતિ અંગે વિસ્તૃત છણાવટ કરતાં ઉમેર્યુ હતું કે, હાલ કચ્છમાં ચોમાસું નિષ્ફળ રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે કુદરતી વરસાદ નહીં પડે તો જળની ખેંચ અનુભવતા કચ્છ જિલ્લાના ખેડૂતો પશુધન અને આમ લોકોને ભારે મુશ્કેલીમાં મુકાઇ જશે. આવનારા સંભવિત સંકટને નિવારવા સત્વરે કચ્છમાં કૃત્રિમ વરસાદ માટેના પ્રયાસો હાથ ધરવા પર તેમણે ભાર મૂકયો હતો. કૃષિમંત્રી સાંઘાણીએ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી સત્વરે યોગ્ય પગલા ભરવા હૈયા ધારણ આપી હતી. ગાંધીનગર ખાતે વધુમાં ભાનુશાલીએ પાણી પુરવઠા મંત્રી નિતિનભાઇ પટેલને પણ મળીને અબડાસામાં જળ સંચયના નવા આડબંધ અને ચેકડેમોના કામોની ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપવાની માંગણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અબડાસા તાલુકામાં ઉત્તરોત્તર કૃષિ ક્ષેત્રે થઇ રહેલી પ્રગતિ જોતા આવા વધુ કામોની તાતી જરૂરિયાત છે.

YOUR JOB SEARCH ENDS HERE...
ભાસ્કર
appointment
Every Tuesday, Thursday & Saturday
Bhuj : 99796 33555, Gandhidham : 9909944072

Prestine
સેલ્સ ઓફીસર જોઈએ છે.
ઈન્સ્ટીટ્યુશનલ માર્કેટીંગનો ઓછામાં ઓછો ૩ વર્ષ નો અનુભવ ધરાવતાં
મેલ/ફીમેલ સેલ્સ ઓફીસર ની દરેક શહેરમાં નિમણુંક કરવાની છે.
રસ ધરાવનાર પોતાનો સંપૂર્ણ બાયોડેટા તથા ઈન્સ્ટીટ્યુશનલ જોબ જર્ની, પોતાના ફોટોગ્રાફસ સાથે ઈમેલ કરશો.
Email : sales@prestineoriginal.com inquiry@prestineoriginal.com

જોઈએ છે
સુરતનાં નામાંકિત ફોટો સ્ટુડીયોને સુરત માટે સ્ટુડીયો ફોટોગ્રાફીના જાણકાર ફોટોગ્રાફર
Mo. 93747-15507

સિવિલ કોન્ટ્રેક્ટ ટેન્ડર
રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા
"શ્રી મનુભાઈ એ. શેઠ ઈંગ્લિશ સ્કૂલ"
રાણપુર ખાતે બાળમંદિરથી ૧૨ સાયન્સ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ
જેની વિગત
✻ અંદાજીત ૫૫૦૦૦ સ્વે.ફીટ કંસ્ટ્રક્શન ✻
✻ ગ્રાઉન્ડ + ૫ માળ બાંધકામ ✻
✻ અંદાજીત ૫ કરોડનો પ્રોજેક્ટ ✻
કુશળ અને અનુભવી કોન્ટ્રાકટરોએ બીડ કરવી.
ટેન્ડર બહાર પાડવાની તારીખ : ૦૫/૦૮/૨૦૧૧
ટેન્ડર બીડ કરવાની છેલ્લી તારીખ : ૧૫/૦૮/૨૦૧૧
ટેન્ડર ફી : રૂા.૧૦૦૦/-
વધુ માહિતી અને વિગત માટે
શ્રી મુકુંદભાઈ વઢવાણા : ૯૮૨૫૩૧૪૩૪૪
શ્રી દિલીપભાઈ પરીખ : ૯૮૨૫૨૮૯૯૬૭
રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, રાણપુર, જિ.અમદાવાદ

જોઈએ છે
આફ્રિકા માટે
આફ્રિકામાં આઇવરી કોસ્ટ અને બુર્કિના ફાસો માટે
૨ વર્ષના અનુભવી
૨ વ્યક્તિઓ
જે તલના બીજોની ગુણવત્તા નિયંત્રક કરી શકે.
आवश्यकता है.
अफ्रीका में आइवरी कोस्ट और बुर्किना फासो के लिए
2 व्यक्ति जिसे तिल के बीज की गुणवत्ता नियंत्रक के रूप में 2 वर्ष का अनुभव हो.
GS INTERNATIONAL
gaurav.gsint@gmail.com
: 8141057095

ભાસ્કર નોટિસ
(દરરોજ)
જાહેર ખબર માટે સંપર્ક : ૯૯૭૯૬ ૩૩૫૫૫
૯૯૨૫૧ ૬૧૦૮૮

**જાહેર નોટીસ**

ના. શ્રી ૩જા અધીક સિનિયર સીવીલ જજ અને જ્યુ. મેજી ફ. ક. સા. ની કોર્ટ ભુજ કચ્છ.
ફો. પ. અ. ન. ૪૫૦/૨૦૧૧

રવજી રામજી વરસાણી ..........અરજદાર

વિરૂધ્ધ

તલાટી સહમંત્રીશ્રી ........સામાવાળા

બાબત જન્મ નોંધણી અંગેના હુકમ અંગે

અરજદારના વકીલ શ્રી વીનોદ વી. જોબનપુત્રા

આથી લાગતા વળગતા સર્વે શખ્સોને જાણ કરવામાં આવે છે કે આ કામના અરજદારે તેમની પુત્રી હંસાબેન રવજી વરસાણી નો જન્મ તા. ૭/૧૨/૧૯૭૯ ના રોજ ભારાસર મુકામે થયેલો છે. તે મતલબની નોંધણી સામાવાળા તેમના દફતરે કરી દાખલો કાઢી આપે તેવો હુકમ ફરમાવા અત્રે કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. જે અંગે કોઇ શખ્સને વાંધો કે તકરાર હોય તે નોટીસ પ્રસીદ્ધ થયેથી દીન ૧૫ માં આ કોર્ટ " સમક્ષ જાતે કે વકીલ મારફતે હાજર રહેવું. અન્યથા મુદત વિત્યે કોઇજાતનો વાંધો કે તકરાર નથી તેમ માની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની નોંધ લેશો.

આજ તારીખ ૨/૮/૨૦૧૧ના રોજ મારી સહી સીકકો કરી આપ્યું.

| તૈયાર કરનાર | મુકાબીલ કરનાર | | |
| --- | --- | --- | --- |
| આસીસ્ટન્ટ | આસીસ્ટન્ટ | કોર્ટનો સીકકો | રજીસ્ટ્રાર |
| હિતેશ જે ચૌહાણ | આર. એમ. ભટ્ટ | | ચીફ કોટ, ભુજ કચ્છ |

Digitially Archived by: www.realpatidar.com/library

# ટેન્કરમાંથી કેમિકલ લીક થતાં દોડધામ

**જામનગરથી કંડલા આવી રહેલું ઓર્થોઝાઇલિન નામનું કેમિકલ રસ્તામાંજ ઢોળાયા બાદ તાત્કાલિક લીકેજ બંધ કરાયું**

ભાસ્કર ન્યૂઝ . ગાંધીધામ

realpatidar.com

કંડલામાં આવેલી આ સીઆરએલ કંપનીમાં જઇ રહેલા એક ટેન્કરમાંથી કેમિકલ લીક થતા દોડધામ મચી હતી. -મીઠુ ચૌહાણ.

બારૂદના ઢગલા પર બેઠેલા કંડલા બંદર પર નાની બેદરકારી પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારે જામનગર નજીક રિલાયન્સ કંપનીમાંથી ટેન્કર મારફતે કંડલા આવેલું આર્થોઝાઇલિન નામનું જ્વલનશીલ કેમિકલ ટેન્કરમાંથી માર્ગ પર ઢોળાતા રીતસરની દોડધામ મચી હતી. સીઆરએલ ટર્મિનલમાં આવી રહેલું આ ટેન્કર ટર્મિનલમાં કેમીકલ ઠલવે તે પહેલાજ રસ્તામાં ટેન્કરમાંથી ઓર્થોઝાઇલિન ઢોળાયું હતું. જેના પગલે સીઆરએલ ટર્મિનલે તાત્કાલિક રસ્તાની બન્ને બાજુ પરિવહન બંધ કરાવી લીકેજ બંધ કર્યુ હતું.

મળતી વિગતો મુજબ જામનગરથી ઓર્થોઝાઇલીન નામનું બી કેટેગરીનું જ્વલનશીલ કેમિકલ ભરી કંડલાના સીઆરએલ ટર્મિનલના ટેન્કમાં ખાલી કરવા આવી રહેલું જીજે ૧૦ વી ૮૯૮૬ નંબરના ટેન્કરમાંથી સવારે રસ્તા પર કેમિકલ લીક થયું હતું. આ વાત બહાર આવતા કંડલામાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના સીઆરએલ ટર્મિનલને ધ્યાને આવતા તાત્કાલિક રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટર્મિનલના ઉચ્ચ અધિકારીઓ તથા રેસ્કુય ટીમ ઘટના સ્થળ પર દોડી જઇ બન્ને બાજુ વાહનોની અવરજવર બંધ કરાવી દીધી હતી. તો બીજી બાજુ ઢોળાઇ ગયેલા જ્વલનશીલ કેમિકલ પર ફાયરબ્રીગેડની ટીમે ફોમ છાટ્યું હતું. તો લીકેજ વાળા ટેન્કરમાંથી તાત્કાલિક કેમિકલ અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું અને લીકેજ વાળા ટેન્કરમાં લાકડાનું બૂચ ભરાવી લીકેજ બંધ કરી દેવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બી કેટેગરીનું આ કેમીકલ આમ તો બહુ મોટું નુકસાન કરે તેવી શકયતા નહીવત હતી તેમ છતા ગાંધીધામ જેવા ભરચક વિસ્તારમાં આ કેમિકલ ઢોળાયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત તેવી શક્યતા સો ટકા થઇ જાય છે.

**લીકેજ તાત્કાલિક બંધ કરાવ્યું હતું**

આ બાબતે સીઆરએલ ટર્મિનલના મેનેજર ડી બી આગરિયાએ જણાવ્યું હતું કે, કંપનીની બહાર જ લીકેજ થયું હતું. ઘટનાની જાણ થતા કંપની દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા. લીકેજ વાળા ટેન્કરમાંથી કેમિકલ અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરી લીકેજ બંધ કરવામાં આવ્યું હતું.

# કાસેઝની કંપનીમાંથી લેપટોપ ચોરનાર ત્રણ ચોર પકડાયા

**કંપનીમાંજ ફરજ બજાવતા એક સુરક્ષા કર્મચારી અને બે મજૂરની ધરપકડ**

ભાસ્કર ન્યૂઝ . ગાંધીધામ

ગાંધીધામની ભાગોળે આવેલા કંડલા સ્પેશિયલ ઇકોનોમીક ઝોન (કાસેઝ)માં આવેલી એક રબર સ્ટેમ્પની કંપનીમાંથી રૂા. ૪૦ હજારના બે લેપટોપની ચોરીમાં બી ડિવિઝન પોલીસે કંપનીના બે કર્મચારી અને એક સુરક્ષા કર્મચારીની ધરપકડ કરી બન્ને લેપટોપ કબજે કર્યા હતા.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.પી. પઠાણે જણાવ્યું હતું કે, કાસેઝમાં આવેલી વોકો મધર્સન એન્ડ રબ્બર સ્ટેમ્પ કંપનીમાં બે લેપટોપની ચોરી થઇ ગઇ હતી.

આ ચોરીમાં પોલીસે સુરક્ષા કર્મચારી જયસીંગ સુગારામ ગુજ્જર, કર્મચારી ભુપેન્દ્ર ઉર્ફે વીકી શ્રીવકોલ મંડલ અને આર્યનકુમાર શ્રીદસરથ પ્રશાદ મંડલ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે કર્મચારીઓ પર વોચ રાખી આ ચોરી ઉકેલી છે. ત્રણેય આરોપીઓ પાસેથી ચોરાયેલા બન્ને લેપટોપ કબજે કરાયા હતા.

# ગાંધીધામમાં મહિના અગાઉ દાઝેલી પરિણીતાનું મોત

ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ

ગાંધીધામમાં એક માસ પહેલા રસોઇ બનાવતી વખતે દાઝી ગયેલી પરિણીતાનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતુ કે, શહેરના ચામુંડા નગર ખાતે રહેતા શાંતિબેન રમેશભાઇ યાદવ(ઉ.૪૦) ગત તા. ૪/૭ ના પોતાના ઘરે રસોઇ બનાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે ગંભીર રીતે દાઝી ગયા હતા. ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા બાદ ગત તા. ૧૦/૭ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં દાઝી જવાને લીધે અવાર નવાર મહિલા મૃત્યુ પામતી હોવના બનાવ બનતા રહે છે. જેમાં અનેક કિસ્સામાં સાસરીયાના ત્રાસથી મહિલા જીવનો અંત આણતી હોવાનું સામે આવે છે.

## ગટરે સુની પાડી વચલી બજાર

તસવીર મીઠુ ચૌહાણ

ઝીણામાં ઝીણી વસ્તુ ગાંધીધામમાં જો ક્યાંયથી મળે તો તે માત્ર વચલી બજારમાંથી જ મળી શકે છે. મેઇન માર્કેટની વચ્ચે આવેલી આ બજારમાં અનેક દુકાનો ધમધમે છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અહીં ગટર ગંગા વહેતી હોવાથી વેપારીઓને તો દુર્ગંધનો સામનો કરવો પડે જ છે. સાથે ગ્રાહક પણ ઓછા આવતા થઇ ગયા હોવાથી બેવડો માર પડી રહ્યો છે. સુધરાઇમાં કોઇ સાંભળતું ન હોવાની તેમની રાવ છે.

# સુધરાઇના ભ્રષ્ટ તત્ત્વો સામે ફોજદારી નોંધાવવા માગણી

**નાણાં ઉઘરાવતા રંગે હાથે પકડાઇ ગયેલા કર્મચારીઓ સામે વિરોધ પક્ષે બાંયો ચડાવી**

ભાસ્કર ન્યૂઝ . ગાંધીધામ

ગાંધીધામમાં નગરપાલિકા દ્વારા પાણીની નવી લાઇન નાખવામાં આવતી હતી ત્યારે કનેકશનના નામે પૈસા ઉઘરાવી રહેલા ત્રણ કર્મચારીઓને એક નગરસેવકે રંગે હાથે પકડી લીધા પછી પણ કોઇ પગલાં ન લેવાતાં કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર સુધી ધા નાખી છે અને પૂરતા પુરાવા હોવાથી ભ્રષ્ટાચારીઓ સામે ફોજદારી રાહે પગલાં લેવા માગણી કરી છે.

ગુજરાત મહિલા કોંગ્રેસના મહામંત્રી તુલસી સુજાન, ગાંધીધામ નગરપાલિકાના વિપક્ષી નેતા સંજય ગાંધી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હાજી જુમા રાયમાએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ ઉઘરાણાના વીડિયો રેકોર્ડિંગ અને તસવીરો સહિતના પુરાવા હોવા છતાં સુધરાઇના સત્તાધીશો પગલાં લેવામાં પાછા પડી રહ્યા છે.

જે વિસ્તારોમાં વારંવારની રજૂઆત છતાં પાણી ન આવતું ત્યાં હવે અચાનક પાણી વિતરણ શરૂ થઇ ગયું છે તો શું રૂપિયા ઉઘરાવવા માટે જ પાણી બંધ કરવામાં આવ્યું હતું, એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

આ ઉઘરાણામાં કોઇ પદાધિકારીની તો સંડોવણી નથીને તે તપાસ કરવાની પણ તેમણે માગણી કરી હતી. જે રીતે કર્મચારીઓને છાવરવામાં આવ્યા હતા તે જોતાં આ ઉઘરાણાના મૂળ ઉંડે સુધી છે. વધારામાં આવા કેસની તપાસ પણ મળતિયાઓને સોંપવામાંઆવી છે.

નગરપ્રમુખના રાજીનામાની માગણી કરતા કોંગ્રેસે આ કેસમાં ફોજદારી ફરિયાદ નોંધાવવાની પણ માગણી કરી હતી.

દરમિયાન આ કેસ સંદર્ભે ચીફ ઓફિસરે સરકારી મોબાઇલ ન ઉપાડવાનું મુનાસિબ સમજ્યું હતું.


LEADING JEWELERS of the WORLD — THE MARK OF DISTINCTION

NAKSHATRA DIAMOND JEWELLERY

THIS MONSOON, the rain drops will sparkle like never before!

LEADING JEWELERS OF THE WORLD PRESENTS

RAIN & SHINE OFFER

~ Up To 28th August 2011 ~

Get up to 40%* Value of Discount & FREE watches on Diamond Jewellery purchase

For more info call 1800 102 4480

*Terms and conditions apply. Images shown are indicative. Actual products may vary.

Selected Superbrand India 2009-10 Consumer Validated | Certified by IGI

**Available at: GUJARAT: Gitanjali Jewels : GANDHIDHAM:** Main Market: 226300, **BHAVNAGAR:** Wagha Wadi Road : 3001212 **Gitanjali Lifestyle: AHMEDABAD:** Law gardenroad: 9427633847 **Also available at: GUJARAT: ANAND:Gamdiwad:** M.V. Jewellers - 02692-243527 **BARODA:Alkapuri:** Shree Mukt Jewellers 2314499 **BHAVNAGAR: M.G. Road:** Soni Dwarkadas Virchand 2515454, **GANDHIDHAM:**Uma Jewellers- 02838-230548, Jimmy's Bazzar: 02838-230438 **JAMNAGAR:** Suvarna Shikha Jewellers- 0288-2664930/31/32 **RAJKOT:** Mohit Chimanlal Jewellers: 9825821901 **KESOD:** A. J. Jewellers: 9898613451 **HIMMAT NAGAR:** Manubhai Jewellers 9428198111 **SURAT: Parle Point:** D.Kushalbhai Jewellers 9824130007 **Majura Gate –Fire Station:** Sonal Jewellers 2654216 **Ghod Dhod Road:** Premier Gems & Jewels: 0261-2650974 **Adajan:** Novel Jewels: 0261-2770895 **Bardoli:** Gold Studio 02622-226518 **Visit us at:** www.nakshatradiamonds.in

Also available at maya

Invites Dynamic & Result Oriented FRANCHISEE / DISTRIBUTORS / RETAIL JEWELLERS
Interested parties may email their details to info@bcj.in or call 09324179905 / 022-42094377 / 75, from 9 AM to 5:30 PM Toll free No: 1800 102 4482



S.J. COLLEGE OF ENGINEERING AND TECHNOLOGY
42 km stone, NH 11, Bhandana, Dausa, Agra Road Jaipur
Approved by AICTE, Affiliated by RTU, Kota
Admission in B.Tech, Ist Year
• Civil • Elect. • Mech. • Comp. Sci. • Elect. & Comm.
ELIGIBILITY : 45% (General), 40% (SC, ST)
Regional Office (RAJKOT) : Patel Education Centre
Satyam Sivam Sundram Complex, Near Indira Circle,
Opp. SBI Bank, University Road (Rajkot) Gujarat. Ph : 0281-3054640
HELPLINE : Rasik-96381-65300, Kalpesh-099240-47465
Rajesh-098296-67825, Upendra-096029-21000
B.O. : 301/1, Aniket, Near Girish Cold Drink, Cross Road, G.G. Road, Navrangapura, Ahmedabad-079-40074054
Admission open Diploma to Degree (Lateral Entry)



આપના પ્રોજેક્ટને આપો આગવી ઓળખ

બાલ્કની કવર, હાઉસ એક્સ્ટેન્શન અને હાઉસ/શોપ એલીવેશન માટે ઉત્તમ
• વિવિધ ફિનિશમાં ઉપલબ્ધ
• ટકે વર્ષોવર્ષ
• લગાવવામાં સરળ
• અવાજ અને ગરમી સામે ઇન્સ્યુલેશન
Gloria Siding Panels — Magical masterpieces
www.sintex-plastics.com
Bidhan-SIL-17-11
SINTEX INDUSTRIES LIMITED, PLASTICS DIVISION, B.O.: AHMEDABAD Ph.: 26462328, 26468730, E-mail: interiors@sintex.co.in
AHMEDABAD: AKSHAR ENTERPRISE, PH.: 9377809897, RAJEE DISTRIBUTOR, PH.: 9824055061 SHREENATH TRADERS, PH.: 9327041321, NATIONAL TECHNOLOGIES, PH.: 9227591591, HIMMATNAGAR: BHUMI ENTERPRISE, PH.: 9426306668, BARODA: EBBY INDUSTRIAL SALES, PH.: 2774496, RAJESH HARDWARE, PH.: 2568735, JAMNAGAR: STERLING AGENCIES, PH.: 2558018, RAJKOT: NEW ERA TRADERS, PH.: 9825418655, NAVSARI: VIPUL SALES, PH.: 280911, SURAT: RAJ SALES, PH.: 2779845, VAPI: MOTHER SALES, PH.: 9898033007, BHAVNAGAR: J D DESAI 9824211452



નાનું અંગ નિરાશ કેમ
જાપાની અંગવર્ધક યંત્ર ૧૦૦/-
૧૨ કલાકમાં અસર શરૂ ઉપયોગ કરતા જ
જો આપ આપના અંગમાં શકિતની કમી મહેસુસ કરો છો અને પોતાની શારીરિક ક્ષમતા વધારવા માંગો છો તો ઉકત યંત્રનો પ્રયોગ અસરદાર સાબિત થઇ શકે છે. આ કમજોરીને દુર કરે છે. ૪૫ દિવસની દવા સાથે જાપાની આયુર્વેદિક તેલ, ઉત્તેજના કેપ્સૂલ, રોમાંટીક સ્પ્રે, કામસૂત્ર પુસ્તિકા, ડીવીડી, ૮ જીબી મેમરી કાર્ડ, ટોનર ક્રીમ મફત મેળવો.
અસર નહી તો પૈસા પાછા. લાભની સંપુર્ણ ગેરેન્ટી વિચારો નહી ફોન કરો
09934525461
09708423888



TVC SKYSHOP — 11th successful Year — Over 50 Lacs Satisfied Customers & Growing

સંધી સુદ્દ્ધાં

AS SEEN ON TV

સાંધાની બીમારી (આર્થરાઇટીસ) ને જડમૂળથી મિટાવવાની અચૂક ઔષધિ
Original Ancient Ayurvedic Formula 100% Effective

TV ઉપર મૂલ્ય: ₹ 3,100/- સ્પેશિયલ ઓફર: ₹ 1790/- (Incl. of all Taxes)
Net Quantity 100ml ની 3 બોટલ

મેડીકલ સાયન્સમાં સાંધાના દુઃખાવાને લાઇલાજ માનવામાં આવે છે પણ મેડીકલ સાયન્સ માટે પડકાર બનેલ અનેક રોગો પર આયુર્વેદે વિજય પ્રાપ્ત કર્યો છે. સંધી સુદ્દ્ધાં ઘૂંટણ, બધાંજ સાંધાઅને સંધિવા (આર્થરાઇટીસ) ની વર્ષો જૂની, અચૂક ઔષધિ છે.

હિમાલયની દુર્લભ અને અમૂલ્ય જડીબુટ્ટીઓથી બનેલ સંધી સુદ્દ્ધાં, ચામડીના નીચલા સ્તર સુધી પહોંચીને સાંધાઓમાં રહેલ જોઇન્ટ ફ્લુઇડને વધારી દે છે, નબળા ટીશુઝને બળ આપે છે જેનાથી હાડકાંના સાંધાઓમાં તાકાત આવે છે, સોજા અને પીડા સમાપ્ત થઇ જાય છે.

સંધી સુદ્દ્ધાં આપની સાંધાઓની બધીજ બિમારીઓથી મુક્તિ અપાવે છે, અને આપ જીવનની દરેક ક્ષણનો આનંદ લઇ શકો છો.

Order Now: SMS 'SSO' to 9870 900 388
0 9223 366 405 / 0 7738 086 656
For More Value for Money Products Visit www.tvcskyshop.com

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



તંત્રી લેખ

# ઓછા વરસાદે વધારી ખાદ્ય સુરક્ષાની ચિંતા

**ચોમાસાની** ભવિષ્યવાણીએ ચિંતામાં વધારો કર્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં જુલાઈમાં વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો પડ્યો છે. હવામાનખાતાના અનુમાન અનુસાર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ સ્થિતિમાં સુધારો થવાની સંભાવના નથી. જે દેશમાં વરસાદ પર આધારિત ખેતી હોય તેના માટે તો આ ખરાબ સમાચાર છે. ખાસ તો એટલા માટે કે છેલ્લી બે સિઝનમાં લાંબા સમય બાદ કૃષિ થોડી સુધરતી જોવા મળી હતી. મોંઘવારીએ અર્થવ્યવસ્થાની હાલત પહેલાથી જ ખરાબ કરી મૂકી છે. હવે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે ૨૦૧૧-૧૨માં અર્થવ્યવસ્થાના વિકાસ દરનું અનુમાન ઘટાડીને ૯ થી ૮.૨ ટકા કરી નાખ્યું છે. આર્થિક ક્ષેત્રમાં વધતી જતી નિરાશા એક નકારાત્મક ધારણાનું પરિણામ છે એવી સરકારની માન્યતા સાથે ઉદ્યોગજગત સહમત નથી. નાણામંત્રી પ્રણવ મુખર્જી સાથે મોટા ઉદ્યોગપતિઓની બેઠક દરમિયાન રતન તાતાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, નકારાત્મક માન્યતા વર્તમાન પરિસ્થિતિને કારણે જ ઊભી થઈ છે. બીજા એક ઉદ્યોગપતિએ સરકારની વિકાસ નીતિ પર નિશાન તાકતા જણાવ્યું કે, એવું લાગે છે કે જાણે આપણે એક એવી એસી કારમાં બેઠા છીએ જેના એક્સેલેટર અને બ્રેક પર બે જુદા-જુદા ડ્રાઈવર બેઠા છે. સરકારે તાત્કાલિક ધોરણે એવાં પગલાં લેવા પડશે જેનાથી રોકાણના 'સેન્ટિમેન્ટ' સુધરે. મોંઘવારી, જમીન સંપાદનના મુદ્દે પેદા થયેલી સમસ્યાઓ, કરમાળખું સુધારવામાં મોડું અને પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવામાં આવતા વિઘ્નોએ ઔદ્યોગિક રોકાણ સામે નવા પડકારો પેદા કર્યા છે. હવે જો કૃષિ ક્ષેત્રમાં પણ ગ્રાફ નીચે ગયો તો તેના પરિણામે વિકાસ દરની સાથે-સાથે દેશની ખાદ્ય સુરક્ષા માટે પણ ખતરો પેદા થઈ શકે છે. સરકાર પાસે સમય ઓછો છે અને

જીવન-પંથ પં. વિજયશંકર મહેતા

# જીવનના સારા-નરસા ટાણે ભગવાનને ન ભૂલવા

**આપણને** ગૌરવ થાય તેવી આપણી પાસે ઘણી સાંસારિક બાબતો હોય છે. ગૌરવ જો અહંકારશૂન્ય હશે તો આત્મબળ વધારશે, પરંતુ આપણે મનુષ્ય છીએ તેનું સૌથી વધારે ગૌરવ કરવું જ જોઈએ. ધન, પદ, સંતાન અને સફળતાનું ગૌરવ પાણીના પરપોટા જેવું પણ સાબિત થઈ શકે છે. મનુષ્યને પરમાત્માએ તેમની સીધી ઝાંખી કરાવી છે. આપણું જીવન એક સરોવર જેવું છે, જેમાં તેમનો કરુણારસ ભરેલો છે. જો તેમાં ઊંડે ઉતરીને જોઈએ તો ખ્યાલ આવશે કે તે માનસરોવર કરતાં વધારે શ્વેત અને સ્વચ્છ છે. આ સરોવરમાં વિહાર કરવા માટે હંસ બનવું પડશે, તો જ મોતીનો ચારો ચરી શકાશે. માત્ર મનુષ્ય પાસે તે સંભાવના છે કે તે હંસ બને છે કે કાગડો. આપણે ઈશ્વરના પ્રતિનિધિઓ છીએ, તેથી આપણે પતનથી બચવું જોઈએ. આપણે ઈશ્વરના સામ્રાજ્યના રાજકુમાર અને રાજકુમારી છીએ. આપણું દરેક આચરણ સમૃદ્ધ હોવું જોઈએ. આ સરોવરમાં વિહાર કરવા માટે જે હોડીની જરૂર પડે છે તે છે ગુરુ. ગુરુરૂપી આ હોડી જીવનસફરને વધારે સાર્થક બનાવે છે. મહાન તો આપણે છીએ જ કારણ કે આપણને માનવદેહ મળ્યો છે, પણ આપણે મહાનમાંથી મહાનતમ બનાવાનું છે. તેથી પોતે મનુષ્ય છીએ તેના પર ગર્વ કરવો જોઈએ અને સાથે સાથે તેનો ઉપયોગ પણ કરવો જોઈએ.તેથી પોતાના જીવનમાં સારા કે નરસા સમયે ભગવાનને ન ભૂલવા જોઈએ.

humarehanuman@gmail.com

જીવન દર્શન

# સમય પ્રમાણે કાર્ય કરનાર કાયમ આગળ રહે છે

**એક** પુસ્તકપ્રેમી દરેક વિષયોનાં પુસ્તકોની શોધમાં રહેતો હતો. તે અનેક દુકાનો પર જતો અને પુસ્તકોનું બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો. આ પુસ્તક પ્રેમી એક વખત બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક એવી પુસ્તકની દુકાન પર ગઈ . તે તરત જ દુકાનમાં પ્રવેશી ગયો અને પુસ્તકો જોવા લાગ્યો. થોડો સમય પુસ્તકોનું નિરીક્ષણ કર્યા બાદ તેણે ત્યાં રહેલા એક કર્મચારીને એક પુસ્તક બતાવીને તેની કિંમત પૂછી. કર્મચારીએ જણાવ્યું કે એક ડૉલર. તે બોલ્યો તેમાં કંઈ ઓછું થઈ શકે તેમ નથી? કર્મચારીએ સ્પષ્ટ ના પાડી દીધી. ત્યારે તેણે દુકાનના માલિકને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. માલિક આવ્યા ત્યારે તેણે તેમને પૂછ્યું કે તમે આ પુસ્તકને ઓછામાં ઓછી કેટલી કિંમતમાં વેચી શકો છો. માલિકે જવાબ આપ્યો સવા ડૉલર. વ્યક્તિને આશ્ચર્ય થયું અને તેણે કહ્યું કે તમારા કર્મચારીએ તો તેની કિંમત એક ડૉલર કહી હતી. માલિક બોલ્યા તેણે સાચી કિંમત જણાવી હતી પણ ઉપરની કિંમત મારા સમયની છે. વ્યક્તિને ફરીથી તેનો અંતિમ ભાવ પૂછ્યો તો માલિકે કહ્યું હવે દોઢ ડૉલર. તમે જેટલી વાર કરશો તેટલી તેની કિંમત વધતી જશે કારણ કે તેમાં સમયની પણ કિંમત જોડાતી જશે. આખરે તેણે દોઢ ડૉલરમાં પુસ્તક ખરીદ્યું. તે સમયની કિંમત જણાવનારા હતા બેન્જામિન ફ્રેંકલિન કે જે પાછળથી જાણીતા રાજનીતિજ્ઞ અને દાર્શનિક બન્યા. સમય પ્રમાણે કાર્ય કરનારા હંમેશા આગળ વધે છે, કારણ કે તેઓ દરેક કાર્યને સફળતાથી પૂરું કરવાના સાચા સમયથી પરિચિત હોય છે.

ભાસ્કર પીડિયા... પીસ બ્રિજ

# નાયગ્રા નદી પર બનેલો આંતરરાષ્ટ્રીય પુલ

**અમેરિકા** અને કેનેડા વચ્ચે નાયગ્રા નદી પર બનેલો 'પીસ બ્રિજ' (શાંતિ સેતુ) જાણીતા નાયગ્રા ફોલથી માત્ર ૨૦ કિમી દૂર આવેલો છે. આ સેતુ અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા સિટી ઓફ બફેલોને કેનાડાના ઓન્ટેરિયોમાં આવેલા ફોર્ટ એરી કસ્બા સાથે જોડે છે. સાત કમાનવાળા આ પુલની લંબાઈ લગભગ પોણા બે કિમી છે. તેના નિર્માણમાં ૧૭૦૦ ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. આ પુલનું નિર્માણ અમેરિકા અને કેનેડા વચ્ચે થયેલી શાંતિ સ્થાપનાના સો વર્ષ પૂરા થવાના પ્રસંગે કરવામાં આવ્યું હતું. આથી તેનું નામ 'પીસ બ્રિજ' રાખવામાં આવ્યું છે. આ પુલનું નિર્માણ ૧૯૨૫માં શરૂ થયું અને ૧૯૨૭માં બનીને તૈયાર થઈ ગયો હતો. ૧ જૂન ૧૯૨૭ના રોજ તેને પ્રજા માટે ખુલ્લો મુકાયો. તેના બે મહિના બાદ આજના જ દિવસે એટલે કે ૪થી ઓગસ્ટ ૧૯૨૭ના રોજ ભવ્ય સમારોહ દ્વારા તેનું ઔપચારિક ઉદ્‌ઘાટન કરાયું હતું જેમાં બંને દેશો ઉપરાંત દુનિયાના ઘણા દેશોના ટોચના નેતાઓ હાજર રહ્યા

સનત મહેતા

લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

letter2editor@bhaskarnet.com



ચીનમાં 'એક બાળક બસ' થકી મોટી સમસ્યા

**દીકરીને જન્મતાં જ મારી નાખવાની બદી એક બાળકની નીતિ વગર પણ ભારતમાં વધી છે. ભારતમાં આમ જ રહેશે તો વીસ વરસ પછી દુલ્હાને પૂરતી સંખ્યામાં દુલ્હન નહીં મળે.**

# સામાજિક સુધારણા શાણપણ માગે છે

સામાજિક સુધારણા આર્થિક સુધારા જેટલી સહેલી નથી. એમાં અતિરેક લાંબે ગાળે સુધારવા મુશ્કેલ એવા પ્રશ્નો સર્જે છે. શિક્ષણ અને ગરીબીની નાબૂદી વગર સંતતિ નિયમન સંતુલિત ન બને કારણ એ માનવીય સવાલ છે. એમાં ધોકાપંથી ન ચાલે.

**શ્રી**મતી ઈન્દિરા ગાંધીએ ભારતમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ત્યારે એ કટોકટીના ગાળામાં સંજય ગાંધીએ સંતતિ નિયમનની નીતિનો અતિરેકભર્યો અમલ શરૂ કરેલો અને સમગ્ર ભારતનું સામાજિક જીવન ક્ષુબ્ધ બની ગયું હતું. પણ એના આવા અમલથી રાજકીય અવળી અસર થતી દેખાઈ એટલે સલુકાઈથી એ પગલાને વાળી લેવાયું. પછી સંતતિ નિયમન અને નસબંધી એટલા અળખામણા શબ્દો બની ગયા કે તેને બદલે વ્યાપક અર્થવાળો શબ્દ 'કુટુંબ કલ્યાણ' શબ્દ આવી ગયો. ભારતનું બંધારણ લોકતંત્ર આધારિત છે એટલે આવું બની શક્યું પણ એકાધિકાર પદ્ધતિવાળા ચીને ત્રણ દાયકાથી વધુ પહેલાં વસ્તીવધારાથી ગભરાઈ ૧૯૭૯માં ચીનમાં 'એક બાળક'ની નીતિ ઠોકી બેસાડી. આજે હવે એમાંથી જન્મેલાં દૂષણો અને એનું આખરી પરિણામ કેટલું વિકૃત આવ્યું છે એની વૈજ્ઞાનિક અને સામાજિક અસરો પણ વિશ્વભરમાં ચર્ચાના એરણે ચડી છે. આ નીતિનો અમલ કેવો વિકૃત રીતે કરાતો હતો એની વિગતો હુનાન પ્રાંતના 'કાઈક્સીન' નામના સામયિકમાં હમણાં બહાર આવી છે.

હુનાન પ્રાંતની 'લોન્ધુઈ કાઉન્ટી'ના 'યુઆન ચાઓ' નામના નાગરિકે આનું વર્ણન કરતા 'કાઈક્સીને' જણાવ્યું કે- '૧૯૯૭ પહેલાં એક બાળકની નીતિના ભંગ બદલ અફસરો અમારા ઘર તોડી-ફોડી નાખતાં, ૨૦૦૦ પછી એમણે અમારાં બાળકો જપ્ત કરવાનું શરૂ કર્યું.' 'કાઈક્સીન'ના જણાવ્યા પ્રમાણે અધિકારીઓ આ બાળકોને અનાથાશ્રમ ભેગા કરતા. જ્યાં એમને દત્તક આપવા રખાતાં, અને દત્તક લેવા ઈચ્છતાં મા-બાપો આવાં બાળક ત્રણથી પાંચ હજાર ડૉલરમાં લઈ જતા. આ નાણાં પછી અધિકારીઓ વહેંચી લેતા. વધારાનાં બાળકોની આવી ચોરી એક સંતાનની નીતિનો ભાગ નહોતી પરંતુ આવો માનવ અધિકારનો અને મા-બાપોના પ્રાથમિક હક્કનો ભંગ કરતો અમલ એના નિયમોના ઓઠા નીચે કરાતો. આવા અમલના કારણે આજે પેઢીઓ વચ્ચેનું સંતુલન ખોરવાઈ ગયું છે. અલબત્ત, એનાં

વિકૃત પરિણામો રાષ્ટ્રના વિકાસને અવળી અસર કરી રહ્યાની હકીકતો એટલી બધી ઉજાગર થઈ છે કે ખુદ ચીનમાં હવે આ નીતિનો વિરોધ થઈ રહ્યો છે. આ મહિને ચીનના સાડા દસ કરોડના સૌથી વધુ વસ્તી ધરાવતા 'ગુંઆંગડોંગ' પ્રાંતના કુટુંબ આયોજન પંચના નિયામક 'જાંગફેંગે' પત્રકારોને જણાવ્યું કે એમણે ગુઆંગડોંગ પ્રાંતને કુટુંબ આયોજનની ચીનની 'એક બાળક બસ'ની નીતિમાંથી છૂટછાટ આપવા રાષ્ટ્રનેતા પાસે માગણી કરી છે. કુટુંબ નિયોજનની આ નીતિથી પ્રારંભમાં થોડો ફાયદો દેખાયો પણ હવે એ ઘણું નુકસાન કરે છે. ચીનની વસ્તીની સમતુલા તૂટી જવા પામી છે. પરિણામે યુવાન, મધ્યમ ઉંમરના અને વૃદ્ધો વચ્ચેનું સંતુલન તૂટી જવા પામ્યું છે. જોકે કાળે કરીને એમાં ઘણી છૂટછાટો અપાઈ છે. જાંગફેંગે પણ નીતિને મૂળભૂત રીતે બદલવાની હિંમત કરી નથી પણ કેટલાક સંજોગોમાં બીજા બાળકની છૂટછાટ માગી છે.

આ માંગ ગુઆંગડોંગ જેવા મહત્ત્વના પ્રાંતે માગી છે એનું વિશેષ મહત્ત્વ છે. આ પ્રાંતમાં પ્રથમ બાળક જો પુત્ર ન હોય અને પુત્રી હોય તો એને મારી નાખવાની બદી વધી ગઈ છે. સામાન્ય રીતે દર સો પુત્રીએ એકસો પાંચ પુત્ર જન્મવા જરૂરી છે, પણ ગુઆંગડોંગ પ્રાંતમાં દસ સો પુત્રીએ, ૧૧૯ પુત્રો જન્મતા હોવાથી વિષમતા વધી ગઈ છે. જોકે, દસ વરસ પહેલાં જાતીય પ્રમાણ ૧૩૦ જેટલું વિષમ હતું. પરિણામે આ પ્રાંતમાં કામ કરનાર વ્યક્તિ અને એના આશ્રિતની સંખ્યા ભાવિમાં ચિંતાજનક સ્વરૂપ લેશે.

આ નીતિના કારણે ચીનનો બીજા પર આધાર રાખવાનું વસ્તીનું પ્રમાણ વિશ્વમાં સૌથી નીચું છે. દરેક એક કમાતા પુખ્ત વયના નાગરિકને ત્રણ આશ્રિત છે. પરિણામે ૨૦૦૦થી ૨૦૧૦ સુધીમાં ભાવિમાં રોજી પેદા કરનાર ૧૪ વરસની ઉંમરની વસ્તીનું પ્રમાણ ૨૩ ટકામાંથી ઘટી ૧૭ ટકા થઈ ગયું છે. ચીનમાં ૨૦૫૦ સુધીમાં આ સંખ્યા માત્ર ૨.૨ થઈ જશે. જાપાન વિશ્વનું સૌથી વૃદ્ધ રાષ્ટ્ર મનાય છે. તેનું આ પ્રમાણ ચીનથી વધુ ૨.૬ છે. દીકરીને જન્મતાં જ મારી નાખવાની બદી એક બાળકની નીતિ વગર પણ ભારતમાં વધી છે. ભારતમાં આમ જ રહેશે તો વીસ વરસ પછી દુલ્હાને પૂરતી સંખ્યામાં દુલ્હન નહીં મળે.

ચીનમાં એક બાળકની નીતિનો શાસકોએ એટલો વિકૃત અમલ કર્યો હતો કે 'એક વધુ બાળક એટલે એક વધુ કબર' સૂત્ર ગુંજતું હતું. આજે આ સવાલ શાસકોને મૂંઝવી રહ્યો છે. આ અર્થમાં ભારત માટે ચીનના વિકાસને ઓળંગી જવાની તક ઘણી મોટી છે, પણ વધતી જતી યુવા પેઢીને પૂરતી રોજી આપવી એ સહેલું નથી. બારમી પંચવર્ષીય યોજનાના એક આલેખમાં આયોજનપંચના ઉપાધ્યક્ષે ખુદ આ વાત કબૂલી છે. કટોકટી સમયે બનેલી ભારતની ઘટના અને ચીનમાં 'એક બાળક બસે' જન્માવેલી ઘેરી સમસ્યા એક વાત સ્પષ્ટ કરે છે કે સામાજિક સુધારણા આર્થિક સુધારા જેટલી સહેલી નથી. એમાં જરા સરખો અતિરેક લાંબે ગાળે વિષમ-સુધારવા મુશ્કેલ એવા પ્રશ્નો સર્જે છે. ભારતમાં હવે આપણે સામાજિક સુધારણાનું ક્ષેત્ર સાવ વિસરી રહ્યા છીએ એ સારી નિશાની નથી. શિક્ષણ અને ગરીબીની નાબૂદી વગર સંતતિ નિયમન સંતુલિત ન બને કારણ એ માનવીય સવાલ છે. એમાં ધોકાપંથી ન ચાલે.

પરદે કે પીછે જયપ્રકાશ ચૌકસે jpchowksey@yahoo.in

# બાબા માટે રાખીનો હઠયોગ કે સ્ટંટયોગ?

**રાખીનું કહેવું છે કે, બાબા રામદેવે આઈટમ ગર્લ્સ માટે અપમાનજનક કથન કર્યું હતું. પોતે આઈટમ ગર્લ હોવા છતાં પણ એક આદર્શ પત્ની બની શકે છે, એવું પુરવાર કરી દેશે.**

રાખી સાવંતે એવી ચીમકી આપી છે કે જો બાબા રામદેવ તેની લગ્નની દરખાસ્ત નહીં માને તો તે અનશન પણ કરી શકે છે, જોકે એટલે જ દાયકાઓ પહેલાંની આ વાર્તા યાદ આવી. સનસનાટી ભરેલું વર્તન રાખીને ચર્ચામાં રાખે છે અને એ કારણે જ એને દામ અને નામ મળે છે.

**હ**રિશંકર પરસાઈના એક વ્યંગ્યમાં એક માણસ પડોશણ સાથે લગ્ન કરવાની જીદ સાથે આમરણ અનશન કરવા બેસી જાય છે. શહેરના આળસુ, કામચોર લોકો ઉપવાસના આ તમાશામાં સામેલ થઈ જાય છે. અનશન ગેરકાનૂની નથી, એટલે પોલીસ તે રોકી પણ શકતી નથી. ઉપવાસ પર ઉતરેલો પ્રેમી મજેદાર ભાષણ કરે છે, પ્રેમની તાકાત અને પ્રેમની લીલા પર ભાષણ કરે છે. રોજે રોજ તેની તબિયતની તપાસ કરનારો ડૉક્ટર તેની નાજુક હાલત વિશે વહીવટીતંત્રને જાણ કરી દે છે. હદ તો ત્યાં આવે છે કે, આખું શહેર પડોશીને વિનંતી કરે છે કે, ઉપવાસ કરનારાની વાત માની લેવામાં આવે. મને યાદ છે ત્યાં સુધી પડોશીને તેની પરિણીત છોકરીનું લગ્ન અનશનકારી સાથે કરાવવા માટે મનાવી લેવાના પ્રયાસો કરવામાં આવે છે.

રાખી સાવંતે એવી ચીમકી આપી છે કે જો બાબા રામદેવ તેની લગ્નની દરખાસ્ત નહીં માને તો તે અનશન પણ કરી શકે છે, જોકે એટલે જ દાયકાઓ પહેલાની આ વાર્તા યાદ આવી. સનસનાટી ભરેલું વર્તન રાખીને ચર્ચામાં રાખે છે અને એ કારણે જ એને દામ અને નામ મળે છે. આ તેની દુકાનદારીનો એક ભાગ છે, જેવી રીતે અનેક નેતા ફાવે તેમ નિવેદનો કરે છે કેમ કે તેના વડે મીડિયામાં તેમનું અસ્તિત્વ ટકાવી રાખે છે. રાખીનું કહેવું છે કે, બાબા રામદેવે આઈટમ ગર્લ્સ માટે અપમાનજનક કથન કર્યું હતું અને એક આઈટમ ગર્લ હોવા છતાં પણ પોતે સેવા કરનારી એક આદર્શ પત્ની બની શકે છે, એવું તે પુરવાર કરી દેશે, એમ કહ્યું હતું. બીજા કોઈ પ્રસંગે રાખીએ કહ્યું હતું કે, બાબા રામદેવ યુવાન છે, અમીર છે, હવાઈ પ્રવાસો કરે છે, અનેક દેશોમાં તેમનાં કાર્યાલયો છે, દવા વેચવાનો વધતો જતો વ્યવસાય છે, તેથી લગ્ન માટે આદર્શ પુરુષ છે. આટલો પૈસો તો કોઈ ફિલ્મ કે ક્રિકેટ સ્ટાર પાસે પણ નથી. રાખીએ ટેલિવિઝન કેમેરાની સામે નિયમિત યોગ કરતી હોવાનો દાવો જ માત્ર નહોતો કર્યો, પણ તેણે કેટલાંક આસનો સરળતાથી કરી દેખાડ્યાં હતાં. શાસ્ત્રમાં બંધાયેલા લોકો કહે છે કે, સાધુનું કાર્ય અધ્યાત્મનું શિક્ષણ આપવાનું હોઈ શકે, પણ કોઈ પ્રકારે આંદોલન કરીને આડકતરી



એક્સ્ટ્રા શોટ : રાખી સાવંતે વર્ષ ૨૦૦૦માં રજૂ થયેલી ગોવિંદા-ટ્વીન્કલ ખન્ના અભિનિત ફિલ્મ 'જોરુ કા ગુલામ'થી બોલિવૂડમાં કદમ માંડ્યાં હતાં.

રીતે રાજકારણમાં જોડાવાનું નહીં.

મનોરંજન જગતમાં આપણને રાખી સાવંતની આવશ્યક્તા છે. તેણે ઉચ્ચ શિક્ષણ નથી મેળવ્યું, તે વ્યવહારુ પણ નથી. અસલમાં તે સુંદર પણ નથી અને અભિનય કલાથી ય અજાણ્યા પણ સફળ છે. અમીર પણ છે અને લોકપ્રિય પણ.

આપણે જે પ્રકારની રાજકીય સિસ્ટમ ઊભી કરી છે, તેમાં અમરસિંહ અનિવાર્ય છે. એટલે જ અમરસિંહ હવે ફક્ત નામ-સંજ્ઞા નથી, તેઓ હવે વિશેષણ બની ચૂક્યા છે. મનોરંજનના ગુલાબી ગાલ ઉપર મસાની જેમ પ્રગટી છે અને બેગમ પારોથી માંડીને રાખી સાવંત સુધી આ શૃંખલા ચાલુ રહી છે. બરાબર એવી જ રીતે અધ્યત્મના ક્ષેત્રમાં પણ કેટલાક સ્ટાર પ્રગટે છે. મીડિયા માટે આ લોકો જરૂરી આહાર એકત્ર કરી આપે છે. વિદેશોમાં વસતા અનેક લોકોને લાગે છે કે, ભારતમાં સ્ટારનો દરજ્જો પ્રાપ્ત કરવો અન્ય કોઈ પણ દેશ કરતા સહેલો છે. બાબા રામદેવના ટીકાકાર દિગ્વિજય સિંહ પણ માનશે કે, બાબાએ લોકપ્રિય બનાવ્યો અને અનેક લોકોને ફાયદો પણ થયો છે, પરંતુ યોગની લોકપ્રિયતા અથવા ફિલ્મી સ્ટારોની લોકપ્રિયતા ક્યારે ય રાજકારણમાં મત આપાવતી નથી.

મેનેજમેન્ટ ફંડા એન. રઘુરામન

# એક ઈન્ટેલિજન્ટ ગિફ્ટ બાળકને બદલી શકે છે

**ઈન્ટરનેશનલ** ઓલિમ્પિયાડ્સમાં ઉત્તરોત્તર સફળતા હાંસલ કરીને પ્રીતીશ પાટીલ દેશ માટે ફરી એકવાર ગૌરવની ક્ષણ લઈને આવ્યા. આ યુવાને ૧૦થી ૧૭ જુલાઈ દરમિયાન તાઈપેઈમાં આયોજિત બાયોલોજી ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં ફરીવાર સિલ્વર મેડલ હાંસલ કર્યો. મહારાષ્ટ્રના નાસિકમાં ૧૨મા ધોરણમાં ભણતા પ્રીતીશે આ પહેલાં એસ્ટ્રોનોમીના ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં પણ રજત પદક જીત્યો હતો. પ્રીતીશની સફળતાની સફર આટલેથી નથી અટકતી. હવે એ ત્રીજીવાર ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. આ વખતે અર્થ-સાયન્સ વિષયમાં તે એકમાત્ર વિદ્યાર્થી છે, જે વિવિધ વિષયો માટે ભારતીય ટીમના સભ્ય રૂપે સતત પસંદ થઈ રહ્યો છે. હવે તે આવતે મહિને ઈટલીના મોડેનામાં આયોજિત અર્થ-સાયન્સ ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં ભાગ લેશે. તેણે રાષ્ટ્રીય સ્તરના પડકારને પાર કરીને ચાર સભ્યોની ભારતીય ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. પ્રીતીશની ઉપલબ્ધિઓને એ વાત વિશેષ બનાવે છે કે, તે કોઈ ક્લાસ કે માર્ગદર્શન વિના પોતાની જાતે જ નવી નવી વસ્તુઓ વિશે અભ્યાસ કરે છે. તે ઈન્ટરનેટ અને ઈન્ટરનેટ ફોરમ્સ દ્વારા સતત પોતાનું જ્ઞાન વધારીને નવી નવી જાણકારીઓ મેળવે છે. એસ્ટ્રોનોમીના તેના અધ્યયનની શરૂઆત ત્યારે થઈ, જ્યારે છઠ્ઠા ધોરણમાં તેના એક અંકલે એક એન્સાઈક્લોપીડિયા ભેટમાં આપી. જે તેને ખૂબ રસપ્રદ લાગી અને તે તેના વિશે વધુ વાંચતો ગયો. કોઈ માર્ગદર્શન વિના જાતે અભ્યાસ કરતા પ્રીતીશ માટે આત્મ-અનુશાસન, નિરંતરતા અને કામ પર સંપૂર્ણ ફોકસ ખૂબ જરૂરી હતું. આ વિશે પ્રીતીશનું કહેવું છે કે, આ બધું સ્વાભાવિક રીતે થયું અને મેં કંઈ ખાસ નથી કર્યું. મને શરૂઆતથી જ આ વિશે અધ્યયન કરવાની અને વધુ ને વધુ જાણવાની ઈચ્છા હતી. જે મને સતત આગળ વધવા પ્રેરતી.'

ફંડા એ છે કે, ઘણીવાર કોઈ બાળકને આપવામાં આવેલી એક નાનકડી ઈન્ટેલિજન્ટ ગિફ્ટ તેનું આખું જીવન બદલી શકે છે. જોકે અહીંયા ભણવા-લખવામાં બાળકની નૈસર્ગિક પ્રતિભા પણ એટલી જ જરૂરી છે.

raghu@bhaskarnet.com

# પાકિસ્તાનમાં ખરી સત્તા જાસૂસી તંત્ર પાસે

પાકિસ્તાન પોતે જ પોતાનું દુશ્મન છે. આઈએસઆઈ ત્રાસવાદીને મદદ કરે છે. કાશ્મીરમાં ઘૂસણખોરીની વાતો અમેરિકા અને ભારતને પહોંચાડે છે. કાશ્મીરમાં ભારતને રંજાડવાનો પોર્ટફોલિયો આઈએસઆઈ પાસે છે.

**એ**ક કરુણ અને હાસ્યાસ્પદ વિરોધાભાસ જોઈલો. ભારત આજે અર્થતંત્રમાં ટોચે છે પણ ક્રિકેટમાં મોટો ધબડકો તમે ઈંગ્લેન્ડ સાથેની મેચોમાં શરમજક હારરૂપે જોયો. ઈંગ્લેન્ડ આજે ક્રિકેટમાં ટોચે ચાલુ છે પણ તેનું અર્થતંત્ર લગભગ દેવાળિયું છે. એક ત્રીજી વાત આપણા દેવાળિયા પાકિસ્તાનની છે. પાકિસ્તાનની સરકાર ઈંગ્લેન્ડ-અમેરિકાના ધર્માદા પર ચાલે છે નબળામાં નબળી સરકારે જગતભરનું ધ્યાન ખેંચવા તેના સુંદર નારી ધનને ઉપયોગ કરી સમગ્ર જગતને માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધી છે. રોજરોજ હિના રબ્બાનીની સુંદર સેક્સી તસવીરો છપાય છે પણ તેનું અર્થતંત્ર ખાડે છે. મોરાલિટી તળિયે છે.

આજે પાકિસ્તાનમાં ઝરદારીનું રાજ નથી, કોઈ શાસકનું રાજ નથી. ધ ન્યુ સ્ટેટ્સમેનના કહેવા પ્રમાણે ત્યાં માત્ર પાકિસ્તાની 'ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલીજન્સ' નામની જાસૂસી એજન્સીનું રાજ છે. અનાતોલ લીવેન નામના ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર પાકિસ્તાન આખામાં ફરીને તારણ કાઢ્યું છે કે આજે જગતભર જેને ધિક્કારે છે તે તાલિબાન સાથેની દોસ્તી કરીને આઈએસઆઈ (જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલીજન્સ)નું રાજ ચાલે છે. અરે, આઈએસઆઈને મોટા ભાગનાં અખબારો અને મીડિયા ટેકો આપે છે-છૂપે છૂપે આપે છે. પાકિસ્તાનીઓ જાણે છે કે પાકિસ્તાની તાલિબોને ૩૫૦૦ પાક. સોલ્જરોની કતલ કરી છે અને આઈએસઆઈના ૮૦ ઓફિસરોને તાલિબાને રહેંસી નાખ્યા છે તોય આઈએસઆઈ છૂપે છૂપે તેને ટેકો આપે છે એટલા માટે કે આજે પાકિસ્તાનની નબળી સરકાર હેઠળ પાક. જાસૂસીતંત્રની બોલબાલા ઈસ્લામાબાદ જઈ તમે તેનું ગ્રાન્ડ હેડ ક્વાર્ટર જુઓ તો કોઈ પણ જગતની અને પાક. સરકારની ભવ્ય બિલ્ડિંગને ઝાંખી પાડી દે. અહી બેઠાંબેઠાં ઓસામા બિન લાદેનને હીરો બનાવનાર આઈએસઆઈ છે. આઈએસઆઈના ઓફિસરો સુપરસ્ટાર છે અને અમેરિકન ટાઈપની લકઝરીમાં રહે છે.

આ આઈએસઆઈની રોજ મોંપાટ લઈએ છીએ તે કંઈ જાતનું ભૂત છે? આઈએસઆઈ મૂળ તો બ્રિટિશ આર્મી ઓફિસર મેજર જનરલ વિલિયમ કાઉથોર્નના ભેજાની પેદાશ છે. જ્યારે કાશ્મીર પ્રકરણે ભારત અને પાકિસ્તાન યુદ્ધે ચઢેલા ત્યારે પણ બ્રિટન છૂપે છૂપે બ્રિટને પોતાના ઘણા સિનિયર ઓફિસરોને પાકિસ્તાની મિલિટરીને તાલીમ આપવા જ નહીં પણ યુદ્ધ કરવા સુધી મદદ કરેલી. પાકિસ્તાન આખું જાસૂસી સંસ્થા કે વ્યક્તિથી ભરેલું છે. આ નબળી સરકારને આજે અમેરિકા-ઈંગ્લેન્ડ સતત મદદ કરે છે. આજ સુધી અમેરિકાએ રૂ. ૧૫૦ અબજની મદદ કરી છે તેમાંથી ૯૦ ટકા લશ્કર અને આઈએસઆઈ રાજકારણી ચાવી ગયા છે.

પાકિસ્તાની મિલિટરીનું પણ એક અલગ જાસૂસીતંત્ર છે જે મિલિટરી ઈન્ટેલીન્સ (એમઆઈ) કહેવાયું છે. પાકિસ્તાને પ્રથમવાર ભારત સામે માથું ઊંચક્યું અને શિરકત ખાધી ત્યારે હકીકતમાં પાકિસ્તાની મિલિટરી બળવો કરવાની હતી એટલે પાકિસ્તાની સરકાર 'મિલિટરી ઈન્ટેલીજન્સ'ને નપુંસક બનાવી આઈએસઆઈને ખૂબ સત્તા આપી હીરો બનાવી. એમઆઈ આજે બળવાન તો છે જ પણ મિલિટરી ઈન્ટેલીજન્સ આજેય મિલિટરી બળવો ન કરે તેનું જ ધ્યાન રાખે છે પણ તે આઈએસઆઈ ઉપર કોઈ નજર નાખી શકતું નથી. તે તેના અધિકાર બહારની વાત છે.

અરે, પાકિસ્તાનમાં હજી એક ત્રીજું ઈન્ટેલિજન્સ ખાતું છે તેને સિવિલિયન ઈન્ટેલીજન્સ બ્યૂરો કહેવાય છે. આ ખાતું ગૃહપ્રધાનની હાથ નીચે છે. આઈએસઆઈ કટાક્ષમાં કહે છે કે આ ત્રીજું જાસૂસી બ્યૂરો પોલીસતંત્રથી કાંઈ વિશેષ નથી, મતલબ કે આઈએસઆઈનું જ રાજ છે. એટલી હદે કે સિવિલિયન ઈન્ટેલીજન્સ બ્યૂરો પણ આઈએસઆઈને ધિક્કારે છે. તાલિબાનની સાથે દોસ્તી કરીને આઈએસઆઈ કેવો પ્રભાવ પાડે છે તેની વિવિધરંગી વાતો જગતભરને આઈબી તરફથી જ (સિવિલ ઈન્ટેલીજન્સ બ્યૂરો) જાણવા મળે છે. ઘણા કહે છે કે ભારત, પાકિસ્તાન દુશ્મન નથી. પાકિસ્તાન પોતે જ પાકિસ્તાનનું દુશ્મન છે. આઈએસઆઈ પોતે જ પાકિસ્તાનમાં ત્રાસવાદીને મદદ કરે છે. કાશ્મીરમાં ઘૂસણખોરીની વાતો પાકિસ્તાન સિવિલ ઈન્ટેલીજન્સ બ્યૂરો અમેરિકા અને એ રીતે ભારતને પહોંચાડે છે. કાશ્મીરમાં ભારતને રંજાડવાનો પોર્ટફોલિયો આઈએસઆઈ પાસે છે.

ઈન્વેસ્ટિગેટીવ પત્રકાર અનાતોલ લેવિન કહે છે કે આજે આઈએસઆઈને 'સ્ટેટ વીધીન સ્ટેટ' કહેવામાં આવે છે. આઈએસઆઈ પાકિસ્તાનની પેરેલલ સરકાર છે. ૧૯૮૯માં પાકિસ્તાનની સરકારે તેની નબળાઈ સામે પાકિસ્તાની જનતાના બળવાનો ભય લાગ્યો ત્યારે આઈએસઆઈને વિશાળ સત્તા આપીને સરકારે નવો દુશ્મન ઊભો કર્યો. ૧૯૮૯માં કાશ્મીરમાં બળવો થયો ત્યારે (કાશ્મીરમાં ખરેખર ધડા વગરની સરકાર હતી) આ બળવાખોરોને મદદ કરવાનું આઈએસઆઈને સોંપાયેલું. આઈએસઆઈએ પોતે જ એક મિલિટંટ ગ્રુપ પેદા કર્યુ જે ભારતને પરેશાન કરે. જનરલ મુશર્રફ સત્તા પર આવ્યા (જેને બધા કારણવાર ધિક્કારે છે) તેણે રિયાલિટી જોઈ અને ભારત સાથે દોસ્તી કરવા પ્રયાસ કર્યો અને આઈએસઆઈએ તેને ફેકી દીધા. તાત્પર્ય કે ભારત સામેની દુશ્મની જ આઈએસઆઈને તગડું રાખે છે!

પ્રકાશક, મુદ્રક આર. કે. ગુપ્તા દ્વારા માલિક મેસર્સ ડી.બી.કોર્પ. લિમિટેડ વતી ભુજોડી સર્વે નંબર ૧૫૮, ભુજ - અંજાર રોડ ખાતેથી મુદ્રિત તેમજ સ્વામિનારાયણ વાણિજ્ય સંકુલ, પહેલો માળ, હોસ્પિટલ રોડ, ભુજ - કચ્છથી પ્રકાશિત. એડિટર (ગુજરાત) : અવનીશ જૈન. ડેપ્યુટી એડિટર : વિપુલ વૈદ્ય* (*સમાચાર પસંદગી માટે પી.આર.બી.ઍક્ટ હેઠળ જવાબદાર) ફોન નં. ભુજ-(૦૨૮૩૨) ૩૯૮૮૮૮, ફેક્સ : (૦૨૮૩૨) ૨૫૫૧૮૦. RNI No. GUJGUJ/2007/21897

Digitally Archived by: www.realpatidar.com/library

## માર્કેટ ડિજિટ્સ

### કચ્છી શેરબજાર તથા સોના ચાંદી

| | | | |
|---|---|---|---|
| ૨૦ માઇક્રોન્સ લિ. | ૫૪.૦૦ | રૂચિ સોયા ઈન્ડસ્ટ્રિઝ | ૯૫.૫૦ |
| આરતી ડ્રગ્સ લિ. | ૧૨૪.૦૦ | સાલ સ્ટીલ | ૬.૨૭ |
| આરતી ઇન્ડિયા લિ. | ૪૮.૦૦ | સફારી ઈન્ડસ | ૧૩૧.૯૦ |
| અદાણી પાવર લિ. | ૧૦૧.૩૦ | સાંઘી ઈન્ડ. | ૧૩.૩૦ |
| અલાઇડ કોમ્પ્યૂટર ઇન્ડ. | ૩.૦૨ | સીન્ટેક્ષ ઇન્ડ. | ૧૬૬.૦૫ |
| આશાપુરા માઇન લિ. | ૧૮.૩૫ | શ્રી અધિકારી બ્રધર્સ | ૫૫.૦૦ |
| ઓસ્ટ્રલ કોક એન્ડ પ્રો. | ૨.૦૫ | સુઝલોન એનર્જી લિ. | ૫૨.૯૫ |
| ડેગર ફોર્સ્ટ | ૭.૨૦ | ટાટા પાવર કો. | ૧,૨૮૭.૯૦ |
| ઇલેક્ટ્રોથર્મ ઇન | ૧૪૫.૦૦ | ટોક્યો પ્લાસ્ટ ઇન્ટી | ૧૬.૫૦ |
| યુરો સીરામીક લિ. | ૨૪.૫૫ | વિડિયોકોન એપ્લા. | ૧૮.૬૦ |
| યુરો મલ્ટીવિઝન લિ. | ૯.૧૫ | વિમલ ઓઇલ એન્ડ ફુડ | ૬૮.૦૦ |
| એવરેસ્ટ કાંટો | ૮૯.૧૦ | વેલસ્પન ગુજરાત | ૧૫૧.૨૦ |
| એક્સેલ ક્રોપ કેર | ૧૬૭.૦૦ | **ભુજ સોના ચાંદીના બજારભાવ** | |
| એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ | ૭૨.૦૦ | ચાંદી ચોરસા | ૫૯૩૫૦-૫૯૪૦૦ |
| ગેલન્ટ મેટલ | ૧૬.૩૦ | સોનું સ્ટાન્ડર્ડ | ૨૪૨૦૦-૨૪૨૨૦ |
| જીનસ પાવર | ૧૭.૩૫ | સોનું તેજાબી | ૨૪૧૩૦-૨૪૧૫૦ |
| ગોકુલ રિફોઇલ્સ | ૯૦.૫૦ | દાગીના ૨૧ કેરેટ | ૨૧૪૧૦ |
| ગુજ.મિનરલડેવ | ૧૬૪.૭૫ | દાગીના ૨૨ કેરેટ | ૨૨૪૧૦ |
| ગુજ. એનઆરઇ કોક | ૪૨.૯૦ | હોલ માર્ક | ૨૨૮૬૦ |
| હરીયા એક્સપોર્ટ લી. | ૪.૮૩ | ૧૦૦ગ્રામ કેડબરી | ૨,૪૨,૨૦૦ |
| હિન્દુસ્તાન લિવર | ૩૨૨.૫૦ | ૧૦૦ગ્રામ બિસ્કીટ | ૨,૪૩,૦૦૦ |
| ઈપ્કા લેબોરેટરી | ૩૩૧.૦૦ | **વિદેશી હુંડિયામણ** | |
| જિંદાલ સો લિ. | ૧૪૩.૭૦ | ટ્રાવેલર્સ ચેક | |
| કચ્છ મિનરલ્સ લિ. | ૭.૭૧ | ડોલર | ૪૩.૫૫-૪૪.૯૫ |
| કનોરિયા કેમિકલ્સ | ૪૦.૦૦ | પાઉન્ડ | ૭૦.૫૫-૭૩.૪૦ |
| કેશર એન્ટ. | ૫૨.૦૦ | યુરો | ૬૧.૬૦-૬૪.૦૫ |
| માન ઇન્ડ. ઈન્ડિયા | ૧૩૮.૦૦ | કરન્સી | |
| માનકસીઆ લિ. | ૬૨.૫૦ | ડોલર | ૪૩.૩૦-૪૫.૦૫ |
| મુન્દ્રા પોર્ટ સ્પેશિઆ | ૧૪૩.૦૦ | પાઉન્ડ | ૭૦.૨૦-૭૩.૬૦ |
| નવનીત પબ્લિકેટ | ૬૫.૪૦ | યુરો | ૬૧.૩૦-૬૪.૨૦ |
| પી એસ એલ લિ. | ૬૯.૦૫ | ૧૦ ગ્રામ ગોલ્ડ કોઇન | ૨૬,૦૫૦ |
| પ્રાજ ઇન્ડસ્ટ્રિઝ | ૮૩.૮૦ | (સૌજન્ય : એસ.બી.આઇ. | |
| રામકો ઇન્ડ. | ૪૩.૦૫ | એન.આર.આઇ. બ્રાન્ચ ભુજ) | |
| રત્નમણિ મેટલ્સ | ૧૦૨.૪૦ | | |

### બ્રાંડ ઇન્ડેક્સ

| કંપની | બંધ | | તફાવત | કંપની | બંધ | | તફાવત |
|---|---|---|---|---|---|---|---|
| સીજી | 12,590.03 | ▼ | 2.65 | સીડી | 6,615.86 | ▼ | 0.93 |
| ઓઇલ/ગેસ | 8,840.53 | ▼ | 0.37 | ટેક | 3,577.32 | ▼ | 0.91 |
| આઇટી | 5,739.79 | ▼ | 1.00 | બેન્કેક્સ | 12,162.74 | ▼ | 0.87 |
| રિયાલ્ટી | 1,993.14 | ▼ | 0.74 | એચસી | 6,400.97 | ▼ | 1.02 |
| એફએમસીજી | 4,050.37 | ▲ | 0.26 | પાવર | 2,457.65 | ▼ | 0.06 |
| પીએસયુ | 8,286.42 | ▼ | 0.04 | મેટલ | 13,627.91 | ▲ | 0.30 |

### કરન્સી માર્કેટ

| ચલણ | ખરીદ | ચલણ | ખરીદ |
|---|---|---|---|
| અમેરિકન ડોલર | 44.32 | જાપાનીઝ યેન | 57.50 |
| પાઉંડ સ્ટર્લિંગ | 72.64 | સિંગાપોર ડોલર | 36.69 |
| કેનેડિયન ડોલર | 46.17 | ચાઇનિઝ યુઆન | 6.88 |
| યૂરો | 63.43 | ઓસ્ટ્રેલિયન ડોલર | 47.65 |
| સ્વિસ ફ્રાંક | 57.46 | | |

સૌજન્ય : વાડીલાલ ફોરેક્સ

### સંસ્થાકીય લેવાલી

| Trade | FII | | | DII | | |
|---|---|---|---|---|---|---|
| DATE | BUY | SALES | NET | BUY | SALES | NET |
| 1/8/11 | 1,848.80 | 1,691.60 | 157.20 | 347.80 | 508.10 | -160.30 |
| August , 11 | 1,848.80 | 1,691.60 | 157.20 | 347.80 | 508.10 | -160.30 |

(Rs. Crore)

### MCX- SXના કરન્સી વાયદા

| કોન્ટ્રાક્ટ | પાકતી તા. | ખૂલી | વધી | ઘટી | બંધ |
|---|---|---|---|---|---|
| રૂપી-યુરો | ૨૯-૦૮-૧૧ | ૬૨.૯૮ | ૬૩.૭૪ | ૬૨.૯૮ | ૬૩.૫૮ |
| રૂપી-યુરો | ૨૮-૦૯-૧૧ | ૬૩.૪૩ | ૬૩.૯૮ | ૬૩.૨૯ | ૬૩.૮૪ |
| રૂપી-યુરો | ૨૭-૧૦-૧૧ | ૬૩.૭૧ | ૬૪.૨૦ | ૬૩.૬૪ | ૬૪.૦૭ |
| રૂપી-પાઉન્ડ | ૨૯-૦૮-૧૧ | ૭૨.૪૭ | ૭૨.૯૩ | ૭૨.૩૮ | ૭૨.૮૬ |
| રૂપી-પાઉન્ડ | ૨૮-૦૯-૧૧ | ૭૨.૭૫ | ૭૩.૨૫ | ૭૨.૭૦ | ૭૩.૧૯ |
| રૂપી-યેન | ૨૯-૦૮-૧૧ | ૫૭.૫૧ | ૫૭.૮૩ | ૫૭.૫૦ | ૫૭.૬૭ |
| રૂપી-યેન | ૨૮-૦૯-૧૧ | ૫૭.૭૪ | ૫૮.૦૧ | ૫૭.૬૪ | ૫૭.૮૬ |
| રૂપી-ડોલર | ૨૯-૦૮-૧૧ | ૪૪.૪૫ | ૪૪.૫૮ | ૪૪.૪૫ | ૪૪.૪૯ |
| રૂપી-ડોલર | ૨૮-૦૯-૧૧ | ૪૪.૬૮ | ૪૪.૭૯ | ૪૪.૬૮ | ૪૪.૭૧ |
| રૂપી-ડોલર | ૨૭-૧૦-૧૧ | ૪૪.૯૨ | ૪૫.૦૧ | ૪૪.૯૦ | ૪૪.૯૩ |
| રૂપી-ડોલર | ૨૮-૧૧-૧૧ | ૪૫.૧૮ | ૪૫.૨૧ | ૪૫.૧૨ | ૪૫.૧૪ |
| રૂપી-ડોલર | ૨૮-૧૨-૧૧ | ૪૫.૩૮ | ૪૫.૪૧ | ૪૫.૩૧ | ૪૫.૩૩ |

## ન્યૂઝ બ્રીફ

**એચડીએફસી બેન્ક : એટીએમ દ્વારા ઇન્કમટેક્સ પેમેન્ટની સુવિધા શરૂ**

**નવી દિલ્હી :** એચડીએફસી બેન્કે એટીએમ દ્વારા ઈન્કમટેક્સ પેમેન્ટની સર્વિસ શરૂ કરી છે. આ સુવિધા શરૂ થતાં બેન્કના કુલ ૧૧૫ લાખ ડેબિટ કાર્ડધારકોને તેનો લાભ મળશે. ગ્રાહકો બેન્કના એટીએમમાં ડેબિટકાર્ડ દ્વારા તેમના ઈન્કમટેક્સની ચુકવણી કરી શકશે. આ સુવિધાના પગલે હવે ગ્રાહકોએ ઈન્કમટેક્સ ચૂકવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ સી. આર. સુંદરામૂર્તિના હસ્તે બેન્કની નવી સેવા શરૂ કરવામાં આવી હતી. એચડીએફસી બેન્કની આ નવી સેવાનો બેન્કના ૫,૯૯૮ એટીએમ ખાતે મેળવી શકશે. આ સુવિધા દેશના ૧,૧૧૧ શહેરોમાં ઉપલબ્ધ રહેશે.

**સેન્ટ્રલ બેન્ક કાર્યકારી નફો વધ્યો**

**અમદાવાદ :** સેન્ટ્રલ બેન્કે જુન-૧૧ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે કાર્યકારી નફો ૧૮.૫૬ ટકા વૃદ્ધિ સાથે રૂ. ૭૯૨ કરોડ (રૂ. ૬૬૮ કરોડ) અને ચોખ્ખો નફો ૧૬.૬૨ ટકા ઘટાડા સાથે રૂ. ૨૮૧ કરોડ નોંધાવ્યો છે. બેન્કની ચોખ્ખી વ્યાજ આવકમાં ૧૮.૮૬ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

**ઇન્ડિયન બેન્કનો નફો વધ્યો**

**અમદાવાદ :** ઈન્ડિયન બેન્કનો ચોખ્ખો નફો ૧૦.૫ ટકા વધી રૂ. ૪૦૬.૯ કરોડ થયો છે. બેન્કની ચોખ્ખી વ્યાજ આવક પણ ૧૩.૯ ટકા વધી રૂ. ૧૦૩૦ કરોડ થઈ છે. કુલ વ્યવસાય ૨૧.૩ ટકા વધી રૂ. ૧૯૨,૯૩૪ કરોડ થયો છે.

### જુલાઈમાં તેજી સાથે વેલ્યુમાં ૪૬ ટકા અને વોલ્યુમમાં ૪૪ ટકાની વૃદ્ધિ

# સોનામાં તેજી, કામકાજમાં ભડકો

**બીરજુ શાહ . અમદાવાદ**

**સોનાની ઝમકમાં સટોડિયા ખીલ્યા**

- > સોનાના વાયદામાં છેલ્લા એક વર્ષના સૌથી ઊંચા કામકાજ
- > કીમતી ધાતુઓમાં એમસીએક્સમાં જુલાઈમાં વિક્રમી કામકાજ
- > ૨૦૧૧ના વર્ષમાં જુલાઈમાં વોલ્યુમ સૌથી ઊંચી સપાટીએ
- > પ્રથમવાર ટ્રેડડ કોન્ટ્રેક્ટ લોટની સંખ્યા ૩૭૫૭૨૦૬ની નોંધાઈ

**ટર્નઓવર**

₹ 253135 કરોડ રૂપિયાનું કામકાજ સોનામાં

₹565097 કરોડ રૂપિયાનું કામકાજ ચાંદીમાં

₹818232 કરોડ રૂપિયાનું કામકાજ કીમતી ધાતુમાં થયા

સ્ત્રોત : એમસીએક્સ

સોનામાં આવેલી આગઝરતી તેજીને પગલે કોમોડિટીઝ એક્સચેન્જના કામકાજમાં પણ જોરદાર વૃદ્ધિ જોવાઈ છે. જુલાઈ ૨૦૧૧માં વેલ્યુની દૃષ્ટિએ ૪૬ ટકાની અને વોલ્યુમની દૃષ્ટિએ ૪૪ ટકાની વૃદ્ધિ જોવાઈ છે. જ્યારે પહેલી જૂન અને ૩૧ જુલાઈ વચ્ચેના ભાવમાં ૪.૨ ટકાનો વધારો થયો હતો. સોનાની સાથે ચાંદીમાં પણ ફરી કામકાજમાં વધારો થયો હતો. જોકે સોનાની સરખામણીએ વેલ્યુમાં ૩૬ અને વોલ્યુમમાં ૨૮ ટકાનો વધારો જોવાયો હતો. કીમતી ધાતુમાં એટલે કે સોનું, ચાંદી અને પ્લેટેનિયમના સંયુક્ત કામકાજમાં ૩૯ ટકાની વૃદ્ધિ જોવાઈ હતી.

સોનાના વાયદામાં ભાવમાં આવેલી તેજીને પગલે કામકાજમાં અસાધારણ વધારો થયો છે. ત્રણ મહિના અગાઉ ચાંદીના ભાવમાં આવેલી તેજીને પગલે તેમાં કામકાજમાં મોટો ઉછાળો આવ્યો હતો. હવે તેનું સ્થાન સોનાએ લીધું છે. જુલાઈ મહિનામાં સોનામાં છેલ્લા એક વર્ષનું સૌથી મોટું કામકાજ નોંધાયું હતું. જુલાઈમાં સોનામાં રૂ. ૨૫૩૧૩૫ કરોડના કામકાજ થયા હતા, જે જૂન મહિનામાં રૂ. ૧૭૨૯૩૮ કરોડના કામકાજ હતા. આમ તેમાં ૪૬ ટકાનો ઉછાળો જોવાયો હતો. તેવી જ રીતે વોલ્યુમ ૪૪ ટકા વધીને ૧૧૦૯૦૪૩.૫૪ ગ્રામનું રહ્યું હતું, જે જૂન મહિનામાં ૭૭૦૨૮૫.૧૬ ગ્રામનું હતું.

એમસીએક્સ ખાતે સોનાને પગલે ચાંદીમાં પણ કામકાજ વધ્યું હતું. તેમાં ૩૬ ટકાના વધારા સાથે રૂ. ૫૬૫૦૯૭ કરોડનું કામકાજ થયું હતું. જ્યારે વોલ્યુમ ૨૮ ટકાની વૃદ્ધિ સાથે ૯૮૭૯૧ કિલોનું થયું હતું. કીમતી ધાતુમાં ૩૯ ટકા કામકાજ વધીને રૂ. ૮૧૮૨૩૨ કરોડનું થયું હતું જે જૂનમાં ૫૮૬૮૮૩ કરોડનું નોંધાયું હતું. અગાઉ જૂન ૨૦૧૦માં રૂ. ૨૬૫૭૫૯ કરોડના રેકોર્ડ કામકાજ સોનામાં થયા હતા. ત્યારબાદ હાલમાં જ જુલાઈમાં તેની નજીક કામકાજ પહોંચ્યા હતા.

# સોનામાં ₹ ૬૪૦, ચાંદીમાં ₹ ૧૬૦૦નો ઝડપી ઉછાળો

**ભાસ્કર ન્યૂઝ. રાજકોટ**

આજે ભારતીય બજારમાં સ્ટોકિસ્ટ અને રોકાણકારોની લેવાલી નીકળતા સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હતા. એક જ દિવસમાં સોનામાં રૂ.૬૪૦ અને ચાંદીમાં રૂ.૧૬૦૦નો ઝડપી ભાવવધારો થયો હતો અને ચાંદીએ ૬૦૦૦૦ની સપાટી વટાવી હતી. યુએસ અને યુરોપ સહિતના અર્થતંત્ર જોખમમાં હોવાની ધારણા વચ્ચે વૈશ્વિક સોનાએ ૧૬૭૦ ડોલરની સપાટી કૂદાવી નવો હાઈ બનાવ્યો હતો. ઘરઆંગણે દિલ્હી ખાતે સોનું સૌથી વધુ રૂ.૬૪૦ વધી રૂ.૨૪૩૩૦ થયું હતું. રાજકોટ ખાતે સોનું રૂ.૫૦૦ વધી રૂ.૨૪૨૫૦, સોનું બિસ્કિટ રૂ.૫૦૦૦ વધી રૂ.૨,૪૨,૫૦૦ અને ચાંદી રૂ.૧૬૦૦ વધી રૂ.૫૯૫૦૦, અમદાવાદ ખાતે સોનું રૂ.૫૭૫ વધી રૂ.૨૪૩૦૦ અને ચાંદી રૂ.૧૪૦૦ વધી રૂ.૫૯૭૦૦ના સ્તરે પહોંચી હતી. મુંબઈ ખાતે સોનું રૂ.૫૯૦ વધી રૂ.૨૪૦૭૫ અને ચાંદી રૂ.૧૪૯૫ વધી રૂ.૬૦૬૧૫ તેમજ કોલકાતા ખાતે સોનું રૂ.૫૭૦ વધી રૂ.૨૪૩૩૫ અને ચાંદી રૂ.૧૭૦૦ વધી રૂ.૫૯૯૦૦ના સ્તરે હતી.

અમેરિકામાં દેવાની મર્યાદા વધાર્યા બાદ પણ જોખમ ઊભુ છે. ખરીદ શકિતમાં પણ ઘટાડો થયો છે. યુરોપનું આર્થિક સંકટ ટળ્યું નથી. આ સંજોગોમાં સેન્ટ્રલ બેન્કો પણ સોનાની ખરીદી કરી રહી છે. યુએસ ડોલર ઈન્ડેક્સ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને પગલે સોના ચાંદીમાં રોકાણ વધ્યું હતું અને વૈશ્વિક સોનું ૧૬૭૦ ડોલરની નવી ટોચે હતું.

# ઈન્ડિયા ઈન્ફોલાઈનનો એનસીડી ઈશ્યૂ આજથી

**ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ**

ઈન્ડિયા ઈન્ફોલાઈન ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીઝ લિમિટેડનો એનસીડી(નોન કન્વિર્ટિબલ ડિબેન્ચર્સ) માટેનો આઈપીઓ ચોથી ઓગસ્ટે ખૂલશે. કંપની આઈપીઓ દ્વારા રૂ. ૭૫૦ કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે જેમાં રૂ.૩૭૫ કરોડ ઓવરસબસ્ક્રિપ્શન દ્વારા ઊભા કરાશે. સિક્યોર્ડ રિડિમેબલ નોન-કન્વિર્ટિબલ ડિબેન્ચર્સની ફેસ વેલ્યુ રૂ.૧,૦૦૦ની રહેશે.

કંપનીના આઈપીઓમાં ત્રણ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પો હશે અને તેની પર વાર્ષિક ૧૧.૯૦ ટકા સુધીનું વળતર છૂટશે. આઈપીઓ ૧૨ ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવામાં આવશે. આઈપીઓ દ્વારા ઊભી કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની વિવિધ ફાઈનાન્સિંગ પ્રવૃત્તિઓમાં કરશે .

# બે દિવસમાં શેરબજાર ૩૭૩ પોઈન્ટ ગબડ્યું

**ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ**

વૈશ્વિક શેરબજારની પાછળ સતત બીજા દિવસે સ્થાનિક બજારમાં નરમાઈ આગળ વધી હતી. આજની નરમાઈમાં સેન્સેક્સ ૨૩ જૂન પછી પ્રથમવાર ૧૮,૦૦૦ની સપાટી તોડીને અંદર ગબડ્યો હતો. બે દિવસમાં આવેલી ૩૭૩ પોઈન્ટની નરમાઈમાં રોકાણકારોની મૂડીમાં રૂ. ૯૨,૦૦૦ કરોડનું ધોવાણ થયું છે. અમેરિકાની સાથે યુરોપ પણ મંદીમાંથી પસાર થતાં અને તેના આંચકા એશિયાની ઈકોનોમી પર થવાની દહેશતને કારણે ઈમર્જીંગ માર્કેટમાં વેચવાલી ફરી વળી હતી. અમેરિકાની સેનેટમાં દેવામર્યાદા વધારવાનું બિલ પસાર થઈ જવા છતાં તેની રેટિંગ ઘટવાની ચેતવણીએ નકારાત્મક અસર થઈ છે. અમેરિકાના પગલાં બાદ ડોલર નબળો પડતાં તેની પાછળ રૂપિયો નબળો પડ્યો હતો. એક સમયે ૨૪૧ પોઈન્ટ ગબડેલો સેન્સેક્સ પાછળથી સાધારણ રિકવર થયા બાદ ૧૬૯.૩૪ પોઈન્ટ ઘટીને ૧૭,૯૪૦.૫૫ની સપાટીએ અને નિફ્ટી ૫૧.૭૫ પોઈન્ટ ઘટીને ૫,૪૦૪.૮૦ની સપાટીએ બંધ રહ્યા હતા. વિદેશી શેરબજાર અને ઈકોનોમીના નકારાત્મક સમાચારની સાથે બજારના મહારથી ગણાતા એક ઓપરેટરે છેલ્લા બે સપ્તાહમાં બજારમાં રૂ. ૩૦૦ કરોડનો નફો બુક કરવાની હિલચાલની પણ સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર થઈ છે. આમાં એફઆઈઆઈની પણ છેલ્લા કેટલાક દિવસથી અનિયમિત બનેલી લેવાલીએ પણ માનસને વધુ સાવચેત કર્યું હતું. છેલ્લા ત્રણ દિવસનો ટ્રેન્ડ જોઈએ તો એફઆઈઆઈ નેટ સેલર રહી હોવાનું શેરબજારમાંના પ્રોવિઝનલ ડેટા સૂચવતા હતા.

વધતા વ્યાજદરને કારણે શેરોની સામે લોન લઈને રોકાણ કરવાનું મોંઘું બનતાં તેની પણ આડઅસર બજારમાં થઈ છે. પીએસએલ સિક્યોરિટીઝના દેવાંગ શાહના જણાવ્યા પ્રમાણે હાલ બજારનો આંતરપ્રવાહ એકદમ ખરડાઈ ગયો છે. હવે જો સરકાર તરફથી ઉદારીકરણના પગલાં લેવામાં આવે તો સેન્ટિમેન્ટ વધુ બગડતું અટકે. સ્થાનિકમાં માર્કેટ બ્રેડથ ખરાબ રહીને વધનાર ૧૧૬૦ શેરો સામે ઘટનાર ૧૭૦૬ શેરો હતા. ઉપલી અને નીચલી સર્કિટને સ્પર્શનાર શેરોનો રેશિયો ૧૪૮:૧૭૦નો હતો. સેક્ટરોલ આંકમાં કેપિટલ ગુડ્ઝ આંક ૩૪૩ પોઈન્ટ સાથે સૌથી વધુ નરમ રહ્યો હતો. ત્યારબાદ ઓટો ઈન્ડેક્સમાં ૧૨૭ પોઈન્ટની નરમાઈ જોવાઈ હતી. સેન્સેક્સ શેરોમાં બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ, એલ એન્ડટી, મારૂતિ, રિલાયન્સ, તાતા મોટર, ટીસીએસ વધુ ઘટ્યા હતા.

બેન્ક શેરમાં એક્સિસમાં એક્સ મારવાડી બ્રોકરેજ હાઉસનો પોર્ટફોલિયો હળવો થતા ભાવમાં રૂ. ૩૫થી વધુનું ગાબડું પડ્યું હતું. અદાણી ગ્રુપના શેરોમાં ખુલાસા બાદનો સુધારો ટક્યો નહોતો અને ભાવમાં નરમાઈ જોવાઈ હતી.

### યુએસનું રેટિંગ ઘટવાની ભીતિએ યુરોપનાં બજાર ૧૧ મહિનાને તળિયે

| આંક નરમ | |
|---|---|
| ▼ 207 | જાપાન |
| ▼ 429 | હોંગકોંગ |
| ▼ 128 | તાઇવાન |
| ▼ 119 | દ.કોરિયા |
| ▼ 284 | પાકિસ્તાન |

અમેરિકાનું રેટિંગ ઘટવાની દહેશતને પગલે યુરોપનાં બજાર ૧૧ મહિનાની નીચી સપાટીએ તો ઇમર્જીંગ માર્કેટ છ સપ્તાહની નીચી સપાટીએ ગબડ્યા હતાં. આશ્ચર્ય વચ્ચે સ્વિસ બેન્કે વ્યાજદર ઘટાડવાનું પગલું લીધું હતું.

### રોકાણકારોના ₹ ૯૨,૦૦૦ કરોડ ધોવાયા

શેરબજારમાં છેલ્લા બે દિવસની નરમાઈમાં રોકાણકારોની મૂડીમાં રૂ. ૯૨,૦૦૦ કરોડનું ધોવાણ થયું છે. મેટલ, રિયાલ્ટી, કેપિટલ ગુડ્ઝ અને ઓટો શેરોમાં આ ગાળામાં વધુ પીછેહઠ જોવાતાં વ્યાજદર સેન્સેટિવ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં રોકાણકારોને ખોટ સહન કરવી પડી છે.

# કોર્પોરેશન બેન્કે ₹૧૭૩ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું

**મેંગલોર :** કોર્પોરેશન બેન્કના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર રામનાથ પ્રદીપે નવી દિલ્હી ખાતે નાણાપ્રધાન પ્રણવ મુખરજીને બેન્ક વતી રૂ. ૧૭૩.૭૮ કરોડનાં ડિવિડન્ડની ચુકવણી કરી છે. ૨૦૧૦-૧૧ દરમિયાન બેન્ક દ્વારા કરવામાં આવેલા નફામાંથી ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવી છે.

**લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીને ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન**

**જલંધર :** વિખ્યાત મેગેઝિન 'ધ સન્ડે ઈન્ડિયન' માટે ઈન્ડિયન કાઉન્સિલ ફોર માર્કેટ રિસર્ચ દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (એલપીયુ)ને દેશની ટોચની ૯ યુનિવર્સિટીઓમાં સ્થાન મળ્યું છે. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એલપીયુને બીસીએના અભ્યાસક્રમ માટે દેશની ટોચની પાંચમી અને બીબીએ માટે ૧૪મું સ્થાન પ્રાપ્ત થયું છે.

**પીએનબીના વ્યાજદરોમાં ફેરફાર**

**નવી દિલ્હી :** પંજાબ નેશનલ બેન્ક

## કોર્પોરેટ પ્લસ

દ્વારા એનઆરઆઈ ટર્મ ડિપોઝિટ તથા ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ ડિપોઝિટ ઉપર આપવામાં આવતા વ્યાજદરો સુધારવામાં આવ્યા છે. તા. ૧લી ઓગસ્ટ ૨૦૧૧થી એનઆરઆઈ ફિક્સ ડિપોઝિટ ઉપર ૧ વર્ષથી વધારે અને ૨ વર્ષથી ઓછી મુદતની થાપણ ઉપર ૨.૫૧ ટકા, બે વર્ષથી વધારે અને ૩ વર્ષથી ઓછી થાપણ ઉપર ૨.૩૯ ટકા વ્યાજની ચુકવણી કરાશે.

**હીરાનાં મનપસંદ આભૂષણોની ખરીદવાની તક**

**બેંગલોર :** તમે ક્યારેય એવી કહેવત સાંભળી છે કે ડાયમંડ્ઝ આર ગર્લ્સ બેસ્ટ ફ્રેન્ડ્ઝ? આ વાત સો ટકા સાચી છે કોઈ સ્ત્રી એવી નહીં હોય કે જેને કીમતી ઘરેણાં ખરીદવાનો શોખ ન હોય. આ વાતને ધ્યાનમાં રાખીને ઘરેણાંની જાણીતી બ્રાન્ડ 'તનિષ્ક'એ પોતાનાં હીરાનાં ઘરેણાં ઉપર ખાસ ૨૦ ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. તા. ૩૧મી જુલાઈથી ૩૧મી ઓગસ્ટ ૨૦૧૧ સુધી ચાલશે.

**ચ્યવનપ્રાશનું બજાર ખૂબ મોટું છે : બૈદ્યનાથ આયુર્વેદ**

**લખનઉ :** બૈદ્યનાથ આયુર્વેદ દ્વારા લખનઉ ખાતે તેના ઉત્તરપ્રદેશના વેપારીઓ સાથે આ વર્ષની ચ્યવનપ્રાશ ટ્રેડ પ્રમોશન ઓફર ૨૦૧૧-૧૨ રજૂ કરવામાં આવી હતી. આ વખતની પ્રમોશન ઓફર રજૂ કરતાં બૈદ્યનાથના સેલ્સ વિભાગના જનરલ મેનેજર એ. કે. શર્માએ જણાવ્યું હતું કે ચ્યવનપ્રાશનું બજાર ખૂબ જ મોટું હોવાથી વેપારીઓ માટે આ કમાણીની એક સારી તક છે.

**મુલતાની ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સ્ટોકિસ્ટ્સ મિટિંગનું આયોજન**

**નવી દિલ્હી :** મુલતાની ફાર્માસ્યુટિકલ્સ દ્વારા રાયપુર છત્તીસગઢ ખાતે તેના સ્ટોકિસ્ટસની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુલતાની ફાર્માસ્યુટિકલ્સના છત્તીસગઢ ખાતેના તમામ સ્ટોકિસ્ટસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા સ્ટોકિસ્ટસનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

**આઈઓબીના વેપારમાં સુધારો**

**ચેન્નાઈ :** ઈન્ડિયન ઓવર્સીઝ બેન્કનો કુલ વેપાર જૂન ૨૦૧૧ દરમિયાન વધીને રૂ. ૨,૭૦,૩૨૦ કરોડનો થવા પામ્યો છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૧,૯૨,૪૧૨ કરોડનો હતો. કંપનીની કુલ થાપણો ૩૮.૧૧ ટકા વધીને રૂ. ૧,૫૧,૧૭૩ કરોડની થવા પામી છે .

**આકાશને આંબવાની સફર કરો કરિયર એવિયેશન એકેડેમીથી**

**પૂણે :** ઉડ્ડયન ક્ષેત્ર અગણિત તકોથી ભરપૂર ક્ષેત્ર છે. એમ એટલા માટે કહી શકાય કે ભારતમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા લોકો માટે પૂણેસ્થિત કરિયર એવિયેશન એકેડેમી પાઈલટ તેમજ એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જિનિયરિંગ ટ્રેનિંગ માટે ઉત્તમ સંસ્થા છે.

# કોરીયો ગ્રાફર રેમો ડીસોઝા શુક્રવારે ગાંધીધામમાં

**બીઝનેશ પ્લસ . ગાંધીધામ**

બોલીવુડના જાણીતા કોરીયો ગ્રાફર તથા ઝી ટીવીના ડાન્સ ઈન્ડીયા ડાન્સ અને ઝલક દીખલાજા શો ના નીર્ણાયક રેમો ડીસોઝા શુક્રવારે ગાંધીધામ આવશે. ગાંધીધામ ખાતે શરૂ થયેલી પોતાની ડાન્સ એકેડમી રેમોસ ડાન્સ ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓનો પ્રતિભાવ જોઇ રેમો ગાંધીધામ આવી રહ્યા છે. રેમો ડીસોઝા શુક્રવારે સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી ગાંધીધામમાં રેમોસ ડાન્સ ઈન્સ્ટીટ્યુટ ઓમ ક્રોસ-વે ખાતે ઉપસ્થિત રહેશે. પોતાના ચાહકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ડાન્સ પ્રીય લોકોને માર્ગદર્શન આપશે. કચ્છના ફ્રેન્ચાઈઝર રેઈનબો ડાન્સ ક્લાસના પાર્ટનર રોશન એમ સંગવી તથા કીશોર આહિરે દરેક વ્યક્તિને ડાન્સ ઈન્સ્ટીટ્યુટનો લાભ લઈ પોતાની ટેલેન્ટને પ્લેટફોર્મ આપવાની લાગણી વ્યક્ત કરી હતી.

# ઘણા ફેશન ડિઝાઈનર એરિયલ સાથે જોડાયા

**બિઝનેસ ભાસ્કર . દુબઈ**

અભિનેતાઓ અને ખેલાડીઓ બાદ હવે ફેશન ડિઝાઈનર્સ પણ ઉત્પાદનોના પ્રચારમાં જોડાઈ ગયા છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પોતાના ડિટર્જન્ટ પાઉડર એરિયલ માટે ભારતના મનીષ મલ્હોત્રા સહિત વિશ્વભરના ફેશન ડિઝાઈનર્સને તેનાં ઉત્પાદન સાથે જોડ્યા છે. તાજેતરમાં જ દુબઈ ખાતે રજૂ કરવામાં આવેલી એરિયલ ઉડી ટેક્નિકમાં આ તમામ ડિઝાઈનર્સ એક સાથે જોવા મળ્યા હતા. કંપનીએ મનીષ ઉપરાંત અમેરિકાની સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અને સ્ટાઈલિસ્ટ જૂન એમ્બ્રોસ, નેધરલેન્ડના જેન કાયટાનેન અને દુબઈની આયેશાનો એરિયલ ઉડીનો પ્રચાર કરવા માટે સાથ લીધો છે. આ જાહેરાત મારફતે કંપની એવો સંદેશો આપવા માગે છે કે મોંઘાં કપડાંની માવજત પણ એરિયલ ઉડી દ્વારા કરી શકાય છે. મનીષ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કોઈ પણ બ્રાન્ડ સાથે જોડાવું તે મારા માટે એક મોટી જવાબદારીની વાત બની જાય છે કારણ કે હું પોતે જ એક મોટી બ્રાન્ડ છું અને લોકો મારા ઉપર વિશ્વાસ કરે છે. મેં બેઈજિંગ ખાતે આવેલા એરિયલનાં રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલાં રિસર્ચના કામનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ જ મેં એરિયલ ઉડી સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. જૂન એમ્બ્રોસે પણ આ જ પ્રકારના વિચારો પ્રદર્શિત કર્યા હતા. આ વૈશ્વિક લોન્ચિંગ સમયે દુબઈ ખાતે ૪૦ દેશોના ૧૫૦ કરતાં પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્પાદનને તૈયાર કરવા માટે કંપનીએ માઈક્રો સિટી, એમઆરઆઈ અને એસઈએમ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે.

## કચ્છ બજારના ભાવ

**ભુજ સ્થાનિક બજારભાવ**

**(૧૦૦ કિલોના)**

| | |
|---|---|
| ઘઉં નવા | ૧૧૫૦-૨૦૦૦ |
| બાજરો | ૧૦૮૦-૧૨૦૦ |
| ચોખા આઈઆર | ૧૫૫૦-૧૬૫૦ |
| ચોખા બેગમી | ૧૯૦૦-૨૦૦૦ |
| ચોખા જીરાસર | ૨૦૦૦-૩૪૦૦ |
| મગ નવા | ૫૧૦૦-૫૫૦૦ |
| મગ ફાડા | ૪૯૦૦-૫૧૦૦ |
| મોગરદાળ | ૫૮૦૦-૫૯૦૦ |
| તુવેરદાળ | ૫૪૦૦-૫૭૦૦ |
| તુવેરદાળ રેંટિયો | ૬૪૦૦-૬૭૦૦ |
| ચણાદાળ | ૩૮૦૦-૪૦૦૦ |
| અડદદાળ | ૫૬૦૦-૬૩૦૦ |
| ખાંડ એસ | ૨૮૪૦-૨૮૬૦ |
| ખાંડ એમ | ૨૮૯૦-૨૯૨૦ |
| ખાંડ કટ્ટા | ૨૮૫૦-૨૮૭૦ |
| **ટીનના ભાવ (વેટ સહિત)** | |
| સીંગતેલ ૧૫ લિટર | ૧૫૬૦-૧૫૭૦ |
| સીંગતેલ ૧૫ કિલો | ૧૬૧૦-૧૬૭૦ |
| વેજીટેબલ ૧૫ કિલો | ૯૬૦-૧૦૦૦ |
| કપાસિયા તેલ | ૧૧૧૦-૧૨૧૦ |
| કપાસિયા તેલ ૧૫ લિટર | ૧૧૪૫-૧૧૫૦ |
| કોપરેલ ૧૫ કિલો | ૧૭૮૦-૧૮૦૦ |
| પામોલીન | ૯૦૦-૯૦૨ |
| સૂરજમુખી | ૧૨૫૦-૧૩૩૦ |
| સોયાબીન | ૧૦૬૫-૧૦૭૦ |
| **૨૦ કિલોના ભાવ** | |
| કોલ્હાપુરી ગોળ | ૬૫૦-૭૩૦ |
| યુપી | ૫૮૦-૫૯૦ |
| **એક ગૂણીના ભાવ** | |
| ઝીણુ ભૂસું | ૪૦૦-૪૫૫ |
| બેસન ૫૦ કિલો | ૨૦૪૦-૨૪૪૦ |
| કપાસિયા ખોળ | ૬૬૫-૬૭૫ |
| કપાસિયા જાડા (વેટ સહિત) | ૭૮૦ |
| **ભુજ માર્કેટ યાર્ડ** | |
| **૧૦૦ કિલોના ભાવ** | |
| મઠ | ૧૬૫૦-૨૧૮૦ |
| ગોવાર | ૩૧૦૦-૪૦૬૮ |
| મગ | ૨૦૦૦-૪૮૫૨ |
| **૪૦ કિલોના ભાવ** | |
| એરંડા | ૧૯૪૦-૧૯૭૬ |
| રાયડો | ૧૦૦૦-૧૦૩૫ |
| ઇસબગુલ | ૧૩૫૦-૧૯૦૦ |
| તલી | ૧૯૧૦-૨૧૦૦ |
| **ભુજ શાક માર્કેટ** | |
| **૧ કિલોના ભાવ** | |
| ડુંગળી | ૯-૧૦.૫ |
| બટાટા | ૮-૯ |
| ટમેટા | ૮-૯ |
| મરચા | ૫-૬ |
| રીંગણા | ૫-૬ |
| કોબી | ૧૦-૧૨ |
| ફુલાવર | ૩૫-૪૦ |
| ગોવાર | ૨૦-૨૫ |
| ધાણા | ૩૦-૩૫ |
| ભીંડા | ૨૫-૩૦ |
| કાકડી | ૦૪-૦૬ |
| પાલક | ૦૩-૦૪ |
| લસણ | ૩૫-૪૦ |
| લીંબુ | ૨૦-૨૫ |
| ગીસોડા | ૨૫-૩૦ |
| દુધી | ૧૦-૧૨ |
| આદુ | ૪૦-૪૨ |
| કારેલાં | ૧૫-૧૭ |
| ચોળા | ૧૦-૧૨ |
| ગીલોડા | ૭-૮ |
| મરચા સિમલા | ૮-૧૨ |
| કેળા કાચા | ૧૨-૧૩ |
| કેળા પાકા | ૧૩-૧૪ |
| પપૈયા કાચા | ૬-૭ |
| પપૈયા પાકા | ૧૧-૧૩ |
| સક્કરટેટી | ૨૦-૨૨ |
| ચીકુ | ૨૪-૨૮ |
| **અંજાર** | |
| ગોવાર | ૩૫૦૦-૪૦૦૦ |
| જુવાર | ૯૫૦-૧૦૨૦ |
| મગફળી | ૧૨૦૦-૧૪૦૦ |
| જીરુ | ૪૮૦૦-૫૪૦૦ |
| ઘઉં | ૧૦૫૦-૧૨૦૦ |
| એરંડા | ૧૯૫૮-૧૯૭૮ |
| **મુન્દ્રા** | |
| મગ | ૨૩૫૦-૩૬૫૦ |
| ગુવાર | ૩૫૦૦-૪૦૨૧ |
| એરંડા | ૧૯૫૦-૧૯૬૦ |
| **રાપર** | |
| ગોવાર | ૬૫૦-૭૭૫ |
| એરંડા | ૯૭૦ |
| **ગાંધીધામ બિલ્ટી** | |
| એરંડા | ૧૦૧૫ |
| રાજકોટ દિવેલ | ૧૦૮૦ |
| રાજકોટ ખાંડી | ૫૩૫૦ |
| કપાસ બીટી | ૫૭૫-૮૭૫ |
| ઘઉં લોકવન | ૨૦૬-૨૩૬ |
| ઘઉં ટુકડા | ૨૦૭-૨૪૭ |
| જુવાર સફેદ | ૩૦૮-૩૫૦ |
| જુવાર પીળી | ૨૫૫-૩૨૫ |
| બાજરી | ૧૭૭-૨૧૫ |
| મકાઇ | ૨૧૨-૨૫૨ |
| તુવેર | ૩૨૫-૫૭૫ |
| ચણા પીળા | ૪૭૫-૫૬૮ |
| અડદ | ૩૦૦-૭૯૦ |
| મગ | ૩૨૫-૮૨૫ |
| વાલ દેશી | ૪૦૦-૬૧૧ |
| વાલ પાપડી | ૧૧૫૦-૧૩૩૧ |
| ચોળી | ૫૫૦-૮૯૦ |
| મઠ | ૪૧૫-૫૩૦ |
| સીંગદાણા | ૧૦૩૫-૧૦૬૦ |
| મગફળી જાડી | ૬૨૭-૮૧૧ |
| મગફળી જીણી | ૬૦૦-૭૪૫ |
| તલી | ૯૨૫-૧૧૦૦ |
| એરંડા | ૯૩૯-૯૬૬ |
| અજમો | ૮૫૦-૧૭૦૦ |
| સુવા | ૪૯૦-૫૨૦ |
| સોયાબીન | ૩૮૦-૪૩૦ |
| સીંગફાડા | ૮૫૦-૯૨૧ |
| કાળા તલ | ૬૫૦-૧૫૮૬ |
| લસણ | ૨૪૫-૫૨૧ |
| વરિયાળી | ૭૪૦-૧૦૦૦ |
| જીરૂ | ૨૦૮૧-૨૭૭૫ |
| રાય | ૪૪૦-૪૫૫ |
| મેથી | ૪૬૦-૪૯૫ |
| રાયડો | ૪૬૧-૫૧૦ |
| રજકાનું બી | ૪૦૦૦-૪૮૬૦ |
| **જામનગર** | |
| જુવાર | ૨૯૬-૩૫૦ |
| બાજરો | ૨૦૦-૨૨૧ |
| ઘઉં | ૨૦૪-૨૧૭ |
| મગ | ૭૮૬-૯૨૬ |
| ચોળી | ૬૦૦-૬૭૦ |
| મઠ | ૪૦૦-૪૮૦ |
| ચણા | ૫૦૦-૫૬૩ |
| લસણ | ૩૦૦-૭૦૧ |
| મગફળી જીણી | ૬૮૦-૭૬૧ |
| મગફળી જાડી | ૬૦૦-૬૯૦ |
| એરંડા | ૯૨૫-૯૬૯ |
| જીરૂ | ૨૦૦૦-૨૬૮૦ |
| રાયડો | ૪૫૫-૪૯૪ |

NCDEX/MCX/NSE/BSE/CURRENCY
फ्रेंचायजी/ट्रेडिंग/टर्मिनल के लिये संपर्क करें
इंडो थाई कमोडिटीज प्रा. लि.
CALL : 098260 45315 093000 77400

## શેરબજારના ભાવ

### એ થી ઝેડ

એ.સી.સી.૯૯૦,૯૯૮,૯૮૫.૦૫,૯૮૭.૯
અબાન લોઇડ૪૬૫.૧,૪૭૬.૮,૪૫૯,૪૭૨.૮૫
એબીબી લિ.૮૬૦,૮૬૦.૭,૮૫૩,૮૫૬.૨૫
અદાણી એક્ષપોર્ટ્સ૬૬૫,૬૭૨.૩૫,૬૫૨.૭,૬૫૭.૦૫
એડી બીર નુવોલ૫૯.૬૫,૬૦.૩૩,૫૯,૬૯.૯
અલ્હાબાદ બેન્ક૧૯૭.૫,૧૯૮.૭,૧૯૩.૨૫,૧૯૭.૪૫
આન્ધ્ર બેન્ક૧૩૫.૫,૧૩૫.૫,૧૩૨.૪૫,૧૩૩.૬
એપોલો હોસ્પિટલ૫૩૧.૯,૫૩૭.૯,૫૨૨.૦૫,૫૩૩.૧૫
એપોલો ટાયર્સ૭૨.૬,૭૩.૭૫,૭૨.૫,૭૨.૭
અરેવા૨૩૫,૨૩૭.૫,૨૩૧.૫,૨૩૬.૨૫
અશોક લેલેન્ડ૨૫.૬,૨૬.૧,૨૫,૨૫.૨૫
એશિયન પેઇન્ટસ૩૦૩૧.૯,૩૦૬૦,૩૦૧૨,૩૦૨૬.૭૫
ઓરોબિંદો ફાર્મા.૧૬૩.૪,૧૬૪.૬,૧૫૮.૮,૧૬૩.૧૫
બજાજ ઓટો૧૫૩૩,૧૫૬૯,૧૫૨૮.૫,૧૫૬૨.૧૫
બેયર ક્રોપ્સ.૧૭૯.૮,૧૭૩,૧૭૩.૨,૦
બીએફ યુટીલીટીઝ૬૭૫.૨,૬૮૮,૬૬૨,૬૮૧.૯૫
ભારત ઇલેક્ટ્રી.૧૯૬૬.૭,૧૯૯૯.૯૫,૧૯૫૪.૦૫,૧૯૬૭
ભારત ફોર્જ૨૯૫.૩૫,૩૦૭.૫૫,૨૯૦,૩૦૩.૫
ભારત પેટ્રો. કોર્પો.૬૫૮,૬૬૮.૯,૬૫૬,૬૬૫
ભારતિ ટેલિ૭૫૭,૭૭૪.૯,૭૫૭,૭૬૯.૨૫
ભારતી ટેલિ.૪૨૮.૪,૪૩૧.૪૫,૪૧૩.૧,૪૨૬.૭૫
ભેલ૧૮૦૨,૧૮૧૪.૯,૧૭૮૬,૧૮૧૧.૦૫
ભુ સ્ટીલ સ્ટ૩૭૧,૩૮૬.૧૫,૩૬૦.૩,૩૮૦.૪
બાયોકોન લિ.૩૫૬.૧,૩૫૭.૯,૩૫૧.૧,૩૫૨.૩૫
બેન્ક ઓફ બરોડા૮૫૯,૮૮૫,૮૪૬.૫,૮૭૪.૫
બેન્ક ઓફ ઇન્ડિયા૩૭૫,૩૭૬.૭,૩૬૨.૬,૩૭૩.૧૫
કેડીલા હેલ્થ૮૬૩,૮૭૯.૭,૮૬૧,૮૭૬
કેનેરા બેન્ક૪૩૧.૬,૪૩૧.૬,૪૧૭.૮,૪૨૭.૪૫
કેસ્ટ્રોલ ઇન્ડિયા૫૬૦,૫૬૪.૯,૫૫૩.૨૫,૫૫૮.૧૫
સેન્ચુરી ટે. એન્ડ ઇન્ડ.૩૩૧.૫૫,૩૩૯.૦૫,૩૨૭.૨,૩૩૭.૩૫
ચંબલ ફર્ટિ. એન્ડ કેમ.૯૨.૪૫,૯૪.૪,૯૧.૭,૯૩.૮૫
સિપ્લા લિ.૩૧૦.૫૫,૩૧૫,૩૧૦.૫૫,૩૧૨.૬
કોલગેટ પામોલીવ૯૭૦.૧,૯૮૪,૯૭૦.૧,૯૭૮.૪
કન્ટેઇન કોર્પો.૧૦૯૦,૧૧૩૩.૨,૧૦૯૦,૧૧૦૫.૯
કોરોમંડલ ફર્ટિલાઇઝર૩૨૪,૩૨૪,૩૧૬.૩૫,૩૧૭.૯
કોર્પોરેશન બેન્ક૪૯૨.૮૫,૪૯૨.૮૫,૪૮૬,૪૮૮.૨૫
ક્રોમ્પટન ગ્રીવ્ઝ૧૬૧.૪,૧૬૫,૧૬૦.૬૫,૧૬૩.૦૫
કયુમિન્સ (ઇ).૬૧૧.૨,૬૨૪.૩૫,૬૦૨.૯૫,૬૧૦.૩૫
ડાબર ઇન્ડિ. લિ.૧૦૭.૫,૧૦૭.૫,૧૦૫.૩,૧૦૫.૬
ડિવીઝ. લેબ.૮૧૧.૯૫,૮૧૫,૭૯૯,૮૦૮.૯૫
ડો.રેડ્ડીઝ લેબો.૧૫૮૭,૧૫૮૯.૮૫,૧૫૬૭.૩,૧૫૭૫.૦૫
ઇ-સર્વ ઇન્ટર.૫૦૧.૦૫,૫૦૫,૪૮૦,૪૯૧.૪
ઇમામી૪૮૨.૧,૪૮૮.૯,૪૮૨.૧,૪૮૬.૨
એન્જી. (ઇ).૨૮૦,૨૮૦,૨૬૯.૩૫,૨૬૯.૯
એસ્સાર ઓઇલ૧૧૩.૨૫,૧૧૩.૫૫,૧૧૧,૧૧૨.૩
એકસાઇડ ઇન્ડસ્ટ્રીઝ૧૪૮.૫,૧૫૧.૩૫,૧૪૭.૨૫,૧૫૦.૨૫
ફેડરલ બેન્ક૪૦૦.૨૫,૪૦૮,૩૯૨.૧,૪૦૬.૧
ફાઇનાન્સિયલ ટેકનો.૭૭૦.૮૫,૭૮૬,૭૬૦.૩,૭૮૧.૮૫
ફ્લેક્ષટ્રોનિક્સ૭૦૯.૦૫,૭૨૪,૭૦૯.૦૫,૭૨૩.૧
જી.ઇ.શિપીંગ૨૬૬,૨૬૮,૨૬૧.૫૫,૨૬૨.૧૫
ગેઇલ ઇન્ડિયા૪૬૦,૪૬૫.૮,૪૫૯.૧,૪૬૨.૯૫
ગ્લેક્ષોસ્મિથ કોનર૩૭૭,૨૪૨૮,૨૩૫૦.૦૫,૨૪૧૧.૩
ગ્લેક્ષોસ્મિથ૨૨૭૫,૨૨૯૨.૧૫,૨૨૬૫.૧૫,૨૨૭૫.૪
ગ્લેનમાર્ક ફાર્મા.૩૩૫,૩૩૮.૯,૩૨૬,૩૨૯.૯
ગોદરેજ કન્ઝ્યુમર૪૨૫,૪૩૨.૭,૪૨૨,૪૨૯.૭
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ૨૨૨,૨૨૭,૨૧૯.૬,૨૨૬
ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ૨૧૮૦,૨૨૧૧,૨૧૮૦,૨૧૯૯.૪
ગુજરાત અંબુજા સિમેન્ટ૧૨૭,૧૨૯.૪,૧૨૬.૧,૧૨૯.૨૫
હાવેલ ઇન્ડિયા૩૫૬.૭૫,૩૬૪.૮,૩૫૩.૨૫,૩૬૦.૫૫
એચસીએલ ટેકનો.૪૭૫,૪૭૫.૪,૪૬૨.૨૫,૪૭૩.૪૫
એચડીએફસી૬૮૦,૬૮૪.૩૫,૬૭૬.૬,૬૭૯.૮
એચડીએફસી બેન્ક૪૮૦,૪૮૬.૫,૪૭૬.૨૫,૪૮૨.૨
હિરો હોન્ડા૧૭૯૪.૯,૧૮૨૨,૧૭૭૨,૧૮૦૪.૪૫
હિન્દ લીવર કેમિકલ્સ૧૯૧.૩,૧૯૪.૫,૧૯૩,૦
હિન્દુસ્તાન પેટ્રો.૩૭૪.૨૫,૩૭૯.૮૫,૩૭૩.૦૫,૩૭૭.૩૫
હિન્દ. ઝીંક૧૩૮.૦૫,૧૩૮.૦૫,૧૩૪.૬૫,૧૩૫.૩
હિન્દ.કોપર૨૪૭.૫,૨૪૮,૨૩૬,૨૪૦.૧૫
હિન્દ. લિવર૩૨૩.૪,૩૨૩.૫,૩૧૭.૨૫,૩૨૨.૬
હિન્દાલ્કો૧૬૨.૫,૧૬૬.૪૫,૧૫૯.૩૫,૧૬૫.૭
હિન્દાલકોએસએલ૧૨૯.૬,૧૩૦,૧૨૭.૫,૧૨૭.૫
એચએમટી લિ.૫૫.૩૫,૫૫.૫,૫૪.૩,૫૪.૫
આઇ-ફ્લેક્ષ સોલ્યુ.૨૦૯૯,૨૧૪૫,૨૦૩૦,૨૧૨૮.૩૫
આઇબીપી લિ.૩૯૮,૪૦૦,૩૯૫.૯૫,૩૯૬.૪૫
આઇસીઆઇબીકે૮૩૦,૮૫૨,૮૨૯.૨,૮૫૦
આઇસીઆઇસીઆઇ બેન્ક૧૦૧૫,૧૦૧૫,૯૯૦.૬,૧૦૦૧.૮
આઇડીબીઆઇ બેન્ક૨૫.૨૫,૨૫.૯,૨૫.૩,૦
આઇડીબીઆઇ લિ.૧૨૪.૫,૧૨૪.૯૫,૧૨૨.૩૫,૧૨૪.૫૫
આઇએફસીએલ લિ.૪૪.૯૫,૪૬,૪૪.૫,૪૫.૯
આઇગેટ ગ્લોબ૩૭૫,૩૭૭.૫,૩૭૨,૩૭૩.૭
ઇન્ડિયા બુલ્સ૧૬૪,૧૭૨.૯,૧૬૨.૨,૧૭૧.૧૫
ઇન્ડિયન હોટેલ૭૫.૭,૭૮.૦૫,૭૪.૬૫,૭૭.૧૫
ઇન્ડિયન ઓઇલ૩૧૧.૨૫,૩૨૦,૩૧૦.૬૫,૩૧૮.૩
ઇન્ડિયન ઓવરસીઝ૧૩૩.૧,૧૩૪.૩,૧૩૦.૨૫,૧૩૩.૩૫
ઇન્ડો ગલ્ફ ફર્ટિલાઇઝર૨૪૭.૮૫,૨૭૪,૨૪૧,૨૬૦.૬૫
ઇન્દ્ર ગેસ૪૨૨,૪૨૭.૮,૪૧૬.૧,૪૧૮.૭૫
ઇન્ડસ ઇન્ડ બેન્ક૨૬૯.૬,૨૭૧.૫,૨૬૩.૧,૨૭૦.૩૫
ઇન્ફોસીસ ટેકનો.૨૭૩૯,૨૭૪૦,૨૭૧૦.૨,૨૭૩૨.૦૫
ઈન્ફ્રા ડેવ. ફાઈનાન્સ૧૨૪,૧૨૫.૧૫,૧૨૨.૧૫,૧૨૪.૦૫
આઈપીસીએલ૨૭૦,૨૭૧.૪,૨૬૮,૨૬૯.૨૫
ઇસ્પાત ઇન્ડસ્ટ્રીઝ૧૭.૪,૧૭.૯,૧૬.૯૫,૧૭.૭
આઇટીસી લિ.૨૦૪,૨૦૮,૨૦૨.૮,૨૦૬.૫૫
જૈન ઇરિગેશન૧૬૮.૨૫,૧૬૮.૫૫,૧૫૮.૫૫,૧૬૫.૮
જયપ્રકાશ એસોસિયેટ૬૩.૫૫,૬૫,૬૧.૮,૬૪.૪૫
જેટ એરવેઝ૪૩૧,૪૪૫,૪૨૭.૫,૪૩૪.૨
જિન્દાલ સો૧૪૦,૧૪૫,૧૩૯.૨,૧૪૩.૯
જિંદાલ સ્ટીલ૫૬૧,૫૬૮,૫૪૭.૫,૫૫૬.૨
જેપી હાઇડ્રોપાવર૪૧.૩,૪૧.૬,૪૦.૧૫,૪૧
જેએસડબ્લ્યુ એસએલ૬૬૦,૭૧૪.૭,૬૫૧.૭૫,૭૦૯.૬
કોચી રિફાઇનરી૧૬૫,૧૬૮.૮,૧૬૧.૧૫,૧૬૩.૪
કોટક બેંન્ક૪૫૫,૪૬૩.૪૫,૪૫૦.૨૫,૪૫૮.૭
લાર્સન એન્ડ ટુબ્રો૧૭૧૬,૧૭૧૭,૧૬૫૧.૨૫,૧૬૫૮.૭
એલઆઇસી હા.ફાયનાન્સ૨૦૪.૧,૨૧૦,૧૯૯.૭૫,૨૦૯.૧
લ્યુપિન લિ.૪૫૭,૪૫૮.૩૫,૪૫૨,૪૫૩.૫૫
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા૭૧૫.૯,૭૧૯.૪૫,૭૦૩,૭૧૦.૯
મનાપુરમ જી૫૬.૫,૫૬.૫,૫૪.૫૫,૫૫.૬૫
મેરિકો લિ.૧૬૧.૨,૧૬૩.૪,૧૫૯.૪૫,૧૫૯.૮૫
મારુતિ ઉદ્યોગ૧૨૦૦,૧૨૨૧.૮,૧૧૯૬.૬,૧૨૧૫.૧૫
મેકડોવેલ૯૭૯.૯,૯૯૬,૯૭૦,૯૮૩.૦૫
માઇકો લિ.૭૧૧૪.૯૫,૭૧૧૪.૯૫,૭૦૩૦.૨,૭૦૩૧.૮૫
એમએમટીસી૮૬૪.૯,૮૬૯.૬૫,૮૫૫,૮૬૧.૨
મધરસન સુમી ૨૩૧,૨૩૪,૨૨૭.૫,૨૨૮.૧
એમ્ફેસીસ બીએફએલ૪૪૭.૬,૪૫૨.૫,૪૪૨.૫,૪૪૭.૬૫
એમઆરપીએલ૭૫.૦૫,૭૬.૪,૭૪,૭૫.૯
નેશનલ એલ્યુ.૭૧,૭૪.૨,૭૦.૨૫,૭૩.૮૫
નેટ મિનરલ૨૩૯,૨૪૫,૨૩૫.૬,૨૪૩.૪
નેશનલ ફર્ટિલાઇઝર૮૯.૮૫,૯૧.૭,૮૮.૫,૯૦.૩૫
નેસ્લે લિ.૪૨૨૦.૧,૪૨૫૨,૪૨૧૦,૪૨૨૯.૮૫
નેવેલી લિગ્નાઇટ૯૫,૯૬.૪૫,૯૪,૯૫.૭૫
નિકોલસ પીરામલ૩૭૫,૩૮૫,૩૭૦.૩૫,૩૮૧.૭
એનટીપીસી લિ.૧૮૦.૯૫,૧૮૧.૯,૧૭૮.૨૫,૧૮૧.૪
ઓએનજીસી લિ.૨૭૩,૨૮૦.૩૫,૨૭૨,૨૭૬.૯૫
ઓપ્ટો સર્કિટ૨૯૧,૨૯૧.૯,૨૮૭.૦૫,૨૮૮.૭
ઓરિયેન્ટલ બેન્ક૩૪૧.૪,૩૪૧.૭,૩૩૫,૩૩૮
પેન્ટાલુન૩૨૨.૪,૩૨૫.૯૫,૩૦૭.૬,૩૨૦.૭૫
પટની કોમ્પ્યુટર૩૨૦,૩૨૦,૩૧૬,૩૧૮.૪૫
પેટ્રોનેટ એલએનજી૧૭૧.૪૫,૧૭૨,૧૬૮.૧૫,૧૭૧.૪
પીએબીએસએલ૧૦૮૮.૯૫,૧૦૯૫,૧૦૮૫,૧૦૯૩.૯૫
પંજાબ નેશનલ બેન્ક૧૦૮૩,૧૦૯૯,૧૦૬૯.૦૫,૧૦૯૨.૮
રાજેશ એકસપો.૧૦૮,૧૦૯.૫,૧૦૬.૮,૧૦૮.૭
રેનબેક્ષી લેબો.૫૫૯.૫,૫૬૩,૫૫૦.૭,૫૫૩.૮
રાષ્ટ્રિય કેમિકલ્સ૭૯,૮૧.૪,૭૮.૫,૮૦.૨
રિલા. કેપિટલ૫૩૦,૫૩૯.૨૫,૫૨૨.૮૫,૫૩૫.૯
રિલાયન્સ૮૨૭.૯૫,૮૩૬,૮૨૩.૫,૮૨૫.૧૫
રિલાયન્સ એનર્જી૫૩૯,૫૬૭.૮,૫૩૭.૨,૫૬૦.૫૫
શેષા ગોઆ લિ.૨૫૯.૫,૨૬૯.૮,૨૫૭.૨૫,૨૬૮
શિપીંગ કોર્પો.૧૦૦.૧,૧૦૧.૧૫,૯૯.૫,૧૦૦.૪
શ્રી સિમેન્ટ૧૭૩૯,૧૭૪૦,૧૭૨૦,૧૭૩૪.૩૫
શ્રીરામ ટ્રાન્સપોર્ટ૬૧૦.૦૫,૬૧૧.૨૫,૫૮૯.૦૫,૫૯૪.૩૫
સીમેન્સ લિ.૯૧૪,૯૧૭.૭,૯૦૭.૫૫,૯૧૧.૨૫
સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ૧૬૮.૧,૧૬૮.૧,૧૬૪.૫૫,૧૬૬.૧
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા૨૨૫૬.૯,૨૨૮૮.૫,૨૨૪૬.૨૫,૨૨૭૮.૯૫
સ્ટીલ એથોરીટી૧૧૮,૧૨૧.૭,૧૧૫.૭૫,૧૨૦.૯૫
સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ૧૫૨.૯૫,૧૫૩.૯,૧૫૦.૮,૧૫૩.૪
સન ફાર્મા. લિ.૫૨૫,૫૨૫,૫૧૪.૭,૫૧૫.૯૫
સુઝલોન એનર્જી૫૧.૬,૫૩.૨,૫૧.૧,૫૨.૮૫
સિન્ડીકેટ બેન્ક૧૧૬,૧૧૭.૪,૧૧૫,૧૧૬.૭
સાઇજેન્ટા લિ.૫૦૦,૫૨૯,૪૯૬,૫૨૩.૪
ટાટા કેમિકલ્સ૩૪૮,૩૫૨,૩૪૪.૨,૩૫૧.૨૫
ટાટા ઇન્ફો૮૦૦,૮૦૫,૭૯૫,૭૯૬.૮
ટાટા મોટર્સ૯૪૪.૯,૯૪૪.૯,૯૨૧.૧૫,૯૨૭.૭૫
ટાટા પાવર૧૨૬૮.૭,૧૨૯૦.૬,૧૨૬૪.૯૫,૧૨૮૬.૬
ટાટા સ્ટીલ૫૫૯.૭,૫૬૫,૫૫૬.૬,૫૬૩.૧
ટાટા ટી૧૦૩.૮,૧૦૮.૬,૧૦૨.૯,૧૦૭.૯
ટીસીએસ લિ.૧૧૨૨,૧૧૨૬.૪,૧૦૯૫.૩,૧૧૦૯.૬૫
થર્મેક્ષ લિ.૫૩૦,૫૩૬,૫૦૯,૫૧૫.૭૫
ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ૨૨૮,૨૨૮.૭,૨૨૨,૨૨૫.૩
યુકો બેન્ક૮૧,૮૧.૫૫,૭૯.૭૫,૮૧.૧
અલ્ટ્રાટેક કેમ.૧૦૨૧,૧૦૩૭,૧૦૨૦,૧૦૨૭.૮
યુનિયન બેન્ક૨૭૮,૨૭૯.૪,૨૭૩.૨,૨૭૭.૮૫
યુનિટેક લિ.૩૦.૮,૩૦.૯૫,૨૯.૮૫,૩૦.૮૫
યુના. બ્રુવરીઝ૪૭૪,૪૭૬,૪૬૮,૪૭૦.૯૫
યુનાઇટેડ ફોસ્ફરસ૧૬૦,૧૬૧.૯,૧૫૭.૦૫,૧૫૭.૯૫
યુટીઆઇ બેન્ક૧૩૨૮.૩,૧૩૨૮.૩,૧૨૯૩.૭૫,૧૩૦૮.૨
વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ૧૮૪,૧૮૮,૧૮૩.૮૫,૧૮૬.૯
વીડિયોકોન (ઇ).૮૫.૭૫,૮૮.૭૫,૮૪.૧,૮૫
વિદેશ સંચાર૨૧૦.૬,૨૧૬.૯,૨૦૬.૦૫,૨૧૬.૧૫
વિજયા બેન્ક૬૧,૬૨.૨૫,૫૯.૮,૬૧.૯
વિઝ્યુઅલ સોફ્ટ૭૫,૭૬.૨,૭૪.૨,૭૪.૭૫
વોલ્ટાસ લિ.૧૩૪.૨,૧૩૪.૨,૧૨૮.૫,૧૩૧.૭૫
વિપ્રો લિ.૩૮૧,૩૮૫.૫,૩૭૬.૨૫,૩૮૧
યસ બેન્ક૩૦૭.૫,૩૦૮,૩૦૧.૫,૩૦૭.૨
ઝી ટેલિ.૧૨૭,૧૨૭.૪૫,૧૨૫.૫૫,૧૨૬.૬

### Top gainers - BSE

| Gainers-A Group | Cur Close | chg% |
|---|---|---|
| LANCO INFRA | 18.65 | 9.38 |
| JSW STEEL | 709.60 | 5.24 |
| NATIONAL ALUM | 73.85 | 3.79 |
| TATAGLOBAL | 107.90 | 3.15 |
| INDIABULLS FIN | 171.15 | 2.95 |
| **Losers- A Group** | | |
| JUBL FOOD | 832.15 | 4.83 |
| L&T | 1658.70 | 4.33 |
| ENGINEERS INDIA | 269.90 | 4.26 |
| THERMAX | 515.75 | 3.89 |
| SINTEX INDS | 166.10 | 3.74 |

### Top 10 By Turnover -NSE

| | Volume (lakh shr) | Turnover (Rs Lakhs) |
|---|---|---|
| JSW STEEL | 1817593 | 12,595.00 |
| SBI | 1817593 | 12,595.00 |
| L&T | 406558 | 6,798.00 |
| BHARTI AIRTEL | 1310012 | 5,534.00 |
| ICICI BANK | 520158 | 5,203.00 |
| CROMPTON GREA | 2636272 | 4,287.00 |
| TATA STEEL | 687569 | 3,859.00 |
| RIL | 449426 | 3,724.00 |
| ADANI ENTER | 496443 | 3,284.00 |
| INDIAN HOTELS | 3985292 | 2,995.00 |

realpatidar.com

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



# ભજ્જી-યુવી શ્રેણીમાંથી આઉટ

**ઇજાગ્રસ્ત :** હરભજનને પેટના સ્નાયુ ખેંચાતાં તથા યુવરાજને આંગળીએ ફ્રેક્ચર થતાં બાકીની બંને ટેસ્ટ મેચ ગુમાવશે, વિરાટ કોહલી અને પ્રજ્ઞાન ઓઝા ટીમ સાથે જોડાશે

**પીટીઆઇ . નોટિંગહામ**

મધ્યમ હરોળના ડાબોડી બેટ્સમેન યુવરાજસિંઘ તથા ઓફ સ્પિનર હરભજનસિંઘ ઈજાના કારણે ઇંગ્લેન્ડ સામે રમાતી વર્તમાન ટેસ્ટ શ્રેણીની બાકીની મેચોમાંથી આઉટ થઇ ગયા છે. આ બંને ખેલાડીઓના સ્થાને બીસીસીઆઇએ વિરાટ કોહલી અને ડાબોડી સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને ટીમ સાથે જોડાવાનો આદેશ આપ્યો છે. ટ્રેન્ટબ્રિજ ખાતેની બીજી ટેસ્ટ દરમિયાન હરભજનના પેટના સ્નાયુ ખેંચાઇ ગયા છે જ્યારે યુવરાજને બ્રેસનાનનો એક શોર્ટ પિચ બોલ ડાબા હાથની આંગળીએ વાગતાં તેને ફ્રેક્ચર થયું છે જેના કારણે બંને ખેલાડીઓ બાકીની શ્રેણીમાંથી બહાર થઇ ગયા છે. યુવરાજની આંગળીએ સોજો આવ્યો છે અને તે આંગળીને હલાવી પણ શકતો નથી. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમમાં સ્થાન નિશ્ચિત કરવા માટે વધુ એક તક આપવામાં આવી છે.

તબીબોએ જણાવ્યું છે કે હરભજનના પેટના નીચલા ભાગના સ્નાયુઓ જબરજસ્ત રીતે ખેંચાઇ ગયા છે. હરભજનની ગેરહાજરી એક રીતે ભારત માટે મોટા ફટકા સમાન છે. ભજ્જી ભલે પ્રથમ બે ટેસ્ટમાં પોતાની ક્ષમતા મુજબનો દેખાવ કરી ના શક્યો હોય પરંતુ એક મેચવિનર બોલરના ઇજાગ્રસ્ત થવાથી ટીમને મોટી ખોટ પડશે. હરભજને જણાવ્યું હતું કે હું ત્રીજી ટેસ્ટમાં રમી શકું તેમ નથી અને મને સ્વસ્થ થવામાં સમય લાગશે. ઓફ સ્પિનરે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ દરમિયાન માત્ર ૧૩.૪ ઓવર જ નાખી હતી અને તે દુઃખાવાના કારણે પેવેલિયન પરત ફર્યો હતો.

હરભજનની ગેરહાજરીમાં લેગ સ્પિનર અમિત મિશ્રાને તક મળે તેવી પૂરી સંભાવના છે. હરભજને હવે તેની ૧૦૦મી ટેસ્ટ માટે ચાલુ વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. ઝહિર ખાન ફિટ થઇ ગયો હોવા છતાં ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડવાનું જોખમ ખેડતા પહેલાં બે દિવસની પ્રેક્ટિસ મેચમાં તેની ફિટનેસ ચકાસશે. જો ઝહિર ફિટ હશે તો ભારત ત્રીજી ટેસ્ટમાં ચાર ઝડપી બોલર્સ સાથે રમી શકે છે. જો ઝહિરને નહીં રમાડવામાં આવે તો જ મિશ્રાનો અંતિમ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવશે તેવા સંકેત મળ્યા છે.

## એજબેસ્ટન ટેસ્ટની ટિકિટોની જબરજસ્ત માગ વધી

**લંડન :** ભારતીય ટીમ સામે રમાઇ રહેલી ચાર મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ ૨-૦ની સરસાઇ મેળવી ચૂક્યું છે અને સ્થાનિક પ્રેક્ષકોના ઉત્સાહમાં વધારો થયો છે. એજબેસ્ટન ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ માટેની ટિકિટોનું વેચાણ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ટિકિટોની માગણીમાં જબરજસ્ત વધારો થયો છે. એજબેસ્ટન મેદાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે લોર્ડ્ઝ અને ટ્રેન્ટબ્રિજમાં ઇંગ્લિશ ટીમના વિજયના કારણે સ્થાનિક પ્રેક્ષકો મોટી સંખ્યામાં હાજર રહેવા માગે છે. આ શ્રેણીમાં જો ઇંગ્લેન્ડ તેની ૨-૦ની સરસાઇ જાળવી રાખશે તો બાકીની મેચોની ટિકિટોના કાળાંબજાર થાય તેમાં કોઇ શંકા નથી. નોંધનીય છે કે લોર્ડ્ઝ અને ટ્રેન્ટબ્રિજના અંતિમ દિવસે વિક્રમી સંખ્યામાં પ્રેક્ષકોએ સ્ટેડિયમમાં હાજરી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આટલી બધી ટિકિટોનું વેચાણ એશિઝ શ્રેણી દરમિયાન થયું હતું.

## સ્પોર્ટ્સ બ્રીફ

### ઝિમ્બાબ્વે છ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમશે

**હરારે:** ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાન માટે એકબીજા સામે બાથ ભીડી રહ્યા છે ત્યારે વિશ્વની બે નબળી ટીમો ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ ગુરુવારથી પોઇન્ટ ટેબલમાં છેલ્લા બે સ્થાનમાં એકબીજા કરતાં પોતે વધારે સારા છે તે સાબિત કરવા માટે મુકાબલો કરશે. ઝિમ્બાબ્વે લગભગ છ વર્ષ બાદ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમશે. ઝિમ્બાબ્વેએ છેલ્લે ભારત સામે ૨૦૦૫ના સપ્ટેમ્બરમાં પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી. ત્યારબાદ તે પોતાના રમતના સ્તરને સુધારવા માટે ટેસ્ટ ક્રિકેટથી કેટલાક સમય માટે દૂર થઇ ગયું હતું. બાંગ્લાદેશ પણ એક વર્ષ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યું છે. બાંગ્લાદેશે પોતાની છેલ્લી ટેસ્ટ ગયા વર્ષના જૂન મહિનામાં ઇંગ્લેન્ડ સામે રમી હતી. બંને ટીમો લગભગ એક સરખી હોવાના કારણે મુકાબલો રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે. ઝિમ્બાબ્વે હવે પોતે ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર છે તે સાબિત કરવા માટે રમશે જ્યારે બાંગ્લાદેશ પોતે પરિપક્વ બની ગયું છે પુરવાર કરવા માટે મેદાનમાં ઊતરશે.

realpatidar.com

### સોમદેવનો બીજા રાઉન્ડમાં પ્રવેશ

**વોશિંગ્ટન :** ભારતના સોમદેવ દેવબર્મને ડેનિસ ગ્રેમિલિયર્સ સામે આસાન વિજય મેળવીને એટીપી લેગ મેસન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો વિશ્વના ૨૫મા ક્રમાંકિત માર્કોસ બઘડાટિસ સામે થશે. સોમદેવે પ્રથમ રાઉન્ડમાં ડેનિસને ૬-૨, ૬-૩ના સ્કોરથી પરાજય આપ્યો હતો.

### રિધમ પ્રાપ્ત કરવી મહત્ત્વપૂર્ણ : સાઇના

**નવી દિલ્હી :** ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ ઘૂંટણની ઇજામાંથી મુક્ત થઇ ચૂકી છે અને તેણે જણાવ્યું છે કે આગામી મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલાં રિધમ મેળવવી મારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ૨૧ વર્ષીય ખેલાડીએ ઇન્ડોનેશિયન સ્પર્ધા દરમિયાન આરામ કર્યો હતો.

### ન્યૂમેરિક્સ

**169** રનના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે ભારતના યુવરાજસિંઘે ૩૫ ટેસ્ટમાં ત્રણ સદી વડે ૧૭૦૯ રન બનાવ્યા છે.

### ટિન્ટુ લુકાએ કાર્લસ્ટેડમાં ગોલ્ડ જીત્યો

**નવી દિલ્હી:** ભારતની ૮૦૦ મીટરની સ્ટાર સ્પ્રિન્ટર ટિન્ટુ લુકાએ સ્વિડનમાં કાર્લસ્ટેડ ગ્રાન્ડ પ્રિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાઉથ કોરિયામાં ચાલુ મહિને યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીમાં વ્યસ્ત બનેલી લુકાએ આ પ્રકારની સીરિઝમાં પ્રથમ વખત ગોલ્ડમેડલ જીત્યો છે. ગયા મહિને જાપાનના કોબે ખાતે યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય દોડવીરે બે મિનિટ અને ૦૨.૫૮ સેકન્ડનો સમય પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે આ સમય તેના નેશનલ રેકોર્ડ કરતા ૫૯.૧૭ સેકન્ડથી વધારે છે. લિથાનિયાની ઇઝેઝ બાલસિયાન્તીએ બે મિનિટ અને ૦૨.૭૨ સેકન્ડ સાથે સિલ્વર તથા કેનેડાની મેલિસા બિશપે બે મિનિટ અને ૦૨.૮૦ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટિન્ટુએ ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન બે મિનિટ અને ૦૧.૨૫ સેકન્ડના સમય સાથે અગાઉથી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી લીધું હતું.

### ચેમ્પિયન

તસવીર એએફપી

**ગોલ્ડમેડલ :** કેલિફોર્નિયા ખાતે યોજાયેલી યુએસ નેશનલ સ્વિમિંગ સ્પર્ધામાં એલિઝાબેથ બાઇસિલ તથા કેથરિન હોફ ૨૦૦ મીટર વ્યક્તિગત મિડલેમાં ચેમ્પિયન બની હતી.

### બીજી ટેસ્ટમાં તકનો લાભ ઉઠાવ્યો : બ્રેસનાન

**નોટિંગહામ :** ભારત સામેની બીજી ટેસ્ટમાં ઇજાગ્રસ્ત ક્રિસ ટ્રેમ્લેટના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઇંગ્લેન્ડના ઝડપી બોલર ટિમ બ્રેસનાને આશા વ્યક્ત કરી હતી કે ત્રીજી ટેસ્ટમાં તેને રમાડવામાં આવશે. બ્રેસનાને જણાવ્યું હતું કે મેં બીજી ટેસ્ટમાં રમવાની મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો છે અને હું શાનદાર પ્રદર્શન કરી શકું છું તે પુરવાર પણ કર્યું છે. ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં મને રમાડવો કે નહીં તેનો મદાર કોચ, સુકાની સ્ટ્રાઉસ તથા ટીમ મેનેજમેન્ટ પર રહે છે. મારા મતે ટ્રેમ્લેટના ફિટ થયા બાદ મેનેજમેન્ટ માટે અંતિમ ઇલેવનની પસંદગી કરવી અત્યંત મુશ્કેલ બનશે. મને આશા છે કે મને નિરાશા નહીં સાંપડે. દસમી ઓગસ્ટથી રમાનારી ત્રીજી ટેસ્ટ માટે મારી પસંદગી કરવામાં આવશે તેવી મને આશા છે. અમારી પાસે ઘણા સારા ઝડપી બોલર છે તે ઇંગ્લેન્ડના ક્રિકેટ માટે સારો સંકેત છે.

# ધોનીની ફરિયાદ અંગે બોર્ડ ચૂપ

**પીટીઆઇ . મુંબઇ**

ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનની આકરી ટીકા થઇ રહી છે અને આ માટે ભરચક કાર્યક્રમને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે પરંતુ બીસીસીઆઇએ આ અંગે કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરવાનો ઇનકાર કરી દીધો છે અને પૂરા પ્રકરણ પર ચૂપકીદી સાધી છે. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં નાલેશીભર્યો પરાજય મળ્યા બાદ સુકાની ધોનીએ પણ અપૂરતો આરામ તથા ભરચક કાર્યક્રમની ફરિયાદ કરી હતી. બીસીસીઆઇના પ્રમુખ શશાંક મનોહરે જણાવ્યું હતું કે હું મીડિયાની ટીકાઓ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતો નથી. હું આ બાબતે કોઇ ચર્ચા કરવા પણ માગતો નથી. નોંધનીય છે કે ભરચક કાર્યક્રમ અંગે ટીકાઓ કરવામાં ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીનો પણ સમાવેશ થાય છે.

ગાંગુલીએ જણાવ્યું હતું કે મારા મતે તમે જ્યારે વિદેશનો કોઇ પ્રવાસ ખેડો છો ત્યારે પૂરતી મેચપ્રેક્ટિસ નહીં હોવાના કારણે પરાજયનો સામનો કરવો પડે છે. ભારતે ઓછામાં ઓછી બે પ્રેક્ટિસ મેચ રમવાની જરૂર છે. ટ્રેન્ટબ્રિજ ખાતે પરાજય મળ્યા બાદ ધોની પણ કાર્યક્રમથી નારાજ હતો અને તેણે જણાવ્યું હતું કે ટીમે સતત સાત ટેસ્ટ મેચ રમી છે જેના કારણે ખેલાડીઓને આરામ મળ્યો નથી.

શશાંક મનોહર

# ઇંગ્લેન્ડનો લક્ષ્યાંક નંબર વન બનવાનો છે : બ્રોડ

**એજન્સી . નોટિંગહામ**

ભારત સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી ૧૪ વિકેટ ઝડપવા ઉપરાંત ૧૮૨ રન બનાવી ચૂકેલા ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બ્રોડે જણાવ્યું હતું કે અમારી ટીમ વિશ્વની પ્રથમ ક્રમાંકિત ટીમ બનવા માટે કટિબદ્ધ છે. બીજી ટેસ્ટ દરમિયાન મેં સતત આક્રમક રહેવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે મને બોલ તથા બેટથી સફળતા મળી હતી. જ્યારે તમે કેટલાક સારા શોટ્સ રમો છો ત્યારે હરીફ ટીમ તેના ગેમપ્લાનમાં ભૂલ કરી બેસે છે.

જ્યારે મને બીજી ટેસ્ટમાં નવમા ક્રમે બેટિંગમાં જવાનું કહેવાયું ત્યારે મેં મજાક કરી હતી કે પ્રથમ ટેસ્ટમાં અણનમ ૭૪ રન બનાવ્યા બાદ હજુ પણ મારે આ ક્રમે જ બેટિંગમાં જવાનું છે પરંતુ ટિમ બ્રેસનાને ૯૦ રન બનાવીને આઠમા ક્રમે તેને બેટિંગમાં મોકલવાના નિર્ણયને સાચો સાબિત કરી આપ્યો હતો.

## સચિન હોત તો વિવાદને મોટું સ્વરૂપ મળ્યું હોત : ફ્લાવર

**પીટીઆઇ . લંડન**

ઇંગ્લેન્ડના કોચ એન્ડી ફ્લાવરે ભારત સામેની બીજી ટેસ્ટમાં ઇયાન બેલના વિવાદાસ્પદ રીતે રનઆઉટનો બચાવ કરીને જણાવ્યું હતું કે જો બેલના સ્થાને સચિન તેંડુલકર હોત તો આ આંતરરાષ્ટ્રીય ઘટના બની ગઇ હોત. નોંધનીય છે કે બેલના આઉટ થયા બાદ ટી-ટાઇમમાં ફ્લાવર તથા સુકાની સ્ટ્રાઉસ બંને ભારતના ડ્રેસિંગરૂમમાં જઇને ધોનીને અપીલ પાછી ખેંચવાનો આગ્રહ કર્યો હતો. આ સંદર્ભમાં ફ્લાવરે જણાવ્યું હતું કે ધોનીને આગ્રહ કરવાનો ઇંગ્લેન્ડ પાસે તમામ અધિકાર હતો. મને નથી લાગતું કે અમે અમારા ડ્રેસિંગરૂમમાં બેસીને જે બન્યું હતું તે નિહાળીને ચૂપચાપ બેસી રહીએ. અમારું માનવું છે કે ભારતીય ટીમનો સંપર્ક સાધવાનો આ મુખ્ય વિકલ્પ હતો. અમને લાગ્યુ હતું કે બેલ રન માટે દોડ્યો નહોતો તેથી અમે ભારતીય ટીમને તેના નિર્ણય પર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.

### પૂર્વતૈયારી

તસવીર એએફપી

**પ્રેક્ટિસ :** શ્રીલંકાના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયન ટીમના શેન વોટ્સને કોલંબોમાં સાથી ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી હતી.

# સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સગવડના નામે મીંડુ

**રિપ્પલ ક્રિસ્ટી . અમદાવાદ**

વર્ષના અંતે યોજાનારા ખેલ મહાકુંભની પૂર્વતૈયારીરૂપે અમદાવાદમાં વિવિધ સ્તરે શાળાકીય રમતગમતોનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને આ કારણથી ખોખરા વિસ્તારમાં લગભગ છ કરોડની જંગી રકમના ખર્ચે તૈયાર કરવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધમધમી ઊઠ્યું છે પરંતુ રમતવીરોને મળતી સગવડોના નામે કોમ્પ્લેક્સમાં મીંડુ છે. ગ્રાસરૂટ લેવલે જ આ પ્રકારની સ્થિતિ હોય તો ગમે તેટલું કરો પરંતુ ગુજરાતના રમતગમતનું સ્તર ઉપર નહીં આવે તે ચોક્કસ છે. છેલ્લા બે સપ્તાહથી અલગ અલગ સ્પર્ધાઓ યોજાઇ રહી છે પરંતુ એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો, લોંગ જમ્પના મેદાન તૈયાર નથી. મેદાનમાં ચારેય તરફ મોટું ઘાસ ઊગી નીકળ્યું છે. પ્રશ્ન એ છે કે ગ્રાઉન્ડને સારી સ્થિતિમાં રાખવાનું કામ કોનું છે ? કોમ્પ્લેક્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે શાળાકીય રમતો યોજાતી હોવાના કારણે ગ્રાઉન્ડને સારી કન્ડિશનમાં રાખવાનું કામ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસરનું છે કારણ કે તેમને સીધી ગ્રાન્ટ આપવામાં આવે છે. ચર્ચાનો વિષય એ છે કે શાળાકીય ગેમ્સ માત્ર બે મહિના રમાય છે તો બાકીના દસ મહિનાની જવાબદારી કોની?

શાળાની રમતગમતો દરમિયાન મોટી સંખ્યામાં બાળકો રમવા આવે છે પરંતુ તેમને પીવાના પાણી માટે ફાંફાં મારવા પડે છે. એક સુરક્ષા અધિકારી પણ બાળકોને ટાંકીનું પાણી નહીં પીવાની તાકીદ કરી રહ્યા છે કારણ કે લાંબા સમયથી મોટી પાણીની ટાંકી સાફ થઇ નથી.

લગભગ છેલ્લાં એક વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જો તમારે ઇવનિંગ વોક કરવું હોય કે બાસ્કેટ બોલ રમવું હોય તો તમારે ચોક્કસ પ્રકારની ફી ચૂકવવી પડે છે. ખોખરા તથા હાટકેશ્વરનો વિસ્તાર મધ્યમવર્ગનો છે અને ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓ આ પ્રકારની ફી ભરી શકતા નથી. સ્થાનિક ખેલાડીઓનું માનવું છે કે અત્યાર સુધી કોઇ ફી લેવામાં આવતી નહોતી અને અચાનક હવે શા માટે લેવામાં આવે છે તે સમજાતું નથી. સરકાર જ્યારે રમતગમતોને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે તેમણે આ પ્રકારની ફી નાબૂદ કરવી જોઇએ. નોંધનીય છે કે ગયા વર્ષે લગભગ એક લાખ રૂપિયા કરતાં વધારે ફી એકત્ર

### રમતવીરોને પડતી હાલાકી

- ગ્રાઉન્ડને સારી પરિસ્થિતિમાં રાખવાની જવાબદારી કોની ?
- ખો-ખોના ગ્રાઉન્ડમાં નકરાં કાંકરા તથા ખાડાખરબચડાં છે.
- મેદાનની વચ્ચે આવેલી પાણીની નીક ગંદકીથી ખદબદે છે.
- એથ્લેટિક ટ્રેક ક્યાં છે તેનો કોઇને ખ્યાલ જ આવતો નથી.
- લોંગ જમ્પ માટેની જગ્યા માત્ર ખાડા સિવાય કશું નથી.

### માહિતી માટે કોઇ અધિકારી હાજર હોતો નથી

**છેલ્લાં** વર્ષમાં ગુજરાતે કુલ કેટલા મેડલ મેળવ્યા, હિલશિલ્ડ ટૂર્નામેન્ટ સહિત વિવિધ બાબતની માહિતી સિનિયર અધિકારીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હાજરી નહીં હોવાના કારણે મળી શકતી નથી. ઘણા ખેલાડીઓને ધક્કો ખાઇને નિરાશા સાથે પરત ફરવું પડ્યું હોવાના પણ બનાવ જોવા મળ્યા છે. ગ્રાઉન્ડની જવાબદારી કોની તે અંગે પણ તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો.

### એસએજીની વેબસાઇટ અપડેટ નથી

**ગુજરાતમાં** થઇ રહેલા વિકાસ અંગે શરૂ કરવામાં આવેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઇટ છેલ્લે ૨૦૦૮-૦૯માં અપડેટ થઇ હતી ત્યાર બાદ તેના પર કોઇ નવી માહિતી નથી. ખેલ મહાકુંભની પણ જરૂરી માહિતી તેના પર મૂકવામાં આવી નથી. માત્ર નવા ટેન્ડરો અપડેટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરની કંપની દ્વારા ૨૦૦૭-૦૮માં શરૂ કરવામાં આવેલો ઓડિટ રિપોર્ટ હજુ સુધી પૂરો થયો નથી.

# ધોનીની ક્ષમતા પર પ્રશ્નાર્થ ના થાય : અકરમ

**અભિપ્રાય** બે પરાજયથી ધોનીને નિષ્ફળ સુકાની ગણી શકાય નહીં, વિકેટકીપિંગ પર વધારે ધ્યાન આપવું જોઇએ

**પીટીઆઇ . લંડન**

પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની તથા ઝડપી બોલર વસિમ અકરમનું માનવું છે કે ઇંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ મેચમાં મળેલા પરાજય બાદ ભારતીય ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીની ક્ષમતા પર પ્રશ્નાર્થ કરવો ખોટી બાબત છે. અકરમે યાદ અપાવ્યું હતું કે ધોનીએ પોતાના નેતૃત્વમાં ભારતને ટી૨૦ તથા વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું છે અને ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચાડ્યું છે.




અકરમે જણાવ્યું હતું કે માત્ર એક કે બે પરાજયના આધારે તમે ધોનીને નિષ્ફળ સુકાની તરીકે ગણી શકો નહીં. તેણે ભારત માટે વર્લ્ડ કપ જીતવા ઉપરાંત મોટા ભાગના દેશમાં સારો દેખાવ કર્યો છે. ધોનીએ માત્ર એક જ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે અને તે છે તેની વિકેટકીપિંગ. મહેન્દ્રસિંહ ધોની સુકાની તરીકે નિષ્ફળ રહ્યો છે તે આપણે કહી શકીએ તેમ નથી. મારા મતે તેના માટે હવે સાવચેત થવાનો સમય પાકી ગયો છે.

ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલી સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ ધોનીએ બીજી ટેસ્ટમાં પ્રથમ બોલિંગ કરવાના કરેલા નિર્ણયની ટીકા કરી હતી પરંતુ અકરમનો અભિપ્રાય અલગ છે. અકરમે જણાવ્યું હતું કે પ્રથમ દિવસની સવારે પિચ પર ઘણું ઘાસ હતું અને ધોનીએ પોતાના સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. મારા મતે પ્રથમ બોલિંગ કરવાનો તેનો નિર્ણય સાચો હતો. પ્રત્યેકનો અભિપ્રાય અલગ હોઇ શકે છે પરંતુ બોલર હોવાના નાતે મારું માનવું છે કે મેં ટ્રેન્ટબ્રિજની પિચ પર પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત. સ્ટુઅર્ટ બ્રોડ તથા ગ્રીમ સ્વાન વચ્ચે નવમી વિકેટે મોટી ભાગીદારી ના નોંધાઇ હોત તો મેચ સુકાની ધોનીના ગેમપ્લાન તરીકે આગળ વધી રહી હતી.

સેહવાગના પુનરાગમનથી ભારતની બેટિંગ વધુ મજબૂત બનશે તેમાં કોઇ શંકા નથી.

Digitially Archived by: www.realpatidar.com/library

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



# ગોધરા તપાસપંચે રાજ્યના પાંચ ઓફિસરને સમન્સ પાઠવ્યા

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

ગોધરાકાંડ બાદ હિન્દુઓને પોતાનો ગુસ્સો ઉતારવા દેવા માટે મુખ્યમંત્રીએ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ની બેઠકમાં આપેલી સૂચનાઓનો ઘટસ્ફોટ કરનાર આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના આક્ષેપોના મામલે નાણાવટી તપાસપંચે રાજ્ય સરકારના ઉચ્ચકક્ષાના પાંચ અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. ૯, ૧૮ અને ૨૯મી ઓગસ્ટના રોજ આ અધિકારીઓને જુબાની માટે હાજર રહેવા પંચે જણાવ્યું છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને પંચે સમન્સ પાઠવતાં અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતા કમિશન દ્વારા આજે રાજ્ય સરકારના પાંચ ઉચ્ચ અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે, જેમાં ગોધરાકાંડ સમયે ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ની મુખ્યમંત્રીની બેઠકમાં હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓમાં અશોક નારાયણ , કે. નિત્યાનંદન (તત્કાલીન હોમ સેક્રેટરી), કે. ચક્રવર્તી, પી.સી. પાંડે (તત્કાલીન અમદાવાદ શહેર પોલીસ કમિશનર) અને અનિલ મુકીમ (પ્રિન્સિપાલ સેક્રેટરી મુખ્યમંત્રી કાર્યાલય)નો સમાવેશ થાય છે. આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા તાજેતરમાં નાણાવટી કમિશન સમક્ષ આપેલી જુબાનીમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, આ અધિકારીઓ જે બેઠકમાં હાજર હતા તે બેઠકમાં જ મુખ્યમંત્રીએ એવો આદેશ આપ્યો હતો કે હિન્દુઓને તેનો ગુસ્સો ઠાલવવા દો. જે બાદ નાણાવટી તપાસપંચે આ અધિકારીઓને બોલાવતાં આ મામલે પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.

### પંચે આ અધિકારીઓની ઊલટતપાસ કરવાની પણ પરવાનગી આપવી જોઈએ: મુકુલ સિંહા

જનસંઘર્ષ મંચના એડ્વોકેટ મુકુલ સિંહાએ આ મામલે જણાવ્યું હતું કે, કે. ચક્રવર્તી, અશોક નારાયણ અને પી.સી. પાંડે અગાઉ નાણાવટી પંચ સમક્ષ પોતાની જુબાની આપી ચૂક્યા છે. જો તેઓ પંચ સમક્ષ કોઈ પણ નિવેદન આપે તો તેમની પુનઃ ઊલટતપાસનો તેમને અધિકાર મળવો જોઈએ. પંચની આ ક્રિયા રિકોલ ઓફ વિટનેસ છે, ત્યારે તપાસપંચની સેક્શન-૫ પ્રમાણે તેમને ઊલટ તપાસનો હક્ક મળવો જોઈએ. આ અંગે તેઓ પંચ સમક્ષ માગ કરશે.

# સૂરજબારીની ખાડીમાં તપાસ કરવા હાઈકોર્ટનો આદેશ

પાવર ગ્રીડ કોર્પોરેશન અને માછીમારોના એડ્વોકેટ્સને ત્રણ મહિનામાં અહેવાલ આપવા કોર્ટની તાકીદ

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

કચ્છમાં સૂરજબારીની ખાડીમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા વીજળીના થાંભલા ઊભા કરવા માટે મોઝેક ખાડીમાં નાખી હોવાથી માછીમારીમાં અનહદ તકલીફ પડતી હોવાની અને અસંખ્ય જળચરોના જીવ ખતરામાં મુકાયા હોવાના મુદ્દે હાઈકોર્ટમાં માછીમારોએ જાહેરહિતની અરજી કરી છે. જેમાં મુખ્ય ન્યાયમૂર્તિ મુખોપાધ્યા અને પારડીવાલાની ખંડપીઠે બુધવારે માછીમારો અને પાવરગ્રીડ કોર્પોરેશનના એડ્વોકેટ્સને સંયુક્તપણે સ્થળ તપાસ કરી કોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સૂરજબારીની ખાડીમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા વીજળીના થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જો કે આ થાંભલા ઊભા કરવા પ્લેટફોર્મ બનાવવા કંપની દ્વારા હજારો ટન મોઝેક ખાડીમાં નખાઈ છે, જેથી માછીમારો પાંચ-છ ફૂટ પાણીમાં પણ માછલી પકડવાનું કામ કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, કંપની દ્વારા ૧૫ ફૂટના થાંભલા નાખવા ખાડીમાં પાળ બનાવી છે, જેથી માછીમારીનું કામ હાલ સદંતર મૃત અવસ્થામાં જતું રહ્યું છે.

જાહેરહિતની અરજીમાં અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટ દ્વારા ખાડીને ખુલ્લી કરી દેવાનો આદેશ અપાયો હતો. ત્યારે કોર્પોરેશને જણાવ્યું હતું કે, ખાડીને ખુલ્લી કરી દેવાઈ છે. તે ઉપરાંત વીજ થાંભલા માટે સી.આર.ઝેડ.ની પરવાનગી હાઈકોર્ટમાંથી લેવાઈ છે, પરંતુ માછીમારોના એડ્વોકેટ આનંદ યાજ્ઞિક મારફતે કરાયેલી રજૂઆત મુજબ ખાડીને ખુલ્લી કરાઈ નથી.

# ઉદ્યોગમાં મહારાષ્ટ્ર નંબર વન પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત

મારા પ્રવાસમાં રાજકીય ઉદ્દેશ નથી : ઠાકરે , વિશ્વમાંથી લોકો આવી શકે છે : મોદી

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાના વિરોધીદળ અને હિન્દીભાષીઓને હાંકી કાઢવાની હાકલ કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમોની ગુજરાતની મુલાકાતથી બંને રાજ્યોમાં રાજકીય હલચલ પેદા થઈ છે. તેવા સંજોગોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અને તેમને 'સ્ટેટ ગેસ્ટ' જેવો દરજ્જો આપવાની ઘટનાએ સચિવાલયમાં ખળભળાટ સર્જ્યો છે. રાજ ઠાકરેએ ગુજરાતમાં આવીને એવું કહ્યું છે કે, 'ઔદ્યોગિક મૂડીરોકાણમાં મહારાષ્ટ્ર આજે પણ નંબર-વન છે, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ગુજરાત અગ્રેસર હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે, તેથી વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેવા આવ્યો છું.'

ગુજરાતની નવ દિવસની મુલાકાતે આવેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સુપ્રીમોએ કહ્યું હતું કે, દેશના ટોચના ઉદ્યોગપતિ રતન તાતા પશ્ચિમ બંગાળથી તેમનો નેનો પ્રોજેક્ટ ખસેડીને ગુજરાત આવ્યા તે જોઈને મને કુતૂહલ થયું હતું અને મેં ગુજરાતની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. ગુજરાતના વિકાસ માટે મેં ઘણું સાંભળ્યું છે. મરાઠીભાષી એવા આ નેતાએ ગુજરાતમાં હિન્દીમાં વાતચીત કરી હતી. અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાત પછી તેઓ ગાંધીનગર આવ્યા હતા. રાજ ઠાકરેએ આખો દિવસ ગુજરાત સરકારના વિવિધ વિભાગોનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને જાતમુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાંથી આવેલા ૪૫ સભ્યોના પ્રતિનિધિમંડળની વચ્ચે મુખ્યમંત્રીએ રાજ ઠાકરેનું સ્વાગત કર્યું હતું. સામે રાજ ઠાકરેએ મોદીને શાલ ઓઢાળી શિવાજીની પ્રતિકૃતિ સ્મૃતિભેટ આપી અભિવાદન કર્યું હતું. તેમણે મોદીની હાજરીમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, હું કોઈ રાજકીય ઉદ્દેશથી અહીં આવ્યો નથી.

પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત જેવા લોકતાંત્રિક દેશમાં રાજનીતિથી ઉપર ઊઠીને રાષ્ટ્રનીતિને કેન્દ્રમાં રાખી આપણે સકારાત્મક અભિગમ અપનાવવાની જરૂર છે. દેશમાં વિકાસની જે ઉત્તમ સિદ્ધિઓ અને કાર્યપદ્ધતિ હોય તેનો રાજકીય દૃષ્ટિએ નહીં પણ દેશના હિતમાં અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતનો વિકાસ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની અલગ રાજ્ય તરીકેની યાત્રા શરૂ થઈ ત્યારથી ગુજરાતે જે પ્રગતિ કરી છે તે જોવા માટે અલગ રાજકીય વિચારધારા ધરાવતા પક્ષના નેતા તેમનું પ્રતિનિધિમંડળ લઈને આવે તેમાં કોઈ રાજકીય ઉદ્દેશ નથી.

મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના વિકાસની સિદ્ધિઓનો અભ્યાસ કરવા યુનિસેફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિત દુનિયાના દેશોના પ્રતિનિધિઓ ગુજરાત આવે છે. વિવિધ રાજ્યોના અધિકારીઓ પણ આવે છે. રાજ ઠાકરેએ ગયા એપ્રિલ મહિનામાં ગુજરાત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મેં તેમને ગુજરાતના અનુકૂળ પ્રવાસ માટે જણાવ્યું હતું. હિન્દુસ્તાન કે દુનિયામાંથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ગુજરાતનો વિકાસ જાણવા આવી શકે છે.

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે વિકાસ થયો છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત જે વિકાસ કરી રહ્યું છે તે જોવાના ઉદ્દેશ સાથે હું આવ્યો છું.

### આ મુલાકાતને રાજકીય દૃષ્ટિથી ન જોવી જોઈએ

સરકિટ હાઉસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજ ઠાકરેની મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી જોવી જોઈએ નહીં, કારણ કે તેઓ ગુજરાતના વિકાસને જોવા માટે આવ્યા છે. અમારી સરકારના અધિકારીઓ સાથે તેમણે પ્રેઝન્ટેશન જોયું છે. તેઓ ગુજરાતમાં નવ દિવસ સુધી રહીને વિવિધ પ્રોજેક્ટ નિહાળવાના છે. મહારાષ્ટ્રિયન પ્રતિનિધિમંડળ સાથેની ચર્ચામાં મોદીને એવું પૂછવામાં આવ્યું કે અન્ય રાજ્યમાંથી ગુજરાત શું બોધપાઠ લે છે, ત્યારે તેમણે કહ્યું કે અમે વહીવટી તંત્રની વાર્ષિક ચિંતનશિબિર કરીએ છીએ ત્યારે અન્ય રાજ્યોની સારી બાબતોની ચર્ચા થતી હોય છે.

### મારો કોઈ પોલિટિકલ એજન્ડા નથી :

ગાંધીઆશ્રમની મુલાકાત પછી રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર આજે ભલે ઉદ્યોગ સેક્ટરમાં નંબર-વન હોય, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી અને રસ્તામાં નબળો દેખાવ કરે છે. ભ્રષ્ટાચારની માત્રા પણ વધારે જોવા મળે છે. રતન તાતાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં ત્યારે મને લાગ્યું કે ગુજરાતની મુલાકાત લેવી જોઈએ. ખરેખર મને મોદી માટે સન્માન છે. પત્રકારોના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, મારો કોઈ પોલિટિકલ એજન્ડા નથી. હું માત્ર ગુજરાતનો વિકાસ જોવા આવ્યો છું.

# અમદાવાદમાં પ્રેમી યુગલે દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

ધોળકાનો યુવક અને બાપુનગરની યુવતી વચ્ચે કઈ રીતે સંબંધ બંધાયો તે રહસ્ય

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

ઓઢવ ફાયર સ્ટેશન નજીક આવેલા ગેસ્ટ હાઉસમાં સવારે ૭ વાગ્યે એક પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોતને વહાલું કરનાર યુગલ ગત રાત્રે ૮ વાગ્યે ગેસ્ટહાઉસમાં આવીને રોકાયું હતું. જો કે ધોળકાના સહિજ ગામના યુવક તથા બાપુનગરની યુવતી વચ્ચે ક્યારથી અને કેવી રીતે પ્રેમસંબંધ બંધાયો હતો તે રહસ્ય હજુ પણ અકબંધ છે.

ઓઢવ ફાયર સ્ટેશન નજીક આવેલા મિલન ગેસ્ટહાઉસના રૂમ નં.૧૦૪માં બુધવારે સવારે ૭ વાગ્યે કોઈના પડવાનો અવાજ આવતાં ગેસ્ટહાઉસના સંચાલક શંભુસિંહ ચંદનસિંહ રાવ દોડીને રૂમ તરફ ગયા હતા, જ્યાં ડબલ બેડ પર યુવતી નિસ્તેજ થઈને પડી હતી, જ્યારે યુવક રૂમમાં નીચે તરફડિયાં મારી રહ્યો હતો. આ જોઈ ગભરાયેલા શંભુસિંહે તાત્કાલિક ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાન સાથે ઓઢવ પોલીસને જાણ કરી હતી. જો કે તબીબી સારવાર મળે તે પહેલાં જ બંને મોતને ભેટ્યાં હતાં. આ અંગે પોલીસે અકસ્માત મોત નોંધ લઈ તપાસ કરતાં તેમના નામ નિકુલ ધીરુભાઈ ચાવડા (ઉં.વ.૨૨, રહે. સહિજ ગામ, ધોળકા) તથા આશા મીઠાભાઈ વૈષ્ણવ (ઉં.વ.૨૦, રહે. ચામુંડાનગર, વિ-૧, બાપુનગર) હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે રૂમમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ સેલ્ફાસ નામની ઝેરી દવા સાથે યુવકનો મોબાઈલ ફોન તથા પાકીટ કબજે કર્યાં હતાં.

# જૂનાગઢ પાસે સ્કૂલ બસ પલટી ખાઈ જતાં બે બાળકોનાં મોત

શિક્ષિકાઓ સહિત ૧૬ ને ઇજા : ડ્રાઇવર સામે નોંધાયો ગુનો : વાલીઓમાં ભભૂકતો રોષ

ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

વંથલી તાલુકાનાં ઉમટવાડા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કુલનાં બાળકોને જૂનાગઢથી લઇને જતી સ્કુલબસ શાળા નજીક પહોંચી ત્યારે બસનું આગળનુ વ્હીલ પાણી ભરેલા એક ખાડામાં પડતાં ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ રોંગ સાઇડમાં એક ઝાડ સાથે ધડાકાભેર ટકરાઇને પલ્ટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં ફૂલ જેવા બે બાળકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ, બે શિક્ષિકા અને ડ્રાઈવર સહિત કુલ ૧૬ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જે પૈકી એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઇજા હોઇ સઘન સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવને પગલે વાલીઓનાં ટોળેટોળાં સીવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ઘાયલ બાળકોને હોસ્પિટલે પહોંચાડાયા હતા. બનાવ અંગે અકસ્માતમાં મોતને ભેટેલા એક માસુમ વિદ્યાર્થીનાં પિતાએ બસનાં ડ્રાઈવર વિરૂદ્ધ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વંથલી તાલુકાનાં ઉમટવાડા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં જૂનાગઢનાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી અમુક ખાનગી વાહનો અને અમુક શાળાની બસમાં અપડાઉન કરે છે. આજે સવારે બાળકોને બસમાં બેસાડી 'સી' નંબરથી ઓળખાતી જીજે-૧૧ ડબલ્યુ-૩૮૭ નંબરની બસ શાળા નજીક પહોંચી ત્યારે રસ્તામાં આવતો ખાડો તારવવા જતાં બસ ઝાડ સાથે ટકરાઇને પલ્ટી ખાઇ ગઇ હતી.

# રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાંથી સદી પુરાણી નમકદાનીની ચોરી

યુરોપિયન આર્ટ વિભાગના શો-કેસમાંથી ચિનાઇ માટીની આકર્ષક વસ્તુ ગુમ

ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

રાજકોટના જ્યુબિલી ગાર્ડનમાં આવેલા ૧૨૫ વર્ષ જૂના વોટ્સન મ્યુઝિયમના શો-કેસમાંથી ચિનાઇ માટીના એક નાના પરંતુ આકર્ષક અને એન્ટિક પીસની ચોરી થઇ છે. મ્યુઝિયમ સંચાલકોની બેદરકારી આ બનાવે છતી કરી છે.પોલીસે આ અંગે તપાસ આદરી છે.

શહેરના એક માત્ર વોટ્સન મ્યુઝિયમના યુરોપીયન આર્ટ વિભાગમાં આવેલો શો કેસ નીચે પડતાં ફરજ પરના કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા. તપાસ કરતાં શો કેશમાંથી પૌરાણિક ચીનાઈ માટીથી બનાવેલી નમકદાની ગાયબ હતી. શોધખોળ કરવા છતાં નહીં મળતાં અંતે પોલીસને જાણ કરી હતી.

ચોરીના બનાવથી એ ડિવિઝન પોલીસના ફોજદાર કે.જે.પાટિલ મદદનીશ હરભમસિંહ ત્યાં પહોંચ્યા હતા અને મ્યુઝિયમના ઇન્ચાર્જ ક્યુરેટર વિરેશભાઇ વનમાળીભાઇ દેસાઈની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.

વિરેશભાઇના જણાવ્યા મુજબ, ચોરાયેલી નમકદાની અંદાજિત ૧૦૦ વર્ષ જૂની હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. એક માત્ર મ્યુઝિયમમાં થયેલી ચોરીના બનાવથી ચર્ચા જાગી છે.

જે રીતે શો-કેસ પડયું છે તે જોતાં એક શંકા એ પણ છે તે ચોરીનો પ્રયાસ કરનારે આખો શો કેસ કાઢવાનો પણ પ્રયત્ન કર્યો હોવો જોઈએ.પરંતુ તે ન નીકળ્યો હોવાથી અંતે નમકદાની ચોરી ગયા હોવા જોઈએ.

### વર્ષોથી ઇન્ચાર્જના સહારે વહીવટ

મ્યુઝિયમના નામે અનેક કાર્યક્રમો થાય છે, ગ્રાન્ટ ફાળવાય છે પરંતુ લગભગ એક દાયકાથી વધારે સમયથી રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં ક્યુરેટર નથી. ઇન્ચાર્જ ક્યુરેટર જ મ્યુઝિયમનું સંચાલન કરે છે.

### મ્યુઝિયમમાં કેમેરા છે પણ ચાલુ નથી

શહેરના એક માત્ર વોટ્સન મ્યુઝિયમમાં ઐતિહાસિક ચીજ વસ્તુઓનો સંગ્રહ છે. તેમજ મ્યુઝિયમમાં સી.સી. ટીવી કેમેરા પણ ગોઠવાયા છે. પરંતુ જ્યારે ચોરીના બનાવ બાદ પોલીસ પહોચી ત્યારે એક પણ કેમેરો ચાલતો ન હોવાનું ખુલ્યું હતું. ચાલુ કેમેરા ચોરી પકડી શકે પરંતુ આ બંધ કેમેરાએ મ્યુઝિયમના સ્ટાફની બેદરકારી છતી કરી હતી.

### નમકદાની જૂનાગઢથી આવી હતી

મ્યુઝિયમના ઇન્ચાર્જ ક્યુરેટર વિરેશભાઇના જણાવ્યા મુજબ, ચોરાયેલી નાની એવી નમકદાની આજથી ૩૦ વર્ષ પહેલા જૂનાગઢથી રાજકોટના મ્યુઝિયમમાં આવી હતી. જે યુરોપિયન આર્ટ વિભાગમાં મુકવામાં આવી હતી.

# ઈશરત કેસનો સ્ટેટસ રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ કરાશે

ભાસ્કર ન્યૂઝ,અમદાવાદ

ઈશરત એન્કાઉન્ટરની તપાસ કરતી એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ગુરુવારે હાઈકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની છે. એસઆઈટીની તપાસ પ્રગતિમાં હોવાનો અને જે લોકોની તપાસ કરવાની બાકી છે તેનો જ રિપોર્ટમાં ઉલ્લેખ કરવાની હોવાનું સૂત્રો મારફત જાણવા મળ્યું છે.

એસઆઈટીએ જુલાઈ મહિનાની શરૂઆતમાં એન્કાઉન્ટરનું સીએફએસએલ અને એઈમ્સના ડોક્ટરોની ટીમની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પરંતુ તેનો રિપોર્ટ હજી આવ્યો નથી એસઆઈટી ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે ૪ ઓગસ્ટના રોજ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની છે. એસઆઈટીએ ગઈ ૧૪ મી જુલાઈના રોજ હાઈકોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ઘણી બધી બાબતો અંગે શંકા વ્યક્ત કરી હતી. પરંતુ હજી સુધી સીએફએસનો રિપોર્ટ આવ્યો ન હોવાથી એસઆઈટી હાલપૂરતુ સ્ટેટસ રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરવાની નથી. એસઆઈટીના નવા વડા રાજીવ વર્માએ એસઆઈટીની બે ટીમ કાશ્મીર અને મુંબ્રા તપાસ માટે મોકલવાની છે. આ ઉપરાંત એસઆઈટીના નવા વડા રાજીવ વર્મા સીઆઈડી ક્રાઈમના વડા પી.પી.પાંડેની ફરીથી પૂછપરછ કરવાના છે. અગાઉના એસઆઈટીના વડા સત્યપાલસિંઘ એડીજી પી.પી.પાંડેના બેચમેટ હોવાથી પૂછપરછ વખતે હાજર રહ્યા ન હતા. પરંતુ નવા વડા પી.પી.પાંડેની ટૂંક સમયમાં પૂછપરછ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત વડોદરા જેલમાં બંધ સસ્પેન્ડ એસીપી નરેન્દ્ર અમીનની વધુ એક વખત પૂછપરછ કરે તેવી પણ શક્યતા છે.

# અમદાવાદમાં અનામત આંદોલનના આરોપીઓ નિર્દોશ

ભાસ્કર ન્યૂઝ, અમદાવાદ

શહેરના રાયપુર વિસ્તારમાં ૧૯૮૫ના અનામત આંદોલન સમયના તોફાનોના કેસમાં ૨૬ વર્ષ બાદ આખરે સેશન્સ કોર્ટે ૧૫ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોશ મુકત કરવા આદેશ કર્યો છે.આરોપીઓ સામે તોફાન કરવા અને જાહેર મિલ્કતોને નુકશાન કરવાની ફરિયાદો હતી.

કેન્દ્ર સરકારે ૧૯૮૫માં પછાત વર્ગના લોકો માટે જાહેર કરેલી ૩૩ ટકા અનામતની જોગવાઈઓનો વિરોધ કરતા લોકોએ સ્થાનિક વિસ્તારમાં એ.એમ.ટી.એસ.બસને સળગાવી હતી. આ કેસમાં પોલીસે ૨૭ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે જાહેર મિલ્કતને નુકશાન કરવા તથા તોફાન કરવા અંગેનો કેસ નોંધવામાં આવ્યો હતો.

# ઈશરત કેસમાં ત્રણ વોન્ટેડની તપાસમાં SIT કાશ્મીર જશે

૨૦૦૯માં પોટા જજે ધરપકડ વોરંટ કાઢ્યા હતા

ભાસ્કર ન્યૂઝ,અમદાવાદ

ઈશરત બોગસ એન્કાઉન્ટરની તપાસ કરતી એસઆઈટી મૂળ કાશ્મીરના ત્રણ વોન્ટેડને પકડવા માટે કાશ્મીર જવાની છે. આ ત્રણ વોન્ટેડની વિરુદ્ધમાં પોટા કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યા હતા. પરંતુ હજી સુધી પકડાયા ન હોવાથી આ ત્રણેયની તપાસ માટે એસઆઈટી કાશ્મીર જવાની છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કોતરપુર પાસે ઈશરત અને તેની સાથેના ત્રણ સાથીદારોએ ઠાર માર્યા હતા. પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા ઝીશાન જોહર અને અમજદઅલી રાણા પાકિસ્તાનથી ઘૂસણખોરી કરીને આવ્યા હતા. તેમને કાશ્મીરમાં ઘૂસાડવા માટે મૂળ કાશ્મીરના માજીદ હુસેન ઉર્ફે બલાલ ઉર્ફે અબુહુજેકા ખુરશીદ અહેમદ કાદરી (રહે.લાલબાગ શ્રીનગર), પરવેઝ અહેમદખાન ઉર્ફે બિલાલ અહેમદ (રહે.બેમીના હાઉસિંગ સોસાયટી,અલફારુફ મસ્જિદ પાસે સેકટર-૨-એ શ્રીનગર) અને અબ્દુલ અજીજી શાહ અબ્દુલ ખાલીદ શાહ રહે. કુપવાડા શ્રીનગરની વિરુદ્ધમાં વર્ષ-૨૦૦૯માં પોટા જજ જ્યોત્સનાબેન યાજ્ઞિકે ધરપકડ વોરંટ કાઢ્યું હતું.

તે વખતે આ બનાવની તપાસ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ વોરંટ કાશ્મીર પોલીસને મોકલી આપ્યું હતું, પરંતુ હજી આ ત્રણ પકડાયા નથી.

એસઆઈટીના વડા રાજીવ વર્માએ તપાસ સંભાળ્યા બાદ વોન્ટેડ આરોપીઓની તપાસ કરવા માટે સૂચના આપી હતી.

# 'નીટ'ના સિલેબસ અંગે સરકાર MCIને અભિપ્રાય આપશે

બે દિવસમાં સિલેબસનો અભ્યાસ કરીને જરૂરી ભલામણો કરવા રાજ્ય સરકાર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરાઈ

ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર

એમ.સી.આઈ.(મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) દ્વારા ગુજરાત સહિત દેશભરમાં વર્ષ ૨૦૧૨થી મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુકો માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દાખલ કરવાનો નિર્ણય કરીને કોર-સિલેબસ તૈયાર કર્યો છે.જેની સામે રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિરોધનો ઉગ્ર સૂર પેદા થવા પામ્યો છે ત્યારે ગુજરાત સરકારે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં છ સભ્યોની એક 'ટાસ્ક ફોર્સ'ની રચના કરી છે.જેમને એમસીઆઈનો અભ્યાસક્રમ સ્વીકારવો કે તેમાં સુધારા-વધારા સાથે તેનો સ્વીકાર કરવો કે કેમ તે બાબતે અભ્યાસ કરીને ભલામણો કરવાની જવાબદારી સોંપી છે.આ ટાસ્ક ફોર્સ હવે ૫મી,ઓગસ્ટે તેનો અહેવાલ સરકારને સુપરત કરશે તે પછી ગુજરાત સરકાર એમસીઆઈને તેનો અભિપ્રાય રજૂ કરશે.

### ટાસ્ક ફોર્સ કઈ બાબતોની ચકાસણી કરીને અહેવાલ આપશે

- એમસીઆઈ દ્વારા તૈયાર કરાયેલા 'કોર-સિલેબસ'નો અભ્યાસ કરશે, તે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સુસંગત છે કે કેમ,તેમાં ફેરફારો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સિલેબસ તૈયાર કરી શકાય કે કેમ તેની ચકાસણી કરશે.
- કોર-સિલેબસમાં ધો.૧૧ના વિષયો પણ આવરી લેવાયા છે.તે સુસંગત છે કે કેમ? આ અંગેની વિસંગતતાઓ ધ્યાને લાવી તે દૂર કરવાના ઉપાયો સૂચવશે.
- અન્ય રાજ્યોમાં કેવું વલણ અપનાવાયું છે તેનો અભ્યાસ કરાશે.
- પરીક્ષાની ભાષાનું માધ્યમ પ્રાદેશિક કક્ષાનું છે કે કેમ? માધ્યમ ગુજરાતી રાખી શકાય કે કેમ તેની શક્યતાઓ ચકાસશે.
- કોર-સિલેબસ સુધારા-વધારા સાથે સ્વીકારાય તો હાલ રાજ્યમાં સ્ટેટ બોર્ડની પરીક્ષા તથા 'ગુજસેટ'ના નિયમો પ્રમાણે શું થઈ શકે તેનો ખાસ અભ્યાસ કરાશે.

# નરોડા પાટિયા કાંડના સાક્ષીને નિવેદન ફેરવા મહેબુબ સિનિયરની ધમકી

ભાસ્કર ન્યૂઝ, અમદાવાદ

નરોડા પાટીયાકાંડના સાક્ષી નદીમ સૈયદને પોતાનું નિવેદન ફેરવી તોળવા માટે ટેલીફોનીક ધમકી આપનાર માથાભારે મહેબુબ સીનીયર સામે નદીમે ગુજરાત યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં નરોડા પાટીયા ખાતે પણ મોટા પાયે નરસંહાર થયો હતો. જે પ્રકરમની સુનાવણી ઈન્કમટેક્ષ જુનીહાઈકોર્ટ ખાતે ચાલતી સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહી છે અને નરોડાકાંડમાં નદીમ સૈયદ સાક્ષી છે. આ પ્રકરણમાં આવતીકાલે નદીમને કોર્ટમા નિવેદન પણ આપવાનું છે. દરમિયાના બુધવારે બપોરે નદીમ મહેબુબઅલી સૈયદ કોમર્સ છ રસ્તા નારાયણપાર્ક સોસાયટીમાં આવેલા જયદેવસિંહના ઘરે બેઠો હતો .

# શુક્રવારે બેન્કોની હડતાળ અબજોના વ્યવહારો ખોરવાશે

ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

બેન્કોના કર્મચારી-અધિકારીઓના કુલ નવ સંગઠનોના આદેશ અનુસાર શુક્રવારે બેન્કોની દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. તમામ ક્ષેત્રની બેન્કોના દસ લાખ કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે અને અબજો રૂપિયાના બેન્કિંગ વ્યવહારો તેને લીધે ઠપ્પ થશે. સૌરાષ્ટ્રની બેન્કોના પણ સાત હજાર કર્મચારીઓ તેમાં પોતાનો સૂર પૂરાવશે. બેન્ક યુનિયનોએ સરકાર સમક્ષ પોતાની માગણીઓની લાંબી યાદી મૂકી છે અને તે અંગે ઉપેક્ષિત વલણ દર્શાવાતું હોવાથી હડતાળ પડાઈ રહી હોવાનું પણ કહ્યું છે. બેન્કિંગ કાયદામાં આવી રહેલા ફેરફારોનો પણ સંગઠનો વિરોધ કરવાના છે.

બેન્ક કર્મચારી-અધિકારીઓના નવ સંગઠનોએ આપેલા હડતાળના આદેશનો અમલ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો ઉપરાંત વિદેશી તેમજ ગ્રામીણ બેન્કોના કર્મચારીઓ કરશે અને તા. ૫ ઓગસ્ટને શુક્રવારે તેઓ કામથી અળગા રહેશે તેમ જ માગણીઓ દોહરાવતા સૂત્રોચ્ચાર કરશે. સૌરાષ્ટ્રની પણ વિવિધ બેન્કોની તમામ શાખાઓ આ હડતાળમાં જોડાશે. બેન્કોના વ્યવહારો તે દિવસે બંધ રહેશે.

### શું છે બેન્ક કર્મીઓની માગણીઓ ?

- જાહેરક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ ન કરવું
- બેન્કોનું વિલીનીકરણ ન કરવું
- બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ ૧૨(૨) નાબૂદ ન કરવી
- ઉદ્યોગગૃહોને બેન્ક ખોલવા મંજૂરી ન આપવી
- રહેમરાહે નોકરી આપવા યુનિયનો સાથે થયેલી મંજૂરીનો અમલ કરવો
- બેન્કોમાં ફાઇવ-ડે વિકનો અમલ કરવો
- અધિકારી માટે કામનો સમય નક્કી રાખવો
- પેન્શન યોજનામાં સુધારો કરવો
- ખંડેલવાલ કમિટીની ભલામણો નાબૂદ કરવી

Digitially Archived by: www.realpatidar.com/library

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



ફેક્ટ ફાઈલ

બ્રાઝિલમાં વાયુ સેનાનું સિંગલ એન્જિન વિમાન તૂટી પડતાં તેમાં સવાર તમામ ૮ સૈનિકોના મૃત્યુ થયા હતા.



## ન્યૂઝ ઈન બોક્સ

### દિલ્હીથી જમ્મુ જતાં એર ઈન્ડિયાના વિમાનનું આઈજી એરપોર્ટે ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી : દિલ્હીથી જમ્મુ માટે ઉડેલું એર ઈન્ડિયાનું વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. ૧૨૨ મુસાફરો સાથે ટેક ઓફ થયેલા વિમાનમાં થોડી ક્ષણો બાદ એલાર્મ વાગતાં પરત દિલ્હી એરપોર્ટે લેન્ડિંગ કરવું પડ્યું હતું. કોકપિટમાં વાગેલો આ એલાર્મ બાદમાં બોગસ સાબિત થયો હતો. કેમ કે, એલાર્મ સીસ્ટમમાં ક્ષતિ સર્જાતાં કોઇ જાતના ખતરા વગર એલાર્મ વાગવો શરૂ થઇ ગયો હતો. આમ છતાં ટેક્નિશિયનોએ એરક્રાફ્ટ એન્જિનોની તપાસ કરી લીધી હતી.

### શિરડીમાં સાઇ સંસ્થાનના સીઈઓને મોઢે શિવસૈનિકોએ કાળું ચોપડ્યું

શિરડી : શિરડી એરપોર્ટ અને સરકારી કંપનીઓને ભંડોળ આપવાના અધિકાર સાઈ સંસ્થાનને આપવા માટે કાયદામાં સુધારણા કરવાના વિરોધમાં શિવસૈનિકોએ બુધવારે આંદોલન કર્યું હતું અને સાઈ સંસ્થાનના સીઈઓના મોઢા પર કાળું ચોપડ્યું હતું. શિવસેના જિલ્લા પ્રમુખ રાવસાહેબ કેવરેના નેજા હેઠળ શિવસૈનિકોએ મોરચો કાઢ્યો હતો. સંસ્થાના કાર્યકારી અધિકારી અને ઉપ કાર્યકારી અધિકારી બહાર હોવાથી વિશેષ કાર્યકારી અધિકારી (સીઈઓ) એકનાથ વાઘે નિવેદન સ્વીકાર્યું હતું.

### પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબ રમજાનમાં રોજા રાખ્યા નથી

મુંબઈ : મુંબઈ પરના ૨૬ નવેમ્બરના ત્રાસવાદી હુમલામાં તેની ભૂમિકા માટે દોષિત ઠેરવાયેલા અને ફાંસીની સજા અપાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ અમીર કસાબ ચાલી રહેલા પવિત્ર રમજાન મહિના નિમિત્તે રોજા ન રાખ્યા હોવાનું આર્થર રોડ જેલના જ્યેષ્ઠ અધિકારીએ કહ્યું હતું. ગઈ વખતના રમજાનમાં કસાબે ચોક્કસ દિવસોમાં રોજા રાખ્યા હતા, પણ આ વખતે તે માટે પોતાની અનિચ્છા પ્રગટ કરી હતી, જેલના સુપરિન્ટેન્ડેન્ટ રાજેન્દ્ર ધામલેએ કહ્યું હતું. 'અમે તેને અગાઉથી રમજાન બાબતે જાણ કરી હતી.

### ઓમપ્રકાશ ચૌટાલા સામેના કેસની સુનાવણી શરૂ

નવી દિલ્હી : હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા સામે અપ્રમાણસર સંપત્તિ ધરાવવા મામલે દિલ્હીની કોર્ટે કેસ નોંધી તપાસનો આદેશ આપ્યો હતો. સ્પેશિઅલ સીબીઆઇ જજ પી એસ તેજીએ સીબીઆઈને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કેસ દાખલ કરવા આદેશ કર્યો હતો. સીબીઆઇ દ્વારા ગયા વર્ષે જુલાઇ માસમાં રૂા.૬ કરોડની બેનામી સંપત્તિ ધરાવવા બદલ ચૌટાલા સામે આરોપનામું દાખલ કર્યું હતું. આ અંગેનો ચુકાદો ૨૭ જૂને કોર્ટે અનામત રાખ્યો હતો.

### કર્ણાટકના લોકાયુક્ત તરીકે પાટિલે શપથ ગ્રહણ કર્યા

બેંગલુરુ : કર્ણાટકના રાજ્યપાલ એચ આર ભારદ્વાજે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શિવરાજ વી.પાટિલને રાજ્યના નવા લોકાયુક્ત પદે બુધવારે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં આયોજિત શપથ સમારોહમાં કર્ણાટક હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ આર. ગુરરાજને પણ ઉપલોકાયુક્ત તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. પાટિલ સંતોષ હેગડેના સ્થાને લોકાયુક્ત બન્યા છે. હેગડેનો કાર્યકાળ મંગળવારે સમાપ્ત થયો હતો. પાટિલ રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂકયા છે.

# ગેરકાયદે પાર્કિંગ ! મેયરે ટેન્ક નીચે મર્સિડીઝ કચડી

યુરોપિયન રાષ્ટ્ર લિથુવેનિયાના પાટનગરની આ અનોખી ઘટનાની વીડિયો જારી કરાઇ

સ્તબ્ધ કાર માલિક

એજન્સી. વિલ્નીયલ

મોટાં શહેરોમાં માથાના દુ:ખાવા સમાન પૂરવાર થઈ રહેલા ગેરકાયદે પાર્કિંગની સમસ્યાનો ખતરનાક હલ લિથુનિયાના વિલ્નિયસના મેયરે શોધી કાઢ્યો હતો. તેણે સાઈકલ લેનમાં પાર્ક કરાયેલી એક મોંઘીદાટ મર્સિડીઝ કાર પર ટેન્ક ચઢાવી દીધી હતી.

લિથુવેનિયાની રાજધાની વિલનિયસ ખાતે કાર ચાલકો દ્વારા આડેધડ કરાતાં પાર્કિંગ સામે ૪૩ વર્ષીય મેયર આર્ટરસ ઝુઓકાસનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. આ તરવરિયા સુટેડ બૂટેડ રાજકારણીએ ગેરકાયદે પાર્કિંગ સામે લડવા અનોખો ઉપાય અપનાવ્યો હતો. તેણે એક રશિયન ટેન્ક વડે આ ગેરકાયદે પાર્ક કરાયેલી મોંઘીદાટ કારોનો નાશ કરી નાખ્યો હતો.

### સમગ્ર ઘટનાની ચેતવણીરૂપ વીડિયો જારી કરાઇ

**આ સમગ્ર** ઘટનાની સત્તાવાર વીડિયો તંત્ર દ્વારા જારી કરાઈ હતી. તંત્ર ગેરકાયદે પાર્કિંગ સામે કેટલી હવે ખફા છે તે દર્શાવતા આ વીડિયોમાં પોતાની મોંઘીદાટ કાર ગમે ત્યાં પાર્ક નહીં કરવા સલાહ અપાઇ હતી. અને પોતાની ફરારી અને રોલ્સ રોયસને નિયમિત પાર્કિંગની જગ્યામાં પાર્ક કરવા સંદેશો પાઠવાયો હતો. તેમાં કહેવાયું હતું કે, જ્યારે કેટલાક લોકો એમ વિચારે છે કે તેઓ કાયદાથી પણ ઉપર છે ત્યારે તંત્રએ શું કરવાનું રહે. અમને લાગે છે કે તેનો સર્વોત્તમ ઉપાય ટેન્ક છે.

### મેયરનું શું કહેવું છે?

**મેયર** અર્ટરસનું કહેવું છે કે, રાહદારીઓના હકોને છીનવીને મનફાવે ત્યાં પોતાની મોંઘીદાટ વૈભવી કાર પાર્ક કરતાં લોકોને હું સ્પષ્ટ સંદેશો મોકલવા માગું છું. આ સૌજન્યતાનો અભાવ દર્શાવે છે જે સહન નહીં કરી લેવાય.

### કાર ગમે ત્યાં પાર્ક નહીં કરવા સલાહ આપી!

**મર્સિડીઝને** કચડ્યા બાદ મેયર ટેન્કમાંથી ઉતરીને તેના માલિક પાસે ગયા અને તેની સાથે હસ્તધૂનન કરીને કાર ગમ્મે ત્યાં પાર્ક નહીં કરવા સલાહ આપી હતી.

# બિગ બીનો વસવસો : નાહકના ત્રણ વર્ષ કોલેજમાં વેડફી નાખ્યા

તેના બદલે પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયના ગુણ શીખી શખ્યો હોત

પીટીઆઇ. મુંબઇ

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન કોલેજના છાત્રોને સંબોધન કરતાં અતિતમાં સરી પડ્યા હતા. તેમણે પોતાનો કોલેજકાળ યાદ કરતા કહ્યું હતું કે, અમને ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે સલાહ આપનારું કોઇ ન હતું. તે જમાનામાં ગ્રેજ્યુએટ થવું ખૂબ અગત્યનું ગણાતું હતું. આથી વાલીઓ તેમના સંતાનોને ગ્રેજ્યુએટ થવા દબાણ કરતા અને સંતાનો પણ અન્ય કોઇ સલાહ સ્ત્રોત ન મળતા ચૂપચાપ કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ થઇ જતાં હતાં.



બચ્ચને સ્વીકાર્યું કે, તેમણે સાયન્સ સ્ટ્રીમમાં ત્રણ વર્ષ કોલેજ કરીને ભૂલ કરી હતી. અત્યારે બચ્ચન માને છે કે, એ ત્રણ વર્ષ સમયનો માત્ર વેડફાટ હતો. તેમણે માન્યું કે, જો અભિનય ક્ષેત્રે જ કારકિર્દી ઘડવાનો પ્રથમથી મનસૂબો ઘડ્યો હોત તો કોલેજના એ ત્રણ વર્ષ તેઓ પૂણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી શક્યા હોત.

### અમિતાભે સાયન્સ કેમ પસંદ કર્યું હતું?

**નૈનિતાલની** શેરવૂડ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ દિલ્હીની કિરોડીમલ કોલેજમાં અમિતાભે બીએસસી કર્યું હતું. શેરવૂડમાં તેમણે સૌથી વધુ માર્ક સાયન્સના વિષયોમાં આવતા હોવાથી પિતા હરિવંશરાયે તેમને સાયન્સ સ્ટ્રીમમાં મોકલ્યા હતા. સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ કોલકાતાની શિપિંગ કંપનીમાં નોકરીએ લાગી ગયા હતા.

### 'ત્યારે અમે મિત્રો સાથે કોફી શોપમાં બેસી ન શકતા'

**અમિતાભે** મોડર્ન યુગ સાથે ત્યારના જમાનાની તુલના કરતાં પોતાના અનુભવો કહ્યા હતા. તેમણે કહ્યું કે, એકવાર હું મિત્રો સાથે કોફી શોપમાં બેઠો હતો. તેની રાવ એક સંબંધીએ મારી માતાને કરી હતી. જો કે, મારી માતાએ મને કોઇ ઠપકો આપ્યો ન હતો. ત્યારના જમાનામાં કોફી શોપ (ચાની હોટેલ)માં બેસવું પણ અભદ્ર ગણાતું હતું.

# ગ્વાટેમાલામાં ૪ સૈનિકોને ૬૦૦૦ વર્ષની સજા !

૩૬ વર્ષ ચાલેલા ગૃહયુધ્ધમાં અઢી લાખ લોકો માર્યા ગયા'તા : દોષિત સૈનિકોએ ૨૦૧ નિર્દોષ લોકોની લોથ ઢાળી દીધી હતી

એજન્સી. ગ્વાટેમાલા

લેટિન અમેરિકી દેશ ગ્વાટેમાલામાં ચાર માજી સૈનિકોની નરસંહારની ઘટનામાં દોષિત માનીને ૬,૦૬૦ (છ હજાર સાઇઠ) વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ગ્વાટેમાલામાં ૧૯૬૦થી ૧૯૯૬ સુધી ગૃહયુધ્ધ ચાલ્યું હતું. જેમાં, આશરે અઢી લાખ લોકો માર્યા ગયા હતા.

કોર્ટે આ પૂર્વે સૈનિકોને ૧૯૮૨માં લાસ ડોસ એરેસ નામના ગામડામાં થયેલા નરસંહારના દોષિત ઠેરવ્યા હતા. આ ઘટનામાં ૨૦૦થી વધુ લોકો હણાઇ ગયા હતા ત્યારે આ ચારેય સૈનિકો ઉગ્રવાદ નિરોધક વિશેષ દળમાં તૈનાત હતા. જેણે, ૨૦૧ લોકોની હત્યા કરી હતી.

કોર્ટે ફેંસલો સંભળાવતા કહ્યું હતું કે, ડેનિયલ માર્ટિનેજ, મેનુઅલ પોપ, રેચેસ કોલિન અને કાર્લોસ કારિયાએ માનવતા વિરુધ્ધ ગંભીર અપરાધ કર્યો છે. ૨૦૧ લોકોને બર્બરતાપૂર્ણ મારી નાખ્યા હતા. માનવ અધિકાર સંગઠનો ગ્વાટેમાલાની કોર્ટના આ ફેંસલાથી ખુશ થયા છે. ઘણા વર્ષોથી અપરાધીઓને સજા અપાવવા સંગઠનો પ્રયત્નશીલ હતા.

### ગ્વાટેમાલાના ઇતિહાસમાં બર્બરતાપૂર્ણ ઘટના

**લાસ** ડોસ એરેસ ગામમાં ૨૦૧ લોકોની હત્યા ગ્વાટેમાલાના ઇતિહાસમાં સૌથી બર્બરતાપૂર્ણ ઘટના તરીકે અંકિત થઇ ગઇ છે. જેમાં, લોકોને ઘરની બહાર ખેંચીને ઢોર માર મારી અધમરા જેવા કરી નાખ્યા બાદ લમણા અને છાતીમાં ગોળી ધરબી દેવાઇ હતી. ત્યારબાદ, લાશોને કૂવામાં ફેંકી દેવાઇ હતી.

# માલેગાંવ ધડાકો : બે આરોપીને જામીન આપતી હાઈકોર્ટ

ભાસ્કર ન્યૂઝ. મુંબઈ

માલેગાંવના બોમ્બ ધડાકાના બે આરોપીઓને આ ધડાકા સાથે સાંકળે એવી કોઈ સામગ્રી નથી, એવું નિરીક્ષણ કરીને મુંબઈ વડી અદાલતે બુધવારે એ બે આરોપીઓ જામીન આપતા તપાસકર્તા નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને એક મોટા ફટકો પડ્યો હતો. ઓક્ટોબર ૨૦૦૮થી જેલમાં રહેલા શિવનારાયણ કાલસંગરા અને શ્યામ સાહુને એક લાખ રૂપિયાની સ્યોરિટી પર જામીન આપવામાં આવ્યા હતા.

જામીન આપતી વખતે જસ્ટિસ એ. એમ. થીપ્સેએ કહ્યું હતું કે, બોમ્બ ધડાકાના કેસમાં બે આરોપીઓની પ્રથમદર્શી સંડોવણી દર્શાવતી પૂરતી સામગ્રી-પુરાવા નથી. તે બેઉ જણે ધડાકાના ષડયંત્રમાં કોઈ સક્રિય હિસ્સો લીધો નથી. તે બેની ધડાકાના કેસ સાથેની એક માત્ર જોડાણ-કડી એવી છે કે બેઉ જણ બોમ્બ ધડાકાના મુખ્ય આરોપી રામચન્દ્ર કાલસંગરાને જાણતા હતા.

## ઓલ્ડ ઈઝ ગોલ્ડ

તસવીર એએફપી

વિતેલા વર્ષોની અભિનેત્રી ઝિન્નત અમાને મહિમા ચૌધરી સાથે આઈઆઈ જેડબલ્યુની સેકન્ડ એડિશનમાં કેટવોક કર્યું હતું.

# અધિકારીના ત્રાસથી બહેનને છોડાવવા ભાઈનું આત્મદહન

ભાસ્કર ન્યૂઝ. થાણે

ઉલ્હાસનગરમાં મહાપાલિકાના શિક્ષણ મંડળના જુલમી અધિકારીના ત્રાસથી બહેનનો છુટકારો કરાવવા માટે ભાઈ ૩૦ વર્ષીય પ્રશાંત લહાનેએ આત્મદહન કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું છે. આને કારણે શિક્ષણ મંડળના અધિકારી એસ. બી. ગાયકવાડ વિવાદમાં સપડાયા છે.

પ્રશાંતની બહેન સંગીતા ઉલ્હાસનગર મહાપાલિકાના શિક્ષણ મંડળમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી કરતી હગતી. તેની પાસે અપંગ વિદ્યાર્થીઓના સમન્વયક પદનો કારભાર હતો. ગત થોડા મહિનાથી સંગીતા અને ગાયકવાડ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને એકબીજા પર ગંભીર આરોપબાજી કરાતી હતી.

આ બાબતે સંગીતાએ ફરિયાદ નોંધાવી હતી. જોકે ગાયકવાડે સંગીતાનું વર્તન સારું નથી એવું કહીને ગાયકવાડે તેને નોકરીમાંથી કાઢી નાખવા ઠરાવ કરાવ્યો હતો.

# ૨૦૧૦માં ઓસી.એ ભારતીય છાત્રોના ૬૩ ટકા વિઝા નકાર્યા

૨૦૧૦-૧૧માં ફરી ઓસ્ટ્રેલિયાએ ભારતીય છાત્રો માટે લાલ જાજમ બિછાવી: ઓસ્ટ્રેલિયન સરકારે આંકડાઓ બહાર પાડ્યા

પીટીઆઇ. મેલબોર્ન

ઓસ્ટ્રેલિયા સરકારે બ્રિટનની માફક અભ્યાસની આડમાં નોકરી કરવા આવવા માગતા છાત્રો માટે દરવાજા બંધ કરી દેતાં ભારતમાંથી ૬૩ ટકા સ્ટુડન્ટ વિઝા અરજીઓ ડ્રોપ કરાઇ હતી. ગત નાણાંકીય વર્ષમાં ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા અરજીમાં કુલ ૨૦ ટકા જેટલો ઘડાટો નોંધાયો હતો.

નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦માં ઓસ્ટ્રેલિયા સરકારે ભારતમાંથી સ્ટુડન્ટ વિઝા માટે આવેલી ૧૮૫૧૪ અરજીઓ નકારી હતી. આ તમામ અરજીઓ પર વિઝા સ્ટેમ્પ એટલા માટે નહતો લાગ્યો કેમ કે તેઓ બ્રિક લેયર, હેર ડ્રેસર, પેસ્ટ્રીકૂક, બેકર જેવા નિમ્ન સ્તરના કોર્ષનો અભ્યાસ કરવા આવવા માગતા હતા. નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧મા ભારતમાંથી આવેલી સ્ટુડન્ટ વિઝા અરજી પૈકી ૬૮૭૫ અરજીઓ વિવિધ કારણોસર પડતી મૂકાઇ હતી.

ભારત બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિદેશી છાત્રો ચીનમાંથી છે. ચીનના વિદેશીછાત્રો ઉચ્ચ અભ્યાસાર્થે આવે છે. આજે પણ ભારતમાંથી વિદેશ અભ્યાસ કરવા માટે છાત્રોની પહેલી પસંદ ઓસ્ટ્રેલિયા જ છે. હમણાં જ શિક્ષણ મંત્રી ક્રિસ ઇવાન્સે ભારતીય છાત્રો માટે ઓસી. સલામત દેશ હોવાનો દાવો કર્યો હતો.

### ઓસી.માં ભારતીયો બાદ ચીની, વિયેતનામી છાત્રો સૌથી વધુ

**ઓસ્ટ્રેલિયામાં** ભારતીય, ચીની અને વિયેતનામી છાત્રોની સંખ્યા સૌથી વધુ છે. તેની સામે યુરોપ અને આફ્રિકામાંથી ઓસ્ટ્રેલિયા આવતા છાત્રોની સંખ્યા ઘણી ઓછી છે. યુરોપીયન અને આફ્રિકન છાત્રોની પહેલી પસંદગી અમેરિકા છે.

### ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ૧૦૩ ભારતીયો પર હુમલા

**૨૦૧૦માં** ૧૦૩ ભારતીયો પર ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં હુમલાઓ થયા હતા. જેમાં મોટાભાગના હુમલા મેલબોર્ન, સીડની અને બ્રિસબેનમાં થયા હતા. એડીલેડ અને પર્થ આવા વંશિય હુમલાથી બચી શક્યા છે. ગયા વર્ષે ૧૦૩ ભારતીયો પર હુમલામાં કેટલાકે જીવ ગુમાવ્યા હતા.

# સાઉદીમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત બનશે : ૩૨૮૦ ફૂટ

બુર્જ ખલિફાની ઊંચાઇ ૨૭૧૭ ફૂટ : જેદાહમાં સાઉદીના પ્રિન્સ ૧.૨ અબજ ડોલરના ખર્ચે કિંગ્ડમ ટાવર બનાવશે

એજન્સી. જેદાહ

હવે વિશ્વની સૌથી ઊંચી ઈમારત દુબઇની બુર્જ ખલિફા નથી રહેવાની કેમ કે, આ રેકોર્ડ જેદાહમાં બનતાં કિંગ્ડમ ટાવર તોડશે. ૧.૨ અબજ ડોલરના ખર્ચે સાઉદી અરેબિયાની રાજધાની જેદાહમાં બનનારી આ ઈમારત વિશ્વની સૌથી ઊંચી ઈમારત કહેવાશે.

બિન લાદેન્સ નામની કંપનીએ પ્રથમ વખત ૨૦૦૮માં આ મેગા પ્રોજેક્ટ ઘોષિત કર્યો હતો. જેદાહના પ્રિન્સ અલવાલિદ બિન તલાલે કહ્યું કે, તેમણે ૩૨૮૦ ફૂટ ઊંચી ઈમારત કિંગ્ડમ ટાવર અગર કિંગ્ડમ સિટી બનાવવા ડીલ સાઈન કરી લીધી છે.

બે સ્કવેર માઇલમાં કિંગ્ડમ ટાવરનો પાયો ફેલાશે. ઈમારતની ઊંચાઈ લગભગ એક કિલોમીટર હશે. આ મેગા પ્રોજેક્ટ સાકાર થયા બાદ કિંગ્ડમ સિટી તરીકે પણ ઓળખાશે. કિંગ્ડમ ટાવરમાં હોટેલ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ, લકઝરી ફ્લેટ્સ અને શાનદાર ઓફિસો ૮૫૨ સ્કવેર માઇલમાં બનશે.

કન્સ્ટ્રકશન કંપની સાઉદી બિન લાદેન ગ્રૂપને આ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. પ્રિન્સ અલ વાલિદ ઘણા સમયથી વિશ્વની નંબર વન સ્કાયસ્ક્રેપર બનાવવા ઈચ્છતા હતા. તેમણે બુર્જ ખલિફાની કન્સ્ટ્રકશન કંપની એમ્માર સાથે પણ વાતચીત કરી હતી. પરંતુ એમ્માર યુએઇ સરકાર હેઠળ કામ કરતી કંપની છે. આથી બિન લાદેન ગ્રૂપને કોન્ટ્રાક્ટ અપાયો છે.

### કિંગ્ડમ ટાવરની ખાસિયતો

- ૩૨૮૦ ફૂટ ઊંચી
- ૧.૨ અબજ ડોલરનો ખર્ચ
- કિંગ્ડમ સિટી તરીકે ઓળખાશે
- ૮૫૨ સ્કવેર માઇલમાં બાંધકામ
- હોટેલ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ, લકઝરી ફ્લેટ્સ અને આલિશાન ઓફિસો
- ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર પર જવા લિફ્ટમાં ૧૨ મિનિટ થશે
- સાઉદીના બિન લાદેન ગ્રૂપને કોન્ટ્રાક્ટ

**વિશ્વની જાણીતી ઈમારતો**

- કિંગ્ડમ ટાવર જેદાહ ૩૨૮૦ ફૂટ
- બુર્જ ખલિફા દુબઇ ૨૭૧૭ ફૂટ
- વિલ્સ ટાવર શિકાગો ૧૭૨૯ ફૂટ
- ટ્વિન ટાવર ન્યૂયોર્ક ૧૭૭૬ ફૂટ
- કિંગ્ડમ ટાવરનું નિર્માણ હવે શરૂ થશે જ્યારે ટ્વિન ટાવર આતંકી હુમલામાં નામશેષ થઇ ગયા છે.

# ભારત-યુએસ પર અત્યાર સુધીના સૌથી મોટા સાઇબર હુમલાઓ

**આક્રમણ** સૌ પ્રથમ ચીન અને બીજા નંબર રશિયા આરોપીના પીંજરામાં

એજન્સી. બોસ્ટન

અમેરિકના સિક્યુરિટી ક્ષેત્રે કામ કરતી કંપની મેકૂઅફિએ ધડાકો કર્યો છે કે,સંયુક્ત રાષ્ટ્રસંઘ, અમેરિકા, ભારતની સરકારો, કંપનીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાઈબર હુમલો થયો છે. ખાનગી-સરકારી કુલ ૭૨ સંસ્થાઓના નેટવર્ક હેક થઇ ગયા છે.

આ સાઈબર હુમલાઓ પાછળ 'જાણભેદુ' નો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અન્ય એક સાઈબર સિક્યુરિટી નિષ્ણાતે ચીન તરફ અંગુલિ નિર્દેશ કર્યો છે. તેણે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી થતાં સાઈબર હુમલાનો ભોગ બનનારી કંપનીઓની યાદી ઘણી લાંબી છે. ૨૦૦૮માં જિનિવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સચિવના કાર્યાલયની કોમ્પ્યુટર સિસ્ટમ હેક થઇ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના ઘણા ડેટા ચોરી થઇ ગયા હતા. સૌથી મોટા સાઈબર હુમલા અંગેનો પર્દાફાશ થયો છે.

### હેકર્સનું ચીન કનેકશન

**વિશ્વભરમાં** હેકર્સનો ભોગ ૭૨ સંસ્થાઓ કંપનીઓ બની છે. સાઇબર સિક્યુરિટી નિષ્ણાત જિમ લેવિસે મોટાભાગના સાઇબર હુમલાઓ પાછળ ચીનનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના મતે-ચોકકસ સાઇબર હુમલાઓ પાછળ બિજિંગ (ચીન સરકાર)નો બદઇરાદો હોઇ શકે. હેકર્સનું ચીન કનેકશન આજકાલનું નથી. આની પાછળ રશિયા પણ હોઇ શકે છે પરંતુ વધુ સંભાવના ચીનની છે.

### સાઇબર સિક્યુરિટી કંપનીઓની લાસ વેગાસમાં બેઠક મળી

**ટોચની** સાઇબર સિક્યુરિટી કંપનીઓના નિષ્ણાતોની બેઠક બુધવારે અમેરિકાની જુગારનગરી લાસવેગાસમાં મળી હતી. જેમાં મેક્અફિ નામની કંપનીના વડાએ સાઇબર હુમલાઓ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો.

# યુએસમાં આરોગ્ય કૌભાંડમાં ૧૯ ભારતીયો દોષિત ઠર્યા

પટેલ ફાર્મસીના બાબુભાઇ પટેલ સહિત ગુજરાતીઓની પણ સંડોવણી

પીટીઆઇ. ન્યૂયોર્ક

અમેરિકાની એક ફેડરલ ગ્રાંડ જ્યુરીએ ૧૯ ભારતીયો સહિત ૨૬ લોકોને કરોડો ડોલરના આરોગ્યસંભાળ યોજના અને ખાનગી વીમામાં દવા વિતરણ કૌભાંડમાં ખોટા ક્લેઈમ બદલ દોષિત ઠેરવ્યા હતા.

યુનાઈટેડ સ્ટેટ એટર્નિ જનરલ બાર્બરા મકવેડ દ્વારા આજે થયેલી જાહેરાત મુજબ ડેટ્રોઇટની ગ્રાંડ જ્યુરીએ ૨૬ વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા હતા. એક ભારતીય મૂળનો ફાર્માસિસ્ટ પણ આ વિવાદમાં કેન્દ્રમાં હોવાનું કહેવાય છે. ૩૪ વર્ષે ૩૪ મુદ્દાના આ આરોપનામા મુજબ ૪૯ વર્ષીય ફાર્માસિસ્ટ બાબુભાઇ પટેલ જે ૨૬ જેટલી ફાર્માસિસ્ટ પર નિયંત્રણ ધરાવે છે. તેને ભળતા નામે રહેલી ફાર્માસિસ્ટની અન્ય અનેક સંસ્થા પરની પોતાની માલિકી છૂપાવી હતી.

આરોપનામામાં જણાવાયા મુજબ પટેલે પોતાની દવાઓ લખી અપાય તે માટે મેડિકલ સંસ્થાઓ અને ખાનગી વીમા કંપનીઓને લાંચ આપી હતી અને પટેલ ફાર્માસિસ્ટની દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખવા ભલામણ કરી હતી. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનનો હવાલો ધરાવનાર સ્પેશિયલ એજન્ટ રોબર્ટ કોરસોના જણાવ્યા મુજબ ''આજની ધરપકડ અને આરોપનામામાં મૂકાયેલા આરોપોને પગલે મિશિગનમાં અત્યાર સુધીમાં નોંધાયેલું સૌથી મોટું દવા કૌભાંડ બહાર આવ્યું છે. આ વ્યક્તિઓ દ્વારા પોતાના પદનો દુરુપયોગ કરાયો છે.

# 'આદર્શ' પ્રકરણમાં ફરી વિલાસ દેશમુખનું નામ ઊછળ્યું

ભાસ્કર ન્યૂઝ. મુંબઈ

આદર્શ હાઉસિંગ સોસાયટીમાં ગેરરીતિની તપાસ કરતા પંચ સમક્ષ માજી મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખનું નામ ફરી એક વખત ચર્ચાયું હતું. દેશમુખના નિર્દેશ અનુસાર 'આદર્શ'ની ફાઈલ પર તાત્કાલિક અહેવાલ મંગાવાયો હોવાનું બુધવારે રાજ્ય સરકારના નાયબ સચિવ જગદીશ ઘરતે જણાવ્યું હતું. અગાઉ ક્લેક્ટર ચંદ્રશેખર ઓકે પણ દેશમુખ વિશે આવી જ માહિતી આપી હતી.

સભ્ય પી. સુબ્રમણ્યમના બનેલા તપાસ પંચ સમક્ષ બુધવારે જગદીશ ઘરતની ઉલટ તપાસ એડવોકેટ દીપન મર્ચન્ટે લીધી હતી. ઘરતે તેમની જુબાનીમાં જણાવ્યું હતું કે ''૭ ફેબ્રુઆરી-૨૦૦૦ના રોજ આદર્શ સોસાયટી તરફથી દેશમુખને એક નિવેદન સુપરત કરાયું હતું.

Digitally Archived by: www.realpatidar.com/library

# વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વાળંદ યુવાનનો આપઘાત

## બીમારીના ઉપચાર પેટે રૂપિયા વ્યાજે લીધા હતાં

**ભાસ્કર ન્યૂઝ. જામનગર**

જામનગરમાં વ્યાજના વિષચક્રમાં સપડાયેલા વાળંદ યુવાને ઝેરી દવા પી આપઘાત કર લેતાં ચકચાર જાગી છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આ પગલું ભરી લીધાનો મૃતકે મરણનોંધમાં ઉલ્લેખ કર્યો છે ચાર પુત્ર અને પત્નિએ વલોપાત કરતા શોકનું મોજુ પ્રસરી ગયું છે.

જામનગર શહેર સહિત જિલ્લાભરમાં શોક સાથે ચકચાર જગાવનાર આપઘાત પ્રકરણની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વંડાફળીમાં રહેતા જયેન્દ્રભાઈ બાબુલાલ (ઉ.વ.૪૦) નામના વાળંદ યુવાને પોતાને ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ યુવાનનું મૃત્યુ નિપજતાં વાળંદ પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. ચાર પુત્રી અને એક પુત્ર સહીત છ સભ્યોના પરિવારના મોભી એ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયું હતું. આપઘાત કરતા પૂર્વે મૃતકે પત્નિ, ભાઈ-ભાભી, સંતાનો અને જિલ્લા પોલીસ વડાને સંબોધી મરણનોંધ લખી હતી. ચાર વર્ષ પૂર્વે બિમારીની સારવાર કરાવવા વ્યાજખોરો પાસેથી રૂ.૭૦ હજાર વ્યાજે લીધા હતાં. ત્યારબાદ વ્યાજની ઉઘરાણી ચાલુ જ રહેતા અને વ્યાજખોરો પુત્રીઓની મજુરીની રકમ પણ ઝુંટવી જતા હોવાથી આ પગલું ભરી લીધું હોવાનો મરણનોંધમાં ઉલ્લેખ કર્યો છે. પરંતુ મરણનોંધમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ નહીં કરાતા પોલીસે મૃતકના મિત્રો, ભાઈ, પુત્ર સહિત પરિવારના

# જીવતો વિજવાયર બાળકના ગળામાં વીંટાઈ જવાથી મોત

**ભાસ્કર ન્યૂઝ. જામરાવલ**

જામકલ્યાપુર તાલુકાના રાજપરા ગામે આજે વિજવાયરને કારણે એક બાળકનો ભોગ લેવાયો હતો. શાળામાં અભ્યાસ કરતો બાળક વિજપોલ ધરાશયી થયો હતો અને તેનો જીવતો વિજવાયર બાળકના ગળામાં વીંટાઈ જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

રાજપરા ગામે રહેતો રામભાઈ બેલા (ઉ.વ. ૮) નામનો બાળક ગામની શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરી રહ્યો હોય, રિસેસના સમયે પાણી પીવા માટે શાળાની બહાર નીકળ્યો હતો. જીવતા વિજવાયરો રામના ગળામાં વીંટળાઈ જતા ભારે નાસભાગ મચી ગઈ હતી.

# મજૂરોની ઘટથી મગફળીના વાવેતરને ફટકો

**ભાસ્કર ન્યૂઝ. રાજકોટ**

દેશમાં સૌથી વધુ મગફળીનું વાવેતર ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં થાય છે. જ્યાં, જૂન મહિના દરમિયાન વાવણીનો વરસાદ ખેંચાતા વાવેતરમાં મોટો જોવા મળ્યો છે. આજે મોટાભાગના ખેડૂતો આદિવાસી મજૂરોને વાવેતર માટે જમીનો ભાગામી આપે છે. અન્ય મજૂરીકામ તરફ ફંટાયેલા આદિવાસી મજૂરોનો પ્રવાહ ખેતીમાં ઘટ્યો છે અને આવે છે તેઓ મગફળીમાં મહેનત વધુ હોવાથી કપાસનું વાવેતર પસંદ કરે છે. ગત વરસે મગફળીની કાપણી વેળાએ પાછોતરા અને કમોસમી વરસાદ ખેડૂતના હાથમાં આવેલ કોળિયો ઝૂંટવ્યો હતો.


**ટુંકી નિવિદા**
**કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી,**
**બ્લોક નં. ૧૬, ત્રીજો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર**
**પ્રી ઓડિટ અંગેની કામગીરી**

કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી હસ્તકની અમદાવાદ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (તાબાની કચેરી સહિત) નાણાંકીય વર્ષ : ૨૦૧૧-૧૨થી ત્રણ વર્ષ માટે પ્રી ઓડીટની કામગીરી કરવા માટે ગુજરાત રાજ્યમાં નોંધાયેલ સી. એ. ફર્મ પાસેથી પુનઃ ઓન લાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. તેમજ ઓનલાઈન ટેન્ડર અંગેની વિશેષ વિગતો, શરતો અને બોલીઓ વેબસાઈટ www.ruraldev.gujarat.gov.in, ઉપર જોઈ શકાશે. ટેકનીકલ પ્રપોઝલ સાથે જરૂરી ફી તથા દસ્તાવેજો રજીસ્ટર્ડ પોસ્ટથી અત્રેની કચેરીને મોડામાં મોડા તા. ૧૧-૦૮-૨૦૧૧ સુધીમાં મોકલી આપવાના રહેશે.

કમિશ્નર
ગ્રામવિકાસ - ગુજરાત રાજ્ય
માહિતી/૯૨૦/૧૧-૧૨ ગાંધીનગર



**GUJARAT ECOLOGY COMMISSION**
Block No. 18th, First Floor, Udyog Bhavan, Gandhinagar.

**A. E-TENDER NOTICE**

Gujarat Ecology Commission invites offers for supply, installation & commissioning of LED based solar photovoltaic street lighting systems at Ambaji, Ta : Dnata, Di : Banaskantha. The estimated cost of work is Rs. 81.60 Lacs. Tender documents can be downloaded from the nprocure website i.e www.nprocure.com on payment of tender fee of Rs. 2,200/- by D.D. only on any working days during office hours.

| Sr. | Tender Schedule | Date | Time |
|---|---|---|---|
| 1 | Online Downloading start date | 01/08/2011 | 11:30 am |
| 2 | Online Downloading End date | 16/08/2011 | 11:30 am |
| 3 | Last Date of Physical submission in GEC office | 16/08/2011 | 11:30 am |
| 4 | Bid Opening in GEC office | 17/08/2011 | 12:00 am |

Member Secretary, Gujarat Ecology Commission, Gandhinagar reserves the right to reject any/all offers without assigning any reasons thereof.

- Director,
Gujarat Ecology Commission, Gandhinagar.



Gujrat Council of Elementary Education
Sarva Shiksha Abhiyan Mission
Sector No. 17, Gandhinagar

State Project Director, SSA Mission, Gandhinagar invites online tender from registered contractor for Electrical work & supply of Electrical goods at different primary school in different district of the state.

| Schedule of E-Tendering | |
|---|---|
| On line submission of E-Tender | 05.08.2011 to 03.09.2011 up to 18:00 Hrs. |
| Bid Document download end date | 03.09.2011 up to 18:00 Hrs. |
| Last Date & Time of online submission | 03.09.2011 up to 18:00 Hrs. |
| Submission of Document fee, Bid Security, supporting document in physical form | 05.09.2011 up to 18:00 Hrs. |
| Pre – Bid Meeting | 26.08.2011 at 12:00 Hrs. |
| Online opening of Tender | 06.09.2011 at 12:00 Hrs. |

For more details please visit web site: www.nprocure.com

(Manoj Aggarwal)
State Project Director
INF/905/11-12 SSA – Mission, Gandhinagar



**એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સિસ (ટેકનીકલ)**
ACPC એલ.ડી. કોલેજ ઓફ એન્જિનીયરીંગ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૧૫.

**ઈજનેરી ડિપ્લોમા હોલ્ડર્સને સંબંધિત ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમનાં બીજા વર્ષમાં (ત્રીજા સેમેસ્ટર) સીધો પ્રવેશ : વર્ષ ૨૦૧૧-૧૨**

શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૨૦૧૨ માટે ડિપ્લોમા એન્જિનીયરીંગ હોલ્ડર્સને સંબંધિત ઈજનેરી ડીગ્રી અભ્યાસક્રમમાં સીધો પ્રવેશ મેળવવા માટે જેમણે નિયત સમયમર્યાદામાં અરજી કરી હોય અને પ્રવેશ પાત્રતા ધરાવતા હોય તેમજ ગુણવત્તાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબનાં કાર્યક્રમ પ્રમાણે બધાં જ જરૂરી અસલ દસ્તાવેજો સાથે સ્વખર્ચે સમિતિના ઉપરોક્ત સરનામે જરૂરી ફી (સરકારી/અનુદાનિત સંસ્થાઓ માટે અંદાજે રૂા. ૧,૫૦૦/- તથા સ્વનિર્ભર સંસ્થાઓ માટે આંશિક ફી પેટે રૂા. ૨૦,૦૦૦/-) સાથે હાજર રહેવું તથા તમામ ઉમેદવારોને જણાવવાનું કે, જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ પ્રવેશ આપવામાં આવશે. ટી.ઈ.બી.માંથી એમ્પેક સિસ્ટમનો ડિપ્લોમા ધરાવનાર ઉમેદવારોએ બેસ્ટ ઓફ ટેનની અસલ માર્કશીટ તથા નોન-એમ્પેક સિસ્ટમમાંથી ડિપ્લોમા ધરાવનારે ફાઈનલ/પ્રોવિઝનલ અસલ માર્કશીટ ફરજીયાત સાથે લાવવી. અન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કરનાર ઉમેદવારોએ તેઓની ફાઈનલ અસલ માર્કશીટ ફરજીયાત સાથે લાવવી. સંસ્થાઓના પ્રવેશ કોડ, ઉપલબ્ધ બેઠકો, સંસ્થાની ફી વગેરેની માહિતી વેબસાઈટ www.jacpcldce.ac.in ઉપર મૂકવામાં આવેલ છે.

| તારીખ/વાર | ડિપ્લોમા વિદ્યાશાખા | સમય | બોર્ડ | મેરીટ નંબર |
|---|---|---|---|---|
| ૬-૮-૨૦૧૧ શનિવાર | ટ્રાન્સપોર્ટ | સવારે ૯-૦૦ | Non-MPEC | ALL |
| | | | GTU | ALL |
| | ઓટોમોબાઈલ | સવારે ૯-૦૦ | MPEC | ALL |
| | | | Non-MPEC | SC, ST, DS,PH -All Open:1 to 150 SEBC :1 to 75 |
| | | સવારે ૧૧-૦૦ | GTU | SC, ST, DS,PH -All Open:1 to 75 SEBC :1 to 50 |
| | ફેબ્રીકેશન ટેકનોલોજી | બપોરે ૧-૦૦ | Non-MPEC | ALL |
| | ટુલ એન્ડ ડાઈ મેકીંગ | બપોરે ૧-૦૦ | IGTR | ALL |
| | સિવિલ ઈજનેરી | બપોરે ૩-૦૦ | MSU | ALL |
| | | | MPEC | ALL |
| | | બપોરે ૪-૦૦ | Non-MPEC | ALL |
| ૭-૮-૨૦૧૧ રવિવાર | સિવિલ ઈજનેરી | સવારે ૯-૦૦ | GTU | SC, ST, DS,PH -All Open:1 to 200 Including SEBC |
| | | સવારે ૧૧-૦૦ | GTU | Open 201 onwards SEBC ALL |
| | મિકેનીકલ ઈજનેરી | બપોરે ૪-૦૦ | Nirma | ALL |
| | | | MSU | ALL |
| | | | MPEC | ALL |
| ૮-૮-૨૦૧૧ સોમવાર | મિકેનીકલ ઈજનેરી | સવારે ૯-૦૦ | Non MPEC | SC, ST, DS,PH -All Open:1 to 200 Including SEBC |
| | | સવારે ૧૧-૦૦ | Non MPEC | SEBC ALL OPEN 201 onwards |
| | | બપોરે ૨-૦૦ | GTU | SC, ST, DS,PH -All Open1 to 400 Including SEBC |
| ૯-૮-૨૦૧૧ મંગળવાર | મિકેનીકલ ઈજનેરી | સવારે ૯-૦૦ | GTU | Open 401 to 500 SEBC 190 to 600 |
| | | બપોરે ૧-૦૦ | GTU | Open 501 to 1000 |
| | | બપોરે ૪-૦૦ | GTU | Open 1001 to 1400 |
| ૧૦-૮-૨૦૧૧ બુધવાર | બાયો મેડિકલ | સવારે ૯-૦૦ | Non MPEC | ALL |
| | | | GTU | ALL |
| | ઈન્ફોર્મેશન ટેકનોલોજી | સવારે ૯-૦૦ | MSU | ALL |
| | | સવારે ૯-૦૦ | Nirma | ALL |
| | | સવારે ૯-૦૦ | MPEC | ALL |
| | | સવારે ૧૧-૦૦ | Non MPEC | ALL |
| | | બપોરે ૧૨-૦૦ | GTU | SC, ST, DS,PH -All Open 1 to 150 SEBC All |
| | | બપોરે ૨-૦૦ | GTU | Open 151 onwards |
| ૧૧-૮-૨૦૧૧ ગુરૂવાર | ડેરી ટેકનોલોજી | સવારે ૯-૦૦ | Non-MPEC | ALL |
| | એન્વાયર્મેન્ટ ઈજનેરી | સવારે ૯-૦૦ | Non-MPEC | ALL |
| | | | GTU | ALL |
| | ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ | સવારે ૧૦-૦૦ | MPEC | ALL |
| | | | Non-MPEC | ALL |
| | | સવારે ૧૦-૩૦ | GTU | ALL |
| | પાવર ઈલેક્ટ્રોનિક્સ | બપોરે ૧૨-૩૦ | Non-MPEC | ALL |
| | | | GTU | ALL |
| | ઈલેક્ટ્રિકલ ઈજનેરી | બપોરે ૧-૩૦ | Nirma | ALL |
| | | | MSU | ALL |
| | | | MPEC | ALL |
| | | બપોરે ૩-૩૦ | Non-MPEC | ALL |
| ૧૨-૮-૨૦૧૧ શુક્રવાર | ઈલેક્ટ્રિકલ ઈજનેરી | સવારે ૯-૦૦ | GTU | SC, ST, DS,PH -All Open:1 to 300 Including SEBC |
| | | બપોરે ૧૨-૦૦ | GTU | SEBC 107 to 400 Open 301 to 500 |
| | | બપોરે ૨-૦૦ | GTU | Open 501 to 700 |
| | | બપોરે ૪-૦૦ | GTU | Open 701 to 900 |
| ૧૬-૮-૨૦૧૧ મંગળવાર | ટેક્ષટાઈલ ડિઝાઈન | સવારે ૯-૦૦ | GTU | ALL |
| | ટેક્ષટાઈલ મેન્યુફેક્ચરીંગ | સવારે ૯-૦૦ | Non MPEC | ALL |
| | ટેક્ષટાઈલ ટેકનોલોજી | સવારે ૯-૦૦ | MSU | ALL |
| | ટેક્ષટાઈલ પ્રોસેસિંગ | સવારે ૧૦-૦૦ | Non MPEC | ALL |
| | પેટ્રોકેમિકલ | સવારે ૧૧-૦૦ | MSU | ALL |
| | કેમિકલ ઈજનેરી | બપોરે ૧૨-૦૦ | Nirma | ALL |
| | | બપોરે ૧૨-૦૦ | DDU | ALL |
| | | બપોરે ૧૨-૦૦ | MPEC | ALL |
| | | બપોરે ૧-૦૦ | Non MPEC | ALL |
| | | બપોરે ૧-૦૦ | GTU | ALL |
| | પ્લાસ્ટિક ઈજનેરી | બપોરે ૩-૦૦ | Non MPEC | ALL |
| | | બપોરે ૩-૦૦ | Nirma | ALL |
| | | બપોરે ૩-૦૦ | CIPET | ALL |
| | મેટલર્જી | બપોરે ૪-૦૦ | Non MPEC | ALL |
| | માઈનીંગ | બપોરે ૫-૦૦ | Non MPEC | ALL |
| | | | GTU | ALL |
| | મેકાટ્રોનિક્સ | બપોરે ૫-૦૦ | Non MPEC | ALL |
| | | | GTU | ALL |
| ૧૭-૮-૨૦૧૧ બુધવાર | કમ્પ્યૂટર ઈજનેરી | સવારે ૯-૦૦ | MSU | ALL |
| | | સવારે ૯-૩૦ | Nirma | ALL |
| | | સવારે ૯-૩૦ | MPEC | ALL |
| | | સવારે ૧૧-૦૦ | Non-MPEC | ALL |
| | | બપોરે ૧-૩૦ | GTU | SC, ST, DS,PH -All Open:1 to 200 Including SEBC |
| | | બપોરે ૪-૦૦ | GTU | Open 201 to 500 Including SEBC |
| ૧૮-૮-૨૦૧૧ ગુરૂવાર | કમ્પ્યૂટર ઈજનેરી | સવારે ૯-૦૦ | GTU | Open 501 to 700 SEBC ALL |
| | | બપોરે ૧૨-૦૦ | GTU | Open 701 to 1000 |
| | | બપોરે ૨-૦૦ | GTU | Open 1001-1300 |
| | | સાંજે ૪-૦૦ | GTU | Open 1301 onwards |
| ૧૯-૮-૨૦૧૧ શુક્રવાર | ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુ. | સવારે ૯-૦૦ | MSU | ALL |
| | | સવારે ૯-૦૦ | Nirma | ALL |
| | | સવારે ૧૧-૦૦ | Non-MEPC | ALL |
| | | બપોરે ૨-૦૦ | GTU | SC, ST, DS,PH -All Open 1 to 200 Including SEBC |
| | | બપોરે ૪-૩૦ | GTU | Open 201 to 600 Including SEBC |
| ૨૦-૮-૨૦૧૧ શનિવાર | ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુ. | સવારે ૯-૦૦ | GTU | Open 601 to 800 SEBC ALL |
| | | બપોરે ૧૨-૦૦ | GTU | Open 801 to 1100 |
| | | બપોરે ૨-૦૦ | GTU | Open 1101 to 1400 |
| | | સાંજે ૪-૦૦ | GTU | Open 1401 onwards |

તા. ૩/૮/૨૦૧૧ – મેમ્બર સેક્રેટરી



**એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સિસ (ટેકનીકલ)**
ACPC એલ. ડી. કોલેજ ઓફ એન્જિનીયરીંગ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૫.

**ડિગ્રી ઈજનેરી તથા ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પૂરક પરીક્ષા ઉત્તિર્ણ કરેલ તેમજ રજિસ્ટ્રેશનથી વંચિત લાયક ઉમેદવારો માટે અગત્યની સૂચના (પ્રવેશ વર્ષ ૨૦૧૧-૧૨)**

જુલાઈ-૨૦૧૧માં લેવાયેલ પૂરક પરીક્ષામાં ઉત્તિર્ણ ઉમેદવારો કે જેઓ લઘુત્તમ લાયકાત (જનરલ કેટેગરી માટે ૪૫%, SC/ST/SEBC માટે ૪૦%) ધરાવતા હોય તેમજ અગાઉ કોઈપણ કારણસર રજિસ્ટ્રેશનથી વંચિત હોય તેવા ઉપરોક્ત લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારો માટેનો પ્રવેશ કાર્યક્રમ નીચે મુજબ રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જરૂરી PIN અને માહિતી પુસ્તિકા રૂા. ૩૫૦/- રોકડા જમા કરાવી પ્રવેશ સમિતિ, એલ.ડી. કોલેજ ઓફ એન્જિ. ખાતેથી મેળવવાના રહેશે.

| Sr. | Activities | Date |
|---|---|---|
| 1. | Online Registration & submission of filled Registration Forms with necessary documents by eligible candidates passed in supplementary exam and remaining if any only at following help centres | 5-8-2011 to 6-8-2011 upto 5-00 pm |
| 2. | Declaration of Provision Merit List | 10-8-2011 |

સદર પ્રવેશ કાર્યક્રમ માટે ઉમેદવારોએ નીચે મુજબના હેલ્પ સેન્ટર ખાતે સવારે ૧૦-૦૦થી સાંજે ૫-૦૦ કલાક સુધીમાં જરૂરી અસલ પ્રમાણપત્રો તેમજ તેની નકલ સાથે હાજર રહેવાનું રહેશે.
(૧) ગર્વમેન્ટ ગર્લ્સ પોલિટેકનીક, પી.આર.એલ. સામે, એલ. ડી. કોલેજ ઓફ એન્જિ. પાછળ, નવરંગપુરા, અમદાવાદ.
(૨) એલ. એમ. કોલેજ ઓફ ફાર્મસી, ગુજરાત યુનિવર્સિટી સામે, નવરંગપુરા, અમદાવાદ.

પ્રવેશ કાર્યક્રમની વધુ વિગતો સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in ઉપર મૂકવામાં આવશે.
તા. ૩/૮/૨૦૧૧ – મેમ્બર સેક્રેટરી

**હેલ્પ લાઈન નંબર ૦૭૯-૨૬૮૫૫૪૪૪**



**એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ**
પ્લાસ્ટીક એન્જી. બિલ્ડીગ, સરકારી પોલિટેકનિક,પાંજરાપોળ પાસે, આંબાવાડી, અમદાવાદ :૧૫.

**CHANGE OF KEY DATES (SCHEDULE)**

ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસક્રમોમા નિર્ધારીત કાર્યક્રમ મુજબ તાઃ ૦૩/૦૮/૨૦૧૧ સુધીમાં રાઉન્ડ–૧માં મળેલ પ્રવેશ કાયમ કરવા માટેનો સમયગાળો લંબાવીને તાઃ ૦૪/૦૮/૨૦૧૧ સુધી કરવામાં આવે છે. જેનો લાભ લેવા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોને જણાવવામાં આવે છે. હવે પછીની પ્રવેશને લગતી કાર્યવાહી નીચે જણાવ્યા મુજબ કરવામાં આવશે.

| Sr. | Activities | Date |
|---|---|---|
| 14 | Deposition of Tuition Fees in the Bank and Reporting with original Documents/ Certificates/ testimonials at Help Centres | 30.07.2011 to 04.08.2011 |
| 15 | Commencement of Academic Term | 04.08.2011 |
| 16 | Intimation to not-reporting students by SMS, Email | incorporate during Sr.14 |
| 17 | Reporting at ACPDC for-not reported students | |
| 18 | Display of Vacancy after Round-1 | 06.08.2011 |
| 19 | Consent for Reshuffling and alteration of Choices if any Round-2 | 07.08.2011 to 10.08.2011 |
| 20 | Declaration of Second Allotment List | 14.08.2011 |
| 21 | Deposition of Tuition Fees in the Bank and Reporting with original Documents/ Certificates/ testimonials at Help Centres | 16.08.2011 to 20.08.2011 |
| 22 | Intimation to not-reporting students by SMS, Email | incorporate during Sr.21 |
| 23 | Reporting at ACPDC not reported students | |
| 24 | Display of vacancy after Round-2 | 21.08.2011 |

– મેમ્બર સેક્રેટરી.



# દેશના નાના કળાકારો ઉર્જા જાળવણી માટે ચિત્રકળા અમારો રસ્તો

**શાળા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ભાગ લેવા માટે આમંત્રણ**

## ઊર્જા સંરક્ષણ પર પેઈન્ટિંગ સ્પર્ધા-2011

ભારત સરકારના ઊર્જા મંત્રાલયે કલ્પનાના વિશ્વનું ચિત્રણ કરવા અને સ્વચ્છ, હરિત અને ઊર્જા સક્ષમ ભવિષ્યની પ્રાપ્તિ માટે બાળકોને આવકાર્યા છે. એવું ભવિષ્ય જે તેમને વારસામાં મળશે. આ પ્રક્રિયામાં ફક્ત બાળકો જ કેટલીક સારી વસ્તુઓ નહીં શીખે બલકે આપણને પણ કેટલીક સારી વસ્તુઓ શીખવાડશે.

**શાળા સ્તરની પેઈન્ટિંગ સ્પર્ધા માટેનો વિષય**

- વિજળી કાપને ટાળવા માટે વિજળી બચાવો
- ઊર્જાનો ઉપયોગ કાળજીપૂર્વક કરો
- ઓછો ખરચ, કરે વધારે બચત

**ઈનામો**

| સ્તર | પહેલું | બીજું | ત્રીજું | સાન્ત્વના |
|---|---|---|---|---|
| રાજ્ય/કે.પ્ર. સ્તર | રૂ. 10,000/- | રૂ. 8,000/- | રૂ. 5,000/- | રૂ. 1,000/- દરેકને (10 ઈનામ) |
| રાષ્ટ્રીય સ્તર | રૂ. 1,00,000/- | રૂ. 50,000/- દરેકને (4 ઈનામ) | રૂ. 25,000/- દરેકને (8 ઈનામ) | રૂ. 10,000/- દરેકને (10 ઈનામ) BEE ના રૂ. 10,000/- દરેકને (10 ઈનામ) |

**શાળા સ્તરની પેઈન્ટિંગ સ્પર્ધા**

- શાળાના પ્રિન્સિપલને **4થી, 5મી** અને **6ઠ્ઠી** કક્ષાના વિદ્યાર્થીઓ માટે 2 કલાકની મુદતની પેઈન્ટિંગ સ્પર્ધા યોજવા વિનંતી છે. બાળકો કોઈ પણ સાઈઝના પેપરનો વાપરી શકે છે પણ A4 સાઈઝનો પેપરો વાંછનીય છે અને પેઈન્ટિંગ સામગ્રી જેવી કે પેન્સિલ, કલર પેન્સિલ, ક્રેયોન્સ અને વૉટર કલર્સ વાપરી શકે છે. બાળકો ઉપરનાં કોઈપણ એક વિષયને ચિત્રકળા માટે પસંદ કરી શકે છે.
- શાળાના પ્રિન્સિપલો 2 શ્રેષ્ઠ ચિત્રો પસંદ કરશે અને તેઓ રાજ્ય/કે.શા.પ્રદેશના નોડલ આફિસરને ઉપરોક્ત સરનામે ચિત્રો અને શાળા સ્તરની સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા અંગે જણાવશે જે વિગત **4 ઑક્ટોબર, 2011** પહેલાં જરૂર પહોંચાડવાની રહેશે.
- ચિત્રના પાછળના ભાગમાં નિમ્નલિખિત માહિતી હોવી જોઈએ: **વિદ્યાર્થીનું નામ • પિતા/માતાનું નામ • માતા-પિતાનો ફોન/મોબાઈલ નં. • કક્ષા • રોલ નં. • વિદ્યાર્થીની ઈ-મેલ આઈડી (જો કોઈ હોય તો) • શાળાનું નામ અને ટપાલ માટેનું સરનામું • શહેર અથવા ગ્રામીણ વિસ્તારમાં સ્થિત શાળા • શાળાનો ટેલીફોન/મોબાઈલ નં. • શાળાના પ્રિન્સિપલની સહી, રાજ્ય/કે.શા. પ્રદેશ**
- ભાગ લેનારા બધા વિદ્યાર્થીઓને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે.
- **State Nodal Officer's address for Gujarat**
  Shri N K Srivastav, Chief Manager,
  400/220 KV Sub Station,
  Power Grid Corporation of India Ltd.,
  P.B. No. 09, Ganeshpura, Vasna-Rathod road,
  Dehgam – 382305, Distt. Gandhi Nagar (Gujarat)
  Tel: (O) 02716-232576, 232427, (M) 09427109252,
  Fax: 02716-232576,
  Email: nrs_01@yahoo.com, nitinks31@gmail.com

બીજા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નોડલ અધિકારીઓના સરનામા માટે અને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓના નામો જોવા www.bee-india.nic.in અને www.energymanagertraining.com પર લૉગ ઑન કરો

**રાજ્ય સ્તરની પેઈન્ટિંગ સ્પર્ધા**

- અધિકતમ 50 શ્રેષ્ઠ ચિત્રો નિષ્ણાત સમિતિ/જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવશે અને ચૂંટાએલા વિદ્યાર્થીઓને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં નિર્ધારિત સ્થળે બે કલાકની સ્થળે પેઈન્ટિંગ સ્પર્ધા માટે બોલાવવામાં આવશે જે **14મી નવેમ્બર, 2011** ના રોજ યોજાશે.
- ભાગ લેનારા દરેક વિદ્યાર્થીને રૂ. 1000/- નગદ અને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે. ભાગ લેનાર વિદ્યાર્થી અને બે વાલીઓનું આવવા-જવાનું સ્લીપર ક્લાસ/એસી ચેર કાર/થર્ડ એસીનું રેલ્વેનું ભાડું અથવા રાજ્ય પરિવહનની બસનું ભાડું સ્પર્ધાને દિવસે ચૂકવવામાં આવશે.
- ઈનામો પણ તે જ દિવસે આપવામાં આવશે.

**રાષ્ટ્રીય સ્તરની પેઈન્ટિંગ સ્પર્ધા**

- દરેક રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશના પહેલા, બીજા અને ત્રીજા ઈનામોના વિજેતાઓને **12મી ડીસેમ્બર, 2011** ના રોજ થનારી. રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી બોલવવામાં આવશે.
- ભાગ લેનાર દરેકને, તેમના બે વાલીઓ સાથે રહેવાનું અને ખાવાનું, આવવા-જવાનું સ્લીપર ક્લાસ/એસી ચેર કાર/થર્ડ એસીનું રેલ્વે ભાડું અથવા સૌથી ટૂંકા રસ્તા માટે રાજ્ય પરિવહન બસનું ભાડું ચૂકવવામાં આવશે. તે ઉપરાંત ભાગ લેનારા દરેક વિદ્યાર્થીને સ્પર્ધાને દિવસે પ્રાસંગિક ખરચ પેટે રૂ. 1000/- અને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
- રાષ્ટ્રીય સ્તરનાં વિજેતાઓને **14મી ડીસેમ્બર, 2011** ના રોજ આયોજિત ''રાષ્ટ્રીય ઊર્જા જાળવણી દિન સમારોહ'' માં મુખ્ય અતિથિ દ્વારા નગદ ઈનામો આપવામાં આવશે.

**નોંધઃ**

- છેલ્લા બે વર્ષોમાં (2009 અને 2010) માં રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે જેઓ 1લા, 2જા, 3જા ઈનામના વિજેતાઓ રહ્યા હોય તેઓ આ વર્ષની સ્પર્ધામાં ભાગ લેવા માટે પાત્ર નથી. પણ રાજ્ય સ્તરના સાંત્વન પુરસ્કારના વિજેતાઓ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે પણ તેઓ 1લા, 2જા, 3જા સ્થાને આવશે તો જ તેઓ ઈનામો માટે તેમને પાત્ર ગણવામાં આવશે.
- સ્પર્ધાના બધા જ સ્તરે ચિત્રોમાં સમુચિત ચિત્ર/પેચવર્ક કરવાની છૂટ નથી.
- જે શાળાઓના 4થા, 5માં, 6ઠ્ઠા ધોરણના 100% વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોવાનો રેકોર્ડ હશે તે શાળાઓના નામ BEE દ્વારા તૈયાર કરાયેલી અને પ્રકાશિત કરવામાં આવેલી ચિત્રકલા સ્પર્ધાની પુસ્તિકામાં પ્રકાશિત કરવામાં આવશે.
- શાળાના સ્તરે પસંદ કરાયેલા બે ચિત્રો અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશના સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પસંદ કરાયેલા ચિત્રો ફક્ત BEE ની સંપત્તિ છે, જેને યોગ્ય જણાય તેવા કોઈ પણ હેતુસર ઉપયોગ કરવાનો તેને અધિકાર છે.
- રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ શૈક્ષણિક વિભાગ અને જેણે સર્વોચ્ચ શાળા અને વિદ્યાર્થીઓને ભાગીદારી અને ગયા વર્ષ કરતાં ટકાવારીમાં સુધારીની ખાતરી આપી છે તે નોડલ અધિકારીને નિમ્નલિખિત શ્રેણીમાં ચાર ઈનામો આપવામાં આવશે.
  - i. **શ્રેષ્ઠ રાજ્ય શૈક્ષણિક વિભાગ અને નોડલ અધિકારી** (ઉત્તર - પૂર્વી રાજ્યો સિવાયનાં)
  - ii. **શ્રેષ્ઠ રાજ્ય શૈક્ષણિક વિભાગ અને નોડલ અધિકારી** (ઉત્તર - પૂર્વી રાજ્યોના)
  - iii. **શ્રેષ્ઠ કેન્દ્ર શાસિત પ્રદેશ શૈક્ષણિક વિભાગ અને નોડલ અધિકારી**
  - iv. **શ્રેષ્ઠ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ શૈક્ષણિક વિભાગ અને નોડલ અધિકારી** ગયા વર્ષની તુલનામાં વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધેલી સર્વોચ્ચ ટકાવારી રેકોર્ડ કરનાર
- પેઈન્ટિંગ સ્પર્ધાના બધા સ્તરોમાં જ્યુરી/નિષ્ણાત સમિતિનો નિર્ણય અંતિમ રહેશે.

**વધુ માહિતી માટે BEE વેબસાઈટની મુલાકાત લો**

ડાયરેક્ટર (ઊર્જા સંરક્ષણ)
**ઊર્જા મંત્રાલય**
**ભારત સરકાર**
રૂમ નં. 408, શ્રમ શક્તિ ભવન,
રફી માર્ગ, નવી દિલ્હી-110 001
ફોનઃ 011-23716020

ENERGY IS LIFE · BEE · CONSERVE IT
ડાયરેક્ટર જનરલ
**બ્યુરો ઑફ એનર્જી એફિશ્યન્સી (BEE)**
(ઊર્જા મંત્રાલય, ભારત સરકાર)
4થો માળ, સેવા ભવન, આર.કે. પુરમ, નવી દિલ્હી-110 066
ફોનઃ 011 26179699 (5-લાઈન્સ) ફેક્સ નં. 011-26178328/52

**પોતાને માટે અને દેશના ફાયદા માટે ઊર્જા બચાવો**

davp34106/13/0029/1 112


Digitially Archived by: www.realpatidar.com/library

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



# ડ્રાઈવરના મુદ્દે લુણવા ગામ અને કંપની આમને સામને

બે દિ'થી ચાલતી બબાલ ઉગ્ર બની : કંપનીએ પોલીસ રક્ષણ મેળવ્યું !

કોક કંપની સામે મેદાનમાં આવી ગયેલા લુણવાના ગ્રામજનો -પપ્પુ સોલંકી

**ભાસ્કર ન્યૂઝ.ભચાઉ**

ભચાઉના લુણવા ગામ નજીક આવેલી એન. આર. આઇ. કોક કંપનીમાં સ્થાનિક ડ્રાઇવરને ઝઘડા બાદ ફરીવાર નોકરીએ રાખવા મુદ્દે ગામ અને કંપની સામ સામે આવી જતા બે દિવસથી ચાલતી બબાલ ઉગ્ર બની હતી.

બે દિવસ પહેલાં લુણવાના ડ્રાઇવર મોહન આહિર અને કંપનીમાં કામ કરતા જીતેન્દ્રકુમાર વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી. જેમાં સ્થાનિક ચાલકને કંપનીએ છૂટો કરી નાખતા કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓએ એક સંપ થઇને જણાવેલ કે જ્યાં સુધી ડ્રાઇવરને પાછા નોકરી પર લેવામાં નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરીએ અને કોઇને કંપનીમા) આવવા જવા દેવામાં પણ નહીં આવે.

કંપનીના મેનેજર સેન ગુપ્તાએ કહ્યું કે ડ્રાઇવર મોહને હજી પણ માર મારવાની વાત કરતાં અમે તેને કાયમ માટે છૂટો કરી નાખ્યો છે. કંપની દ્વારા ગામને ઘણું આપવામાં આવ્યું છે. ૨૦ લાખના ખર્ચે મંદિર, બાળકોને ભણવા જવા-આવવા માટે બસ, રોડ બનાવી આપવામાં આવ્યો છે. હજી સ્કૂલ બનાવવાનું પણ આયોજન છે. વળી ગામના ૩૦૦ માણસો પણ કંપનીમાં કામ કરે છે. બીજી બાજુ ગામના સરપંચ કરમશી રબારીએ કહ્યું કે, જ્યાં સુધી કંપની આ સ્થાનિક ડ્રાઇવરને નહીં રાખે ત્યાં સુધી ગામનો વિરોધ રહેશે. દેવાભાઇ આહિરે કહ્યું કે, કંપની દ્વારા ઘણા કામ ખોટા થાય છે જેમાં પાણીના બોર, ગૌચર જમીન જેવી ઘણી બાબતો છે. ઉલ્લેખનીય છે કે કંપનીના કામદારોએ ઉગ્ર વિરોધ નોંધાવતા પ્લાન્ટ પણ બંધ રાખ્યો હતો.

# અજય યાદ કરે છે 'દાઉદથી સુલતાન મિરઝા' સુધીની સફર

**ભાસ્કર ન્યૂઝ. નવી દિલ્હી**

બોલિવૂડમાં અદાકારીની એક અલગ શૈલી માટે જાણીતા અજય દેવગણનો દેશના સૌથી પહેલા પબ્લિક ચોઇસ એવોર્ડ્સ- ભાસ્કર બોલિવૂડ એવોર્ડ્સમાં 'અભિનેતા નંબર-૧'ની કેટેગરીમાં નોમિનેટ થયેલા પાંચ નસીબદાર અભિનેતાઓમાં સમાવેશ થયો છે. અજયને સુલતાન મિરઝાના પાત્ર માટે આ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં કામ કરવાનો આ ગંભીર અભિનેતાનો અનુભવ કેવો હતો એ જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. સુલતાન મિરઝા ના રોલ માટે અજય દેવગણને વિવેચકોની ભારે વાહવાહી મળી હતી, અજયે સ્વીકાર્યું કે 'રોબિન હૂડ જેવા ડોનનો અભિનય મુશ્કેલ હતો.'અગાઉ રામગોપાલ વર્માની 'કંપની' ફિલ્મમાં દેવગણે ડોન દાઉદ ઈબ્રાહીમની ભૂમિકા ભજવી હતી અને આ કેરેક્ટરનું સુલતાન મિરઝાના પાત્રમાં પ્રતિબિંબ ન પડે એ માટે અજયને ઘણી મહેનત કરવી પડી હતી. 'રોબિન હૂડ જેવા કેરેક્ટરની સાથે સાથે સુલતાન મિરઝા અને મારી વચ્ચે મોટો જનરેશન ગેપ હતો અને તેથી જ મારે મારી વિચારપ્રક્રિયાને જૂના જમાનામાં લઈ જવી પડી હતી. ૬૦ના દાયકાના પહેરવેશ અને જીવનશૈલીનો મેં ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો.'અગાઉ કંપનીના લુચ્ચા, ચાલાક અને લાગણીવિહીના મલિકભાઈના કેરેક્ટર કરતાં હાજીના મૂડના ઉતારચઢાવ અને સૌમ્યહૃદયી તથા રોમેન્ટિક ડૉન સુલતાન મિરઝાની ભૂમિકા ભજવવાનો અનુભવ અલગ હતો' તેમ અજય ઉમેરે છે.

# ગાંધીધામ, ભુજ અને મોટા પૈયામાં વેટ વિભાગના દરોડા

ભુજમાં વેપારીને દુકાન પર વેટ વિભાગનો દરોડો પડયો હતો -પ્રકાશ ભટ્ટ

**ભાસ્કર ન્યૂઝ . ગાંધીધામ**

રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતા વેંચાણ પરના વેરા(વેટ)ની ભરપાઇ કરવામાં ઠાગાઠૈયા કરતા ગાંધીધામ, ભુજ અને મોટા પૈયાના વેપારી-ઠેકેદારો સામે વેટ વિભાગે લાલ આંખ કરી છે અને મોટી રકમની વેટચોરી પકડી પાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાંધીધામ સ્થિત વેટ વિભાગના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ ભુજમાં તેજસ ઈલેક્ટ્રીક નામની વેપારી પેઢીના હિસાબો ચેક કરવામાં આવ્યા બાદ તેમની પાસેથી રૂા. ૩૭૦૦૦ના ટેક્સની રકમ ભરપાઇ કરાવવામાં આવી હતી.આ ઉપરાંત ગાંધીધામમાં એક ઈન્ડિયન નામની પેઢીના હિસાબો પણ ચેક કરવામાં આવ્યા હતાં. તો ગાંધીધામના જ બે વર્ક કોન્ટ્રેક્ટરને ત્યાં વેટના અધિકારીઓએ પડાવ નાખ્યો હતો. મળતી માહિતી મુજબ એક કોન્ટ્રેક્ટરને રૂા. સાડા ત્રણ લાખનો ટેક્સ ભરવા માટે નોટિસ આપવામાં આવી છે. તો બીજા એક કોન્ટ્રેક્ટરને ત્યાં કોઇ માણસ ન મળતા તેને નોટિસ આપીને તેનું તમામ સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું.દરમિયાન ભુજ તાલુકાના મોટા પૈયા ગામે સમા મુસા મામદ નામના ખનિજના લીઝ હોલ્ડરને ત્યાં પણ વેટ વિભાગે કાર્યવાહી કરી હતી. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ આ લીઝ હોલ્ડરે કોઇ જ હિસાબો રાખ્યા ન હતાં. તેની પાસેથી રોયલ્ટીને લગતું મટેરિયલ જપ્ત કરવામાં આવ્યું હતુંઅને હવે તેનો અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેટલી વેટચોરી છે તેનો હિસાબ કઢાશે.

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી
TET ધો.6-8 સામાજિક વિજ્ઞાન
વિભાગ-1 & વિભાગ-2ની તૈયારી માટે નવી બેચ આજ થી શરૂ
લિબર્ટી કેરિઅર એકેડમી ગણેશપ્લાઝા, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદા.
અમદાવાદ 9898856777-26560456-26407703
ગાંધીનગર 9727752015 મહેસાણા 9727752013

# કોટડા(જ)માં સરપંચ દંપતી દ્વારા દલિતોને પરશાની

મગફળીના મિલ માલિક સાથે ભળી જઇ મકાનો તોડી પાડવા ધમકાવાય છે

**ભાસ્કર ન્યૂઝ . નખત્રાણા**

તાલુકાના કોટડા-જડોદર ગામે દલિત સમાજના લોકો સંપથી રહે છે પરંતુ સરપંચ દંપતી દ્વારા ચોક્કસ જ્ઞાતિ સાથે ભળી જઈને હરિજન સમાજ માટે અનેકવિધ સમસ્યાઓ સર્જાઇ છે તેવો આ-ેપ કરાયો છે.

હરિજન સમાજ વતી પ્રમુખ નાનજી ખીમજી વાઘેલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ગામના સરપંચ દંપતી સરલાબેન રમણીકલાલ ભગત દ્વારા હરિજનવાસ નજીક આવેલી મિલ બાબતે સમસ્યાઓ સતાવે છે. કોટડાના પંકજ ઠક્કરની મગફળી સાફ કરવાની મિલના રજ અને પ્રદૂષણથી મુશ્કેલીઓ ઉભી થાય છે. આજુબાજુના રહેવાસીઓ અને મિલની આસપાસની જમીનનો કબજો મેળવવા બન્ને હોદેદારો ભળી જઇને ગેરમાર્ગે દોરતી દબાણ અંગેની નોટિસ પાઠવી છે. ગ્રામસભામાં ગામના દબાણો અંગે કોઇ ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી, તેમજ ૭૦૦ની વસતી ધરાવતા હરિજન સમાજ પ્રત્યે કિન્નાખોરી રાખી મિલમાલિકને મદદ કરવાના હેતુ સાથે ગરીબોના હક્કને નુકસાન પહોંચાડાઇ રહ્યું છે.અવારનવાર મકાન તોડી પાડવાની સરપંચ દ્વારા ધમકી આપવામાં આવે છે.જો સમાજને ન્યાય નહીં અપાય તો આમરણ ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં અપાઇ છે.

# યુવાનોને વ્યસનમુકિત માટે આગળ આવવા હાકલ

ખંભરામાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના ત્રણે પાંખના પ્રમુખોનું સન્માન તથા સરસ્વતી સન્માન યોજાયું

**ભાસ્કર ન્યૂઝ.ભુજ**

સરસ્વતી સન્માનના દાતા બ્રહ્મકુમાર બાબુભાઇ પરમાર તરફથી વિદ્યાર્થીની આરતી પરમારનું સન્માન કરાયું હતું

ખંભરા મધ્યે ડો. હરિશ્ચરી દેવી સંસ્થાનમાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના અખિલ ભારતીય નવ નિર્વાચીત મહાસભાના ત્રણે પાંખોના પ્રમુખો, મંત્રીઓ, ઉપ પ્રમુખોનો સત્કાર સમારંભ યોજાયો હતો.

કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના સત્ર ૨૦૧૧-૨૦૧૪ ના નવ નિર્વાચીત અખિલ ભારતીય મહાસભાના પ્રમુખ મણિભાઇ ચાવડા(રાયપુર) મહાસભાના મહિલા વર્ગના પ્રમુખ હર્ષાબેન ચૌહાણ(જયપુર), મહાસભાના યુવા વર્ગના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, કચ્છ ગુ.ક્ષ. સમાજના પ્રમુખ વિનોદ સોલંકી(માધાપર) તથા મહાસભાના અન્ય ૫૬ અધિકારીઓનું ખંભરા મધ્યે સત્કાર સમારંભ રાખવામાં આવેલ હતો. અને ભારત કક્ષાના પ્રમુખ દ્વારા સરસ્વતી સન્માન થાય તે ઉદેશથી બ્ર?કુમાર બાબુભાઇ પરમારે સરસ્વતી સન્માન નો ટોટલ ખર્ચ તથા સમાજના જમણવારનો ખર્ચ ઉપાડ્યો હતો.

સંચાલન વિનોદભાઇ ખોડીયાર, તથા આભાર વિધિ ગોપાલભાઇ ચાવડાએ કરી હતી. મહાસભાના યુવા વર્ગના પ્રમુખ ભાવેશભાઇ એ યુવાનોને વ્યસન મુકિત માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. અનીલભાઇ ટાંક, લાધુરામ રાઠોડ, વિનોભાઇ સોલંકી હાજર રહ્યા હતા.

# શિક્ષિત યુવાનો પરંપરાગત ધંધો કરતાં પણ શરમાય છે

હું તો નોકરી કરું છું નું સ્ટેટસ મેળવવા બેરોજગારી પસંદ કરે છે, પણ કોઇ વ્યવસાય નહી

**શશિકાંત આચાર્ય. ભુજ**

આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. પરંતુ બીજી બાજુ ભણીગણીને બહાર પડતા યુવાનોને હવે બાપ-દાદાનો પેઢીગત વ્યવસાય અપનાવવો ગમતો નથી. નોકરી જોઇએ તો અપટુડેટ એ વિચાર સાથે આજના યુવાનો વ્યવસાય કરવાનું પસંદ કરે છે. પરંતુ પેઢીગત વ્યવસાય કરવાનું પસંદ કરતા નથી. પરિણામે બેરોજગારીની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે. કચ્છમાં પણ હવે આવી હવા

## ઉજ્જવળ ભવિષ્યની તકો



કચ્છમાં ઉદ્યોગના આગમન બાદ ટેકિનકલ ક્ષેત્રે ચારે દિશાઓ ખુલ્લી ગઇ છે. સ્થાનિક તેમજ દેશ વિદેશમાં દરેક ક્ષેત્રના એન્જિનિયરોની ખપત વધતી જાય છે. ઘર આંગણે જ ડિગ્રી, ડિપ્લોમાં કોલેજો તેમજ આઇ.ટી.આઇ.ના કોર્સોનો લાભ લઇને કચ્છના વિદ્યાર્થીઓ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. સ્થાનિક ઉદ્યોગો ટેકિનશિયનોને આવકારી રહ્યા છે.

**દિનેશ એલ સુથાર ( વ્યાખ્યાતા - સરકાર પોલિટેકનીક - ભુજ )**

## 'ઉત્તમ ખેતીના સૂત્રને' સાર્થક કરો



ખેતી ક્ષેત્રે યુવાન આગળ આવે કૃષિ ક્ષેત્રે નવા નવા સંશોધનો કરી મબલખ ઉત્પાદન તેમજ ફળ - ફળાદિ ઉગાડી, પર્યાવરણની જાળવણી સાથે ગ્રામ્ય લોકોને રોજગારી આપીને ભાંગતા ગામડાં અટકાવે આવા મહાન ઉદેશ સાથે ખેતીને નષ્ટ થતી બચાવીને જગતના તાતની ડિગ્રી મેળવે. કચ્છને હરિયાળું બનાવે :

**માવજીભાઇ પટેલ ખેડૂત અગ્રણી .**

## નોકરી તો સરકારી જ

બે દાયકા પૂર્વે મેટ્રિક બાદ સરકારી નોકરી મળી જતી હતી. જેમને નોકરી મળી જતી તેનું ભાગ્ય ખૂલ્લી જતું, ભણવાનો ખર્ચ નીકળી જતો. એમાં વેતન સારું, પ્રમોશન, પેન્શન, રજાઓ અને આ જમાનામાં તો સાઇડની કમાણી પણ બહુ જ સારી ઉપજે છે. સરકારી નોકરીની સમાજમાં ઇજ્જત થાય છે. પરંતુ સરકારી ભરતી બંધ હોતા યુવાધન બેકાર છે.

## શિક્ષિત બેકારો અઘધ

શિક્ષિત બેકારોની સંખ્યા આજે આકાશ સુધી પહોંચી ગઇ છે. બાવીસ વર્ષ સુધી ઉચ્ચ અભ્યાસ કરાવવા વાલીઓએ બાળકોને ભણાવવા ખેતરો વેંચ્યા, ઉછીના વ્યાજે પૈસા લીધા, ઘરને ખાલી કર્યા અને દીકરાને નોકરી ન મળે ત્યારે ચક્કર આવી જાય છે. જે વિદ્યાર્થી શરૂઆતથી જ ઓફિસર બનવાના સ્વપ્નો જુએ છે અને પટ્ટાવાળા જેવી નાની નોકરી પણ નથી મળતી ત્યારે નિરાશા ઘેરી વળે છે. શિક્ષિતોની બેકારી દેશની સૌથી મોટી સમસ્યા છે.

## અન્ય કામ નથી ગમતું તેથી છેલ્લે હતાશા અનુભવે છે

આજે શિક્ષિત યુવાનોને ખેતીકામ કે સામાન્ય કામ કરવાનું ફાવતું નથી. મોટા વર્ગની આ સ્થિતિ છે. આજે યુવા વર્ગ કમ્પ્યૂટરક્ષેત્રે સારી પ્રગતિ કરી છે. પરંતુ ભણેલાને સરકારી નોકરીનો કોઇ સુયોગ નથી દેખાતો. આ ભણતર નોકરી સિવાય બીજા કોઇ કામમાં આવતું નથી. એ ભણીને ધંધો થઇ શકતો નથી. આજે વડીલો પાર્જિત કલા - કારીગીરી જેવું કામ કરતાં પણ યુવાનો ક્ષોભ અનુભવી રહ્યા છે. જીવનનું સ્વપ્ન ફળીભૂત ન થતાં અંતે ભાંગી પડે છે.

## ભચાઉ ICSમાં ગેરરીતિની ગંધ

**ભચાઉ :**ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્ર પર બાળકોને પોષણ મુક્ત આહાર મળી રહે તે માટે વિવિધ પ્રકારની યોજનાઓ સંકલીત બાળ વિકાસ યોજના અંતર્ગત અમલ કરે છે પરંતુ ભચાઉ આઇ.સી.સી. એસ.માં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. ટ્રાઇસાઇકલ આપવાની યોજના અમલમાં મુકાય છે પરંતુ વર્કરોના બેંકખાતામાં સાઇકલો માટે રૂા.૧૦૦૦ જમા કરાવવામાં આવે અને ઉપરથી એમ કહેવામાં આવે છે કે, આ અધિકારી બહેને બધી બહેનો પાસેથી રૂા. ૧૦૦૦ લઇને બહેનો દ્વારા જે ત્રણ સાઇકલો આપવામાં આવી તે ચાલુ કંપનીની ૨૫૦ વાળી ત્રણ એમ ૭૫૦ થાય.


ભાસ્કર classified

હર્ષ એસ્ટેટ બ્રોકર
જમીન, મકાન, પ્લોટ, વાડી, ખેતર, ફાર્મ હાઉસ તેમજ ચાઇના કલે, બેન્ટો નાઇટને લગતી જમીન ટાઇટલ કિલયર મેળવવા માટે સંપર્ક
મો. ૯૦૯૯૫ ૯૦૩૩૩
મો. ૯૮૭૯૪ ૩૭૫૨૬

ગાંધીધામમાં બેંક એકઝામ વિશે ફ્રી સેમિનાર
કચ્છ કરિયર એકેડમી
મો. ૯૮૭૯૧ ૨૨૮૭૦
તા. ૪-૮-૧૧, ગુરૂવાર
અગાઉથી રજીસ્ટ્રેશન ફરજીયાત
સમય : સાંજે ૫ વાગ્યે હોટલ મારૂતિ, ગાંધીધામ

ગાયત્રી યાત્રાસંઘ
સૌરાષ્ટ્ર દર્શન
તા. ૧૯/૮/૨૦૧૧ ટિકિટ ૨૫૦૦ દિવસ ૬
રહેવા જમવા સાથે
મીતાબેન ગોર
મો. ૯૯૭૮૪૦૯૫૨૦
મો. ૯૯૭૯૯૧૫૭૫૫

વોડાફોન કંપની માટે જોઇએ છે
મુન્દ્રા માટે
સેલ્સમેન - ૧૦
આકર્ષક પગાર તથા કમીશન સાથે
M: 90999 30502

આવકાર રેસ્ટોરેન્ટ A.C.
પંજાબી ફીકસ થાલી ૮૦
ગુજરાતી રસથાળ ૫૦
સાઉથ ઈન્ડીયન, ચાઇનીઝ, પીઝા
પંજાબી જૈન આઇટમોના સ્પે.
આવકાર રેસ્ટોરેન્ટ
૭૧, બેન્કર્સ કોલોની, ભુજ

જોઇએ છે
ડ્રાઈવર કમ સેલ્સમેન
માર્કેટીંગ કરી શકે તેવા
મહેનતુ માણસની જરૂર છે.
પગાર + કમીશન
ડાયમંડ ટ્રેડર્સ, આદિપુર
મો. ૯૮૨૫૭૧૯૩૧૭

શ્રી બ્યુટીપાર્લર
એડવાન્સ સ્કીન કેર બાય
O3+ ઝીટડર્મ થેરોપી એટર્ન
મેલાડર્મ થેરાપી (પીગ્મેન્ટેશન)
સ્કીન રીઝયુવેશન
ઉષા શાહ
મો.૯૮૨૫૦ ૮૧૭૨૭, માંડવી-કચ્છ

રાખડી ફ્રેન્ડશીપ બેન્ડ
આ જાહેરાતનું કટીંગ લાવનારને સ્પે. ડીસ્કાઉન્ટ
VIRUS-The Gift Shop
Shop-1, Plot-1, Sec-1/A,
Kutchkala Road, Gandhidham

તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓના એજન્ટ મિત્રો પોતાની આવક વધારવા માટે મળો.
જોઈએ છે
માર્કેટીંગ કામના અનુભવી - ૧૦
પટ્ટાવાળા - ૦૨
મળવાનો સમય :
સવારે ૧૦.૦૦ થી ૧.૦૦
બપોરે ૨.૦૦ થી ૭.૦૦
:: સંપર્ક ::
Phonix Consultancy
101, Square Apartment,
Ward 12/B, Near LIC Bldg,
Gandhidham - 370201
phonixguj@yahoo.in

જય માતાજી જ્યોતિષ
૧૦૧% કામની ગેરન્ટી ,સચોટ સલાહ
યંત્ર-મંત્ર-તંત્ર-દેવીશક્તિ સાધનાથી કામ કરનાર.
A to Z સમસ્યાનો
૨૪ કલાકમાં તાબડતોડ નિકાલ
લવપ્રોબ્લેમ ,છુડાછેડા ,મેલીવસ્તુ ,
બગડેલા સંબંધ ,શત્રુનાશ, ગૃહકલેશ,
ધારેલી વ્યક્તિનું મિલન ,અણબનાવ
દારૂ છોડાવવા ખાસ મળો
૧૧ કલાકમાં મોહીની વશીકરણ,
સોતનમુક્તિ,પ્રેમલગ્ન સ્પેશ્યાલીસ્ટ
આંગડીયા અને ફોન થી પણ કામ કરવામાં આવશે.
ડી-૧૩, અજીતનાથ સોસા.,નવસર્જન સ્કૂલ પાછળ, રાણીપ, અમદાવાદ.
9924742473

ADMISSION OPEN
સરકાર માન્ય યુનિવર્સિટી
Ph.D. / M.Phill
B.A | B.Com | B.Sc. (All)
M.A | M.Com | M.Sc. (All)
BBA | MBA | BCA | MCA
PGDCA | ENGINEERING
Graduation/ Post Graduation in ONE YEAR
GOLDEN CAREER
16, Prakash Park, TGB Corner, Commerce Six Road, Navrangpura, Ahmedabad-380009
Phone: 079-40045428/9377985982

કોટન કીંગ
તહેવારો ઉજવો કોટન કાપડ સંગ.
એકસપોર્ટ કવોલેટીમાં વિવિધ વેરાયટીમાં વ્યાજબી ભાવે કોટન કાપડ મળશે.
કોટન કીંગ : એ.આર.એ. ૧૪, વર્ધમાન નગર સાઉથ, ભુજોડી. મો: ૯૬૩૮૧૧૩૫૭૨ (ફોન કરીને આવવું).
શીલ્પી : ડો. ભાણજી સ્ટ્રીટ, ભુજ. મો: ૯૮૯૮૯૯૩૩૨૪
વ્યાપારીક પૂછ-પરછ આવકાર્ય

NPAV
Protect your PC
Net Protector Anti-Virus
Call:
09271983694
09225664812
india antivirus .com

જમીન લે-વેંચ માટે મળો
રાપર તાલુકામાં જમીન, મકાન, પ્લોટ લે-વેંચ માટે મળો.
:: સંપર્ક ::
નગરપાલિકા શોપિંગ સેન્ટર, સલારી નાકા, રાપર (કચ્છ) - વાગડ
8469740444, 9537135986
9824405040, 9723423479

BOOKING OPEN
2BHK TENEMENTS &
Residential Ploting on Easy Installments
State Highway Road Touch - Varshamedi
Gujarat Estate Brokerage House
7874 22 22 99
7874 22 22 33

સેલ્સઓફિસર જોઇએ છે
મેડિકલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર પર ફરી ઓર્ડર બુકિંગ કરી શકે તેવા સેલ્સમેન-૨૦, સેલ્સ ઓફિસર-૨ (સેલ્સનો અનુભવ હોવો જરૂરી) મો. ૯૭૨૬૨ ૪૬૦૬૦.

અમાર એન્ડ સન્સ
ફાઇનાન્સિયલ સોલ્યૂન્સ પ્રા. લિ. પ્રોવાઇડસ દરેક પ્રકારની લોન / ડીલરશીપ થ્રૂ રજિ. કંપની દ્વારા દિલ્હી 011-25612550, 09310000229, 1800110029 www.amarsonsfinance.com

(રજીસ્ટર્ડ)CFL
મોમબત્તી,દોનોપ પેપર, ડિસ્પોજલ ગ્લાસ ઑટોમૈટિક મશીનોં દ્વારા તૈયાર માલ મુકો U - 152/C, શકરપુર, દિલ્હી-92 # 09711283391, 09654840226

United India
બેંક લોન લોન માત્ર ૨૪ કલાક મા (ન એજેંટ ડાયરેક્ટ બેંક),આઠમી, દસમી પાસ ૨૫૦૦૦૦૦, બેરોજગાર છુટ ૨૫ % પર્સનલ,પ્રોપર્ટી,પ્રોજેક્ટ,ગાડી લોન કરાઓ-૦૯૮૭૩૩૭૭૪૦૫૨ ,૦૯૮૭૩૭૭૪૦૮૨

Appolo India Ltd.
(લોનસિફ ૨૪ કલનક મા) ૮વીં ૧૦વીંપાસ ૨૦ લાખ છુટ % વ્યાજ ૪%શલાના ઇટભટ્ટી, મુર્ગી પાલન, પર્સનલ, પ્રાપર્ટી, ગાડીલોન કરાઓ (એવેટ લાખો કમાઓ) ૦૮૮૨૬૯૫૦૬૦૯,૦૮૮૨૬૯૫૦૬૧૦

પાતાલભૈરવી સાધના દ્વારા
અદ્દભુત ૧૦૧% ઘરબૈઠા ચમત્કાર તંત્રાચાર્ય વશીકરણ, સોતનદુશ્મનપ મુટકળી,XYZ લવપ્રાબ્લમ ૦૮૦૯૪૪૮૪૭૬૮

હવે આપની કલાસિફાઇડ
સ્પે. સ્કીમ
૨+૧
૫+૩
૮+૫
૧૪+૧૦
૧૮+૧૪
૩૦+૨૪
૪૦+૪૦
ડિસ્પ્લે જાહેરાત કલરમાં આપો.
૩ સે.મી. થી ૨૦ સે.મી. સુધીની કોઇપણ જાહેરાત રૂા.૧૦૦/- કોલમ સે.મી. સુધીમાં કરી શકશો + સ્કીમનો લાભ મેળવો
ભુજ : ૮૪૦૧૧ ૬૬૪૪૪
ગાંધીધામ : ૯૯૨૫૧ ૬૧૦૮૮


# ભૂકંપ ટાણે ટેન્ટમાં પા.પુ. બોર્ડના નાયબ ઈજનેરે ગફલો કર્યો

સરકારી બાબુઓ ગુનો કબૂલી લેતાં માત્ર ૬ માસનું ઇન્ક્રિમેન્ટ બંધ થાય :પા.પુ. બોર્ડ: નલિયા પેટા વિભાગના ઇજનેર ૭.૭૦ લાખની ઉચાપત કરી

**ભાસ્કર ન્યૂઝ.ભુજ**

જો સરકારી બાબુ ગુનો કબૂલી લે તો પોલીસ ફરીયાદ કરવાની જરૂર રહેતી નથી. તેવો ખુલાસો ગુજરાત પાણી પુરવઠા બોર્ડ કર્યો છે. ૨૪મી ફેબ્રુઆરી ૨૦૦૧ ના પાણી પુરવઠા બોર્ડ નલિયા પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ૭,૭૦,૦૦૦ ની ઉચાપત કર્યાનું પ્રકાશમાં આવ્યુ છે.

આ અંગે આડેસરના રહીશ જુમ્મા હુકા મહીડા એ જિલ્લા પોલીસ અધિક્ષક અને નલિયા પોલીસ સ્ટેશને એફ.આર.આઇ. નોંધવા લેખિતમાં અરજી કરી છે. જેની કાર્યવાહી પણ ચાલુ છે દરમિયાનમાં ૧૪મી જૂન ૨૦૧૧ના અનુસંધાને એક મુદ્દા પૂરતો ગુજરાત પાણી પુરવઠા બોર્ડે ગાંધીનગરની કચેરીએ જણાવ્યું છે કે આરોપીએ ગુનો કબૂલી લીધો છે જેથી પોલીસ ફરિયાદ કરવાની જરૂર રહેતી નથી.

૨૦૦૧ ના ભૂકંપ વખતે નલિયા પેટા વિભાગના ના.કા.ઇ. એ જૂનાગઢ થી ૮૫ નંગ તંબુની ખરીદી કરી હતી અને તેની પહોંચ પર સહી સીકકા કરી આપ્યા હતા. પરંતુ પેટા વિભાગના સ્ટોર રજિસ્ટરમાં રેકર્ડ પર માત્ર ૩૦ નંગ બતાવેલા છે. અને તેની લેવળ દેવળની વિગત છે બાકીના ૫૫ નંગ એજન્સી અને અમદાવાદના તાત્કાલીન મદદનીશ ઇજનેર ભાનુપ્રસાદ દલાલ જેઓ એ માત્ર માપ પોથીમાં માલ નોંધી અને ચુકવણુ કરવામાં આવ્યું છે આમ ૫૫ નંગ તેવું એકના ૧૪,૦૦૦ લેખે ૭,૭૦,૦૦૦ ની રકમની ઉચાપત કરવામાં આવી છે. આ બાબતે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં આ પ્રકરણનો પર્દાફાશ થયો હતો. આ બાબતે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ગાંધીનગર ની વડી કચેરી પાસેથી તંબુ ખરીદી ઉચાપત પ્રકરણના દસ્તાવેજો ની માગણી કરતાં તે મુદાના જવાબમાં બોર્ડે જણાવ્યું હતુ કે, આરોપી એવા ના.કા.ઇ. એ ગુનો કબુલી લીધો છે. જેથી પોલીસ ફરિયાદ કરવાની જરૂરત રહેતી નથી.

આ બાબતે પા.પુ. બોર્ડ ગાંધીનગર ખાતેના મુખ્ય વહીવટી અધિકારી ડી.બી.વોરાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હા આ બાબતને બોર્ડે ગંભીરતાથી લીધી છે. તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, સાત લાખ સિંતેર હજાર જેટલી રકમ ઉચાપત થઇ છે તેની દંડ સહિતની રિકવરી કરશો કે કેમ તેના ઉત્તરમાં જણાવ્યું હતુ કે બોર્ડ ઠરાવ કરશે અને પછી નિર્ણય લેશે.

## ઉચાપત પ્રકરણમાં ભીનું સંકેલી દેવા વગનો ઉપયોગ

બોર્ડના આંતરિક સૂત્રોમાંથી જાણવા મળે છે કે જો કર્મચારીની મોટી વગ હોય તો ગંભીર નાણાકીય ઉચાપત હોય અને ગણા કિસ્સામાં કર્મચારીઓ ગુનો કબુલી લેતા હોય તેમ છતાં માત્ર ૬ માસનો એક ઇજાફો ભવિષ્યની અસર સીવાય બંધ કરી ભીનું સંકેલી દેવાય છે ખરેખર ઉચાપતની રકમ દંડ સહિત વસૂલવી જોઇએ. અંજારમાં પણ ખોટી એચ. આર. પર હાજરી ભરી નાણાકીય ઉચાપતની તપાસ ના પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીએ ગુનો કબૂલી લેતાં માત્ર તેમનું ૬ માસનું ઇન્ક્રિમેન્ટ બંધ કરી દેવાયું હતું.

Digitally Archived by: www.realpatidar.com/library

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]



# બાંધકામની સામગ્રી રસ્તા પર ફેંકો, કોઇ પૂછનારું નથી

ગાંધીધામમાં ઠેરઠેર ચાલુ બાંધકામની કાચી સામગ્રી રસ્તા પર જ રાખવામાં આવે છે તેની બોલતી. તસવીરો : મીઠુ ચૌહાણ

### નગરપાલિકાએ જ નોટીસ જારી કરી હોવા છતાં કોઇ પગલા ભરાતા નથી

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

અનેક પ્રશ્નોથી ઘેરાયેલા ગાંધીધામમાં આમ તો ગણેય ગણાય નહીં અને વિણાય વિણાય નહીં એટલી સમસ્યાઓ છે. આ બધાની વચ્ચે હવે શહેરના કેટલાક વગદાર લોકો પોતાનું બાંધકામનું મટેરીયલ્સ રસ્તા પર મુકી નવી સમસ્યાઓને જન્મ આપી રહ્યા છે. નગરપાલિકા આમ તો ભારતનગર સહિતની સમસ્યાઓમાં વ્યસ્ત છે ત્યારે આ લોકો સામે કોઇ પગલા ભરવા તૈયાર નથી. બાંધકામના આ કચરાને પગલે ટ્રાફિક સહિતની સમસ્યાઓ ઉભી થઇ રહી છે.

ગાંધીધામના મુખ્ય માર્ગોની સાથે રહેણાંક વિસ્તારોમાં થઇ રહેલા બાંધકામમાં મકાન તેમજ દુકાન માલિકો કાચોમાલ રસ્તા પર રાખી નિર્માણ કરતા હોય છે. મેઇન બજાર, જુનાકોર્ટ રોડ, બેકિંગ સર્કલ અને ભારતનગર સહિતના વિસ્તારોમાં આ સમસ્યા વ્યાપક પણે જોવા મળી રહી છે. નવાઇની વાત તો એ છે કે, અંદાજે એક મહિના પહેલા નગરપાલિકાએ જાહેર માર્ગ પર બાંધકામ સામગ્રી રાખનાર સામે નોટીસ કાઢવામાં આવશે તેવી ચેતવણી વર્તમાન પત્રોમાં આપવા છતાં કોઇને પડી નથી.

તો બીજી બાજુ નગરપાલિકા માત્ર વર્તમાન પત્રમાં નોટીસની જાહેરખબર આપી ચુપ બેસી ગઇ છે. ગત તા. ૨૯/૬ના આ નોટીસ પાઠવ્યા પછી આજ દિવસ સુધી એક પણ વ્યક્તિ સામે આ અંગે પગલા ભરવામાં આવ્યા નથી. જેના પગલે રસ્તા પર બાંધકામ સામગ્ર બેરોક્ટોક રાખવામાં આવે છે. નગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના અનેક માર્ગો પર સિમેન્ટ, લોખંડ, કાકંરી સહિતનો માલ ખડકી દેવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ તો આ બધી સામગ્રીના કારણે રસ્તો પણ બંધ થઇ ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, નગરપાલિકા હાલ ભારતનગરના કામોમાં એટલી બધી વ્યસ્ત છે કે, હાલ તે આ સિવાયની કોઇપણ કામગીરી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. પાલિકાના મોટાભાગનો સ્ટાફ તથા સાધનો ભારતનગરના કામોમાં લાગેલા છે. અંદરખાને કેટલાક અધિકારીઓ પણ આ વાત સ્વિકારી રહ્યા છે. કારણ કે, જો વરસાદ આવે તો ભારતનગરની સ્થિતિ ભયંકર બની શકે તેમ છે તેથી હાલ નગરપાલિકાએ તમામ ધ્યાન અહીં લગાડ્યું છે.

### પાલિકાના વિભાગો એક બીજાને ખો દે છે

જાહેરમાર્ગ પર બાંધકામની સામગ્રી રાખનાર લોકો સામે પાલિકાનો કયો વિભાગ પગલા ભરે તેમાં પણ ભારે મતભેદ છે. સુધરાઇનું બાંધકામ અને દબાણ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે. બાંધકામ વિભાગ એમ જણાવે છે કે, જે પ્રકારે રસ્તા પર કેબીનનું દબાણ હોય છે તેમ રસ્તા પર રેતી અને કાંકરી રાખવી તે પણ એક જાતનું દબાણ કહેવાય તેથી આ કામગીરી દબાણ શાખાની છે. તો બીજી બાજુ દબાણ વિભાગ એવું કહે છે કે, આ કામગીરી પીડબલ્યુડી અને બાંધકામ વિભાગની છે. બાંધકામની સામગ્રી બાંધકામ વિભાગમાં ન આવે તો કેમાં આવે. તો અન્ય કેટલાક લોકો એવું જણાવે છે કે, આ કામગીરી કરવા માટે માત્ર નોટીસ કઢાઇ છે તેને લગતું એકપણ આયોજન કરવામાં આવ્યું નથી.

### પાલિકાને જાણ છે, પગલા ભરાશે

તો આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન પંડ્યાએ જણાવ્યું હતું કે, રસ્તા પર બાંધકામની સામગ્રી રાખનાર લોકોને ચેતવણી નગરપાલિકા દ્વારા આપી દેવામાં આવી છે. આ મુદ્દો નગરપાલિકાની જાણમાં જ છે. પરંતુ હાલ કેટલાક જરૂરી કામો ચાલતા હોવાથી આ મુદ્દા પર ધ્યાન દેવાતું નથી. ટુંક જ સમયમાં રસ્તા પર બાંધકામનું મટેરીયલ્સ રાખનાર તમામ લોકો સામે કડક પગલાં ભરવામાં આવશે.

realpatidar.com

## બ્લુ ફિલ્મ ડાઉનલોડ કરી દેતી દુકાન પર દરોડો

ભાસ્કર ન્યૂઝ | ગાંધીધામ

ગાંધીધામના રાષ્ટ્રીટ ધોરીમાર્ગ પર આવેલી એક મોબાઇલની દુકાનમાં ગ્રાહકોને બ્લુ ફીલ્મ ડાઉનલોડ કરી દેવામાં આવતી હોવાની માહિતી મળતા જ એલસીબીએ દરોડો પાડી સંચાલકની ધરપકડ કરી હતી. દુકાનમાંથી જુના મોબાઇલ લે વેચનું રજીસ્ટર પણ ન મળતા પોલીસે જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેર નામાના ભંગ બદલ પણ ગુનો નોંધ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી જલારામ મોબાઇલ શોપ નામની દુકાનમાં મંગળવારે સાંજે એલસીબીએ દરોડો પાડ્યો હતો. દુકાનનાં કોમ્પ્યૂટરની તપાસી લેતા તેમાંથી પોલીસને અનેક બ્લુ ફીલ્મ મળી આવી હતી.

દુકાનમાં જુના તથા નવા મોબાઇલ ફોનના લે વેચની માહિતી અંગેનું રજીસ્ટર પણ ન બનાવાતા પોલીસે હરેશ અમૃતલાલ ઠક્કરની ધરપકડ કરી હતી.

જેનો ભાઇ મનીષ અમૃતલાલ ઠક્કર સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે જણાવ્યું હતું કે દુકાન સંચાલકો કોમ્પ્યૂટરમાંથી ગ્રાહકોને મોબાઇલ ફોનમાં બીભીત્સ ક્લીપીંગ ડાઉનલોડ કરી આપતા હતાં.

ઉલ્લેખનીય છે કે, મોબાઇલ ફોનનું ચલણ વધતા યુવા વર્ગમાં નગ્ન વિડિયો ક્લિપ પણ ભારે ચાહના ધરાવે છે. એવી પરિસ્થિતિમાં આવા ચાહકો પાસેથી તગડી કમાણી કરી લેવા માટે મોબાઇલના અનેક દુકાનદારો સેક્સી ક્લિપ ડાઉનલોડ કરી આપવાનો વેપલો ચલાવી રહ્યા છે, એ પોલીસ પણ સારી પેઠે જાણે છે..

### આવી તો અનેક દુકાનો છે

ગાંધીધામમાં મોબાઇલ ફોનમાં બ્લુ ફીલ્મ ડાઉનલોડ કરી આપતી અનેક મોબાઇલ શોપ છે. ત્યારે એલસીબીએ માત્ર આ એકજ દુકાન સામે શા માટે કામગીરી કરી તેની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. ખરેખર તો એક સાથે અનેક દુકાનો સામે કાર્યવાહી કરવી જોઇએ જેથી કરીને આ દુષણ બંધ થાય.

## મુખ્ય બજારમાં ઢોરોનો અડિંગો

ગાંધીધામમાં થોડા સમય અગાઉ પોલીસ અને જીવદયા પ્રેમીઓએ સાથે મળીને રસ્તે રખડતા ઢોરોની સમસ્યા મહદ્અંશે ઉકેલી લીધી હતી પરંતુ ફરી આ સમસ્યા ફરી માથું ઉચકી રહી છે. શહેરની મુખ્ય બજારમાં ઢોરોએ રીતસરનો અડિંગો જમાવી દીધો છે. -મીઠું ચૌહાણ

# ઉદયપુરની ઠગાઇનો આરોપી જબ્બે

### ઠગાઇમાં ફોન નંબર પાકિસ્તાનના નિકળતા મામલો ગંભીર બન્યો : કરાચીથી ચાલતું નેટવર્ક બહાર આવ્યું

ભાસ્કર ન્યૂઝ . ગાંધીધામ

રાજસ્થાનના ઉદયપુર શહેર નજીક આવેલા સુખેર ગામ માં એક નર્સરી માલીક સાથે થયેલી રૂપીયા ૮૬૦૦૦ ની ઠગાઇમાં ઉદયપુર પોલીસ મંગળવારે ગાંધીધામમાંથી એક મોબાઇલ શોપના વેપારીની ધરપકડ કરી રાજસ્થાન લઇ ગઇ હતી. મોબાઇલ ફોન પર લોટરી લાગી હોવાનું જણાવી ગ્રાહકોને બાટલીમાં ઉતારવાના આ પ્રકરણમાં નંબર પાકિસ્તાનના નીકળતા બનાવની ગંભીરતા વધી ગઇ છે. તેઓમાં ગાંધીધામ અને કરાચીનું સંપર્ક બહાર આવતા સ્થાનીક ક-ાએ પણ પોલીસ સતર્ક બની ગઇ છે.

ઠગાઇ કરનારા આરોપીની દુકાન. -મીઠુ ચૌહાણ

મળતી વીગતો મુજબ ઉદયપુર નજીક સુખેર વિસ્તારમાં ચામુંડા નર્સરીના સંચાલક કાલુરામ સાલવી નામના વ્યક્તિને ૨૫ લાખ રૂપિયાની લોટરી લાગી હોવાનું ફોન પર જણાવી તેમની સાથે રૂપિયા ૮૬ હજારની ઠગાઇ થઇ હતી. આ બનાવમાં સ્થાનીક પોલીસે છત્તીસગઢના સમસાદ મહેબુબ ખા નામના એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સની કોલ ડીટેલ ચેક કરતા પોલીસની આંખો પહોળી થઇ ગઇ હતી. કોલ ડીટેલમાં પાકિસ્તાનના નંબરો જોવા મળ્યા હતા. ધરપકડ કરેલા સમસાદે આ પ્રકરણમાં ગાંધીધામ સ્થીત વિજય કુમાર રાઠોડને ઓળખતો હોવાનું જણાવતા રાજસ્થાન પોલીસ આરોપીને સાથે રાખી મંગળવારે ગાંધીધામ આવી પહોંચી હતી. એ ડીવીઝન પોલીસને સાથે રાખી રાજસ્થાન પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી ચામુંડા મોબાઇલ શોપના વિજયકુમાર રાઠોડની ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસ વિજયને રાજસ્થાન લઇ ગઇ હતી.

ઠગાઇના રૂપીયા ગાંધીધામ સ્થીત બેન્કમાં વિજય કુમાર રાઠોડના ખાતામાં જમા થયા હતા.જે ફોન નંબર મળ્યા છે તેનું લોકેશન પણ કરાચી બતાવી રહ્યું છે. તેથી પાડોશી દેશ દ્વારા ભારતના લોકો અને અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું કાવત્રુ રચી તો નથી રહ્યું ને ? તેવી શક્યતા પણ પ્રબળ બની છે.

### +૯૨ નંબરથી ચેતજો

પાકિસ્તાનથી આવનારા ફોનના આગળના ભાગે +૯૨ નંબર લખેલા હોય છે. આ બનાવમાં પણ પોલીસને મળી આવેલા નંબર પાક.ના છે. ગાંધીધામ અને છત્તીસગઢ માંથી પકડાયેલા શખ્સો પાકિસ્તાનમાં બેઠેલા શખ્સોના એજન્ટ હોય તેવી પણ એક વાત બહાર આવી છે.

### ગાંધીધામ પોલીસ સાથે હતી

ગાંધીધામ એ ડીવીઝન પીઆઇ એચ આર બલોચે જણાવ્યું હતું કે, મંગળવારે રાજસ્થાન પોલીસ ગાંધીધામ આવી હતી અને ત્યાંની ઠગાઇ કેસમાં ગાંધીધામના શખ્સનો હાથ હોવાના પુરાવા આપ્યા હતા. જેથી ગાંધીધામ પોલીસે સાથે રહી આરોપીને પકડવામાં મદદ કરી હતી.

## ગાંધીધામમાં આંકડો રમાડતા બે પકડાયા

ભાસ્કર ન્યૂઝ . ગાંધીધામ

ગાંધીધામમાં અલગ અલગ બે સ્થળો પર વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને એલસીબી અને ગાંધીધામ એ ડીવીજન પોલીસે પકડી પાડ્યા હતા.

ગાંધીધામ એ ડીવીજને મંગળવારે જુની કોર્ટ પાસે આંકડાનો જુગાર રમાડી રહેલો ચેતન અમૃતલાલ સોલંકીને રંગે હાથે પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂા. ૧૦૫૦ પણ કબ્જે કરાયા હતા.

તો બીજી બાજુ એલસીબીએ ઓસ્લો ટોકીજ પાસે બુધવારે સવારના ૧૧.૩૦ વાગ્યે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા શતીષ વેંકેટેશ પાટીલ ને રોકડા રૂા. ૫૬૦ સાથે ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, મોટા પાયે આંકડાનો જુગાર ખેલાય રહ્યો છે.

# મરીન કોલેજમાં ૧૦ ટકા અનામતનું વિચારાય છે

### ત્રણ વર્ષના કોર્સની ફી ૨૫ લાખ રૂપિયા છે : આવતા વર્ષથી ૧૬૦ બેઠકો ભરવામાં આવશે

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

કંડલા સંકુલમાં ભારતીય વિદ્યામંદિરના કેમ્પસમાં મરીન કોલેજની મંજૂરી આપવાના સંદર્ભે કચ્છના સાંસદ પુનમ વેલજી જાટે માહિતી આપતા જણાવ્યું છે કે, આ કોલેજમાં જ ત્રણ વર્ષનો કોર્સ હશે. પહેલાં વર્ષે વિદ્યાર્થીઓને કેમ્પસમાં થિયરી શીખાડવામાં આવશે અને બીજા દોઢ વર્ષ કંડલા પોર્ટની અંદર વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે અને છેલ્લો અડધો વર્ષે વિદ્યાર્થીઓને ફરજિયાત ઈન્ટરશિપ કરવી પડશે.

ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઈન નોટીકલ સાયન્સની સર્ટિફિકેટ અપાશે જે બી.એસ.સી. નોટિકલ સાયન્સ તરીકે ઓળખાશે. આ સર્ટિફિકેટ મળ્યા પછી આ કોલેજનો વિદ્યાર્થી પોર્ટમાં કેપ્ટનની નોકરી મેળવી શકશે. વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ નોકરી મેળવવી હોય તો બીજા પોર્ટમાં પણ જઇ શકશે. આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી વિષય સાથે ૧૨ સાયન્સ પાસ કરેલું હોવું જોઇએ.

ઈન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી ચેન્નાઇ દ્વારા આ કોલેજમાં કુલ ૧૬૦ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. પણ આ વર્ષ પૂરતું ફક્ત ૪૦ વિદ્યાર્થીઓને જ એડમિશન આપવામાં આવ્યું છે. આવતા વર્ષે કોલેજના સપૂર્ણ વિકાસ થયા પછી ૧૬૦ જગ્યાઓ ઉપર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. કંડલા પોર્ટના છોકરાઓ તથા કચ્છના વિદ્યાર્થીઓ તથા કચ્છી વિદ્યાર્થીઓ માટે આ કોલેજમાં ૧૦ ટકા સીટો અનામત રાખવાની વિચારણા ચાલી રહી છે.

ત્રણ વર્ષના સમયગાળામાં વિદ્યાર્થીઓને કુલ રૂા.૨૫ લાખ રૂપિયા ફી રૂપે ઈન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી ચેન્નઇમાં જમાં કરવાના રહેશે. તેમાં રહેવા, જમવા તથા ડ્રેસ તેમજ પુસ્તકોનો ખર્ચ પણ સમાવશે કરી દેવામાં આવેલ છે.

## મરીન કોલેજમાં કચ્છને ૫૦ ટકા અનામત આપો

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

કંડલા ખાતે શરૂ થનારી મરીન કોલેજમાં ૫૦ ટકા જગ્યા કચ્છના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ રજૂઆત કરી છે.

ચેમ્બર પ્રમુખ હીરાલાલ સી. પારખે જણાવ્યું હતુ કે, મરીન કોલેજમાં હાલ પૂરતા ૪૦ વિદ્યાર્થીઓને બારોબાર પ્રવેશ આપી દીધા હોવાથી કચ્છના વિદ્યાર્થીઓનો છેદ ઉડી ગયો છે.

જો ૫૦ ટકા બેઠકો કચ્છ માટે અનામત નહીં રખાય તો ગાંધીધામ ચેમ્બર દ્વારા લડત શરૂ કરાશે. મરીન કોલેજમાં થયેલા અન્યાય બદલ વિરોધ વ્યક્ત કરવો જોઇએ. આ મનસ્વી પગલાનો વિરોધ કરવાનું તેમણે કચ્છ અને કચ્છ બહારના લોકોને કહ્યું હતું.

ગાંધીધામની મધુબન હોટલમાં ચાલી રહેલા બ્રાન્ડેડ ગારમેન્ટના સેલને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સસ્તા ભાવે મળી રહેલા કપડા ખરીદવા લોકો ઉમટી પડયા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.


**હાડકા, સાંધા, વા ના રોગ તથા બાળકોના રોગ માટેનો વિનામૂલ્યે કેમ્પ**

**સ્થળ : એન્કરવાલા જનરલ હોસ્પિટલ, મુ.મસ્કા, તા.માંડવી**
**તા.૭/૮/૨૦૧૧, રવિવાર, સવારે ૧૦ થી ૧**

ડો.અશ્વિનભાઇ નાડકર્ણી (હાડકાના રોગના નિષ્ણાંત) તથા ડો.લાલજીભાઇ વાઘજીયાણી (બાળરોગના નિષ્ણાંત) પોતાની સેવા વિનામૂલ્ય આપશે. નામ નોંધણી ચાલુ છે

સંપર્ક : ફોન : (૦૨૮૩૪) ૨૨૩૦૪૭, ડો.મૃગેશભાઇ બારડ (મો.૯૨૨૮૭ ૭૩૫૪)
જૂના રિપોર્ટ, એક્સ-રે વિ. સાથે લઇ આવવા નમ્ર વિનંતી છે.


Digitially Archived by: www.realpatidar.com/library

2011-08-04 -Divya Bhaskar -Jayanti Lakdawala -Kadiya Ashram Visit [415]

માંડવીમાં સવારે ભારે ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસતાં શહેરીજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. **સુરેશ ગોસ્વામી**

# મેઘરાજા સવારે બાજી બનાવીને સાંજે બગાડે છે

### ભુજ-માંડવીમાં ઝાપટાં : દિવસભર રહેતાં ગોરંભાયેલા વાદળાં મન મૂકીને ન વરસતાં નિરાશા : ગાગોદરનું તળાવ વધાવાયું

**ભાસ્કર નેટવર્ક. ભુજ**

કચ્છમાં છેલ્લા એકાદ માસથી સૂર્યનારાયણને ઢાંકીને સવારથી જ વરસાદી માહોલની બાજી બનાવીને બગાડતા મેઘરાજા તરફ મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રોને માત્ર રાજી રાખવા હોય તેમ બુધવારે ભુજ અને માંડવીમાં સવારે અને બપોરે ભારે ઝાપટાં જ પડ્યાં હતાં જો કે, પૂર્વ કચ્છમાં ગાગોદર ગામે છલકાયેલું તળાવ શાસ્ત્રોક વિધિથી વધાવાયું હતું.

જિલ્લા મથક ભુજમાંથી સવારે હળવું ઝાપટું પડયા બાદ બપોરે મેઘાડંબર રચાયો હતો પણ ભારે ઝાપટું પડતાં માત્ર માર્ગો ભીંજાયા હતાં. માંડવી અને તેના આસપાસના વિસ્તારોમાં સવારે સાતેક વાગ્યે સાત મિ.મી. જેટલું પાણી ઝાપટાં રૂપે પડ્યું હતું. જો કે વાંઢ અને દરશડીમાં દસ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે પોણા ઇંચ જેટલી મહેર થઇ હતી.

રાપર તાલુકાના ગાગોદરમાં ખેંગારસર તળાવ છલકાંતા સરપંચ અનોપસિંહ જાડેજાએ પંડિત ભાગવતઋષિ અને અંબાલાલ મહારાજે કરાવેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વધાવ્યું તે સમયે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં તેવું પ્રતિનિધિ ધીરજભાઇ મહેતાએ જણાવ્યું હતું.

ભુજમાં ઝાપટા પડતાં લોકો પલડતા બહાર નીકળ્યા હતા. **પ્રકાશ ભટ્ટ**

# બિદડાના સબ પોસ્ટ માસ્તરને ઉચાપત કેસમાં ત્રણ વર્ષની કેદ

### ખાતેદારોના રૂ. ૬૪૪૭૦ હજમ કરી જવાના પ્રકરણમાં ચીફ કોર્ટનો ચુકાદો

**ભાસ્કર ન્યૂઝ.ભુજ**

માંડવી તાલુકાના બિદડા ગામમાં વર્ષ ૨૦૦૩માં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા શખ્સને ભુજની ચીફ જ્યુડિશિયલ એન્ડ મેજિસ્ટ્રેટ કોર્ટે બુધવારે ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. ૫ હજારનો દંડ ફટકારતી સજા ફરમાવી હતી.

મૂળ માંડવીના મોટા સલાયામાં રહેતો લાલજી શામજી ઘેડા બિદડામાં સબ-પોસ્ટ માસ્તર તરીકે ફરજ પર હતો એ દરમિયાન તેણે તા. ૧૧/૧૦/૦૩ ના રોજ એક વર્ષીય મુદતના ખાતા નંબર ૧૯૩૮૧ અને ૧૯૩૮૨ ના ખાતેદારોની જાણ બહાર ખોટા ઉપાડ વાઉચર પોતાના હસ્તાક્ષરમાં બનાવી વ્યાજ સહિતની રૂ. ૬૪૪૭૦ ની રકમની ઉચાપત કરી લીધી હતી. આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં તા. ૧૭/૧૨/૨૦૦૩ ના રોજ ગુનો નોંધાયો હતો. પોલીસે લાલજી ઘેડાની અટક કર્યા બાદ તેની વિરુદ્ધ પુરાવા એકત્ર કરી માંડવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યાર બાદ આ કેસ ભુજની ચીફ કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો.

આ કેસમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ કેસની હકીકતો તથા ગુનાની ગંભીરતા જોતા સરકારી વકીલ એ. એન. પંડ્યાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ વી. એફ. ભાટ્ટે આરોપીને તકસીરવાન ઠેરવી તેને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૫૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.

### પોલીસ તરીકે ઓળખ આપીને ઠેક ઠેકાણે દાગીના લૂંટતી

# કુખ્યાત ઈરાની ગેંગના ૬ સભ્યો ભુજ પોલીસના પંજામાં

### સાબરમતી જેલમાંથી કબજો મેળવાયો

**ભાસ્કર ન્યૂઝ . ભુજ**

પોતાને પોલીસ બતાવીને માર્ગે જતાં લોકો ખાસ કરીને મહિલાઓ પાસેથી સોના ચાંદીના દાગીના પડાવી લેતી મહારાષ્ટ્રની કુખ્યાત ઈરાની ગેંગના છ સભ્યોનો અમદાવાદની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવીને ભુજ પોલીસે તેમની ધરપકડ કરી હતી. કચ્છના આ પ્રકારના અનેક ગુના ઉકેલાય એવી પોલીસને આશા

...અનુસંધાન પાના નં. ૬

આરોપીઓને કોર્ટમાંથી લઇ જતી પોલીસ ટીમ. **પ્રકાશ ભટ્ટ**

# બિનચૂંટાયેલા પાંચ આગેવાનો આરોગ્ય શાખામાં નિમાયા

### સેવાના વ્યાપ માટે જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી વ્યક્તિઓને ઇતિહાસમાં પહેલીવાર અપાયું સ્થાન

**ભાસ્કર ન્યૂઝ. ભુજ**

કે.કે. હિરાણી | વિશ્રામભાઇ | દિલિપભાઇ | સલીમશા | મહાવીરસિંહ

કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સુવિધાનો વ્યાપ વધારવા માટે આર્થિકથી માંડીને વિવિધ પ્રકારની કાર્યવાહી પાર પાડવામાં આવે છે તેમાં હવે જિલ્લામાં આરોગ્ય સાથે નાતો ધરાવતા આગેવાનોને આરોગ્ય સમિતિમાં સમાવવામાં આવ્યા છે. પાંચ અગ્રણીઓને

...અનુસંધાન પાના નં. ૬

# ભુજના ટીડીઓ પર તોળાતી સસ્પેન્સની તલવાર

**ભાસ્કર ન્યૂઝ. ભુજ**

તાલુકાના જુણા ગામે થયેલા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરોજગાર યોજનાના (મનરેગા) કૌભાંડમાં પકડાયેલા તાલુકા વિકાસ અધિકારી મોસમસિંહ બી. રાવ પર સસ્પેન્સની તલવાર તોળાઇ રહી છે. સંભવિત બે દિવસમાં વિકાસ કમિશનર કચેરીમાંથી આવો હુકમ થાય એમ મનાય છે.

મનરેગા કૌભાંડ હેઠળ રૂપિયા સાત લાખના બિલોમાં સહીના મામલે એલસીબી દ્વારા પકડાયેલા ભુજના ટીડીઓ એમ. બી. રાવને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વર્ગ બેના અધિકારી હોવાના કારણે તેમની વહીવટી કારકીર્દિ અંગેનો નિર્ણય વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગરથી લેવાતા હોય છે. તેમની ધરપકડને ૪૮ કલાક વીતી ગયા બાદ ફરજ મોકૂફીની કાર્યવાહી ચાલી રહી છે. ગાંધીનગરથી કેટલાક અહેવાલો મંગાવવામાં આવ્યા છે જે જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા પૂરા

...અનુસંધાન પાના નં. ૬

### વરસાદ ખેંચવાની પરિસ્થિતિ વચ્ચે

# કચ્છમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવા કૃષિમંત્રીને ધા

### ભાજપ પ્રમુખ ભાનુશાલી કૃષિમંત્રીને રૂબરૂ મળ્યા

**ભાસ્કર ન્યૂઝ . ભુજ**

કચ્છમાં ચાલુ વરસે વરસાદ ખેંચાઇ જતાં જળ અને પશુધન માટે ચારાની સમસ્યાઓ નિવારવા જિલ્લામાં જે વિસ્તારમાં વરસાદ થયો નથી ત્યાં તાકીદે કૃત્રિમ વરસાદ માટે તાકીદે સઘન પ્રયાસો હાથ ધરવાની રાજ્યના કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી સમક્ષ, ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલીએ માંગણી કરી હતી.

આજે ગાંધીનગર ખાતે કૃષિમંત્રીને રૂબરૂ મળી કચ્છમાં ચોમાસું ખેંચાઇ જતાં ઉભી

...અનુસંધાન પાના નં. ૬

**શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ**

સંચાલિત : શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ
ગામઃ બિદડા, માંડવી-કચ્છ. ૩૭૦ ૪૩૫
ફો.નં.: (૦૨૮૩૪) ૨૪૪ ૪૪૪/૨૪૪ ૧૪૩, ફેક્સ : (૦૨૮૩૪) ૨૪૪ ૪૬૬
તપોમુર્તી માતુશ્રી લક્ષ્મીબેન મગનલાલ દેઢીયા-ગામઃ ભુજપુર, કચ્છ.
શ્રીમતી રતનબેન નાનજી વેલજી છેડા - ગામઃ બિદડા, કચ્છ. બાળ હાડકારોગ વિભાગ

**બાળ હાડકા રોગ શિબિર**

જન્મજાત ખોડખાંપણ વાંકા-ચુંકા હાથ કે પગ, બાળકોની મણકાની બિમારીઓ, સેરેબલ પાલ્સી, બાળકોની ચાલવાની બિમારીઓ વગેરે માટે મુંબઇના જાણીતા બાળહાડકા રોગ નિષ્ણાંત ડો. તરલ નાગડાના આસીસ્ટન્ટ ડો. સંતોષ તા. ૦૬-૦૮-૨૦૧૧, શનિવારે દર્દીઓની તપાસણી કરશે અને ઓપરેશન યોગ્ય દર્દીઓને તેમના ઓપરેશન માટે તારીખ આપશે.

**-: તપાસણી સ્થળ :-**

શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, બિદડા-કચ્છ.
સમયઃ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦
ખાસ નોંધ :- દર્દીઓના આગળના રીપોર્ટ તથા એક્સ-રે લાવવા વિનંતી
આ શિબિર ફક્ત ૧ થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટેજ છે.
જાહેરાત સૌજન્ય :-
રમણિકલાલ છગનલાલ દેઢીયા - ભુજપુર, કચ્છ
કાનજી વેલજી છેડા - બિદડા - કચ્છ